

પ્રકાશકના બે બોલ....

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
الصَّلَاةُ وَالسَّلَامُ عَلَيْكَ يَا رَسُولَ اللَّهِ ﷺ
وَعَلَىٰ آئِلَكَ وَأَصْحَابِكَ يَا حَبِيبَ اللَّهِ ﷺ

જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને નિષ્ણાત ડોક્ટર ચેક કરીને દવાઓ લખી આપે કે આ સવારે નાશતા પહેલાં, આ નાશતા પછી. આ ગોળી ખાધા પહેલાં અને આ ખાધા પછી. અને આ સૂતી વખતે લેવી. અને આ એક લેવી આ અડધી લેવી.... વગેરે, તો દરેક બીમાર પોતાની તંકુરસ્તીને ખાતર એ જ પ્રમાણે દવા લે છે. કારણ કે એને ડોક્ટર પર વિશ્વાસ છે કે એ મારા ભલા માટે કહે છે. જો ડોક્ટરના કહેવાથી ઉદ્ઘૂર કરે અથવા એક એક કરીને ખાવાને બદલે બધી ગોળી સામટી ગળી જાય તો શું થશે? જાનનો ખતરો! સૌ આ વાત સમજે છે જેથી ડોક્ટરના કહેયા વિરુદ્ધ જવલ્લેજ કોઈ કરે છે, અને જે ડોક્ટરના કહ્યા વિરુદ્ધ કરે તેને બેવફૂફ ઠરાવવામાં આવે છે.

એ જ પ્રમાણે કોઈ અજાણ્યા શહેરમાં તમે જાવ અને કોઈને રસ્તો પૂછો, તો તમને કહેવામાં આવે કે આગળ ચાર રસ્તે જમણી બાજુ વળજો પછી સીધા મેઝિન રોડ પર જાઓ, ત્યાંથી ડાબી બાજુ વળજો, પછી જમણી બાજુ વળજો... તો તમે તમારી મંજિલે પહોંચી જશો. તો ખૂબ જ ધ્યાનથી એ પ્રમાણે કરવામાં આવે છે. જો ગાઈડની સૂચના વિરુદ્ધ સમજ્યા વિના કોઈ કરે તો ભટકી જાય છે અને એવું કરનારને બેવફૂફ કહેવામાં આવે છે.

એ જ પ્રમાણે તે રબ કે જે તમને તમારી માં કરતાં વિશેષ ચાહે છે તેનાથી વધુ તમારું ભલુચાહનારો કોણ હોઈ શકે? અને તે મહિબૂબ પૂર્ણ કે ઉમ્મતીના પગે કાંટો પણ ચૂભે તે પોતે પસંદ નથી કરતા, તે રબ તાલા શુદ્ધ તથા તેના હથીબ રહ્મતુલ્લ લિલુ આલમીન પૂર્ણ જે જીવનમાર્ગ સૂચવે તેના પર ચાલવું એમાં દરેક માનવની દુનિયા તથા આખેરતમાં ભલાઈ જ ભલાઈ છે અને ઈજજત જ ઈજજત છે. અને અલ્લાહ વ રસૂલનો સૂચવેલો માર્ગ જ આપણને સહીહ મંજિલે પહોંચાડી શકે છે.

પરંતુ અફસોસ! પુરુષ લોકો બીમારી વેળા ડોક્ટરની જીણી જીણી વાતોને તો ધ્યાનમાં રાખે છે અને તે પ્રમાણે અમલ કરે છે, મુસાફરો અજાણ્યા શહેરમાં ગાઈડની સૂચના વિરુદ્ધ જરાય જતા નથી, કેમ કે ગાઈડની સૂચના વિરુદ્ધ વર્તવાથી ભટકી જવાનો, લૂટાઈ જવાનો ભય રહે છે. અહીં સર્વની બુદ્ધિઓ કામે લાગેલી રહે છે અને તેમના કહ્યાનુસાર ચાલે છે. પણ અફસોસ! આપણો ખાલિક તથા માલિક રબે કરીમ માનવીને જીવન રથ કયા માર્ગ કઈ રીતે દોડાવવો તે સૂચવે છે, તેના પ્યારા મહિબૂબ પૂર્ણ જીવનનાં સર્વ પાસાંઓમાં કઈ રીતે રહેવું, આપણો શું અફીદો અલ્લાહ વ રસૂલ વિશે હોવો જોઈએ, તથા અન્ય કેવી માન્યતાઓ રાખવી, નમાઝ, રોજા, હજ્જ, ઝકાત શું છે? એને કઈ રીતે અદા કરવા? તથા નિકાઃ, શાદી વહેવાર, પતિ પત્નીની જિંદગી, બાળકોની પરવરિશ, માંબાપના, ભાઈ બહેન, પડોશીના, મુસ્લિમોના, માનવોના શું શું હક્કો છે..... વગેરે જીવનનાં સર્વ પાસાંઓના નિયમો અલ્લાહ શુદ્ધ વ રસૂલ પૂર્ણાંદ્રો દર્શાવ્યા છે છતાં મોટાભાગના લોકો જેઓ પોતાને બુદ્ધિવાળા

તथા કેટલા તો પોતાને તત્વચિંતક અને સૌથી હોશિયાર માનનારા કહેવાતા ડોક્ટર, પ્રોફેસર, સાયન્ટસ્ટો પણ તેના પ્રમાણે ચાલતા નથી ! તો માનવે સમજવું જોઈએ કે સમગ્ર સુષ્પિત્તમાં આપણું સૌથી અધિક ભલું ચાહેનાર રબ તથાલા તથા તેના રસૂલ પ્રસ્તુતના દર્શાવેલા માર્ગે આપણે ન ચાલીએ, અને એક કૃયાસથી દવા કરનારા ડોક્ટર તથા અજાણ્યા શહેરમાં સામાન્ય ગાઈડની વાતને મહત્વ આપીને તેના પર અચૂક અમલ કરીએ તો વિચારો કે આપણાથી મહાન બેવકૂફ કોણ હશે ?! શું ડોક્ટર તથા ગાઈડની વાત રબની વાત તથા રસૂલેપાકની વાતથી અધિક વિશ્વસનીય છે ??

સારાંશ કે આપણે જો દુનિયા અને આખેરતની ભલાઈ ચાહતા હોઈએ તો અલ્લાહ વ રસૂલ પ્રસ્તુતના ફાનૂન એટલે કે "શરીઅત" ના કાયદા મુજબ જીવન જીવવું જોઈએ, એમાં જ બંને જહાનની મુસીબતોનો ઉપાય છે અને એના પર ચાલવાથી જ બંને જહાનમાં સુખી થઈ શકાશે.

પ્રસ્તુત કિતાબ સદરુશશરીઅહ્, ખલીફાએ હુઝૂર આ'લા હજરત, ફકીહે આ'જમ ફખે સુન્નિયત હજરત અલ્લામા મૌલાના શાહ અબુલ ઉલા અમજદઅલી આ'જમી કાદરી રજવી પ્રાણી શરીઅતના ફાનૂન દર્શાવતી, પુષ્કળ હઠીઓ તથા મસાઈલ સાથે સહીહ જીવન માર્ગ દર્શાવતી અજોડ કિતાબ છે. આ કિતાબ ઉર્દૂમાં કુલ ૨૦ ભાગોમાં છપાઈ છે જેના ફક્ત દસ ભાગો ગુજરાતીમાં હજરત અલ્લામા મૌલાના સૈયદ ફુમરુદીન બાવા એ. દરિયાઈ અશારકી (કારંટા શરીફ) તથા મહૂમ જનાબ ડોસુભાઈ કે પણોચીયા નક્ખશબંદી (મોડાસાવાળા) એ કર્યા હતા. મૌલા કરીમ તેઓને જાણે ખેર અતા કરે તથા તેમની આ મહેનતને તેમની નજીતનો જરીયો બનાવે, મહૂમ ડોસુભાઈને જન્તમાં આ'લા મકામ અતા કરે. (આમીન)

અલ્લાહના ફળ્ગલો કરમથી હજરત મૌલાના મુહમ્મદ શાક્રિ રગ્વી નૂરી (અમીરે સુન્ની દા'વતે ઈસ્લામી)ની સૂચનાનુસાર સુન્ની દા'વતે ઈસ્લામી (દયાદરા શાખા) થકી તેને પ્રકાશિત કરવાનું બીજુ જરૂર્યું છે. જે ૧ થી ૫ ભાગો એક સાથે અને ક થી ૧૦ ભાગો એક સાથે આમ બે જિલ્દોમાં છપાવી રહ્યી છીએ. અતે અમો હજરત મૌલાના સૈયદ ફુમરુદીનબાવા કારંટવી સાહબનો આભાર માનીએ છીએ કે તેમણે ખૂબ જ ખુશીભેર ઉખાપૂર્વક દુઅાઓ સાથે અમને આ 'બહારે શરીઅત' ના દસ ભાગો પ્રસિદ્ધ કરવાની ઈજાજત આપી.

મારા દીની સુન્ની ભાઈઓ બહેનોને વિનંતિ કે આપણા જીવનનો, આપણા શરીરનો, આપણી મિલકતોનો હફ્ફીકી માલિક અલ્લાહ છે અને એ જે માર્ગ જીવન જીવનાનો સૂચવે, જે માર્ગ શરીરનો તથા મિલકતનો ઉપયોગ કરવા વિશે સૂચવે તેમાં અગણિત ભલાઈઓ છે, જેથી આ કામમાં આડે આવતી આપણી કુલ્લુદ્ધિને અભરાઈએ ચડાવીને અલ્લાહ વ રસૂલ પ્રસ્તુતના સૂચવેલા માર્ગે આપણે ચાલીએ એમાં જ બંને જહાનની ભલાઈ છે અને જો એને અવગણીશું તો દુનિયામાંય બેઈજજતી થશે તથા આખેરતમાં જહનમાં સણગાવું પડશે, જેથી અત્યારે જ સમજ વિચારીને શરીઅત પર ચાલવું જોઈએ રબ તથાલા તેના હબીબ પ્રસ્તુતના સદકામાં આપણને તેની રજાવાળી જિંદગી નસીબ કરે. (આમીન)

-પટેલ શાલ્લીર અલી રગ્વી

(ખલીફા હુઝૂર તાજુશશરીઅહ, તંત્રી : બરકાતે ખ્વાજા-માસિક, દયાદરા, તા. ૨૦-૬-૨૦૦૬)

અહારે શરીરચિત ભાગ—૬

(ગુજરાતી)

અનુક્ત મણિ કા

ક્રમ	વિષય	પેજ નંબર	ક્રમ	વિષય	પેજ નંબર
૧.	હજજનું બયાન	૧	૨૧.	તવાક્રના મસાઈલ	૪૬
૨.	હજજના દ્વિંદી મસ્તકાઓ	૫	૨૨.	નમાઝે તવાક્ર	૪૬
૩.	સેહતે અદાની શરતો	૧૨	૨૩.	મુલતાનિમથી લિપટબું	૫૦
૪.	ક્રેઝહજજ અદાથવાની શરતો	૧૨	૨૪.	જમજમ તરફ હાજરી	૫૧
૫.	હજજના ફૂરણો	૧૨	૨૫.	સફ્રા તથા મરવાની સર્ધ	૫૨
૬.	હજજના વાળાઓ	૧૩	૨૬.	ધડામતના દિવસેમાં શું હરે	૫૬
૭.	હજજની સુન્નતો	૧૪	૨૭.	તવાક્રમાં આ વાતો હરામ છે	૬૦
૮.	હજજની સફરના આદાખ તથા પૂર્વ રૈયારીઓ	૧૪	૨૮.	તવોક્રમાં આ ૧૫ વાતો મહેન્દું છે	૬૧
૯.	મીડાતનું બયાન	૨૦	૨૯.	આ વાતો તવાક્ર તથા સર્ધ	
૧૦.	એહરામનું બયાન	૨૧	૩૦.	અનેમાં જયજ છે	૬૧
૧૧.	એહરામના એહેડામ	૨૩	૩૧.	સર્ધમાં આ વાતો મહેન્દું છે	૬૧
૧૨.	તે વાતો જે એહરામમાં હરામ છે	૨૮	૩૨.	તવાક્ર તથા સર્ધના મસાઈલમાં પુરૂષ ખીના તદ્દીવત	૬૧
૧૩.	એહરામના મહેન્દો	૨૮	૩૩.	મિનાની રવાનગી અને અરક્ષાનો શુદ્ધદે	૬૨
૧૪.	આ વાતો એહરામમાં જયજ છે	૨૬	૩૪.	અરક્ષાનો વદ્દું	૭૦
૧૫.	એહરામમાં પુરૂષ-ખીના તદ્દીવત	૩૦	૩૫.	વદ્દુંના આદાખ	૭૧
૧૬.	દાખેલીએ ફૂરમ	૩૦	૩૬.	વદ્દુંના મહેન્દો	૭૪
૧૭.	હરમમા દાખલ થવાના એહેડામ	૩૨	૩૭.	મુજદલિફાની રવાનગી અને તેનું વદ્દું	૭૬
૧૮.	તવાક્ર તથા સર્ધ, સફ્રા-મરવહ તથા ઉમરાનું બયાન	૩૬	૩૮.	મિનાના આ'માલ અને હજજના બાકીના કાયો	૮૧
૧૯.	મરિશુદે હરામના અહેડામનું બયાન	૩૬	૩૯.	હજજની કુરખાની	૮૫
૨૦.	તવાક્રનો તરીકો અને હુઆઓ	૪૨			

ક્રમ	વિષય	પેજ નંબર	ક્રમ	વિષય	પેજ નંબર
૪૯.	તવાહે ઈજ્	૮૮	૫૯.	રમીની ભૂલો	૧૧૮
૪૦.	રનીમાં બાર ચીડો મહુદું છે	૯૩	૬૦.	કુરખાની અને હલકમાં ભૂલો	૧૧૮
૪૧.	મછા મોઅઝમા માટે રવાનગી	૯૩	૬૧.	શિકાર કરવું	૧૧૮
૪૨.	ઉમરા	૯૩	૬૨.	હરમના જનવરોને ઈજા આપવું	૧૨૪
૪૩.	સુતખર્ડ સ્થફેની જિયારત	૯૪	૬૩.	હરમના વૃક્ષ વિગેરે કાપવું	૧૨૬
૪૪.	કા'બા મોઅઝમાનો પ્રવેશ	૯૪	૬૪.	જુ મારવું	૧૨૭
૪૫.	હરમૈન શરીરેનના તખર્ડકાત	૯૫	૬૫.	એહરામ વગર મિકાતથી	
૪૬.	કિરાનતું બયાન	૯૭	૬૬.	પસાર થલું	૧૨૮
૪૭.	તમતોઅનું બયાન	૧૦૦	૬૭.	એહરામ ડોવા છતાં ખીલે	
૪૮.	જુમ્ અને તેમના કદ્દારાનું		૬૮.	એહરામ બાંધવું	૧૨૯
	બયાન	૧૦૪	૬૯.	સુહસરતું બયાન	૧૩૦
૪૯.	એહરામ ખૂશ્યું અને તેથી લગાવવું	૧૦૬	૭૦.	હજજ ઝોાત થવાનું બયાન	૧૩૩
૫૦.	સીવેલા વસ્ત્રો પહેરવા	૧૦૮	૭૧.	હજજ બદલતું બયાન	૧૩૪
૫૧.	વાળ હર કરવા	૧૧૧	૭૨.	હજજની મનનતતું બયાન	૧૩૬
૫૨.	નખ કટવા	૧૧૩	૭૩.	ઝાઈદે મહીના તથેબહુ	૧૪૮
૫૩.	ઓસો-ચુંબન (આલિંગન)		૭૪.	મહીનાવાળાઓ સાથે બુરાઈ	
	વિગેરે	૧૧૩	૭૫.	કરવાનો અંભા	૧૪૧
૫૪.	સંલોાગ-સમાગમ	૧૧૩	૭૬.	મહીના તથેબહુની હાજરી	૧૪૨
૫૫.	તવાહું ભૂલો	૧૧૫	૭૭.	બડીઅવાળાઓની જિયારત	૧૬૦
૫૬.	સર્જમાં ભૂલો	૧૧૭	૭૮.	કુખા શરીરેની જિયારત	૧૬૨
૫૭.	લુક્કે અરક્કામાં ભૂલો	૧૧૭			
૫૮.	મુજદલિકામાં લુક્કે	૧૧૭			

નોટ : આ કિતાબ પદ્ધતાં પહેલાં ભૂલો સુધારી દો.

● શુદ્ધિ પત્રક ●

નંબર	અશુદ્ધ	કોલમ	શુદ્હ	પેજ નંબર	લાઇનનંબર
(૧)	સુતદ	૨	સુત્દ	૬	સાતમી
(૨)	ભણુતા	૨	ભણુતો	૬	સત્તરમી
(૩)	અપહિજ	૨	અપાહિજ	૭	છેલેથી ચોથી
(૪)	ભકાઈ	૧	ને કોઈ	૨૦	આડમી
(૫)	અવધે	૧	અલયદે	૪૦	સાતમી

નંબર	આશ્રૂ	કોલમ	શુષ્ઠુ	પેજ નંબર	લાઇન નંબર
(૧)	કુન	૨	કુન	૪૦	ચાથી
(૨)	ખુલા	૨	ખુલા	૫૭	છેલેથી છુટી
(૩)	કાહિન	૨	કારિન	૫૮	છેલેથી બીજી
(૪)	ઉસ્તુલ	૧	ઉસ્તુલ	૬૩	ચાથી
(૧૦)	સરસુલુલાહ	૧	રસુલુલાહ	૬૩	ચૌદમી
(૧૧)	અલઘડે	૧	અલયડે	૬૩	ચૌદમી
(૧૨)	દિલસ	૧	દિવસ	૬૭	ચૌદમી
(૧૩)	બહીઓ	૨	બંદીઓ	૭૪	દસમી
(૧૪)	મરી	૧	મારી	૭૭	છેલેથી અગીયારમી
(૧૫)	મસ	૧	માંસ	૭૮	છુટી
(૧૬)	રાત્રી જેગરણુ	૧	રાત્રી જગરણુ	૭૮	છેલેથી બીજી
(૧૭)	વાળિયા	૧	વાળિય	૮૧	સોણમી
(૧૮)	વારેવિસાલ	૧	મારેવિસાલ	૮૨	છેલેથી બીજી
(૧૯)	રઘુનાનિકટ	૨	રઘુનાનિકટ	૮૨	છેલેથી સાતમી
(૨૦)	રહીયદલાહેં	૧	રહીયદલાહેં	૮૩	છેલેથી ચાથી
(૨૧)	નેઈજ	૧	નાઈજ	૮૫	છુટી
(૨૨)	મરલુ	૧	મારલુ	૮૫	ખારમી
(૨૩)	ઝુંદુ	૧	ઝુંદુ	૮૬	સોણમી
(૨૪)	કૃમશ	૧	કૃમશ	૮૪	પહેલી
(૨૫)	નેઈજ	૧	નાઈજ	૮૫	છેલેથી દસમી
(૨૬)	વદ્દહંદો	૨	વલહર્ડો	૮૬	સોણમી
(૨૭)	ખળાઓ	૧	ખલાઓ	૧૧૧	છેલેથી તેરમી
(૨૮)	બેચી	૧	બેચી	૧૨૭	છુટી
(૨૯)	સુસારખાતું	૨	સુસારખાતું	૧૪૮	છેલેથી આડમી
(૩૦)	અમરા	૨	અમારા	૧૫૦	ખારમી
(૩૧)	રસુલુલલાહ	૨	રસુલુલલાહ	૧૫૨	આડમી
(૩૨)	સર્વલલાહો	૨	સર્વલલાહો	૧૫૨	આડમી

૭૯૬/૮૨

ગુજરાતીશ : (એ ઓલ)

૭૯૬/૮૨

અસસલામો! અલિયકુમ! ૨૫૩૪ આલમીની મહે઱ખાનીથી અને પ્યારા રસુલ સલ્લાહ્સાહો અલયહે વસ્તુલભના સદકામાં ‘બહાર શરીઅત’ ભાગ ૧, ૨, ૩, ૪, અને ૫ નો ગુજરાતી તરજુમો, રજુ કર્મા પણી, ભાગ છાટનો ગુજરાતી તરજુમો ગુજરાતી સુરિકમો સમક્ષ રજુ કરતા અમને એહદ મુશ્ટી થાય છે. ધણુણ લાંબા સમયથી અમારી એ તમના હતી કે, સુની આલમના મહાન અલ્લામા આલિમ, કારી, હાજી, સુફી કષીફેડોરા, મૌલાના અમભજદાલી સાહેબ આજમી (રહમતુલ્લાહે અલયહે) (અલીફાએ આલા હજરત ઈમામ અહમદ રજા કાજિલે બરેલી રહીમલ્લાહો અન્હે)ની સંપાદિત કિતાબ, ‘બહાર શરીઅત’નો ગુજરાતી અનુવાદ કરીએ. અલ્લાહોનો લાખ-લાખ શુકો એહસાન છે કે, તેથે તેના મહે઱ખાના સદકામાં અમારી એ તમના પુરી ક્રમાંની ને આપની નંબર સમક્ષ છે. અલહુમ્બાલિલ્લાહ.

આ કિતાબ પ્રગટ કરવા માટે ગુજરાતની મશીલુર કમિટી-અજમેરજા (અહમદાખાદ)એ ને હિન્મત કરી તે દાદને પાત્ર છે. હજરત મૌલાના અહુકૃષ્ણાનુર અશરફી સાહેબ અને હજરત મૌલાના નિઝામુદીન અશરફી (અતીથ નામે મરિજદ) સાહેબ વિગેરે કમિટીના સભ્યોએ ને પ્રોત્સાહન આપ્યું તે કાબિલે તારીફ છે. ધ્યા સહાયકોને આ નેક કામનો બધાનો મળે તેવી અમારી હુચા છે. આપ સાહેબાન અમારા આ પ્રયાસોને વધાવી દેશો, તે ઈન્શાઅલ્લાહ કુંક સમયમાં ‘બહાર શરીઅત’ના બાકીના ભાગો પણ કુમણ મનજરેઅામ પર આવતા જશ. એ બધું હેંસલા અફિજાઈ અને આપની હુચાએ પર નિર્ભર છે.

અંતમાં ગુજરાતને ઈસ્લામને નમ વિનંતી કરવાની કે, ‘બહારે શરીઅત’ (ભાગ ૬ છૂટો) તે ધણી જ ઉચ્ચ ડોટિની ઉર્દૂ ભાષામાં લખવામાં આવ્યો છે, વધુમાં મજહબી પરિભાષાવાળા અરથી શાહોથી ભરપુર ઈબ્બારતોં રજુ કરવામાં આવી છે. તેના સરળ ગુજરાતી અનુવાદ કરવો એક મુશ્કેલી કામ હોઈ, અમે તેને શક્યતાની હદ સુધી અનુવાદ કરવાની ડોશિશ કરી છે. અને જર્યા જરૂર જણાઈ છે ત્યા એટ્રમાં સમન્વયવાની પણ ડોશિશ કરી છે. પરંતુ ‘મનુષ્ય માત્ર લુલને પાત્ર’ એ કહેવત અનુસાર તેના અનુવાદમાં ડોધ ભૂલ અથવા ક્ષતિ રહી જવા પામી હોય અથવા સુદણ હોયને લાઘિ ડોધ પણ પ્રકારની ભૂલ રહી જવા પામી હોય તો ‘તે અમારી ભૂલ થધ છે.’ તેવું સમજવાનું. છે. આ માટે ‘બહારે શરીઅત’ (ઉર્દૂ) ના મુળ સંપાદક હજરત સદ્ગુરુશરીઅહુ મૌલાના સુફી અમભજદાલી રહમતુલ્લાહે અલયહે તેના માટે જવાખાર નથી અને તે તેનાથી મુક્ત છે. એવા સંલેખોમાં તમારે ‘બહારે શરીઅત’ ની મુળ ઉર્દૂ ઈબ્બારત સાથે મેળવી દેવું. પણ અમારા ધ્યાન પર લાવશો, નથી અમે બીજી પ્રકાશનમાં તેને અવસ્થ સુધારી લઈશું-ઈન્શા અલ્લાહ.

કૃત, નાચીજ હુઅણીરાં :

જનાખ મૌલાના હાજી પીર કમર્દીન એ. પીરજાદા અશરફી (કારંટાવાળા)

ડે. કુતુઅનગર, સુ. પો. કારંટા (તા. લાણાવાડા, જી. પંચમહાલ)

જનાખ દ્વારાત્મેહંમદ (ડાસુભાઈ) ડે. પણાંચીયા (નક્શાખંડી-મુજાહીદી) મોડાસાવાલા

ડે. કાટાકડી ભાગોળ, સુ. માડાસા. (જ. સાખરકાઠા)



بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ਮਹਾਰੇ ਰਾਣੀਆਤ

ਭਾਗ—੬

ਨਹੁਮੋਹੂ ਵ ਨੁਸਲਦੀ ਅਲਾ ਰਸੂਲੇਹਿਲ—ਕੁਰੀਮ

ਨਾਭਾਤੁ ਮਚਾਤ

ਅਲਵਾਡ ਤਾਨਾਵਾ ਈਸ਼ਾਵਿ ਫਰਮਾਵੇ ਛੇ : “ਈਨਾ ਅਵਵਲ ਜੀਤਿਵਾਹੇਵਾ ਲਿਨਾਸੇ ਲਵਲਾਡੀ ਏ ਅਝਤ ਸੁਖਾਰਕੁ ਵਥ ਹੁਲਵ ਲਿਵਾਲਮੀਨ। ਆਧਾਤੁ ਮ ਜੀਧਨਾਤੁ ਮ ਮਕਾਮੇ ਈਅਡਾਈਮ ਵਮਨ ਫ਼ਬਲਾਡੁ ਕਾਨ ਆਮੇਨਾਵਥ ਲਿਵਲਾਡੇ ਅਲਵਨਾਸੇ ਲਿਜ਼ਨ੍ਹੁ ਲ੍ਹੀਤੇ ਮਨਿਸਤਤਾਵਾ ਅਵੀਛੇ ਸਖੀਲਾ ਵ ਮਨ ਕਈਰ ਈਨਨਵਲਾਡਾ ਗਨਿਚੁਨ ਅਨਿਵਾਲਮੀਨ।”

(ਅਥੰ : ਯੇਥੇਕ, ਪ੍ਰਥਮ ਧਰ ਕੇ ਲੋਡੇ ਮਾਟੇ ਅਨਾਵਵਾਮਾਂ ਆਵਥੁ ਤੇ ਛੇ ਕੇ ਮਜ਼ਾਮਾਂ ਛੇ ਅਰਕਤਵਾਗੁਂ ਅਨੇ ਹਿਦਾਇਤ ਸਥਗਾਂ ਜ਼ਹਾਨ (ਵਿਸ਼) ਮਾਟੇ। ਤੇਮਾਂ ਖੁਲਕ-ਖੁਲਵਾ ਨਿਸ਼ਾਨੀਓ ਛੇ, ਮਕਾਮੇ ਈਅਡਾਈਮ ਅਨੇ ਕੇ ਸ਼ਖਸ ਤੇਮਾਂ ਦਾਪਲ ਥਗੇ ਅਮਨਵਾਗੇ। ਅਨੇ ਅਲਵਾਡ ਮਾਟੇ ਲੋਡੇ ਪਰ ਐਤੁਲਵਾਡੀ ਉਜ਼ਨ ਛੇ, ਕੇ ਸ਼ਖਸ ਸ਼ਤਾਨਾ ਏਤੇਆਰਥੀ ਤੇਨੀ ਸ਼ਾਕਿਤ ਧਰਾਵੇ ਅਨੇ ਕੇ ਕੁਝ ਕੁਝ ਤੇ ਅਲਵਾਡ ਸਥਗਾਂ ਜ਼ਹਾਨਥੀ ਏ ਨਿਧਾਤ ਛੇ।)

ਅਨੇ ਅਲਵਾਡ ਤਾਨਾਵਾ ਕੁਚਾਨ ਸ਼ਾਰੀਫਮਾਂ ਫਰਮਾਵੇ ਛੇ, ਵ ਅਤਿਮਭੁਲਹੁਨਜ ਵਲਉਭਤਾ ਲਿਵਲਾਡੁ।”
(ਅਥੰ : ਉਜ਼ਨ ਅਨੇ ਉਭਹੇ ਅਲਵਾਡ ਮਾਟੇ ਪੁਰਾ ਕੁਝੇ।)

ਇਜ਼ਾਰੀ ਇਤੀਲਤ ਹੀਸਨੀ
ਰੋਥਾਨੀਮਾਂ

(੧) ਸਾਡੀਅ ਸੁਵਿਲਮ ਸ਼ਾਰੀਫਮਾਂ ਇਤਰਤ ਅਥੁ ਹੁਰੁ-ਰਲ ਰਲਿਕਾਡੇ। ਤਾਨਾਵਾ ਅਨਹੋਥੀ ਰਿਵਾਇਤ ਛੇ ਕੇ, ਹੁਕੂਰ ਰਸੂਲੇ ਖੁਦ ਸ਼ਕਵਾਡੇ। ਅਥਾਧਲੇ ਵਸ਼ਕਮੇ ਖੁਲ੍ਹੇ ਪਥੇ, ਤੇਮਾਂ ਆਪੇ ਫਰਮਾਵਥੁ, ਹੈ ਲੋਡੇ। ਤਮਾਰੀ ਪਰ ਇਜ਼ਨ ਇੰਝ ਕਵਾਮਾਂ ਆਨੀ ਮਾਟੇ ਉਜ਼ਨ ਅਥਾ ਕੁਝੇ, ਏਕ ਮਾਥੁਸੇ ਅਰਨ ਕੁਝੇ ਕੇ, ਫਰ ਵਖੇਂ ਧਾ ਰਸੂਲਵਲਾਹੁ? ਹੁਕੂਰ ਸ਼ਕਵਾਡੇ। ਅਥਾਧਲੇ ਵਸ਼ਕਮੇ ਮੌਨ ਧਾਰਥ ਕੁਝੁਂ ਤੇ ਸਹਾਅਿਏ ਤਰਖਾਰ ਏ ਸਵਾਲ ਫੋਡਰਾਵਥੇ। ਪਥੀ ਹੁਕੂਰ ਈਸ਼ਾਵਿ ਫਰਮਾਵਥੇ, ਜੇ ਹੁੰ ‘ਹਾ’ ਕਈ ਵੇਤ ਤੇ ਤਮਾਰਾ ਪਰ ਵਾਨਿਅ ਧਈ ਜਾਤ, ਅਨੇ ਤਮਾਰਾਥੀ ਫਰ ਵਖੇਂ ਧਈ ਸ਼ਾਕਤੁ ਨਹਿ।” ਪਥੀ ਆਪੇ ਫਰਮਾਵਥੁ, ਜਥੋਂ ਸੁਖੀ ਹੁੰ ਕੋਈ ਵਾਤਨੇ ਤਮਾਰਾਥੀ ਅਧਾਨ ਨਾ ਕਰੁਂ ਤੰਮੇ ਮਾਰਾਥੀ (ਤਿਨੇ) ਸਵਾਲ ਕੁਝੇ ਨਹਿ। ਆਗਜਨਾ ਲੋਡੇ, ਵਹੁ ਪਤਾ ਸਵਾਨੇ। ਅਨੇ ਪਥੀ ਇਤਰੇ ਨਥੀਮੋਨੀ ਮੁਖਾਲੇਕਿਤ (ਵਿਲਕਤਾ)ਦਾ ਕਾਰਣੇ ਅਰਥਾਵ ਧਈ ਗਿਆ। ਏਥੇਲਾ ਮਾਟੇ ਜਥਾਰੇ ਹੁੰ ਕੋਈ ਵਾਤਨੋ ਹੁਕਮ ਆਪੁਣੇ ਤੋ ਜਥਾਂ ਸੁਖੀ ਸ਼ਾਕਤ ਹੋਵ ਤੇਨੇ ਕੁਝੇ। ਅਨੇ ਜਥਾਰੇ

કુંડોઈ વાતથી મના ફરમાવી દઉં, તો તેને છોડી દો.

(૨) ખુખારી-મુસ્લિમમાં હજરત અષ્ટુ હુરેરહ રહિયલ્લાહો તથાલા અન્હોથી મરવી છે કે, હુઝુરે અદ્વિતીસ સહ્લલ્લાહો અલયહે વસ્તુલમથી અરજ કરવામાં આવી. કચો અમલ અદ્વિતી છે? આપે ફરમાન્યું: અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવવું. પછી વિનંતી કરવામાં આવી કે, પછી કચો અમલ ઉત્તમ છે? આપે ફરમાન્યું: અલ્લાહના માર્ગમાં જેહાદ કરવું. પછી અરજ કરવામાં આવી કે, તેના પછી કચો અમલ અદ્વિતી છે? હુઝુરે ફરમાન્યું: હજને મફરૂર." (મકબુલે બારગાહ થએલી હજન) હજન કર્યા પછી માણસ વધારે સુતકી, પરહેજગાર અને નેક બની જય. ઇસ્કો-ઇન્જુરને ત્યજુ હે.)

હૃદીસ (૩) ખુખારી, મુસ્લિમ, તિરમિઝી, નિસાઈ અને ઈધને માન હજરત અષ્ટુ હુરેરહ રહિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુઝુર રસૂલે ખુદા સહ્લલ્લાહો અલયહે વસ્તુમ ઈર્શાદ ફરમાવે છે: જેણે હજન અદા કરી, અને રહસ (અભિત્સ શઘ્દો કાદ્યા નહિ) કર્યો નહિ અને ઇસ્ક (શુનોહ) કર્યો નહિ, તો તે ગુનાહોથી પાક સાફ થઈને એવો પાછો ઈર્યો જેવો. તેજ દિવસે માના પેઠથી પેદા થયો.

હૃદીસ (૪) ખુખારી અને મુસ્લિમ તથા નિસાઈ અને ઈધને માન હજરત અષ્ટુ હુરેરહ રહિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, ઉમરાથી બીજા ઉમરા સુધી. તે ગુનાહોનો કફીરા છે જે ને એની વચ્ચે થયા અને મફરૂર હજનનો સવાખ જન્મત જ છે.

હૃદીસ (૫) મુસ્લિમ અને ઈધને ખુજ્યમહ વિગેરે હજરત અમ્ર ઈધને આસ રહિયલ્લાહો તથાલા અન્હોથી રિવાયત કરે છે કે, હુઝુર રસૂલે ખુદા સહ્લલ્લાહો અલયહે વસ્તુલમ ઈર્શાદ ફરમાવે છે. હજન તે ગુનાહોને દુર કરી દે છે જે એ પહેલા થયા છે.

હૃદીસ (૬-૭) ઈધને માન હજરત ઉમ્મુલ મુમેનીન બીખી આધિશા સિદ્ધીકા રહિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુઝુર રસૂલે ખુદા સહ્લલ્લાહો

અલયહે વસ્તુલમે ફરમાન્યું: હજન કમજોર લોડો માટે જિહાદ છે." અને હજરત ઉમ્મુલ મુમેનીન બીખી આધિશા સિદ્ધીકા રહિયલ્લાહો અન્હોથી ઈધને માનએ રિવાયત કરી કે, "મેં અરજ કરી કે યા રસૂલુલ્લાહ! ઔરતો પર જિહાદ છે?" ફરમાન્યું: "હા, તેમના જરૂમે તે જિહાદ છે, જેમાં લાહવું નથી (એટલે) 'હજ અને ઉમરહ.' ખુખારી મુસ્લિમમાં બીખી આધિશાથી જ રિવાયત છે કે, હુઝુરે ફરમાન્યું તમારે જિહાદ હજન છે.

હૃદીસ (૮) તિરમિઝી ઈધને ખુજ્યોમા અને ઈધને હજાન, હજરત અષ્ટુલ્લાહ ઈધને મસ઼ઓદ રહિયલ્લાહો તથાલા અન્હોથી રિવાયત કરે છે કે, હુઝુરે અદ્વિતીસ સહ્લલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે. હજ અને ઉમરહ મુહિતાળ (મુહલિસી) અને ગુનાહોને એવી રીત દૂર કરી નાખે છે જેવી રીત ભણી લોખાંડ, ચાંદી અને સોનાના મેલ કાટને દૂર કરી નાખે છે. અને "હજને મફરૂર" તો સવાખ જન્મત જ છે.

હૃદીસ (૯) ખુખારી, મુસ્લિમ, અષ્ટુલ્લાહિ, નિસાઈ અને ઈધને માન વિગેરે હજરત અષ્ટુલ્લાહ ઈધને અષ્ટુસ રહિયલ્લાહો તથાલા અન્હોથી રિવાયત કરે છે કે, હુઝુરે અદ્વિતીસ સહ્લલ્લાહો અલયહે વસ્તુલમે ફરમાન્યું: રમજાન શરીએમાં ઉમરહ (કરવો) મારી સાથે હજનની બરામર છે.

હૃદીસ (૧૦) બજારારે હજરત અષ્ટુ સુસા રહિયલ્લાહો તથાલા અન્હોથી રિવાયત કરી કે હુઝુરે ફરમાન્યું: હાજ પોતાના ધરવાળાએમાંથી ચારસેની શિક્ષાઅત કરશે અને ગુનાહોથી એવો નીદળી જરી જેવો કે તેજ દિવસે માના પેઠથી પયદા થયો.

હૃદીસ (૧૧-૧૨) બયહકી હજરત અષ્ટુ હુરેરહ રહિયલ્લાહો તથાલા અન્હોથી રિવાયત કરે છે કે, મેં અષ્ટુલ કાસિમ (હુઝુર) સહ્લલ્લાહો અલયહે વસ્તુલમને ફરમાવતા સાંબળ્યા છે જે ખાત્મે કાયાના ધરાદાથી આવ્યો અને ઉંટ (સવારી) પર સવાર થયો, અને ઉંટ નેટલા હગલા ઉપાડે છે અને માડે છે, અલ્લાહ તથાલા તેના બદ્લામાં તેના માટે નેક લખે છે, અને ખતા (શુનોહ) લુંસી

નામે છે અને દરજને ખુલંદ ફરમાવે છે, ત્યાં સુધી કે જ્યારે કચ્ચાએ મુઅઝભાની નજીક પહોંચ્યો અને તવાં કર્યો, પછી સહી-મરવાની વચ્ચે સધ કરી, પછી માયું સુદ્ધાન્યું, અથવા વળ કટરાયા તો શુનાહોથી એવો નીકળો ગયો નેવું તે હિવસે કે માના પેઠથી પેઢા થયો. તેની જ નેમ હજરત અફદું દ્વાણ ધર્યને ઉમર રહીયલાહો અનહોથી મરવી થઈ છે.

હૃદીસ : (૧૩) ધર્યને ખુલ્યમહ અને હાકીમ ધર્યને અભ્યાસ રહીયલાહો અનહોથી રિવાયત કરે છે કે, રસુલુલ્લાહ, સહ્લલાહો અલયહે વસ્તલમે ફરમાવે છે. ને મજૂથી પગપાળા હજજ માટે જન્ય ત્યાં સુધી કે મજ્જા પાછો આવે, તેના માટે ફરે હળાલે સાતસો (૭૦૦) નેકોએ, હરમ શરીરની નેકોએની મિસ્લ (જેમ) લખવામાં આવશે. પુછવામાં આન્યું કે, હરમ શરીરની નેકોએનું પ્રમાણ શું છે? આપે ફરમાન્યું : ફરેક નેકી લાખ નેકી (બરાબર) છે. તો આ હિસાએ ફરેક કથમ-હળાલ પર સાત કરોડ નેકોએ. થથ. “વહલાહો જુલ દૂદિલિલ અઝીમ” (અલાહ, મહાન અઝીમ ફરજલવાણો છે.)

હૃદીસ : (૧૪ થી ૧૬) બજારે હજરત જનિર રહીયલાહો ત્યાલા અનહોથી રિવાયત કરી કે, હુદ્દૂરે અકદસ સહ્લલાહો અલયહે વસ્તલમે ફરમાન્યું : હજજ અને ઉમરહ કરવાવાળા અલલાહના વિદ (પ્રતિનિધિ મંણા) છે. અલલાહે તેમને ઓલાયા, તે હાજર થયા. તેમણે અલલાહથી સવાલ કર્યો, તેણે તેમને અર્પણ કર્યું. તેના નેમજ ધર્યને ઉમર અને અણુ હુરયરહ રહીયલાહો અનહુ મથી રિવાયત થયેલાછે.

હૃદીસ : (૧૭) બજાર અને તિથાની હજરત અણુ હુરયરહ રહીયલાહો અનહોથી રિવાયત કરે છે કે, હુદ્દૂરે ફરમાન્યું : હાજની મગફેરત થઈ જન્ય છે. અને હાજ નેના માટે ધસ્તિગફાર (મગફેરતની દુઆ) કરે તેના માટે પણ મગફેરત થઈ જન્ય છે.

હૃદીસ : (૧૮) અસ્થહાની ઈજને અભ્યાસ રહીયલાહો અનહોથી રિવાયત કરે છે કે, હુદ્દૂરે રસુલુલ્લાહ, સહ્લલાહો અલયહે વસ્તલમે ફરમાવે છે: કર્ણ હજજ જેણી અદા કરો. કારણ કે શું અખર

શું પેશ આવે? અને અણુ દાઉદ ત્યા હારોમીની રિવાયતમાં એવું આન્યું છે, “જેનો હજજનો ધરાહો હોય તે જદ્દી કરો.”

હૃદીસ : (૧૯) તિથરાની ઔસ્તતમાં હજરત અણુ જર રહીયલાહો ત્યાલા અનહોથી રિવાયત કરે છે કે, હુદ્દૂર નભીએ કરીમ સહ્લલાહો. અલયહે વસ્તલમે ફરમાન્યું કે, દાઉદ અલયહિસહ્લામે અરજ કરી કે, હે અલ્લાહ જ્યારે તારા બંધાએ તારા ધરની જિયારત (દર્શન) માટે આવે ત્યારે તુ એમને શું અર્પણ ફરમાવશે?” ફરમાન્યું : ફરેક અઈર (દર્શનાર્થી)નો. તેના પર હજ છે, એની જિયારત માટે જન્ય. તેમનો મારા પર એ હજ છે કે, હુનિયામાં હું તેમને આફીયત (સુખ-શાંતિ) આપણિ અને જ્યારે મને (કયામતને હિવસે) મળશે ત્યારે હું તેમની મગફેરત ફરમાની હશીશ.

હૃદીસ : (૨૦) તિથરાની કથીરમાં અને બજાર ઈને ઉમર રહીયલાહો ત્યાલા અનહોથી રિવાયત કરે છે કે, તે કહે છે : હું મિનાની મસજદમાં હુદ્દૂર નભીએ કરીમ સહ્લલાહો. અલયહે વસ્તલમની પિછમત-સેવામાં હાજર હતો. એક અનસારી અને એક સંક્રિએ હુદ્દૂરની સેવામાં હાજર થઈને સલામ અરજ કરી પછી વિનંતી કરી કે, યા રસુલુલ્લાહ સહ્લલાહો અલયહે વસ્તલમ! એમે કાંઈ પુછવા માટે હુદ્દૂરની મુક્દસ સેવામાં હાજર થયા છીએ. આપે ઈર્શાદ ફરમાયો. “જો તમે ઈચ્છા તો હું ખતાવી દઉ કે તમે શું પુછવા માટે હાજર થયા છો? અને જો તમે ચાહો તો હું કાંઈ કહું નહિ, તમે સવાલ કરો.” સહાણીએ અરજ કરી કે, યા રસુલુલ્લાહ! અમને આપ જ ખતાવી દો. ઈરશાદ ફરમાયો. તું એટલા માટે હાજર થયો છે કે, ધરથી નીકળાને ષૌલુલહરામ (હરમતવાળું) ધર. ષૌલુલહાહ શરીરના કરદ (ઈરાદા)થી જવાના સંખ્યા પુછપરછ કરે અને એ કે તેમાં તારા માટે શું સવાય છે? અને તવાં પછી એ રક્ખતો પઠવાને, અને એ કે તેમાં તારા માટે શું સવાય છે? અને સહી-મરવાની વચ્ચે સાઈને અને એ કે તેમાં તારા માટે

શું સવાય છે ? અને અરક્ષણી સાંજે લુક્કેદેને અને તારા માટે તેમાં શું સવાય છે ? અને જેમારના ‘રમી’ (શૈતાનેને કંકરીએ મારવા)ને અને તેમાં તારા માટે શું સવાય છે ? અને કુર્ણાની કરવાને અને તેમાં તારા માટે શું સવાય છે ? અને તેની સાથે “તવાઇ એકાજા”ને (પુષ્ઠવા આવ્યો છે), તે માણસે અરજ કરી ડે, “સોગંદ છે, તે જાતની કેળું હુંઝુર રસુલે ઝુદા (સહલલદાહો અલયહે વસલલમ) ને હુક્કની સાથે મોકદ્યા છે. હું એટલા માટેજ હાજર થયો હતો ડે, આ આખતોને હુંઝુરથી દસ્યાદીત કર.” હુંઝુરે અકદસે ઈર્શાદ ફરમાવ્યો.

જ્યારે તું બેનુલ-હરામતા પાડા ઈરાદાથી ધરથી નીકળ્યો ત્યારે ઉંટના દેરેક કદમ (ગાલા) મુકવા અને દેરેક ગાલું ઉપાડવા પર તારા માટે ‘હુસના’ (નેક્સ) લખવામાં આવશે અને તારી ખતા મિટાવી દેવામાં આવશે. તવાઇ પઢીની એ રક્ષયતો એવી છે હા. ત. હજરત ઈરમાઈલ (અલયહિસ્લલમ) ના વંશમાંથી ડોછ ગુલામ હોય, તેને આજાદ કરવાનો સ્વાય; અને સાઝી મરવાની વચ્ચેની સર્હિનો સવાય એટલો બધ્યો છે હા. ત. ૭૦ ગુલામો આજાદ કરવા પરાબર સવાય છે. અને અરક્ષણાના દિવસે લુક્કે (અરક્ષણમાં થોલવાને) કરવાનો હાલ એ છે ડે, અદ્દાહ ત્યાલા અજર વ જરદા આસમાં હુનિયાની તરફ ખાસ તબદ્દી ફરમાવે છે, અને તમારી સાથે મલાન્યેકા ઇરિશતાએ પર સુધાહાત ફરમાવે છે. ઈરશાદ ફરમાવે છે: મારા અંદા દૂર હુંઝુરથી વિભરાયેલા બાલ (પરાગંદા માંયો) મારી રહુમતના ઉમ્મેદવાર થઈનો હાજર થયા, જો તમારા ચુનાંડો રેતીની રંજકણો અને વરસાદના કંતરાએઓ અને દસ્તિના જાગ (ફાણ)ની પરાબર હોય તો (પણ) હું બધા ચુનાંડોને અફી આપીશ. મારા અંદા પાણ જાયો, તમારી અખથીશ થઈ ગઈ, અને તેની (અખથીશ થઈ ગઈ) જેની તમે શરીરાચાળ કરો. અને જરમારાએ (શૈતાને કંકરીએ મારવાના સ્તલ) પર રમી (કંકરીએ મારવા) કરવામાં, દેરેક કંકરી પર એક એવો કંખારા (ચુનાંડ)

લુંસી નાંખવામાં આવે છે ને અરથાદ કરવાવાળો છે. અને કુર્ણાની કરવી તે તારા રઘુને હુંઝુર તારા માટે જર્ખારો સંગ્રહ (લંડાન) છે. અને માથું મુંથાવવામાં દેરેક વાળને ખદ્દે હુસના લખવામાં આવશે; અને એક ચુનાંડ નષ્ટ કરવામાં આવશે. ત્યાર પછી ખાનએ ઉદ્યથહના તવાઇનો એ હાલ છે ડે, તું તવાઇ કરી રહ્યો છે અને તારા માટે ડોઈ ચુનાંડ નથી. એક ઇસ્ત્રિતો આવશે અને તારા એ ખલાની વચ્ચે હાથ ચુશોને કંદેશો : લવિષ્યના માટે અમલ કર, અને ભુતકણમાં ને કંઈ હતું તે માફ કરી દેવામાં આવ્યું.”

(નોટ : ઉપરોક્ત હૃદીસને પરાબર ઈમાનની નજરથી વાંચો. અને મનન કરો. શું આ હૃદીસથી ઈદમે ગયથે રસુલ સહલલદાહો અલયહે વસલલમનો જીવતો-જાગતો સસ્યુત મળતો નથી ? સહાયીના મનની અંદરની વાત આપે જાણી લીધી અને તરત જ પ્રથમાં ફરમાવી લીધી. ઉપરોક્ત હૃદીસથી એસાં હુંઝુરના ઈદમે ગયથાની સાબિતી મળે છે. —અનુ.)

હૃદીસ (૨૧) હજરત અયુ યથલા, હજરત અયુ હુંઝુરહ રહીયદલાહો ત્યાલા અન્હોથી રિવાયત કરે છે ડે, હુંઝુર રસુલે ઝુદા સહલલદાહો અલયહે વસલલમે ફરમાન્યું : ને હજરત અદા કરવા માટે નીકળ્યો. અને (માર્ગભાંગ) મુંયુ પાંચ્યો. તો કિયામત સુધી તેના માટે હજરત કરવાવાળાનો સવાય લખવામાં આવશે. અને ને ઉમ્રહ માટે નીકળ્યો. અને (અર્ગભા) મુંયુ પાંચ્યો. તો તેના માટે કિયામત સુધી ઉમ્રહ કરવાવાળાનો સવાય લખવામાં આવશે, અને ને જિહાદ (ધર્મસુદ્ધ) માં ગયો. અને મુંયુ પાંચ્યો. તો તેના માટે કિયામત સુધી ‘ગાજી’ નો સવાય લખવામાં આવશે.

હૃદીસ (૨૨) તિથરાની, અયુ યથલા, દારો કુલી અને બયહડી હજરત ઉમ્મુલમુમેનીન બીભી આઈશા સિદ્દીકા રહિયદલાહો ત્યાલા અન્હાથી રિવાયત પ્રથમાં કરે છે ડે, હુંઝુર રસુલે ઝુદા સહલલદાહો અલયહે વસલલમ ઈર્શાદ ફરમાવે છે ડે : ને આ

માર્ગમાં હજજ અથવા ઉમરહ માટે નીકળ્યો અને મૃત્યુ પામ્યો તો તેની પેશી થશે નહિ, ન હિસાય થશે. અને તેને કહેવામાં આવશે, તુ જનતમાં દાખલ થઈ જ.

હૃદીસ (૨૩) તિઝરાની હજરત જનિર રહિયલાહો અન્હોથી રિવાયત વિધાન કરે છે કે, હુસુર રસૂલે ખુદા સંદ્ઘલાહો અલયહે વસદલમે ઇરમાબ્યું : આ ધર ઇરલામનાં રતંબો ચૈકી એક સતંલ છે. પછી જેણે હજજ કરી અથવા ઉમરો કર્યો, તે અલ્યાહીની જમાનતમાં છે. જે મરી જશે તો અલ્યાહ ત્યાલા તેને જનતમાં દાખલ ઇરમાવશે, અને ધરે પાછો ઇરવે તો અજરો (નેક બહલો) ગનીમત સાથે વાપસ કરશે.

હૃદીસ (૨૪-૨૫) દારોમી, હજરત અણુ ઓમામહ રહિયલાહો ત્યાલા અન્હોથી રિવાયત કરે છે કે, હુસુર રસૂલે ખુદા સંદ્ઘલાહો અલયહે વસદલમે ઇરમાબ્યું : જેને હજજ અદ્દ કરવાથી જહેરી જરૂર માનેઅ (આધક) થઈ નહિ, ના ઊલિમ બાદશાહ, ના કોઈ એવી ધીમારી ને હજજ કરવા જવાથી રોકી હે, તેમ છતાં, જે તે હજજ કર્યા વગર મરી ગયો તો યહુદી થઈને મૃત્યુ પામે અથવા નરરાની (ખ્રિસ્તા) થઈને મરી જય, આ લીસની જેમ તિરમિજાએ હજરત મૌજૂદા અલી રહિયલાહો ત્યાલા અન્હોથી રિવાયત કરી છે.

હૃદીસ (૨૬) તિરમિજી અને ઈન્ને માર્ગ, ધૂમતે ઉમર રહિયલાહો ત્યાલા અન્હોમાથી રિવાયત કરે છે કે, એક માણુસે સવાલ પૂછ્યો કે, કઈ વસ્તુ હજજને વાજિય કરે છે ? કરમાબ્યું તોશા (આપવા-જવામાં ખાચાનું લાયું) અને સવારી.

હૃદીસ (૨૭) શર્હ સુનહમાં, તેમનાથી (ઈન્ને ઉમર રહિયલાહો અન્હોમા) રિવાયત છે, કોઈઓ વિનંતી કરી કે યા રમૂલલાહ ! હાજરે કેવું હોય જોઈએ ? આપે ઇરમાબ્યું : પરાગં દા માથું, મેલું-કુચ્ચેલું, ધીન સહાયાએ પૂછ્યું, યા રસૂલલાહ ! હજજનો કંગો અમલ અરેજા છે ? આપે ઇરમાબ્યું,

મોટા સ્વરે લાખીએ કહેલું અને કુઅની કરવી. કોઈ ભીજાએ અરજ કરી : “સણીલા” શું છે ? આપે ઇરમાબ્યું : તોશા (આવતી જતી વખતે ખાવાની વ્યવસ્થા ત્યા ત્યાં સુધી બાલ બચ્ચાએ પણ ધરે સુખ શાંતિથી ખાઈ-પી શકે તે) અને સવારી.

હૃદીસ (૨૮) અણુ હાદદ અને ઈન્ને માર્ગ ઉમ્મલ મુમેની ઉભે સદ્ગ્રામ રહિયલાહો અનંદાથી રિવાયત કરે છે કે, મેં હુસુર રસૂલલાહ સંદ્ઘલાહો અલયહે વસદલમને ઇરમાવતા સાંભળ્યા છે, (આપ ઇરમાવે છે); જે કોઈ માણુસ મરજુદે અકુસાથી મરજુદે હરામ સુધી હજજ અથવા ઉમરાહનો એહારામ બાંધીને આવ્યો, તો તેના આગળના અને પાછળના સર્વ ચુનાહો બાંધ્યા દેવામાં આવશે. અથવા તેના માટે જનત વાજિય થશે.

હજજના હિક્કે મરલાએ।

એહારામ બાંધીને નવમી જિલહિજનાએ અરેસ્તાતમાં થાલવાનું અને ખાનએ કઅથાના તવાદ્દ કરવાનું નામ હજજ છે. તેના માટે એક ખાસ અને ચોક્કસ સમય સુકર્રેર કરેલ છે, જેથી તેમાં એ કાર્યો કરવામાં આવે, તો હજજ છે. હજજ હિજરી સન ૬ નાં ઈજ થઈ. તેની ઇરજીયત કર્ય છે. (કુઅનાં શરીરથી સાબિત છે.) જે તેની ઇરજીયતનો ઈન્કાર કરે તે કાદિર છે. પરંતુ હજ ઉમરમાં એક વાર ઈજ છે. (આદમજીરી-હરેસુખતાર)

મરાયલા (૧) દેખાવ કરવા માટે હજજ કરવા જવું, અને હરામ માલથી હજજ માટે જવું, હરામ છે. હજજ માટે જેને પરવાનગી લેવી વાજિય છે, તેની પરવાનગી વગર હજજ કરવા જવું મફક્ક છે, દા. ત. મા-આપ, જે તેની સેવા-ચાફરીના મોહતાજ હોય તો. જે મા-આપ ના હોય તો દાદા-દાદીનો પણ એ જ હુકમ છે. આ ઈજ હજજનો હુકમ છે. અને જે નિષ્ઠ હજજ હોય તો મુત્તેકન સર્વથા મા-આપની ઇરમાંઅરદારી કરે.

(હરે-સુખતાર, રહેદુલ સુહતાર)

મહસુદા (૨) છોકરો સૌદ્ધિવાન અને ખુઅસુરત અમરદ હોય તો જ્યાં સુધી દાડી ના નીકળે, બાપ તેને (હજજ માટે) જવાથી મનાઈ કરી શકે છે.
(હરે સુખતાર)

મહસુદા (૩) જ્યારે હજજ કરવા પર શક્તિમાન થઈ ગયો ત્યારે હજજ તરન જ ઈર્જ થઈ ગઈ, એટલે તેજ વર્ષ માં અને હવે વિલંબ કરવો ગુનોહ છે. અને કેટલાક વર્ષોં સુધી હજજ અદા કરી નહિ તો દાસિક છે, તેવા ભાણુસની ગવાઈ મરદુદ (રદ કરવાને લાયક) છે, પરંતુ જ્યારે પણ (હજજ) કરશે અદા જ છે, કરા નથી.
(હરે સુખતાર)

મહસુદા (૪) માલ મૌજુદ હતો, અને હજ કરી નહિ, પછી તે માલ તલદ (નાય) થઈ ગયો, તો પછી કરજ લઈને જય; અગરચે તે જાણુંતો હોય કે આ કરજ-દેવું અદા થશે નહિ. પરંતુ નિયત એ હોય કે, અલ્લાહ તચાલા શાકત આપશો તો અદા કરી દઈશ, પછી જે અદા થઈ રાક્યું નહિ અને નિયત અદા કરવાની હતી, તો ઉમ્માદ છે કે, મૌજા અજજ વ જલ્દ તેના પર મુચાખા (તકાઓ) ફરમાવશે નહિ.
(હરે સુખતાર)

મહસુદા (૫) હજજનો સમય શનવાલ મહિનાથી લઈ ૧૦ માં જિલ હજજ સુધી છે. કેમ કે તે પહેલા હજજના અદ્દાલ (કમાં) થઈ સકતાનથી એહરામ જિવાય. કેમ કે એહરામ તે પહેલાં પણ થઈ શકે છે. જો કે મફરૂહ છે,
(હરે સુખતાર-રદ્દુલ સુહૃતાર)

મહસુદા (૬) હજજ વાજિબ થવા માટે આડ શરતો છે. જ્યાં સુધી તે બધા ઉપલઘ્ય ન હોય, હજજ ઈર્જ નથી. શરત (૧) દરલામ. એટલા માટે કે જો મુસ્લિમાન હોવા પહેલા હજજ અદા કરવાની ઈરિતતાઅત (શક્તિ) હતી, પછી ફરજ (માલ રખ્યો નહિ) થઈ ગયો, અને ઈરલામ રખીકાર્યો તો કુબીના યુગની ઈરિતતાઅતના ખુન્યાદ પર દરલામ રખીકાર્યો પછી હજજ ઈર્જ થશે નહિ. કેમકે જ્યારે

ઈરિતતાઅત હતી તેનો અહલ (લાયક) ન હતો, અને હવે તેનો અહલ થયો, પરંતુ ઈરિતતાઅત (શક્તિ) નથી. અને મુસ્લિમાનને જો ઈરિતતાઅત હતી અને હજજ અદા કરી ન હતી, હવે ફરજ થઈ ગયો તો દમણાં પણ ફર્જ છે.

(હરે સુખતાર, રદ્દુલ સુહૃતાર)

મહસુદા [૭] હજજ અદા કરી લાધા પછી મુચાજલાહ સુતદ (ઈરલામથી ફર્જ ગયો) ઈર્જ ગયો, પછી ઈરલામ લાય્યો, તો જો ઈરિતતાઅત હોય તો ફર્જથી હજજ કરવી ઈર્જ છે. કેમ કે સુતદ થવાથી હજજ વિગેરે સર્વ સૌ આ'માલ રદ બાતલ થઈ ગયા [આલમગર્દી] એવા જ રાતેને હજજ દરમાન સુતદ થઈ ગયા તો એહરામ બાતલ ઈર્જ ગયું. અને જો કાદિરે એહરામ બાબુનું હતું, પછી તે ઈરલામ લાય્યો, તો જો દર્દાદો એહરામ ફર્જ અને હજજ કરી તો, હજજ થશે. નહિતર, થશે નહિ.

શરત (૨) દાદલ હંમાં હોય તો એ પણ જરૂરી છે ક, જાણુંતો હોય કે ઈરલામના દરાઇજમાં હજજ છે. એટલા માટે જ્યારે ઈરિતતાઅત હતી આ મહસુદાની અખર ન હતી, અને જ્યારે મહસુદાની અખર પરી ત્યારે ઈરિતતાઅત ન હોય તો હજજ ઈર્જ થઈ નહિ. અને મહસુદાની જાણુંતાની જરૂરી એ છે ક, એ હુક્મથી અથવા એક પુરુષ અને એ સ્ત્રીએ એ નંબતું દાસિક હુલું જાહેર હોય નહિ, તેને અખર આપે અને જો એક આઈલે (જો નંક) અને દર્દાઅતનો પાણ હોય અને જાહેરમાં દરદ્દમાં સંદોવયંલ હોય નહિ તે) અખર આપ્યા તો પણ હજજ વાજિબ ઈર્જ ગયું. અને જો દાદલ ઈરલામમાં છે, તો ર.લે ને હજજ ઈર્જ હુલું માદમ નાહોય, તેમ છતાં હજજ ઈર્જ ઈર્જ જશે. કેમ કે દાદલ ઈરલામમાં દરાઇજનો દરદ્દ ન હોયા હજજ નથી.
[આલમગર્દી]

શરત (૩) હજજ ઈર્જ હોવા ગાંઠ બાલિગ હોલું શરત છે. (બાલિગ એટલે મુખત વધ્યનું હોલું, અથવા પંદર વર્ષ મુશ્ય થયા હોય) નાબાલિગે

હજજ કરી, એટલે પોતાની આપમેળે, જ્યારે કે તે સમજણ્ણો હોય, અથવા તેના વક્તીએ (વડીલે) એહરામ બાંધ્યું હોય, જ્યારે કે તે અખૂસમજ હોય પ્રયોગ હાજરતમાં તે નિદ્દિલી હજજ થઈ, 'હજજતુલ ઈસ્લામ' એટલે ઈર્જ હજજને કાયમ મુકામ થઈ શકતી નથી.

મસ્ટાલા [૮] ના બાલિગે (જે પુઅત વયનું ના હોય તે) હજજતું એહરામ બાંધ્યું, અને તે વુદ્દુદે અરદ્દ પહેલાં આલિગ થઈ ગયો, તો જે ને પહેલા એહરામ પર રહી ગયો, તો નિદ્દિલ હજજ થઈ. હજજતુલઈસ્લામ (ઈર્જ હજજ) થઈ નહિ. અને જે નવેસરથી એહરામ બાંધીને વુદ્દુદે અરદ્દ (અરદ્દતમાં ઘોલવું) કર્યું, તો હજજતુલઈસ્લામ થઈ ગયું. [આલમગીરી]

શરત (૪) હજજ ઈર્જ હોવા માટે આકિલ હોવું શરત છે. મજતુન (ગાંડો-મુર્છિત) પર હજજ ઈર્જ નથી.

મસ્ટાલા [૯] મજતુન (મુર્છિત-ગાંડો) હતો અને વુદ્દુદે અરદ્દ પહેલાં જુતુન જણું રહ્યું, અને નવેસરથી એહરામ બાંધીને હજજ કરી, તો આ હજજ હજજતુલ-ઈસ્લામ થઈ ગઈ. નહિતર, થશે નહિ. બોધરા (ગાંડો) પણ મજતુનના ફુકમાં છે.

(આલમગીરી હુરે મુખતાર)

મસ્ટાલા (૧૦) હજજ કર્મા પછી મજતુન થયો, પછી સારો થઈ ગયો, તો તે મજતુનની હજ પર કોઈ અસર થશે નહિ. એટલે હવે તેને બીજ વખત હજજ કરવાની જરૂરત નથી. જે એહરામ વખતે સારો હતો, નથી મજતુન થઈ ગયો, અને હજજના અદ્દાચ (કર્મ) અદ્દા કર્મા, પછી વધો પછી હોશમાં આવ્યો તો ઈર્જ હજજ અદ્દા થઈ ગઈ. (મનાસિક)

શરત (૫) હજજ ઈર્જ હોવા માટે આજાદ હોવું શરત છે: લોંગી-ગુલામ પર હજજ ઈર્જ નથી. લલે ને તે મુદજિર અથવા મકાંતિબ અથવા ઉચ્ચે વલદ હોય લલે ને તેમના માલિકે તેમને હજજ

કરવાની પરવાનગી આપી દીધી હોય. લલે ને તે મકાં શરીરેમાં જ છે.

મસ્ટાલા (૧૧) ગુલામે પોતાના મૌલા (આકા-માલિક)ના સાથે હજજ કરી તો આ નિદ્દિલી હજજ થઈ, હજજતુલ-ઈસ્લામ થઈ નહિ. આજાદ થયા પછી જે હજજની શરતો ઉપદખધ હોય તો ઈર્જ વાર હજજ કરવી પડશે. અને જે પોતાના માલિક સાથે હજજ માટે જરૂર રહ્યો હતો, રસ્તામાં તેણે આજાદ કરી દીધો તો જે એહરામ બાંધતા પહેલા આજાદ થયો, હવે એહરામ બાંધીને હજજ કરી તો હજજતુલ-ઈસ્લામ [ઈર્જ હજજ] અદ્દા થઈ ગયું. અને જે એહરામ બાંધી લીધા પછી આજાદ થયો તો હજજતુલ-ઈસ્લામ થશે નહિ, લલે ને નવો એહરામ બાંધીને હજજ કરી હોય. (આલમગીરી)

શરત ક હું: તંડુરસ્ત હોય, નેથી હજજ માટે જરૂર શકે, અવયવો સલામત હોય. આંખવાળો જોઈ શકે તેવો હોય. અપંગ અથવા લક્ષવાળો; અને જેના પગ કુપાઈ ગયેલા હોય, વૃદ્ધ પર કે જે સલારી પર પોતો એસી શકતો ના હોય, હજજ ઈર્જ નથી. એવીજ રીતે આંખણા માણુસ પર પણ વાજિબ નથી. લલે ને હાથ પકડીને તેને દોરનારો મળો, એ બધા પર એ પણ વાજિબ નથી, કે કોઈને મોકલીને પોતાના તરફથી હજજ કરાવી હે, અથવા પરિપત કરી જય, અને જે તકલીફ ઉદાહિને હજજ કરી લીધી તો હજજ સહીહ થઈ ગઈ. અને હજજતુલ-ઈસ્લામ અદ્દા થઈ ગયું, એટલે જે તે પછી અવયવો દુરૂર થઈ ગયા તો હવે બીજ વાર હજજ ઈર્જ થશે નહિ. તે જ પ્રથમ હજજ કાઢી છે. (આલમગીરી વિગરે)

મસ્ટાલા (૧૨) જે પહેલા રવરથ અને તંડુરસ્ત હતો, અને અન્ય શરતો પણ ઉપદખધ હતો, છતાં તેણે હજજ કરી નહિ. પછી અપંગ-અપહિંગ વિગેરે થઈ ગયો કે, હજજ કરી શકતો નથી, તો તેના પર તે ઈર્જ હજજ બાકી છે, પોતો કરી શકે તેમ ના હોય તો હજજ બદલ કરવે.

(આલમગીરી વિગરે)

શરત જ મીં : સદરતા ખર્ચનો માલિક હોય. અને સવારી પર શક્તિમાન હોય. ચાહે તે સવારી (ધીણ-ઉંટ-મેયર, ઈત્યાદિ) પોતાની માલિકીની હોય અથવા તેના પાસે એટલો માલ હોય કે આડેથી લઈ શકે.

મસ્યલા (૧૩) ડોઈએ હજુન્ઝ માટે તેને એટલો માલ મુખ્યાદ (છુટ આપી દીધા) કરી દીધો કે તેનાથી હજુન કરી લે, તો હજુન કર્ઝ થઈ નહિ એભાઇની માલિકી થની નથી. અને હજુન કર્ઝ હોવા માટે માલિક હોતું જરૂરી છે. ચાહે મુખ્યાદ કરવાવળાનો તેના પર એહસાન હોય દા. ત. પરયા લોકો અથવા જેટલોક ના હોય દા. ત. મા-બાપ, ઔવાદ. એવી જ રૂટે જે આદ્યિતન (હાથ ઉઠીના) સરારી મળા જશે, તો પણ હજુન કર્ઝ નથી. (આલમગીરી)

મસ્યલા (૧૪) ડોઈએ હજુન માટે માલ હોય. (અખસાશ) કર્યો, તો કુશુલ કરવો તેના જરૂર વાગ્યાં નથી. આપનાર અનુનથી [પરાયા] હોય અથવા માં-બાપ, ઔવાદ વિગેરે. જે કુશુલ કર્યો લેશો તો હજુન વાગ્યાં થર્ઝ જશે. (આલમગીરી)

મસ્યલા (૧૫) “સદરનો ખર્ચ તથા સવારી પર કાદિર” (શક્તિમાન) હેલાનો. એ અર્થ છે કે, આ વસ્તુઓ તેની જરૂરનું ઉપરાંત હોય [જરૂરતથા વધારેની હોય] દા. ત. મધ્યાન, લેઅસ [પોપાક], ખાદિમ [સંઘક-નોકાં] અને સંપરાંતું નનાર, ધંધાના એનાંદી, ખાનાદારી જાંનો સામાન [ધર વખર] અને દેવા થી એટલા વારે હોય કે, સવારી પર મંકડા શરીર જાણ અને ત્યાથી સવારી પર પાછો ઇરે અને ગયા પદ્ધતી બાદ-ગચ્છા, પત્નીના ભરણું પોષણ રૂધા ધરના રિપેરીંગ માટે કાંઈ-કુર્રનો માલ છોડી જાય. જવા-આવવામાં પોતાનું ભરણું પોષણ તથા ધરે અહલો-આયાલ [આલ-અદ્યાં] અને પત્નીના ભરણું પોષણમાં ભધ્યમ પ્રમાણું માન્ય છે. ના કોઈ હોય ના કુશુલ-વયર્ઝ ખર્ચ હોય. અહલો અયાલ થી તે લોકો સુરોદ છે, જેનું ભરણું પોષણ

તેના પર વાજિય છે. જે જરૂરી નથી કે. આવવા પણી પણ તાં અને અહિંના ખર્ચ કર્યા પણી કાંઈ આકી અચે. (હર્રે સુખતાર, આલમગીરી)

મસ્યલા (૧૬) સવારીથી સુરોદ તે પ્રકારની સવારી છે, જે પ્રકારિત અને આદતન તે શખ્સની સ્થિતિને અનુલક્ષિતે હોય. દા. ત. જે તે માલદાર (શ્રીમંત) અને વૈભની હોય તો તેના માટે (શક્કદ્દ) હૃદાર થશે. એવી જ રીતે તોશા (ખાવા-પીવા) માં તેના સુનાસિય પોરાક જેઈએ, સામાન્ય ખાલું ઉપકાંખ થર્ઝ જવું હજુન કર્ઝ હોવા માટે પુરું નથી. જ્યારે કે તે સારા પોરાક (નોજન)ની આદત વાળો હોય. (મુંસિક)

મસ્યલા (૧૭) જે લોકો હજુન માટે જાય છે તેઓ સગા-સંઅંધીઓ. ને મિત્રા માટે તોહદ્દા લાંયા કરે છે. આ જરૂરીઆતથી નથી. એટલે જે ડોઈની પાસે એટલો માલ છે કે, ને જરૂરીયાતો અતાવવામાં આવી, તેના ગાટે અને આવવા જવાના ખર્ચાંગો માટે પુરનો છે, પરંતુ તેમાં કાંઈ બયશે નાદિ, કે હોલોટો ત્થા સગા-લાંયાઓ. માટે લેટ લાવી શકે, તો પણ હજુન કર્ઝ છે. તે કારણે હજુન ના કર્વી દરમ છે. (રદ્દહલ સુહતાર)

મસ્યલા (૧૮) જેની અસર ઔદ્ધાર (આજવિકા) વહેપાર પર છે, અને તેમાંથી એટલી હુસ્તિયત થર્ઝ ગાંધ કે પોતાના જવા-આવવાનો ખર્ચ અને પાંજ ઇરણ્યા નુંદી આલ-અદ્યાનો. પોરાક કાઢી લે તો એટાં આકી રહેશે જેનાથી પોતાનો વહેપાર પોતાના ગુલાન પ્રમાણે કદ્રી શકે તો હજુન કર્ઝ છે. નહિનુર નથી. અને જે તે એડૂટ છે, તો તે બધા ખર્ચાંગો પણી એટાં અચે કે જેઠીના સામાન હળ, જળ વિગેરે માટે પુરું હોય તો હજુન કર્ઝ છે. અને ધંધાદારાઓ માટે તેમના ધંધાના સામાનને લાયક માલ [નાણા] અચ્યો જરૂરી છે. (આલમગીરી હર્રે સુખતાર)

મસ્યલા (૧૯) સવારીમાં પણ એ રૂટે કે, ખાસ તેના માટે હોય, જે એ માણસોની

ભાગીદારીમાં છે, કે વારા ઇરતી બંને થોડે થોડે દુર સવાર હોય છે, તો એ સવારી પર કુદરત નથી. એટલે હજાજ ઈર્ઝ નથી. એવી જ રીતે ને એટલી શક્તિ છે કે એક મંજિલ (પગાવ) માટે હા. ત. ભાડેથી જનવર લે, પછી એક મંજિલ પગપાળા ચાલે (એવી રીતે આગળ સમળે) તો એ સવારી પર કુદરત નથી. (આદમગીરી).

આજકાન જે શક્તિ અને શક્તિ નો રિવાજ છે કે એક માણુસ એક તરફ સવાર થાય છે અને બીજે માણસ બીજુ તરફ સવાર થાય છે, ને એવી રીતે એ વચ્ચે સવારીનું જનવર ભાગીદારીમાં હોય તો હજાજ ઈર્ઝ છે, કેમ કે સવારી પર કુદરત (શક્તિ) ઉપયોગ થઈ અને પગપાળા ચાલવું પડ્યું નહિ, (રદ્દુલ મુહુતાર)

મહસુલા (૨૦) મહ્કા મુઅબ્ઝમા અથવા મહ્કા મુઅબ્ઝમાથી ત્રણ દિવસથી ઓછા રસ્તા-વાળાઓને આટે સવારી શરત નથી. ને પગપાળા ચાલી શક્તા હોય તો, તેમના પર હજાજ ઈર્ઝ છે. અદેને સવારી પર કાદિર ના હોય.. અને ને પગપાળા ચાલી શકે તેમ ના હોય તો તેમના આટે પણ સવારી પર કુદરત ધરાવવું શરત છે. (આદમગીરી-રદ્દુલ મુહુતાર)

મહસુલા (૨૧) મીકાતથી બધાર રહેવાઓન્યારે મીકાત સુધી પહોંચી જય અને પગપાળા ચાલી શક્તો હોયે તો તેના માટે સવારી શરત નથી, એટલા માટે ને ઇઝીર હોય તો પણ તેને ઈર્ઝ હજાજની નિયત કરવી જોઈએ, નિઝલની નિયત કરો તો તેને તેના પર બીજુ વાર હજાજ કરવી ઈર્ઝ થશે. અને જે સુલાક (સર્વથા) હજાજની નિયત કરી એટલે ઈર્ઝ અથવા નિઝલ કાઈ નક્કો કર્યું નહિ તો ઈર્ઝ અદા થઈ ગયો. (રદ્દુલ મુહુતાર)

મહસુલા (૨૨) તેની જરૂર નથી કે મહમલ વિગેર આરામની સવારીઓનું બાડું તેની પાસે હોય બદ્દુક ને કણવા (ઉંટ પર મુફ્તવાની કાઢી) પર એસંચેતું બાડું છે, હજાજ ઈર્ઝ છે. હા, ને કણવા

પર એસી શક્તો ના હોય તો મહમલ (ઉંટ પર આરામની એસવાનું આસન) વિગેરના લાગથી કુદરત સામિત થશે, (દર્દેમુખતાર-રદ્દુલ મુહુતાર)

મહસુલા (૨૩) મહ્કા શરીર અને મહ્કાશરીએથી નાથક રહેવાવાળાઓને સવારીની જરૂરત હોય તો અન્યર અથવા ગવેઠા બાડેથી લેચા પર શક્તા ધરાવતો હોવાથી પણ સવારી પર કુદરત થઈ જશે, ને તેના પર સવાર થઈ શકો, તેના વિશ્ક દુરવાળા-ઓને માટે ઉંટનું બાડું હોલું જરૂરી છે, કેમકે દુરવાળાઓ માટે અન્યર નિગેર સવાર થના ત્યા સામાન ઉપાયના માટે પુરતા નથી. અને આ ઇર્ઝ દરેક જગ્યાઓ ધ્યાનમાં રહેવો જોઈએ. (રદ્દુલ મુહુતાર)

મહસુલા (૨૪) પગપાળા ચાલવાની શક્તા હોય તો પગપાળા હજાજ અદા કરવી અફ્જાન (ઉત્તમ). છે. હુદીસ શરીરથી માણુસ-પગપાળા હજાજ કરે તેના માટે ફરેક ફદ્દમ પર સાતસે (૧૦૦) નેકીએ છે. (રદ્દુલ મુહુતાર)

મહસુલા (૨૫) ફરીર (ને માલદાર ના હોય તે) પગપાળા હજાજ કરી લીધી, પછી માલદાર થઈ ગયો, તો તેના પર બીજુખાર હજાજ કર્યું ઈર્ઝ નથી. (આદમગીરી)

મહસુલા (૨૬) એટલે માન છે કે તેનાથી હજાજ કરી શકે છે, પરંતુ તે માલથી નિકાહ કરવા ચાહે છે, તો નિકાહ ના કરે, બદ્દે હજાજ કરે, કેમકે હજાજ ઈર્ઝ છે, એટલે જ્યારે હજાજનો જમાનો (શર્વાલના પહેલા ચાંદથી...) આવી ગયો હોય, અને ને પહેલા નિકાહમાં ખર્ચ કરી નાંખ્યા અને મુજર્દ (નિકાહ વગર એકલા) રહેવામાં ચુનાલ થઈ જવાનો લય હતો તો વાંધ્યો નથી. (આદમગીરી-દર્દે મુખતાર)

મહસુલા (૨૭) રહેવા માટે ધર, પિઘમત (સેવાચાડી) માટે ચુલામ, પહેરવા માટે કપડાં અને વાપરવા માટે રાચયનીલું છે, તો હજાજ ઈર્ઝ નથી, એટલે લાજિભ-જરૂરી નથી કે તેને વેચીને હજાજ

કરે. અને જો તેની પાસે મફાન છે, પરંતુ તેમાં રહેતો નથી, ચુલામ છે પરંતુ તેનાથી સેવા-ચાકડી કેતો નથી, તો તેને વેચીને હજજ કરે, અને જો તેની પાસે ના મફાન છે, ના ચુલામ વિગેરે છે, અને ઇસ્પિયા (નાણાં) છે, જેનાથી હજજ કરી શકે છે, પરંતુ મફાન વિગેરે ખરીદવા ઈરાહો છે, અને ખરીદ કર્યાં પણો હજજને લાયક નાણાં બયશે નહિ, તો ઈર્જ છે કે હજજ કરે, ખીંચ વાતોમાં ઉદ્ઘાવલું (નાણાં લગાવી હેવા) ચુનોંડ છે, એટલે તે સમયે કે તે શહેર (વસતી)વાળા હજજ માટે જરૂર રહ્યા હોય અને જો આ પહેલા મફાન વિગેરેમાં નાણાં રોચી લાધા તો હજજ-વાંદો નથી. (આલમગીરી)

મસ્યલા (૨૮) તે ક્રમા જેને વપરાશમાં નથી લાવતો જો તેમને વેચી નાંબે તો હજજ કરી શકે છે, તો તેને વેચી હે, અને હજજ કરે, અને જો ખર મોડું છે, જેના એક ભાગમાં રહે છે બાકીનો ક્રાન્સ પદ્ધા છે, તો એ જરૂરી નથી કે ક્રાન્સને વેચીને હજજ કરે. (આલમગીરી)

મસ્યલા (૨૯) જે ઘરમાં રહે છે, જો તેને વેચીને તેનાથી કમ હૈસીયતનું ખરીદશો તો એટલા નાણાં બચી જરો કે તેનાથી હજજ કરી લે, તો વેચલું જરૂરી નથી, પરંતુ જે એવું કરે તો અરંઝલ છે. એટલા માટે ઘર વેચીને હજજ કરવી, અને ભાડાના ઘરમાં ચુંઝારો કરવો તો બદર્જાં એ ઉલા જરૂરી નથી. (આલમગીરી-દરો સુખતાર)

મસ્યલા (૩૦) જેની પાસે આપ્યા વર્ષ માટેનું અનાજ હોય તો એ લાંઝિમ નથી કે, તેને વેચીને હજજ માટે જન્ય. અને જો તેનાથી વધારે છે તો જો વધારાને વેચાનામાં હજજનો સામાન થઈ શકે છે, તો ઈર્જ છે, નહિતર ઈર્જ નથી. (મનાસિક)

મસ્યલા (૩૧) દીની કિલાઓ ને અહુસે ધર્મ (ધર્મવાળાઓ) પાસે છે, જે તેના કામમાં રહે છે, તો તેને વેચીને હજજ કરવું જરૂરી નથી, અને એધરમ (જહિલ)ની પાસે હોય અને એટલી બધી છે કે, જેને વેચી નાંબે તો હજજ કરી શકશે તો

તેના પર હજજ ઈર્જ છે, એવી જ રીતે ગૈદ્ધીય અને રિયાજી વિગેરેની કિલાઓ (ખુડો) બદેને કામમાં રહેતી હોય, જો એટલા પ્રમાણમાં હોય કે વેચીને હજજ કરી શકે છે, તો હજજ ઈર્જ છે (રદ્દુલ સુખતાર)

શરત (૮) વક્ત : એટલે હજજના ભહિના-ઓમાં આ બધી શરતો ઉપલબ્ધ હોય અને જો દૂરનો રહેવાવાળો છે તો જ્યારે ત્યાંના લોડા હજજ માટે રવાના થતા હોય ત્યારે તે શરતો ઉપલબ્ધ હોવી જોઈએ. અને જો હજજની શરતો એવા સમયે ઉપલબ્ધ થઈ કે હવે પહોંચી શકશે નહિ, તો હજજ ઈર્જ થઈ નહિ, એવી જ રીતે જો આદત પ્રમાણે પ્રવાસ કરશો તો પહોંચશે નહિ, અને જરૂરી ત્થા દોડ-ધૂપ કરીને જાય તો પહોંચી જરો, તો પણ હજજ ઈર્જ નથી. અને એ પણ જરૂરી છે કે, નમાઝો પઢી શકે, જો એટલો સમય છે કે નમાઝો વખતમાં પઢો તો ના પહોંચશો, અને નમાઝો ના પડે તો પહોંચી જરો, તો ઈર્જ નથી. (રદ્દુલ સુખતાર) અહિં સુધી હજજના વુજુબ (ઈર્જ હોવા) ની શરતોનું અધ્યાત્મ થયું. અને અદ્દ કરવાની શરતો પાળવામાં આવે જો પોતે હજજ કરવા જવું જરૂરી છે. અને બધી શરતો પાળવામાં ના આવે તો પોતે જવું જરૂરી નથી, બલ્કે બીજાથી હજજ કરાવી શકે છે અથવા વસીયત કરી જાય, પરંતુ તેમાં એ પણ જરૂરી છે કે હજજ કરવાયા પઢી અંતિમ ઉમર સુધી પોતે (હજજ કરવા પર) શક્તિ ધરાવતો ન હોય. નહિતર પોતે પણ કરવી જરૂરી થશે.

તેની શરતો આ પ્રમાણે છે: (૧) રસ્તામાં અમન સુરક્ષિત હોવું એટલે ગાલિય ચુમાન સલા-મતીનું હોય તો જવું વાળિય, અને ગાલિય, ચુમાન (વધુ પઢતુ ચોક્સ અનુમાન) એ હોય કે, ધાડ વિ. ને કારણે પ્રાણુ જોઈ નાખશો તો જવું જરૂરી નથી. જવાના સમયમાં અમન (સલામતી) હોવું થશે. એ પહેલાની બદલામની અને અસલામતી માન્ય નથી. (રદ્દુલ સુખતાર)

મસ્ટાલા (૩૨) ને અદ્યામનીના જમાનામાં ઈન્ટેકલ થઈ ગયો અને હજનના વાનિય થવાની શર્તો ઉપલબ્ધ હતી. તો આવી હાલતમાં હજને બદલની વસીયત જરૂરી છે. અને અમન કાયમ થયા પણ ઈન્ટેકલ થયો તો બતરીકેઓલા (ચુંદરતાની રીતે) વસીયત વાળું છે. (રદ્દુલ સુહૃત્તાર)

મસ્ટાલા (૩૩) ને અમન માટે કાઈ રૂષ્વતાંલાંચ આપવી પડે તો પણ (હજન માટે) વાનિય છે. અને આ ચોતાના ઝર્ઝ અદ્દા કરવા માટે મજબૂર છે. એટલા માટે એ આપનાર પર મુખાખેડા (જવામ લેવામાં આવશે) નહીં.

(હરે સુખ્તાર, રદ્દુલ સુહૃત્તાર)

મસ્ટાલા (૩૪) રસ્તામાં ચુંગી (ઓક્ટ્રોય) વિ. દેતા હોય તો આ અમન વિરુદ્ધ નથી, અને ન જવા માર્ટેનું ઉજર (કારણ) નથી. (હરે સુખ્તાર)

એવીજ રીતે ઈન્ઝેક્શન તથા રસી વિગેરે ને આજ્ઞાકોલે હાણુઓને મૂકુવામાં આવે છે એ પણ ઉજર નથી.

શરેત (૨) સ્વીને ભક્તા શરીર સુધી જવામાં ત્રણ દિવસ અથવા તેથી વધારાનો રસ્તો હોય તો તેની સાથે પતિ અથવા મહરમનું હોવું શરેત છે. ચાહે તે સ્વી જવાન હોય અથવા વૃદ્ધ હોય. અને ને ત્રણ દિવસથી એણાનો રસ્તો છે તો મહરમ અને પતિ વગર પણ (હજન માટે) જરૂર રાડે છે. મહરમથી મુરાહ તે પુરુષ છે, જેનાથી હુંમેશા માટે તે સ્વીને નિકાલ હરામ છે. ચાહે વંશ (નસઅ)ને કારણે હરામ હોય, દા.ત. બાપ, એટા, બાઈ વિગેરે અથવા દૂધના રિસ્તા (સગાઈ)થી નિકાલ હરામ હોય, દા.ત. દૂધલાઈ, દૂધ બાપ, દૂધ બેટા વિગેરે અથવા સાસરીઓના રીશ્તાને કારણે નિકાલમાં હુરમત આવી હોય દા.ત. સ્વસુર, પતિનો દીકરો, વિગેરે. પતિ અથવા મહરમ જેની સાથે સ્વી પ્રવાસ કરી શકે છે તેનું આકિલ (ગાંડી [ના હોય તે]), વાલિંગ (પુષ્ટ વધની) વિનાના નશ્શે (તીયારીમાં) હોય, બાલિંગના હુકમમાં છે. અર્થાત મરાહિકની સાથે જરૂર રાડે છે. અને મરાહેકા છોકરીને પણ મહરમ અથવા પતિ વગર સફર કરવાની મનાઈ છે. (જૌહરહણ, આલમગીરી)

અથવા નાણાલિંગ અથવા ફાસિકની સાથે જરૂર શકતી નથી. આજાદ અથવા મુસલમાન હોવું શરેત નથી. અલયતા મજુસી (અગિન પૂજણ) જેના અક્રૂદામાં મહારિમથી નિકાલ જરૂર છે. તેની સાથે જરૂર શકતી નથી. મરાહિક તથા મરાહેકા અર્થાત છોકરો અને છોકરી ને વાલિંગ (પુષ્ટ વધની) થવાના નશ્શે (તીયારીમાં) હોય, બાલિંગના હુકમમાં છે. અર્થાત મરાહિકની સાથે જરૂર રાડે છે. અને મરાહેકા છોકરીને પણ મહરમ અથવા પતિ વગર સફર કરવાની મનાઈ છે. (જૌહરહણ, આલમગીરી)

મસ્ટાલા (૩૫) ખીનો ગુલામ તેના મહરમ નથી, કેમ કે તેની સાથે નિકાલની હુરમત હુમેશા માટે નથી, કે ને આજાદ કરી હે તો તેની સાથે નિકાલ કરી રાડે છે. (જૌહરહણ)

મસ્ટાલા (૩૬) લોંગીઓને મહરમ વગર સફર કર્યું જાઈ છે. (જૌહરહણ)

મસ્ટાલા (૩૭) ને ક વ્યાલિયારથી પણ હુરમતે નિકાલ સાયિત થાય છે, દા.ત. ને સીધી માનાજલાલ જિના કર્યું, તો તેની દીકરીથી નિકાલ કરી રાફતો નથી. પરંતુ તે છોકરીને તેની સાથે સફર કર્યું જાઈ નથી. (રદ્દુલ-સુહૃત્તાર)

મસ્ટાલા (૩૮) ઔરતને ના પતિ છે ના મહરમ છે, તો તેના પર એ વાનિય નથી કે હજન માટે જવા સાંદ્ર નિકાલ કરી લે. અને જ્યારે મહરમ છે તો હજને ઝર્ઝ માટે મહરમ સાથે નાય, ભલેને પતિ પરવાનગી આપતા ના હોય. નિશ્ચિલ અને મિનાત (બાધા)ની હજન હોય તો પતિએ મનાઈ કરવાનો અધિકાર છે. (જૌહરહણ)

મસ્ટાલા (૩૯) મહરમ સાથે જરૂર તો તેનું ભરણ-પોષણ સ્વીના જરૂરે (શિરે) છે. એટલા માટે હવે એ શરેત છે કે, ચોતાના અને તેના ઘનેતા નિકાલ (ભરણ-પોષણ) પર શક્તિમાન હોય.

(હરે સુખ્તાર-રદ્દુલ સુહૃત્તાર)

શરત (૩) જવાના સમયમાં ઓરત ઈદ્હતમાં ના હોય, તે ઈદ્હત પતિની વહીનની હોય અથવા તલાકની ઈદ્હત હોય. બાઈન તલાકની ઈદ્હત હોય યા રન્ધર તલાકની ઈદ્હત હોય. (સારાંશ કે, ઈદ્હતમાં તે હજજ માટે જરૂર શકતી નથી. અનુ.)

શરત (૪) ડેફમાં ના હોય પરંતુ જાયારે ડાઈ હુક્કને કારણે ડેફમાં હોય અને તે અદા કરવા પર શક્તિમાન હોય તો એ ઉકર (મજખુરી) નથી. અને ઘાદશાહ (શાસક) જે હજજ માટે જવાથી રોકતો હોય તો એ ઉકર (મજખુરી) છે.

(દરેં મુખ્યતાર-રહ્દરુલ મુહુતાર)

સેહતે અદાની શરતો

હજજના સહીહ અદા થવા માટે નવ (૬) શરતો છે. જે તે ના પામવામાં આવે તો હજજ સહીહ નથી. તે આ પ્રમાણે (૧) ઈરલામ: કાફિરે હજજ કરી તો હજજ થઈ નહિ. (૨) એહરામ: એહરામ વગર હજજ થઈ શકતી નથી. (૩) જમાન: એટલે હજજ માટે જે જમાના મુકરેર છે. તેના પહેલા હજજના કર્મો થઈ શકતો નથી. દા. ત. તવારે રહુમ અને સર્ઝ કે તે હજજના ભિનનાથી પહેલા થઈ શકતા નથી. તથા “ચુકુરે અરક્કા” ઝીલીજિજના નવમી તારીખના જવાલથી પહેલા અથવા દસમીની સવાર થયા પણ થઈ શકતો નથી, અને “તવારે જિયારત” દસમીથી પહેલા થઈ શકતો નથી.

(૪) મકાન : તવારેની જગ્યા મરજિરુલ હરામ શરીર છે, અને વુર્ડે માટે અરક્કોત ત્યા સુઅદ્દલ્ક્કા છે. કાંકરીઓ આરવા માટે મિના છે, કુર્માના કરવા માટે હુરમ છે. સારાંશ કે જે કાર્ય માટે જે રથળ નિયુક્ત કર્યું છે તે ત્યાં જ થશે. (૫) તમીજ (૬) અક્લ, જેમાં તમીજજ ના હોય દા. ત. અણ્ણસમજ બન્સું અથવા જેમાં બુદ્ધ જ ના હોય દા. ત. ગાંડો, આ પોતે તે અણ્ણાલ (કર્મ) નથી કરી શકતા જેમાં નિયતની જરૂર છે. દા. ત. એહરામ અથવા તવારે, બલ્કે તેમના તરફથી કોઈ અન્ય કરે, અને જે ઇદ્દાલમાં નિયત શરત નથી દા. ત. વુર્ડેએ અરક્કા માટે તે પોતે કરી શકે છે. (૭) ઇરાધારે હજજનું

બનવી લાવવું, પરંતુ જાયારે કે ઉકર (કરણ) હોય. (૮) એહરામ બાંધા પણ અને વુર્ડેએ પહેલા જેમાય (સંભોગ)ના હોલું જે સંભોગ થઈ ગયો તો હજજ બાતદ થઈ જશે. (૯) જે વર્ષે એહરામ બાંધો એજ સાલે હજજ કરવુ. એટલા માટે જે તે વર્ષે હજજ હોતું (ખૂરી) થઈ ગઈ, તો ડિભરા કરીને એહરામ જોવી નાખે અને આવતા વર્ષે નવિન એહરામથી હજજ અદા કરે, અને જે એહરામ જોવ્યો નહિ અને તેજ એહરામથી હજજ કરી તો હજજ અદા થઈ નહિ.

કેર્જ હજજ અદા થવાની શરતો

હજજ કેર્જ થવા માટે નવ (૬) શરતો છે. પ્રથમ : ઈરલામ (૨) મુત્યુ પર્યંત ઈરલામ પર જ કાયમ રહેવું. (૩) આકિબ હોલું (ગાંડો ના હોય) (૪) બાલિગ હોલું (પુત્ર વર્ષનું હોલું) (૫) આત્રાદ હોલું (ગુલામ ના હોય) (૬) જે શક્તિમાન હોય તો પોતે અદા કરવી (૭) નિદ્દલની નિયત ના હોલ્લી (૮) ભીજના તરફથી હજજ કરવાની નિયત ના હોલ્લી (૯) કાસિદ ના કરવી; ઉપરોક્તા શરતોની ઘણી તદ્દસીલ અધ્યાત્મ થઈ ગઈ છે. બાકીની પાણી અધ્યાત્મ કરીશું.

હજજના કરણો

મસ્યલા (૪૧) હજજમાં આ વરતુંયો કેર્જ છે, (૧) એહરામ કે તે શરત છે (૨) વુર્ડેએ અરક્કા એટલે નવમી જિદ્દીજજના સર્ઝ ઠળી ગવા પણથી દસમીની સુણહ સાહિકા પહેલા સુધી કોઈપણ સમયે અરક્કોતમાં થોખલું. (૩) તવારે જિયારતનો વધુ જાગ એટલે આનંદે કાચ્યાના આર કેરા. પાછલી અન્ને વરતુંયા એટલે વુર્ડેએ અને તવારે રૂક્ન છે. (૪) નિયત, (૫) તરતીઅ, એટલે પ્રથમ એહરામ બાંધવું પણ વુર્ડેએ, પણ તવારે, દરેક કેર્જનું પોતાના સમયમાં હોલો. એટલે વુર્ડેએ તે સમયે હોલું જે મજદૂર થયું, તેના પણ તવારે, તેના સુખ વુર્ડેએ પણથી અંતિમ ઉમર સુધી છે. (૬) મકાન એટલે થોખલું અરક્કોતની જમીનમાં દોખનું અતને એમારના મિવાયકે, તવારેનું રથળ મસજીદે હરામ છે. (કેર્જ મુખ્યતાર-રહ્દરુલ મુહુતાર)

હજજના વાળ્યો

હજજના વાળ્યો આ પ્રમાણે છે: (૧) મીકાતથી એહરામ બાંધવું એટલે મીકાતથી એહરામ વગર પસાર થવું નહિ. અને ને મીકાતથી પહેલાં એહરામ બાંધી લીધું તો જાઈજ છે. (૨) સરી-મર્વાહની વર્ચ્યે હોડું—ચાલવું, તેને સઈ કહે છે. (૩) સધેને સરીથી શર કરવો, અને ને મર્વાહની શર કરી તો પ્રથમ ઝેરે ગણવામાં આવશે નહિ. તેને ફરી દોહરાવવામાં આવે, (૪) ને ઉજર (મજખુરી) ના હોથ તો પગપાળા સઈ કરવું; સઈનો તવાદે મુઅતથણેહિ પછી, એટલે ક્રમસી કુમ ચાર ઝેરા પછી હોવું, (૫) દિવસમાં પુરું કર્યું તો એટલી વાર સુધી પુરું કરે કે સૂર્યાસ્ત થઈ જય, ચાહે સૂર્ય ઠળતાજ શર કર્યું હોય યા પછી, સારાંસ કે સૂર્યાસ્ત સુધી પુરું (અરદ્ધાતમાં ચોલવા) માં અસ્યયલ રહે. અને ને રાતમાં પુરું કર્યું હોથ તો તેના માટે કોઈ ખાસ હદ સુધી પુરું કરવું વાળ્યાં નથી, પરંતુ તે એ વાળ્યાને છોડી હેનાર થયો કે દિવસમાં સૂર્યાસ્ત સુધી પુરું કરતો, (૬) પુરુંમાં રાત્રીનો અમુક ભાગ આવા જાયો, (૭) અરદ્ધાતથી પાછા ફરવામાં ઈભામની તામેદારી કરવી એટલે જવા સુધી ઈભામ જાંથી નાડો નહિ તાં ચુંચી એ પણ ચાલે નહિ, હા, ઈભામે ને વખતથી વિવંશ કર્યો તો તેને ઈભારથી પહેલા ચાલવા જન્મું જાઈજ છે. અને ને લીઠ-ભાઈ વિગરને કારણે કોઈ જરૂરતને લીધે ઈભામના ચાલવા ગયા પછી, ચોલ્યા ગયો અને સાથે ગયો નહિ, તો પણ જાઈજ છે (૮) સુજદ્વદ્રામાં ચોલવું. (૯) મગરિય અને ઈશાની નમાજને, ઈશાના પ્રયત્નમાં સુજદ્વદ્રામાં આપીને પદ્ધતું. (૧૦) નણે જરૂરાયો પર દસમાં, અગિયારમા અને બારમા ચાદે કાંકરીએ. મારવી એટલે ૧૦મા ચાદે રેણુ જમરતુલ-ઉકણા પર કાંકરીએ. મારવી, અને અગિયારમા ત્યા આરમણે નણે જમરાયો પર રંગી કરવું એટલે કાંકરીએ. મારવી. (૧૧) જમરાયે ઉકાની રમી પ્રથમ દિવસે હડક (માથાનું મુકન) પહેલાં હેઠળી, (૧૨) દરરોજની રમી (કાંકરીએ. મારવી)

તું તેજ દિવસે હોવું. (૧૩) માથું મુંગવવું અથવા માથાના વાળ કૃપાવવા—જાવવવા. (૧૪) અને તેનું એયામે નહેર (કુર્યાનીના દિવસોમાં) (૧૫) ત્યા હરમ શરીરમાં હોવું, જીંને “મિના”માં ના હોથ. (૧૬) હજજે કિરાત ત્યા તમતોઅવાળાને કુર્યાની કરવી. (૧૭) અને તે કુર્યાનીનું હરમ ત્યા કુર્યાનીના દિવસોમાં હોવું. (૧૮) તવાદે એકજાનો વંકુભાગ એયામે નહેર (કુર્યાનીના દિવસો : ૧૦, ૧૧, ૧૨ ચાંદ)માં હોવો, અરદ્ધાતથી પાછા ઝર્યા પછી જે તવાદે કરવામાં આવે છે, તેનું નામ તવાદે એકજાઝણ છે, અને તેને ‘તવાદે જિયારત’ પણ કહે છે. તવાદે જિયારતના વંકુભાગથી, ને બાકી રહી જયો છે એટલે ખાનગે કઅખણના ત્રણ ઝેરા, તે એયામે નહેર સિવાય પણ થઈ રહે છે, (નોંધ : ખાનગે કઅખણના સાત ઝેરા ઝેરા તો એક તવાદે થાય. અનુ.) (૧૯) તવાદે, હતીમની બહારવા હોવું. (૨૦) જમરણી બાળુથી તવાદે કરવું. એટલે કઅખણે મુઅત્જઝમા તવાદે કરવાળાની હાથી બાળુણે હોથ; (૨૧) ઉજર (મજખુરી)ના હોથ તો પગપાળા ચાલવાને તવાદે કરવું તાં સુધી કે હસડાતા હસડાતા તવાદે કરવાની મનત (ખધા) માની તો પણ તવાદમાં પગપાળા ચાલવું લાગિયે છે, અને નિશ્ચિલ તવાદીથી હસડાતા હસડાતા કર્યેં તો થઈ જશે પરંતુ અદ્ભુત-અહંતર એ છે કે પગાથી ચાલવાને કરે. (૨૨) તવાદે કરવામાં જનરાને હુકમાયિથી પાક હોવું એટલે કે કુરુય (નાનારી જરસ્ત) અને પુજુ વગર અથવા જનાયતના હાતથી તવાદે કર્યો તો પીઠવાર હોહરાવે. (રસા પુજુ કરીને અથવા નાધને તવાદે કરે, અનુ.) (૨૩) તવાદે કરતી વખતો સત્તર છુપાયેલું હોવું, એટલે ને એક અવયવની ચોણે ભાગ અથવા તેનાથી વધારે ભાગ ઉધ્યોગ રહી ગયો તો ‘દમ’ વાળ્યાં થશે અને ડેટલાડ જગ્યાએથા ઉધાડું રહ્યું તો તેને એવિન કરીશું. સારાંશ કે ના જમાં સત્તર મુલી જવથી ૦.૨૦ના નમાજ ઝાસિદ થાય છે, અહિં દમ વાળ્યાં થશે. (૨૪) તવાદે પછી એ રક્માત નમાજ પઢવા. ને પછી નહિ તો

હમ વાનિય નથી. (૨૫) કંદરીઓ ઇંદ્રી, જુખણ કરવા, માથું સુંડાવવું અને તવાં કરવામાં તરતીય (ક્રમ) પ્રમાણે કરવું. એટલે પ્રથમ કંદરીઓ મારની, પછી જે હાજ તમતૌચ અથવા કેરાન હજજ કરી રહ્યો છે તે કુર્ણાની કરે, (મુદ્રિદ હાજને કુર્ણાની કરવાની વાનિય નથી, જે ઇન્હા હજજ કરે લે, મુદ્રિદ કહેવાય છે. અનુ) પછી માથાનું સુંડાન કરાવે, પછી તવાં કરે, (૨૬) તવાં સહ એટલે મિકાતથી બદાર રહેવાવાળા હાજનો માટે ઇખ્સતીનો તવાં કરવા, જે હજજ કરવાણી રહેલી હોજ અથવા નિદ્રાસમાં છે અને તહારતથી (પાક થતા) પહેલા કાફિલો રવાના થઈ જરો તો તેણી પર તવાં ઇખ્સત નથી,

(૨૭) વુડ્ઝે અરદ્ધથી માંડી માથાનું સુંડાન કરવાના સુધી સ્વી સાથે સંલોણ ન હોયો. (૨૮) અહરામમાંની પ્રતિયાંતિત બાબતો દા. ત. સિવિલ કપ્પું પહેલાં અને મોઢું અથવા માથું છુપાવનાથી બચવું. (નોટ : ઉપરોક્તા બાબતો હજજના વાનિયોમાંથી છે. અનુ.)

મહાયદા (૪૨) વાનિયના છુટી જવાથી હમ લાજિમ આવે છે. ચાહે જાણું જેઠને કર્યું હોય અથવા લુકથી જીતાના તૌર પર હોય યા નિયાન (એ ખ્યાલીયા તે માણસ તેનું વાનિય હોયું જાણુંતો હોય યા ન જાણુંતો હોય, હા, જે જાણું જેઠને કરે અને જણે પણ છે તો ગુનેહગાર પણ છે, પરંતુ વાનિયના તરક થવાથી હજજ બાતિલ થરો નહિ, અદ્દાયત કેટલાક વાનિય આ હુકમથી અપવાદ્યપ છે, કે તેના તરક (ખુર્દી) થવાને કરણે હમ લાજિમ નથી, દા. ત. તવાં પછીની એ રક્યાત નમાજ, અથવા ડોઈ કારણના લીધે માથું સુંડાંસું નહિ અથવા મગરિયની નમાજને ઈશા સુધી મુચ્યાખ્યર (વિલાંપિત) કરી નહિ, અથવા ડોઈ વાનિયનો તરક એવા ઉજર (કારણ) થી હોય જેને શરીરિયે માન્ય રાખ્યો હોય એટલે ત્યાં ઈન્જનીય (ખુર્દી) આપી હોય, અને કફ્ફારો સાક્ષિત (જવાબ શરીરથી સુક્તિ) કરી દીધો હોય.

હજજની સુન્નતો

હજજની સુન્નતો આ પ્રમાણે છે. (૧) “તવાં હૃહમ” એટલે મિકાતના બહારથી આવવાવાળો કે મક્કા મુચ્યાજીમાંન હાજર થઈ સૌથી પહેલા તવાં કરે, તેને તવાં હૃહમ કહે છે. તવાં હૃહમ સુદ્રિદ અને કારિન સાટે સુન્નત છે, તમતૌચ હજજ કરનાર માટે નથી. (૨) તવાંનું ‘હજજ અસ્વદ’થી શર કરવું. (૩) તવાં હૃહમ અથવા તવાં હૃહમાં ‘રમલ’ કરવું. (૪) સફા-મર્વાની વચ્ચે એ મીલે અધ્યર લીલા રંગના પદા છે) તેમની વચ્ચે દોષવું (જડપી ચાલે ચાલવું) (૫) ઈમામતું મક્કામાં સાતમાં ચાંદે અને (૬) અરદ્ધાતમાં નવમાં ચાંદે અને (૭) મિનામાં અગિયારમાં ચાંદે ખુલ્લો પદબું (૮) આઠમીની ફરાર પછી મક્કા શરીરથી રવાના થબું કે, મિનામાં પાંચ નમાઝો પઢી લેવામાં આવે. (૯) નવમીની રાત્રિ મિનામાં પસાર કરની. (૧૦) સ્વર્યોદય પછી મિનાથી અરદ્ધાત માટે રવાના થબું. (૧૧) વુડ્ઝે અરદ્ધ માટે ગુસલ કરવું, (૧૨) અરદ્ધાતથી પાછા ફરતી વખતે સુજાદ્દામાં રાંને રહેવું, (૧૩) સ્વર્યોદય થતા પહેલા અહિયા મિના ચાલ્યા જવું, (૧૪) દસમાં અને અગિયારમાં ચાંદ પછી જે બન્ને રાત્રિઓ છે તેમને મિનામાં પસાર કરવી અને જે તેરમાં ચાંદે પણ મિનામાં રહ્યો તો બારમી તારીખની પછીની રાત્રિ પણ મિનામાં રહે (૧૫) અણતાહ એટલે ‘વાહીયે સુહુકુસાખ્ય’માં ઉત્તરવું, લદેને થોડીજ વાર માટે હોય, આ સિવાય પણ અન્ય સુન્નતો છે, જેમનું બધાન જે તે વિલાગમાં આવશે, તહ ઉપરાંત હજજના સુસ્તહણે. ત્યા મક્કાહોટું બધાન પણ તેના સંબંધિત સ્થળે આવશે. હવે હરમૈને તૈયેબૈન (મક્કા-મદ્દિના શરીર)ની રવાનગીનો પાકો ઈરાહો કરો, અને હજજની સફરના આદાય ત્યા તેની પૂર્વ ભૂમિકા જે લખવામાં આવે છે, તેના પર અમલ કરો.

હજજની સફરના આદાય ત્યા પૂર્વ તૈયારીયો।

(૧) જે કોઈનું હેવું હોય અથવા અમાનત પાસે હોય તે આહા કરી હે, જેનો નાહું માલ

કીથો હોય તે પાછા આપો હે અથવા માફ કરાવી લે. પતો ના મળે તો એટલો માલ કષ્ટારો (ગરિયો)ને આપી હે. (૨) નમાજ, રોજા, જ્કાત, એટલી ઈયા-હંતો પોતાને જ્મે હોય તે અદા કરે, તૌથાડુ કરે અને ભવિષ્યમાં ચુનાડુ ના કરવાનો પાડો ઈરાહો કરી લે. (૩) જેની ઈજનજત વગર સફર કરવો મહિંઝ છે, દા. ત. મા-આપ, પતિ તેમને રાળ કરી લે, જેનો તેની પર કરજ આવે છે, તે સમયે જો ના આપી શકે તેમ હોય તો તેનાથી પણ ઈજનજત લે, પછી હજજ ઈર્જ ડોઈની ઈજનજત ના આપવાથી રોકી શકતો નથી. ઈજનજત મેળવવા માટે કોણિય કરે, ઈજનજત ના મળે તો પણ ચાલ્યો જાય. (૪) આ સફરથી મહિંઝ ઈજન અવ્યાહ અને રસ્દુલ હોય, રિયા, સુમારુ (દેખાવો કરવા) અને અભિમાનથી જુદો રહે. (૫) ક્રી સાથે જ્યાં સુધી પતિ અથવા પુષ્ટ વયનો મહુરમ, સાંતોષમારક ના હોય, જેની સાથે નિકાહ હંમેશને માટે હરામ છે, સફર કરવો હરામ છે, જે પતિ અથવા મહુરમ વગર સફર કરશે તો હજજ તો થઈ જશે, પરંતુ દરેક ડગલે ચુનાડુ કખવામાં આવશે.

(૬) તોશો (ખાવા-પીવાની વસ્તુ) હલાક માલથી લે, નહિતર હજજ કષ્યુલ થવાની ઉમ્મીદ નથી. બાલેને ઈર્જ ઉતરી જરો, જો પોતાના માલમાં કાંઈ થાંક હોય તો કરજ લઈને હજજ માટે જાય, અને તે કરજ પોતાના માલથી અદા કરી હે. (૭) જરૂરતથી વધારે તોશો (રસ્તામાં ખાવા-પીવાની વસ્તુ, ભાથું વિગેર) સાથે લે, જેથા સાથાંયોની મહદ્દ અને જરૂરતમાંદો પર સદ્ગો જૈરાત કરતો ચાલે, ચા મખૂર હજજની નિશાની છે, (૮) આલિમ, હિકૃતી કિનાયો જરૂરત પુરતી સાથે લે, અને એ ધર્મ ડોઢ આલિમની સાથે જાય, એ પણ ના મળે કભેથી કંમ આ રિસાલો (ખણારે શરીરિત ભાગ ૬, અથવા મનાસિક હજજની કિઠાય) સાથે હોય. (૯) દર્પખું-અરીસો, સુરમો, કાંસકી ત્યા ઢાંતણ સાથે રાખે, કેમકે તે સુન્તનત છે. (૧૦) એકલો પ્રવાસ કરે નહિ, કેમકે તેની મનાધ છે. સાથીદાર દીનદાર

અને નેક સન્નિષ્ઠ હોય, કેમકે ખફમજહથીના સથ-વારાથી એકલા રહેવું એહતર છે. સાથી અનાયા ક્રૂદુંખવાળાથી જેહતર છે.

(૧૧) હંતિસ શરીરિમાં છે, જ્યારે ત્રણ માણસો સફરમાં જાય, પોતાનામાં એકને સરદાર-આગેવાન બનાવી લે. તેમાં કાગેની સુવ્યવસ્થા રહે છે. સરદાર તેને બનાવે જે સારા અખલાકવાળો, સમજદાર અને દીનદાર હોય, સરદારને લેછાયે કે પોતાના સાથી-ઓના આરામને પોતાના આરામ પર અચ્ચિમતા આપે, (૧૨) હજજ સફર કરતી વખતે સર્વ સગા-સંયુક્તીની અને ભિત્રાને મળે અને પોતાના કસુર ત્યા ભુલેને માફ કરાવી લે. અને હવે તેમના પર લાજિમ છે કે હિન્દુથી માફ કરી હે. હંતિસ શરીરિમાં છે : હુંકુરે ફરમાયું જેની પાસે તેનો મુસલમાનભાઈ મઅઝરત (ક્ષમા ચાહે) લાવે, વાજિય છે કે તેને કષ્યુલ કરી લે નહિતર હોય કૌસર પર આવવું નસીબ થશે નહિ, (૧૩) ઇખ્સત થતી વખતે દુઅા કરાવે કે બરકત પ્રાપ્ત કરશે, કેમકે બીજાંયોની દુઅાની કષ્યુલ થવાની વધારે ઉમ્મીદ છે, એ માલમ નથી કે તેની દુઅા મફ્ફૂલ છે. એટલા માટે બધાથી દુઅા કરાવે અને લેડો હાજ અથવા ડોઈને વિદાય કરે ત્યારે વિદાય સમયે આ દુઅા પદે :

“અસ્તૌદેઉદ્દાહ દીનકા વ અમાનતકા વ અવાતીમ અમલેકા”

(હુંકુરે અકદસ સલ્લાખાહો અસ્યખે વસલ્લમ જયારે ડોઈને ઇખ્સત ફરમાવતા ત્યારે આ દુઅા પદ્ધતા, અને જે ચાહે તો તેના પર એટલો ઓાર વધારો કરે :

“ વ ગાદર જુખ્યકા વ યસ્સેર લકુદ્દ્જોર હ્યસો માફુનતા જાયદકદલાહુતકથા વ જન્નાખુરોદા”

(૧૪) તે સૌના દીન, જન-માલ, ઔદ્વાદ, તંદુરસ્તી, કુશળતા ખુદાને સૌંપે (૧૫) સફરનો લિયાસ પહેરી ધરમાં ચાર રક્મત નિકુલ અલહુર્દો તથા કુલ થી પહીને ખાડાર નિકળે, તે રક્મતો પાછા આવવા સુધી તેના ધરવાળાંયો તથા માલની

રક્ષા કરશે. નમાજ પછી આ દુચા પડે.

અહલાહુમ્મ એકા ઈન્તશરેં વ ઈલયકા તવજજહેતો વ એકા અયતસમ્તો વ અલયકા તવજજહેતો અહલાહુમ્મ અન્ત સંકૃતી વ અન્ત રજાઈ અહલાહુમ્મ અકેણી મા અહુમ્મની વ મા લા અહુતમ્મો એહિ વ મા અન્ત અયતમ્મો એહિ મિન્તી અન્જ જાયોકા વ જજહની, લા ઈલાહી ગયરોકા અહલાહુમ્મ જીવીદની તકવા વળીરવી. છુન્ણી વ વજજહેતી ઈલલ અધર અયનમા તવજજહેતો, અહલાહુમ્મ મની અઉજો એકા મિંવ અયતશાઈસહેરે વ કાયતિં સુન્કલણે વહજવહે અયતશાઈસહેરે વ સુધુલ અન્જરે ઝીં અહુલે વહમાલે વહવલદે.

અર્થો : હે અહલાહુમ્માક તારી મદદથી હું ધરથી નીકળ્યો અને તારી તરફ કેન્દ્રિત થયો અને તારા પર મેં સંપૂર્ણ યકીન કર્યું અને તારા પર ભરાસો કર્યો, હે અહલાહુમ્મ મારી વિશ્વાસ છે, તું મારી ઉમ્મીદ છે. ઈલાહી તું મારી કિશાયત કરતે ચીજથી કે ને વરતુ મને ફિકર-ચિંતામાં નાખે, અને તેનાથી જેની હું ચિંતા કરતો નથી. અને તેનાથી જેને તું મારાથી વધારે જાણે છે. તારી પનાહ લેનાર ને ઈજગતવણો છે. અને તારા સિવાય ડોઈ પૂજનીન નથી. (૧૬) ધૈરથી નિકળવાથી પહેલાં સંકો કરે. (૧૭) સફર જુમેરાત અથવા શનિવાર અથવા પીર (સોમવાર)ના દિવસે કરે. અને સવારનો સમય સુખ્યારક છે અને જુમ્માના દિવસે જુમ્માથી પહેલાં પ્રવાસ કરવું સારું નથી. (૧૮) દરવાજાની અહાર નાકળતો જ ચા દુચા પડે.

અન્નસ્મીલલાહે વ અન્નસ્મીલલાહે વ તવજજહેતો. અહલલાહે વ લા હૌલા વ લા કુલ્લવતા ઈહલા અન્નસ્મીલલાહે. અહલાહુમ્મ ધનના નજીજો એકા મિન અન નજીલ અવ નજીલેલા અવ નોદિલ અવ તુદુલ અવ નજીલેમા અવ તુઅલસમા અવ નજહુલ અવ યજહુલા અહલયના અહુદુન, અને દુર્દ શરીર અધિકતાથી પડે.

(૧૯) સૌથી ઇખસત થયા પછી મહોલાના મર્સિજદમાંથી ઇખસત થાય ને કરાહતનો સમય ન હોય તો તેમાં એ રક્યત નિક્ષે પડે.

(૨૦) ઇજા પ્રવાસમા પોતાની જરૂરતની વરતુ એ સાથે રાખે અને સમજદાર તથા જાણકાર માણસથી સલાહ પણ લો. પહેરવાનાં કપડાં અધિક તાથી હોય અને મધ્યમ કશાના માનવીએ જાણ અને મજબૂત કપડાં લેવા જોઈએ અને ઉત્તમ એ છે હે તેને રંગી લે અને જો ખ્યાલ હોય કે શરીરની મંતુ આવી જશે તો થોડાક ગરમ કપડાં પણ સાથે રાખે. અને શિયાળાની મોસમ હોય અને ખ્યાલ હોય કે પાણ આવતા સુધીમાં ગરમા આવી જશે તો થોડાક આરીક કપડાં લઈ લો. પાથરવા માટે જો નાનકડું રહું ગાઢું પણ હોય તો બહુ સારાં છે કે જહાજમાં પાથરવા માટે બહુ આરામ આપે છે. અદ્યકે ત્યાં પહેંચાને પણ તેની જરૂરત પડે છે. કેમકે હિન્દુસ્તાની આદમી સામાન્યત આઠલાંઓ મર સુદ્ધ રહેવાની ટેવવાળા. હોય છે. ચટાઈ વિગરે પર સુદ્ધ રહેવામાં તકલીફ થાય છે. અને ગાઢલાના કારણે થારીક રાહત થઈ જશે. અને સાચુ પણ સાથે લઈ જાય કે અફસર પોતાના હાથાથી કપડાં ધોવા પડે છે. ચાડુ અને સુતળા અને સોયો. પણ જરી છે. અને થારીક દવાએ. પણ સાથે રાખી લેલા તેની કે પણ જરૂરત પડે છે. ખાંસી, તાવ, ધરદી, મરડો, બદહજીમા વિગેરેથી પાણો પડે છે.

(પરંતુ હવે ઉપરોક્ત વરતુંએ મંજૂલા શરીરી મદીના શરીરિમાં મળો રહે છે એટલે જરૂર પ્રમાણે વરતુંએ લંઘ જવ તો તે સારાં છે.)

ડોલ-રાસ પણ સાથે લઈ લો. (હાથમાં પાણી માટે કેન, મશાક, ચાંચુ વિ. સાથે રાખે માર્ગભાં તેની જરૂર પડે છે. ખાસ કરીને વિમાનાં સફરમાં ત્યા એરપોર્ટ વિગરે રથળોમાં હાથ-પાણી લેવાનાં તકલીફ હોય છે, ત્યારે તે કામમાં આવશ.) ક્રેમ કે કેટલાક સ્થળોએ પર જાતે જ પાણી લરેવું પડે છે અને કેટલાક સ્થળોએ પાણી વેચનારા અંતિ જાય

છે. જહાજમાં નગ કેટલીકવાર બંધ પડી જય છે. ત્યારે ને મીઠું પાણી જરૂર કરતાં વધારે ના હોય તો વજુ વિગેર માટે ફરિયામાંથી પાણી જેંચને કામ ચલાવી લેલું પડે છે. થોડા દ્રષ્ટાલા જુના ક્રપદાં પણ સાથે રાખો કે જહાજ પર ઈસ્ટીન્જે સુધાવવામાં કામમાં આવશે. લોબંડેનો ચુલો (સગડી) પણ સાથે રાખો, જહાજ પર તેની સખત જરૂરત પડે છે. જે ડોલસાની સગડી છે તો મુંબઈથી જરૂર પ્રમાણે ડોલસા પણ ખરીદી દ્યો. જે લાકડાનો ચુલો છે તો લાકડા સાથે લઈ જવાની જરૂર નથી, કેમ કે જહાજના વાળા તરફથી જરૂર પ્રમાણે લાકડા મળી જય છે. આવી હાલતમાં કુહાડીની જરૂર પડશે. કેમ કે જહાજ પર જાગાં જાગાં લાકડા મળે છે, તેમને દ્રષ્ટાલાની જરૂર પડશે.

મુંબઈથી થોડાં લીંઝુ જરૂર લઈ લો કે જહાજ પર બહુધા ઉભા આવે છે. જે સમયે તેનાથી બહુ જ શાન્તિ થાય છે. એક ઉગાનદાન પણ સાથે રાખો કે જેથી ઉદ્દી કરવામાં અથવા ચુંકવામાં કામ આવે. મીથાભતી પણ સાથે છેય તો પેશાબ પાખાના જતી વેળા કામ લાગશે. પોતાના સામાન પર નામ લખી લેવા કે જેથી શાધવામાં તકલીફ ન પડે. અહરામના ક્રપદાં મુંબઈમાંથી લેવા કેમ કે જેથી અહરામ જહાજ પર જ બાંધવો પડો. ખ્યાલોએ અહરામની હાલતમાં મૂખ ઢાંકવા માટે ખજુરના પંખા મુંબઈમાંથી ખરીદી લેવા. એહરામમાં ખ્યાલોએ કોઈ એવી વરતુથી મુખ ઢાંકવું જે ચહેરાથી ચોંટી જય તે હરામ છે. કંઈન પણ સાથે રાખવું કેમ કે મુત્કુનો સમય ક્યારે આવે તે કોઈને ખરીર નથી. સારાંશ કે જીવન જરૂરીયાતની વરતુઓ સાથે રાખો.

નોટ:- જે હવે હવાઈ જહાજની સહેર થઈ ગઈ છે. અને હજાજ કુરો દરેક પ્રકારની વ્યવસ્થા કરે છે એટલે સામાન લઈ જવાની જરૂરત રહેતી નથી.

(૨૧) ખુશીખુશી ઘેરથી જય અને જિકે ધરાડી અધિકતાથી કરે. અને ધડી ધડી ખુદાનો જોઈ દિવભાં રાખો. ગુરુસાથી બચો. લોકાની વાત સહન

કરે. શાન્તિ તથા વકાર ગુમાવે નહિ. એકાર વાતોમાં ન પડે. (૨૨) ઘેરથી નિકળે તો એ જ્યાદ કરે કે જણે દુનિયામાંથી જરૂર રહો છે.

ઘેરથી નિકળતી વખતે આ હુદા પડે.

અહલા હુદા ઈન્ના નજીઓ એક મિંબદ્ય અશા ઈસ્ટસ્ક્રેવ વ કાય્પતિલ્મુન્કલિય વ સુઈલ્મન્જરે ફીલ્મઅસ્ટે વદ્વાખુસે વ વદ્વે.

પાણ ઇરતા સુધી માલ તથા ધરવાળા સુરક્ષિત રહેશે.

(૨૩) એજ સમયે આયતુલ કુરસી અને કુલ યા અચ્યુતાલ કાંક્રિન થી કુલ અહીંજુ એ રહિયાનાસ સુધી તથાપત સિવાય પાંચ સુરતો એસ્ટ્રિમલાડ સાથે પડે. પછી આખરમાં એકવાર એસ્ટ્રિમલાડ શરીર પડીલે. રસ્તા ભર આરામથી રહેશે (૨૪) તદ્વિપરાંત તે સમયે ઈન્નલાંજી ઝ્રદા અદૌલ્કાર્નિન લરાદ્કા ઈલ્લા મચ્યાએ એક વખત પડી લે, એરીયતથી પાણો આવશે (૨૫) રેલ્વે વિગેર ને સવારી પર સવાર થાય એસ્ટ્રિમલાલું નણ વાર કહે પછી, અહલાલું અચ્યુતર અને અલાહુમુલિલદાલું અને સુઅહુનાલ્લાલું દરેક નણ નણ વાર કહે અને લાઈલાલું એક વાર કહે, પછી કહે સુઅહુનાલ્લાંજી સાખ્ખર લના હોજા વમાકુના લહુ સુકરેનીના વઈના ઈલા રખ્યેના સુન્કલયુન તેના શરથી બચો.

(૨૬) જયારે દરિયામાં (અથવા પ્લેનમાં) સવાર થાય આમ કહે એસ્ટ્રિમીલાલું મજરેહા વ સુરસાંહા ઈન્ન રખ્યાં લગુહુર્હીમ વમાક્યિયાતો વસ્સસમાવાતો મુલ્લીયાતુન એ

યમીનેહિ સુઅહુનહું વત્યાલા અમ્ભમા ચુશરેકુન” હુઅવાથી અથવા (એકરમાતથી) સુરક્ષિત રહેશે. (૨૭) જહાજ પર જરૂરી સવાર થઈ જય કે જેથી થોડું જગ્યા મળી જય. ઉત્તાવળ ન કરે. કેટલીક વેળા સામાન રહી જય છે (૨૮) નીળ વર્ગમાં પ્રવાસ કરનાર ચટાઈ જરૂર લઈ જય કેમકે બહુધા બિસ્તર ખરાં થઈ જય છે.

(૨૬) કટું તુમા (હોકા પંન) પાસે રાખે કેનેથા કિલાની દિશા જાણવામાં મદદ ગાર થાય (૩૦) જિલ્લામાં ઉત્તરીને પોતાના સામાનની ચકાસણી કરી લો કે જેથી કંઈ કંઈ રહી જાય નહીં (૩૧) હવે અણીંયા સામાનની બરાબર દેખોએ રાખો અહીં ચુંગી આતામાં સામાનની તપાસ થાય છે કે સાથે કાઈ વેપારનો સામાન તો નથી લાયા ? (૩૨) મહુા મોઅઝારમાં કેટલા મોઅદ્વિત છે તે સૌતા જિલ્લામાં વક્તીવિ રહે છે મોઅદ્વિતનું નામ બતાવવાથી તેમનો વક્તીવિ તમને પોતાની સાથે લઈ ને તમારો સામાન પોતાના ત્યાં અથવા તમારા રહેણાણના રથ્યે પહોંચાડી દેશે. અહીં પણ પોતાના સામાનની ચોકસાઈ કરી લેવી (૩૩) બદ્દુન્યો અને સૌ અર્થેથી બહુજ નરમી સાથે વર્તાવ કરો, જો તે સખ્તી કરે તો અદભૂતી સહન કરે, તેના પર શાયાદિત પ્રાપ્ત થવાનો જાયદો ફરમાયો છે જાસ કરીને અહુલે ફરગૈન, અહુલે મદીના, અહુલે અરબના ઇલો (કર્મી) પર આદેશ ન કરો. ન દિવમાં ભવિનતા લાવે તેમાં બનેજહાંનની સચાદાત છે (૩૪) જે લોકો અરથી જાણતાનથી તેમને કેટલાક સખત સ્વભાવીઓ ગાળો બદ્દે છે એવું થાય તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવામા આવે. દિવમાં મેન ન લાગવામાં આવે. આમે મહાકાવાળાઓ સખત મિનજ છે તેમની સખ્તી પર નરમી લાગમી છે. (૩૫) હજનતું કષુલિયત માટે નણ શરતો છે—

અલ્લાહ તચ્ચાલા ફરમાવે છે હજનતુંમાં ન ફરસ (ગંદી) બેદ્યાઈવાળી વાત હોય ન અમારી ના ફરભાની, ન કોઈથી જગડો લડાઈ. આ વાતાથી બહુ દુર રહેવું જોઈએ, જ્યારે ગુસ્સે આવે અથવા જધડો થાય અથવા કોઈ ગુનાહનો ઘ્યાલ થાય તત્કાળ ભરતક શુકાની દિન પ્રત્યે ધ્યાનિત થધને આ આપતની તિલાવત કરે એક વખત લાહૌર શરીર પદે. આ વાત જતી રહેશે. કેટલીક વેળા વગર કારણે જધડો ઉલો થાય છે માટે દરેક પોણે સાવચેત રહેવું જોઈએ નહીં તો એક એ શબ્દોમાં સધળી

મહેનત અને ડીપીયા બરાયાદ થઈ જશે.

(૩૬) જે કોઈ પડાવ પર ઉત્તરવાનું થાય તો આ હુંથા પઢી લે. અગ્રોચ્ચ એ કલેમાતિદલાહિતા-માતે મિન શરે' મા ખલ્લક અલ્લાહુમ્મ અચ્છતેના ખ્યરા હાજરમન્જેલે વ ખ્યરા માઝીહે વ અક્ફેના શર્રી હાજરમન્જીલે વ શર્રી માઝીહે અલ્લાહુમ્મ અન્જીદીની મન્જેલમ મુખ્યારકન વ અત્યત ખ્યરુદ્દમુન્જેલીન.

(અર્થ): અલ્લાહના પરિધૂર્ણ કલેમાનની પનાહ માચું છું, તેની ખુરાઈથી જેણે તેને પેદા કર્યું, ઈલાહી તુ એ ઉતારાની જૌર અર્પણ કર, અને તેની જૌર જે કાઈ તેમાં છે, અને તેના શર (ખુરાઈ) થી અમને બચાવ. અને જે કાઈ તેમાં છે તેની ખુરાઈથી બચાવ. ઈલાહી તુ અમને બરકતનાળા ઉતારાયાં ઉતાર. અને તુ બેહલતર ઉતારવા વાળો છે.) દરેક તુકસાનથી ખ્યશે અને સાંદ્ર એ છે કે ત્યાં એ રક્યત નમાજ પદે (૩૭) જ્યારે મંજ્રિલ (પડાવ) થી કુચ કરે એ રક્યત નમાજ પઢીને રવાના થાય. હંદીસમાં છે કે, કયામતના દ્વિવસે તે મંજ્રિલ તેના હજ્જમાં આ કાર્યની ગવાહી આપશે (૩૮) મહુ મોઅઝાથી જ્યારે મદીના તથેખાાહ માટે સવારી (મોટર) બાડે કરો તો એ શરત કરી લો કે નમાજના સમયે થોભવું પડશો. આ હાલતમાં નમાજ જમાયત સાથે સરળતાથી અદા કરી શકશો. ખખરહાર નમાજ હરગિઝ છેાડશો નહીં કે તે હમેંશા બહુ મેટો ગુનોહ છે અને આ હાલત વધારે સખતતમ કે જેના દરખારમાં જવ છે રસ્તામાં તેમની જ નાફરમાની કરતા જવ, તો બતાવો. કે તમેએ તેમને રાજ કર્યા કે નારાજ. આપણે જોઈએ છીએ કે કેટલાંએ હાજરીઓ નમાજ પ્રતિ બિદ્કુલ ધ્યાન આપતા નથી. થોડીક તકલીફ પર નમાજ છેહી હે છે નેકે શરીરાતે જ્યાં સુધી આદ્ધી હોશમાં છે નમાજ ત્યજવાની રણ આપી નથી (૩૯) મદીના તથેખાાહના પ્રવાસમાં કેટલીક વેળા કાફિલો (વાહન) ન થોખવાના કારણે મજબૂરીએ ઓહર તથા અસર મેળવીને પઢની પડે છે. તેના માટે લાજિમ છે છોહરની

ફરલોથી ફરેગ થવાથી પહેલા ઈરાહો કરી લો કે એજ સમયે અસર પડીશ. અને જોહરની ફરજ પછી તુરતન અસરના નમાજ પડે ત્યાં સુધી કે વચ્ચમાં જોહરની સુનનો પણ નથી, આવી રહે બજ મગરિબ પછી ઈશા પણ એજ શરતોથી જઈજ છે અને ને એવો મોકા હોય કે અસરના સમયે જોહર અથવા ઈશાના સમયે મગરિબ પછી હોય તો ડેવળ એટલી શરત છે કે જોહર તથા મગરિબ સમય નિકળી જવાથી પહેલા ઈરાહો કરી લો કે તેમને અસર તથા ઈશા સાથે પડીશ, (૪૦) જ્યારે તે વંતી નજરે પડે જેમાં થોલવા અથવા જવા ઈચ્છે છે તો આમ કહે: અટલાહુમ રૂપણ સસમાન વાતીસસણે બમા અજલદન વ રૂપણહૃમરહીન સુસણે બમા અકુલદન વ રૂપણ શરાયાતીના વ માચમહલદન વ રૂપણહૃમરહ્યાહુ બમા અરથન, અટલાહુમ ઈનના નસચલોકા ઝોરા હાજોહેલ કરયતે વ ઝોરા અહલેહા વ અરથા માઈહા વનદીજો એકા મિન શરે હાજોહિટકરયતે વ શરે અહલેહા વશરે માઈહા.

અર્થ: હે અદ્વાહ! સાતે આસમાનોના રૂપણ! અને તેના રૂપણ જેને આસમાનોએ છાંયડો કરો, અને સાતે ધરતીઓનો રૂપણ! અને તેમનો રૂપણ જેને નમાનોએ ઉડાવી રાખ્યા છે, અને શેતાનોના રૂપણ જેમને તેણે ગુમરાહ કર્યો, અને હવાઓનો રૂપણ! અને તેમનો રૂપણ જેને તેમણે ઉડાયા, હે અદ્વાહ! અમે તારાથી આ વસતિની અને વસતિવાળાઓ અને ને કાઈ તેમાં છે તેનાથી ભવાઈનો સવાલ કરીએ છીએ અને એ વસતિ તથા એ વસતીવાળા એની ખુરાઈ અને ને કાઈ તેમાં છે તેની ખુરાઈથી તારી પનાહ માંગીએ છાયે. અથવા ડેવળ પાછલી દુઅઓ પડે. દરેક બલાથી સુરક્ષિત રહેશે. (૪૧) ને શહેરમાં નય લોંના સુની આલિમો અને બા શરય ક્ષુરોની પાસે અહથી હાજર થાય. મજારોની જિયારત કરે, વર્થુ હરવા-કરવામાં સમય ન બગાડે. (૪૨) ને આલિમની પિછમતમાં નય તે મજાનમાં હોય તો અવાજ ન આપે. બહાર આવવાનો ઈન્ટેજાર કરે,

તેની સમક્ષ વગર જરૂરતનો વાત ન કરે. રણ લીધા સિવાય મસ્થલો ન પૂછે. તેની કોઈ વાત પોતાની નજરોમાં શરીરચતના જિલાઈ જણાય તો આક્ષેપ ન કરે અને હિલમાં નેક યુમાન રાખે. પરંતુ આ સુની આલિમ માટે છે. ખદમજહબના પહુંચાયાથી પણ જાગે. (૪૩) ખુદાના જિક્કથી કિલ બહેલાવે કે ફરિશ્ટો સાથે રહેશે. શરેર તથા બેહુદી વાતો અને નિરર્થકતાથી હિલ બહેલાવે નહિ. કે શયતાન સાથે હશે. (૪૪) દરેક સિર ખાસ કરાને હજજના સિરમાં પોતાના અંત પોતાના સગાઓ. અને મિત્રા માટે દુઅથી ગાંઠલ ન રહે કે મુસાફિરના દુઅા ઝૂલ છે.

(૪૫) “યારે કોઈ સુશકેલામાં મદદની જરૂરત હોય તો નણ વાર કહે—યા ઈખાઈટલાહુ અઈતુની” અથ અહ્લાહના નેક બંદાંયા. મારી મદદ કરે. જીથી મદદ થશે. આ દુકમ હ્યાસમાં છે. નયારે સવારોનું જનવર નાસા નય અંત પડીન રહેશે આ દુઅાજ પડી અઙ્ગેર દીનાનેટલાહુ યથગૂના વલાહુ ઘ્યકુલમ મન દ્વારસમાવાતે વહચ્યદ્વી તોચ્યંબ કરણું વ ધાર્દોહુ પુરુજ ડીન” તુરતન ઉલ્લં રહી જશે. (૪૬) યાસમદુ ૧૩૪ વખત દરરોજ પડી. ભૂખ તરસથી બચરા. (૪૭) ને દુઃમન અથવા હુટારાઓના લય હોય લેઈલાહુ પડે. દરેક બલાથી અમાન મળશે. (૪૮) નયારે રાતનો અંધકાર પરેશાન કરનાર આવે તો આ દુઅા પડે.

યા અહોં રૂપણી વરૂપ્યોકલાહુ અડોઝો બિટલાહુ મિન શરેંકા વ શરેં માઈકા વ શરેં માખલક દીકે વશરેં મા રૂપણ અલયકા વ અડોઝો બિટલાહુ મિન શરેં અસદીન વ અસ્વદ મિનલજનતે વલચ્યકરણે વમિન સાકિનિટખલહે વમિન વાલિદિંબ મા વલદ.”

(૪૯) નયારે કથાંક દુઃમનાથી લય હોય આ પઢી લા “અટલાહુમ ઈનના નજયલોક દી નોહુરેહિમ વ નજીઓ મિન શારૂરેહિમ”

(૫૦) નયારે ગમ તથા પરેશાની આવી પડે આ દુઅા પડો.

લાઈલાહા ઈટલાહુ અંજીમુલહુલીમ લા
ઇલાહા ઈટલટલાહો રૂભુલારોસીલઅંજીમ.
લાઈલાહા ઈટલટલાહો રૂભુસમાવાતે
વલયાર્થી વ રૂભુઅર્થીલકરીમ.

અને એવા સમય “લા હોલ વલા કુલ્બતા
ઇટલા પિટલાહુ” અને “હસ્તાનટલાહુ વ
નેચુભલ વડીલ” અધિકતાથી પઢા.

(૫૧) જ કાઈ વરતુ ગુમ થઈ જાય તો કહે :

યા જમેચુનનાસે દો યોમલ-લારયથ હાહે
ઇનનટલાહા લા ચુખુલુલુલમાચાદ, વજભચ્ય
ખચના વ ખચના હાલલતા.

ઈનશાચલાહ રૂણા જરો, (૫૨) દરેક ખુલંદી
પર ચચાતાં અદલાહો અકખર કહે અને ટાળામાં
ઉત્તરતાં સુષ્ઠાનટલાહ કહે, (૫૩) કુઈ રહેતા
વ ખતે એક વ ખત “આયતુલ કુર્સી” હમેશા
પઢો કે ચાર અને શયતાનથી અમાન છે, (૫૪)
બંને દરખારેમાં નમાનનું સમય શરી થતાં જ થાય
છે, તરકણ શરી સમય પર હુરત જ અજાન અને
થાડીવાર પછી તકથીર તથા જમાએત થઈ જાય
છે, ને કષ્ણ થાડો છેં કિરંલા હોય, એટલા
ચુંનાધા નથી પામતો કે અજાન સાંકળા વુઝુ કરે
પછી હાજર થઈને જમાએત અથવા પ્રથમ રકાએત
મળા શકે અને ત્યાંની માટી બરકત એજ તવાહ
તથા જ્યારેત અને નમાનની પ્રથમ તકથીર છે,
માટે સમય જાહ્યાંન અજાનથી પહેલા વુઝુ રૈથાર
રાખે અજાન સાંલળતાં જ હુરત જ ચાલા નિકળે
તો પ્રથમ તકથીર રૂણા અને ને કેવળ પ્રથમ
સહી ઈચ્છે, નેનો સવાલ અનહદ છે, ત્યારે તો
અજાનથી પહેલા હાજર થઈ જયું લાજીમ છે.
(૫૫ાંતું આજકાલ તો સંઈદી-વહુઅથી હુકુમત છે.
ઈમામો પણ વહુઅથી ધરમ પ્રમાણે અકાદા ધરાને
છે તો આવા ઈમામની પાછળ નમાજ પઢે નહિ-અનુ.)

(૫૫) પાછા ઈસવામાં પણ એજ તરીકો દર્શિએત
રાખે ને કે અહીંથા સુધી ખચન થના છે. (૫૬) મકાન
પર આવવાની તારીખ તથા સમયથી અગાઉ ખખર
આપા હે, ખખર આપા સિવાય હરેગિજ જાય નહીં.

ખાસ કરીને રાતમાં, (૫૭) લેડોએ હાજરું સ્વાગત
કરવું જોઈએ અને તેના ઘર પહેંચવાથી પહેલા
દુઅા કરાવે કે હાજ ન્યાં સુધી પોતાના ધરમાં
કદમ મુક્તો નથી તેની દુઅા કુલુલ છે, (૫૮) સૌથી
પહેલા પોતાની મરિજદમાં આવીને એ રકાએત નિશ્ચલ
પઢે, (૫૯) એ રકાએત ધરમાં આવીને પઢે, પછી
સૌથી ગળે મલે. (૬૦) સગાં-વહાલાઓ, મિત્રો માટે
કાંઈને કાંઈ તોહડો જરૂર લાને અને હાજરો
તોહડો તખુર્ઝ કાતે હરગૈન શરીરદ્વિનથી અધિક શું છે
અને ખીજે તોહડો દુઅાનો, કે મકાનમાં પહેંચવાથી
પહેલા સ્વાગત કરનારાઓ અને સૌ મુસલમાનો
માટે દુઅા કરે.

મીકાતનું બધાન

મીકાત તે સ્થળને હાહે છે કે મકા મોઅજમા
જનારાને એહેરામ વગર ત્યાંથી આગળ વધવું જાઈજ
નથી, લલે વેપાર વિગેરે કોઈ થીન હેતુથી જતો
હોય, (આમામએ કુતુખ)

મસ્ફુલા : (૧) મીકાત પાંચ છે. (૧) જુલાલુલયદેહ આ મદીના શરીરીનું મીકાત છે. આ
જમાનામાં આ જગ્યાનું નામ અધિયારે અદ્વી છે,
ભારતવાળા અથવા થીન દેશથાણ હજથી પહેલા
ને મદીનાશરીરી જાય અને ત્યાંથી પછી મક્કા
મોઅજમાં આવે તો તે પણ જુલાલુલયથી એહેરામ
બાંધે (૨) ઝીતેઈક ઈરાક આ ધરાકવાળાઓનું મીકાત
છે, (૩) હજક્રેહ આ શામીઓનું મીકાત છે, પરંતુ
હજક્રેહ હવે સાવ નાન્ય જેણું થઈ ગયું છે, તાં
વરતી રહી નથી, કેવળ કેટલાક ચિન્હ મળી આવે છે,
તેને એળાખનાર હવે એચા હણો. માટે શામવાળાઓ
રાખિગથી એહેરામ બાંધે છે કે હજક્રેહ રાખિગના
નાન્ય ક છે (૪) કરન, આ નજીવાળાઓનું મીકાત
છે. આ જગ્યા તાઈદીની નિકટ છે. (૫) યલમલમ
ધમનવાળાઓનું મીકાત છે.

મસ્ફુલા : (૧) આ મીકાતો તેમના માટે
પણ છે જેનો ઉદ્દેશ થયો અને તેમના સિવાય જે
શાખા ને મીકાત પાસેથી પસાર થાય તેના માટે

એ જ મીકાત છે. અને જે મીકાત પાસેથી પસાર થયો નહીં તો જ્યારે મીકાતની સમક્ષ આવે તે સમયે એહરામ બાંધી લે.

દા. ત. બિન્દીઓની મીકાત કોઈ વલમલમની સન્મુખતાઓ છે, અને સન્મુખતાઓમાં આવવું તેને પોતાને અખર ન હોય તો કોઈ જાણુંકરેને પૂછી લે, અને જે કોઈ એવો ન ભલે જૈનાથી પૂછી શકે તો તહર્રી (અરાયર વિચાર કરીને નક્કો કરવું) કરે જે કોઈ રીતે મહાઝાત (સમક્ષતા)ની જાણુંકરી ન થાય તો મજૂદ મોઅઝમા જ્યારે એ મંજિલ બાકી રહે, એહરામ બાંધી લે. (આલમગીરી, દુરો સુખતાર, રદ્દુલ સુહૃતાર)

મસ્ટિલા : (૩) જે શાખસ એ મીકાતો પાસેથી પસાર થયો દા. ત. શાખી કે તે મહીના સુનવ્યરાના ભાર્ગથી કુલ હુદૌરીફલ આવ્યો અને ત્યાંથી હજાફલ, તો અફીજન એ છે કે ગ્રથમ મીકાત પર એહરામ બાંધો અને બીજી પર બાંધવું પણ વાંધાજનક નથી, એમજ જે મીકાત પાસેથી પસાર થયો નહીં અને સન્મુખતાઓમાં એ મીકાત આવે છે તો જે મીકાતની સન્મુખતા ગ્રથમ થાય ત્યાં એહરામ બાંધવું અફીજન છે. (દુરો સુખતાર, આલમગીરી)

મસ્ટિલા : (૪) મજૂદ મોઅઝમા જવાનો ઈરાદો ન હોય બલ્કે મીકાતની અંદર કોઈ ખીજન સ્થળે દા. ત. જિદ્દાહ જવા ઈચ્છે છે તો તેને એહરામની જરૂરત નથી, પછી જે ત્યાંથી મજૂદ મોઅઝમા જવા ઈચ્છે તો એહરામ વગર જઈ શકે છે માટે જે શાખસ હરમાં એહરામ વગર જવા ઈચ્છે છે તે આ હીલો કરી શકે છે, એ શરતે કે વાસ્તવમાં તેનો ઈરાદો ગ્રથમ દા. ત. જિદ્દાહ જવાનો હોય, અને મજૂદ મોઅઝમા હજ અને ઉમરહના ઈરાદથી ન જતો હોય, દા. ત. વેપાર માટે જિદ્દાહ જય છે અને ત્યાંથી દ્વારે થઈને મજૂદ મોઅઝમાનો ઈરાદો છે તો એહરામ વગર જઈ શકતો નથી, જે શાખસ ખીજન તરફથી હજને બહલ માટે જતો હોય તેના માટે આ હીલો જરૂર નથી. (દુરો સુખતાર, રદ્દુલ સુહૃતાર)

મસ્ટિલા : (૫) મીકાતથી અગાઉ એહરામ બાંધવામાં વાંધો નથી અલ્કે ઉત્તમ છે; એ શરતે કે હજના મહીનાઓમાં હોય. અને શવાલથી પહેલા હોય તો મના છે. (દુરો સુખતાર, રદ્દુલ સુહૃતાર)

મસ્ટિલા : (૬) જે લોકો મીકાતની હજની અંદર રહેનાર છે પરંતુ હરમથી બહાર છે, તેમના એહરામનું સ્થળ હિલ અર્થાત હરમની બહાર છે, હરમથી બહાર જ્યાં ઈચ્છે એહરામ બાંધે અને એહતર એ છે કે ધરેથી એહરામ બાંધે અને તે લોકો હજ અથવા ઉમરાનો ઈરાદો ન રાખતા હોય તો એહરામ વગર મજૂદ મોઅઝમા જઈ શકે છે, (આમભાયે કુતુષ્ય)

મસ્ટિલા : (૭) હરમના રહેનાર હજનો એહરામ હરમથી બાંધે અને એહતર એ છે કે મરિન્જદુલ હરમ શરીરમાં એહરામ બાંધે અને ઉમરાનો હરમના બહારથી અને એહતર એ છે કે તનઅભીમથી હોય. (દુરો સુખતાર વિગરે)

મસ્ટિલા : (૮) મજૂદાવાળા જે કોઈ કામથી હરમની બહાર જાય તો તેમણે પાણ આવવા માટે એહરામની હાજર નથી અને મીકાતથી બહાર જાય તો હવે એહરામ વગર પાણ આવવું તેમના માટે જરૂર નથી. (આલમગીરી, રદ્દુલ સુહૃતાર)

એહરામનું અધ્યાત્મ

અક્ષાંધાંક કુર્ચાન શરીરફાં હરમાવે છે : શહે રૂમ-મસ્ટિલુમાતુન ક્રમન દ્વારા ક્રીલિનદ્રોજનજ દ્વારા રક્સ વલા દ્વારુંકૂડ વલાજિદાલા દ્વીદ્રોજનજે વમા તક્ષિલુ મિન જૌરિયાં લગ્નુંદલાહે. વ તજીવદ્વદ્વ દ્વારા ખરા જાહીતકથા વત્તાકુની યા ઉલિદઘદઘાયે.

તરણુમેં : હજનાં કેટથાક મહીના ભાગુમ છે, જેણે તેમાં હજ (પોતાના ઉપર) લાજિમ કર્યું (એહરામ બાંધ્યું) તો ન દેખશ છે ન દિશ્ક, ન ઝગડું હજમાં, અને જે કોઈ લક્ષાઈ કરે અલ્ફાહ તેને જણે છે અને તૌશાલો, એશક સૌથી સારો

તૌશો તો તકવો છે અને ભારથી જ હરો અથ અંજુલનાળાળાઓ.

અને કુર્ચાન શરીરિમાં અલ્લાહપાડ ફરમાવે છે :

યા અચ્યોહદલજીના આમનું ઓફ બિલચ્યોકુદે, એલિલિત લકુમ બધીમ-તુદ્યાનચાસે હદલા મા ચુલા અલયકુમ જીરા માલિલીચીસ્ટોહ વ અન્તુમ હોચેસુન ધનલ-હલાહ યહકોચો મા ચોરીદ, યાચ્યોહદલજીના આમનું લા તોહિલલુ શચ્યાચેરહલાહે વ લ શચ્યાચેરહલાહ વલદહલાઈદા વલા આમનીનલ્યોતલહલામ ચચ્યતગુના ફેદલમ મિર્દ્યોહિમ વ રિદ્ધાનન, ઈજા હેલદલુમ ફેસ્તાદ્યં. (કુર્ચાન)

તરજુમો : અથ ધર્માનવાળાઓ. અદ્યુદ્ધ પુરા કરેલા તમારા માટે ચો પગા જનવર હલાલ કરવામાં આવ્યા સિવાય તેમના, જેમનું તમારા પર વયાન થશે. પરંતુ એહોમની હાલતમાં શિકારનો ઈરાહોન કરો, એથક અલ્લાહ ને ચાહે છે હુકમ ફરમાવે છે. અથ ઈમાનવાળાઓ, અલ્લાહનાં ‘શચ્યાઈદ’ અને હરામ (હુરમતવાળા) મહીના અને હરમની હુરાની અને ને જનવરોના ગણામાં દાર નાખવામાં આવ્યા (કુર્ચાનની ઓળખ માટે) તેમની એ હુરમતી ન હશે અને ન તે લોકોની ને આનંદો કા’નાનો ઈરાહો પોતાના રષ્યાના ફંજલ અને રજા તલખ કરવા માટે હરે છે અને જયારે એહોમ પોદો, તે સમયે શિકાર કરી શકો છો.

હૃદીસ (૧) સહીહેન (ખુખારી-મુસ્લિમ)માં ઉમ્મુદ મોામિન આઈશા સિદ્ધીકા રહીયદાહો અન્હાથી રિવાયત છે કે, હું રસ્તાલાહ સલ્લાલાહો અલયહે વસલ્લામને એહોમ માટે એહોમથી પહેલા અને એહોમ જોલના માટે તચાદ્ધથી પહેલા ખૂબશ્યુ લગાયતી નેમાં સુશક (કશુરી) હતી, તેની ચમક હુકુરની ભાંગ (પાંથા)માં એહોમની હાલતમાં જણે હું અત્યારે જોછ રહી છું.

હૃદીસ (૨) અદ્યુદાહિદ અધિરિન સાબિત

રહીયદાહો અન્હોથી રિવાયત કરે છે કેનથીએ કરીમ સલ્લાલાહો અલયહે વસલ્લામે એહોમ બાંધવા માટે ગુસુલ કર્યું.

હૃદીસ (૩) સહીહ મુસ્લિમ શરીરિમાં અખુદ સઈદ રહીયદાહો અન્હોથી મરવી છે: અમે હુકુરની સાથે હજજ માટે નિકુયા, પોતાનો આવાજ હજજ સાથે ખુબ થુબંદ કરતા.

હૃદીસ (૪) તિરમિજી તથા ઈન્નેમાન તથા અખુદી સહલ મિન સચદ રહીયદાહો અન્હોથી રાવી છે કે રસ્તાલાહ સલ્લાલાહો અલયહે વસલ્લામે ફરમાયું: ને મુસુલ્માન “લણ્યેક” કહે છે તો અથે જમણે ને પથર અથવા વૃક્ષ અથવા ફેલો અમીનના છેલા સુધી છે તે લણ્યેક કહે છે,

હૃદીસ (૫-૬) ઈન્નેમાન તથા ઈન્ને અગ્રીમદ તથા ઈન્ને હુથાન તથા હાકિમ જેયાભિન પાલિદ બુહનીથી રિવાયત કરે છે કે રસ્તાલાહ સલ્લાલાહો અલયહે વસલ્લામે ફરમાયું કે જિયીલે આવીને મને એ કર્યું કે, પોતાના અખોમે હુકમ ફરમાવી દો કે, લણ્યેક માં પોતાના અવાજો ખુલંદ કરે કે આ હજજો શિશ્યાદ (રિન્હ) છે. અનેજ જેવું સાઈં રહીયદાહો અન્હોથી રિવાયત છે.

હૃદીસ (૭) તિથાની ઔસતમાં અખુદ હુરયરહ રહીયદાહો અન્હોથી રિવાયત કરે છે કે, લણ્યેક કહેવાવાનો જ્યારે લણ્યેક કહે છે તો તેને બશારત આપવામાં આવે છે, અર્જ કરવામાં આવ્યું શું જનતની બશારત આપવામાં આવે છે. આપે ફરમાયું: હા,

હૃદીસ (૮) ઈમામ અહોમદ તથા ઈન્નેમાન નાભિરિન અદ્યુદાહ અને તિથાની તથા બયહુદી આભિરિન રથીએ રહીયદાહો અન્હુભથી રિવાયત કરે છે કે, રસ્તાલાહ સલ્લાલાહો અલયહે વસલ્લામે ફરમાયું: મુહરિમ (એહોમથાળા) જ્યારે સૂરજ કુઅવા સુધી લણ્યેક કહે છે તો સૂરજ કુઅવાની સાથે તેના ચુનાહ ગાયથ થઈ જય છે અને એવો થઈ જય છે કે જાણે તે હિવસે પૈદા થયો.

હૃદીસ (૯) નિરમિતી તથા ઈન્નેમાળ તથા ઈન્ને ખુણીમહ અમીરદ મોભિનીન હજરત સિદ્ધીકે અકુઅર રહીયદાહો અન્હોથી રિવાયત કરે છે કે કોઈએ રસ્દલુલવાહ સદ્વલવાહો અવયહે વસલબમને પૂછ્યું કે હજના અફલખ (ઉત્તમ) આમાદ શું છે? આપે ઇરમાયું: બુન્દ અવાજથી લખાયેક કહેવું અને કુરાયાની કરવું.

હૃદીસ (૧૦) ઈમામ શાહેર ખુણેમહ બિન સાબિત રહીયદાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસ્દલુલવાહ સદ્વલવાહો અવયહે વસલબમ જ્યારે લખાયેકથી કારેગ થના તો અહીંથી તેની રજા અને જનતની માંગ કરતા અને દોઝખથી પનાહ માંગતા.

હૃદીસ (૧૧) અખૂદાઉં તથા ઈન્નેમાળ ઉમ્મુખ મોભિનીન ઉન્મે સલમા રહીયદાહો અન્હોથી રિવાયત કરે છે કે મેં રસ્દલુલવાહ સદ્વલવાહો અલયહે વસલબમને ઇરમાવતા સાંભળ્યું કે ને શખ્સ મરિજાહે અકુસા (ગૌતુલ-મુક્કદસ)થી મરિજનુલ હરામ (મક્કા શરીરદ) સુધી હજ અથવા ઉમરાનો અહોમ આધીને આવ્યો તેના ઓગડા અને પાછલા ગુનાહ ખખશી દેવામાં આવશે અથવા તેના માટે જનત વાજિબ (અનિવાર્ય) થઈ ગઈ.

અહોરામના અહોકામ

(૧) એ તો આગળ જણાવી ગયા છીએ કે હિન્દીઓ માટે મીકાત (ન્યાંથી અહોરામ બાંધવાનો હુકમ છે) ‘ચલમલમ’ના પહાડની સન્મુખના છે. આ રથળ કામરાનથી નિકળી સમુદ્રમાં આવે છે, જ્યારે જિફા એ નાણ મંજિલ રહી જાય છે જહાજવાળા ખખર આપે છે, પહેલાથી અહોરામનો સામાન તૈયાર રાખો.

(૨) જ્યારે તે રથળ નિકટ આવે મિસ્વાક કરો અને વુદ્ધ કરો અને સારી રીતે મસળાને નહાઈલો; જો નહાઈ ના શકો તો કેવળ વુદ્ધ કરો તાં સુધી કે હેઠાં તથા નિકાસનાળી રીયો ને બાળકો પણ નહાય અને તહારત સાથે અહોરામ બાંધો. ત્યાં

સુધી કે જો ગુસલ કર્યું પણ એ વુદ્ધ થઈ ગયો અને અહોરામ બાંધીને વુદ્ધ કર્યું તો ઇજીલનો સવાલ નથી અને પાણી નુકસાન કરે તો તેના રથને તયમુખ નથી, હા જો નમાજે અહોરામ માટે તયમુખ કરે તો થઈ શકે છે (૩) પુરષો ઈચ્છે તો માધું મુંગવી લે કે અહોરામમાં વાળોની રક્ષાથી મુક્તિ મળે. નહી તો કાંસડો કરીને ઘૂણપૂદ્ધાર તેવાં નાંને.

(૪) ગુસલથી પહેલા નખ કલશાળી લો, અગદ તથા હુંગીની નીચેના વાળ હૂર કરીલો અફકે પાછળના પણ કે ઢેલો લેતા સમયે વાળોના તુટવા-ઉખડવાનો સવાલ રહે નહી (૫) શરીર અને કપડાં પર ઘૂણપૂદ્ધ લગાડો કે સુન્નત છે જો સુગંધી એવી છે કે તેનું લાંબન (ડાઘ) બાકી રહે છે. જેવું કે ફસુરી વિગેરે તો કપડામાં ન લગાડો.

(૬) પુરુષ સિવેની કપડાં અને મોણ ઉતારી નાંને, એક નંદી અથવા ધોયેલી ચાદર એટે અને અવોજ એક તહથાંધ (લુંગી) બાંધો, આ કપડાં સફેદ અને નવા બહેતર છે અને ને એકંજ કપડું પહેલ્યું જેનાથી સંધળું સતર દાંદા ગયું તો પણ જાઈજ છે. કેવાંક લોકો એવું કરે છે કે એજ સમયથી ચાદર જમણી બગલના નીચે લઈને બંને છેડા ડાબા ખલા પર નાખી હે છે, આ સુન્નત વિરાધ્ય છે, બદકે સુન્નત એ છેકે, આવી રીતે ચાદું તાદું તવાંના સમયે છે અને તવાં સિવાયના બાકીના સમયોમાં આદત અતુસાર ચાદર એદાવમાં આવે, અર્થાત બંને ખલાઓ અને પીઠ અને છાતી સંધળું દાંડાયું રહે.

(૭) જ્યારે તે રથળ આવે અને મકરણ સમય ન હોય તો એ રક્ખ્યાત નમાજ અહોરામની નિયતથી પદે, પ્રથમ રક્ખ્યાતમાં સુરત્યે ઝાતેઝા પછી કુલ ચા અરચુષાલ કાદેરન અને બીજુમાં “કુલહોવદ્વાહ”ની સુરત પદે, (૮) હજ નાણ પ્રકારની હોય છે. એકે નસું હજ કરે તેને ઈચ્છા કરું છે અને હાજરને મુદ્રિદ કરે છે, તેમાં સલમ ઝર્યા પણ આમ કહે-

“ અદલાહુરમ ઈન્ની ઓરીદુદહુજ્જ ઝ્યસ્સીહોં લી વ તકખાયાહોં મિન્ની, નવયતુદહુજ્જ વ અહુરમો એહિ મુખ્યેસન લિદલાહે ત્યાલા.

(અર્થ) હે અદલાહુરમ! હું હજારનો ઈરાહો કર છું, તેને તુ મારા માટે સરળ બનાવી હે અને તેને મારાથી કૃષુન ઇરમાવ, મેં હજારની નિયત કરી છે અને ખાસ અદલાહુરમાટે, મેં હજારનો ઓહરામ બાંધ્યો.

ભીજું એ કે અહીંથી નર્દી ઉમરાની નિયત કરે, મજ્જા મોઅક્રમાં હજારનો ઓહરામ બાંધે તેને તમનોથ કહે છે અને હાજુને “મુતમતેચ્ચ” કહે છે. તેમાં અહીં સલામ ઇરવ્યા પણ પણ આમ કહે.

અદલાહુરમ ઈન્ની ઓરીદુલ ઉપ્રતા ઝ્યસ્સીહોલો વ તકખાયાહો મિન્નીદહુઇપ્રતા વ અહુરમો એહા મુખ્યેસન લિદલાહે ત્યાલા.

નોટ : આમાં તરજુમો એ જ છે ઉપર મુજબ છે. તકખાત એટલો છે કે હજારની જગ્યાએ ઉમરો છે.

શ્રીજું એ કે હજ તથા ઉમરા બંનેની અહીંથી જ નિયત કરે અને આ સૌથી અફ્ઝલ છે, તેને કિરાન કહે છે અને એ હાજુને કારિન કહે છે આમાં સલામ પણ આવી રીતે કહે.

અદલાહુરમ ઈન્ની ઓરીદુદહુઇપ્રતા વલ હજજ ઝ્યસ્સીહોરમા લી તકખાયાહોમા મિન્ની નવયતુદહુઇપ્રતા વદહુજ્જ વ અહુરમો ઓહેમા મુખ્યેસન લીદલાહે ત્યાલા.

નોટ : આને તરજુમો પણ પ્રથમ અનુસાર છે તકખાત એટલો છે કે આમાં હજારની જગ્યાએ ઉમરો તથા હજજ બંને છે.

આ ત્રણે સ્વરૂપોમાં આ નિયત પણ લખ્યેક શુદ્ધ અવાજથી કહે. લાંઘોક આ છે.

લખ્યેક! અદલા હુરમા લખ્યેક! લખ્યેક! લા શરીરક લકડા લખ્યેક ઈન્નાલ હુરમા વ નેવ્યમતલકડા વલ મુદ્દક. લા શરીરક લકડ,

જ્યાં જ્યાં વકેરના ચિન્હો કરેલા છે ત્યાં વકેર કરે, લખ્યેક ત્રણ વખત કહે અને હુરશરીર પદે, પણ હુઅા માંગે, એક હુઅા અહીંથા આ રીતે મનકુલ છે.

અદલાહુરમા ઈન્ની અસચ્યોકા રિદાકા વદહુત્તનતા વ અડીઓ એકા મિન ગદ્યેકા વનનારિ.

તરજુમો : અય અદલાહુરમ! હું તારી રજા અને જનતનો માંગકર્તા છું. અને તારા ગરુન અને જહનમથી તારીજ પનાડ માંગુ છું.

અને આ હુઅા પણ મુજુગોથી મનકુલ છે (તે પણ પદે).

અદલાહુરમ અહુરમ લકડા શાખરી વ બશરી વ અજમી, વ દમી મિનનિ સાચે વતીલે વ કુદ્દે શયઈન હર્ભમતહુ અવહમહરમ અણતણી એ જાલિયા વજહેકફરીમ લખ્યેક વ સચાહ્યેક વદખ્યરો કુદ્દોહુ એ યદ્યયક વર્દગબાચો ઈલોકા વલ અમલુસ્સાલેહા લખ્યેકા જન્તુઅમાચો વદફદ્દલીલહસને લખ્યેકા મરણબન વ મૌહુબન ઈલોકા, લખ્યેકા ઈલાહુદખવકે, લખ્યેકા હુક્કન હુક્કેન તચ્યેપોદન વ રિક્કેન લખ્યેક અદતોરાયે વહુરસ લખ્યેક, લખ્યેક, અદમારિને લખ્યેક-લખ્યેક, મિન અફ્નીન આબિકિન ઈલોક લખ્યેક લખ્યેક કર્રોજણ કુરેણે, લખ્યેક લખ્યેક અના અફ્નોક લખ્યેક લખ્યેક ગઢેશર જોતુણે લખ્યેક અદલાહુરમ અધિની અલા અદાઈદ્રદીલહુજ્જને વ તકવખલોક મિન્ની વજામની મિનહલગીનસ્તભાયુ લકડા વ આમતુ એ વચ્છેકા વતીઅજી અચ્ચાકા વજામની મિન્બુદ્ધેકલગીના રદીતો અનહુમ વરદ્યતહુમ વ કલિકતહુમ.

તરજુમો—અય અદલાહુરમ! તારા માટે ઓહરામ બાંધ્યો, મારા વાળ અને મુશરહ (યહેરા) એ અને મારા હાથકાં અને મારા લોહીએ ઓરતો અને મુશ્યબુધ્યા

અને દરેક તે કસ્તુથી જેને તે એહરામવાળા પર હરામ કરી તેનાથી હું તારી કૃપાના કારણોનો તાલિય છું. હું તારી હુઝુર (સમક્ષ) હાજર થયો અને તમામ જૈર તારા હાથમાં છે અને રગયત (ઝીચી) તથા અમલે સાલેહ (સુહેલ્યો) તારા તરફ છે, હું તારી સમક્ષ હાજર થયો અથ નેઅમત અને સારા ઇજલવાળા, હું તારી સમક્ષ હાજર થયો, તારી પ્રત્યે રગયત કરતો અને ઉરનો, તારા સમક્ષ હાજર થયો અથ મખૂફના મખૂફ (પૂજય) વારંવાર હાજર છું, હું સમજુને ઈભાઈત અને બંધી જાણીને, ખાક અને કાંઈરીઓની ગણની અતુસાર, લખણૌક, વારંવાર હાજર છું, અથ બુલંદીઓવાળા વારંવાર હાજર છું. હાજરી છે, નાકેલાગુલામની તારી સમક્ષ, લખણૌક, લખણૌક અથ સાખીઓને હુર કરનાર, લખણૌક, લખણૌક હું તારો બંધો છું, લખણૌક લખણૌક, અથ ગુનાહોના બખ્શનાર, લખણૌક, લખણૌક અથ અદ્વાહ ફરજ હજ આદા કરવા પર મારી મદદ કર અને તેને મારા તરફથી કૃપૂત્ર કર અને મને તે લોકોમાં કર જેમણે તારી વાત કૃપૂત્ર કરી અને તારા વાયદા પર ઈર્માન લાવ્યા અને તારા અમર (હુકમ)તું અનુકરણ કર્યું અને મને પોતાનાં તે વફા (પ્રતિનિધિ મંજા)માં કરી હે જેનાથી તુ રાજ છે અને જેમને તેં રાજ કર્યા અને જેમને તેં મકખૂલ બનાવ્યા.

અને “લખણૌક”ની કસરત (અધિકાતા) કરે. જ્યારે શરીર કરે નણું વખત કહે.

મસ્ટાલા (૬) લખણૌકના શખદો ને મજકુર છે તેમાં કંમી કરવામાં આવે નહિ અધિકાતા કરી શકો છો બદ્દે એહતર છે. પરંતુ અધિકાતા અંતમાં હોય, વચ્ચે ન હોય. (જવહરહ)

મસ્ટાલા (૧૦) ને શર્જસ બુલંદ અવાજથી લખણૌક કહી રહ્યો છે તો તેનો તે હાવતમાં સલામ કરવામાં આવે નહિ, કે, તે મકરહ છે. અને ને કરી દ્વારા તો ખતમ કરીને જવાબ આપે, હા, જે જાણુનો હોય કે ખતમ કરવા પણી જવાબનો પ્રસંગ

સંપર્શો નહીં તો તે સમયે જવાબ આપી શકે છે. (મુનસ્ક)

મસ્ટાલા (૧૧) એહરામ માટે એક વેગા જીબથી લખણૌક કહેવું જરી છે અને ને તેના સ્થાને સુહંદુનાનદલાહે અથવા અલહુન્હાલિલલાહે અથવા લાઈલાહુન્હલલદલાહે અથવા કોઈ બીજું જિછે ઈલાહી કર્યું અને એહરામની નિયત કરી તો એહરામ થઈ ગયો. પરંતુ લખણૌક કહેવું સુનત છે. (આલમગીરી વિગેર) ગુંગો (મુંગો) હોય તો તેણે હોઠ હવાવવા જોઈએ.

મસ્ટાલા (૧૨) એહરામ માટે નિયત શર્ત છે. ને નિયત વગર લખણૌક કર્યું તો એહરામ ન થયું. એવી જ રીતે એકલી નિયત પણ કાશી નથી જ્યાં સુધી કે લખણૌક અથવા તેના કાયમ મુકામ (સ્થાને) કોઈ બીજુ વસ્તુ ન હોય. (આલમગીરી)

મસ્ટાલા (૧૩) એહરામના સમયે લખણૌક કહે તો તેના સાથે જ નિયત પણ હોય, તે કટલીએ વાર જાણી લીધું છે કે નિયત હિલના ધરાદાને કહે છે. દિવિમાં ઈરાદો ન હોય તો એહરામ જ ન થયું અને ઉત્તમ એ છે કે જુબથી પણ કહી લે. દા. ત. કિરાતમાં લખણૌક ઘિલ ઉભરતે વલ હજને અને તમતોઅમાં લખણૌક ઘિલ ઉભરતે અને ઈરાદમાં લખણૌક ઘિલ હજને કહે,

(હરે મુખતાર, રહેદુલ સુહુતાર)

મસ્ટાલા (૧૪) બીજા વતીથી હજ માટે ગયો તો તેની તરફથી હજ કરવાની નિયત કરે અને એહતર એ કે લખણૌકમાં એમ કહે લખણૌક અન ઇલાં (ઝાંની જર્યામે તેનું નોમ લેતું) અને ને નોમ ન લીધું પરંતુ દિવિમાં ઈરાદો છે તો પણ વધી નથી. (નાસુક)

મસ્ટાલા (૧૫) સુઈ રહેનાર અથવા બીમાર અથવા એહોશ તરફથી કોઈ બીજાએ એહરામ બાંધ્યો તો તે સુહરમ (એહરામવાળો) થઈ ગયો. જેની તરફથી એહરામ બાંધવામાં આવ્યો સુહરમના

એહારામ તેના પર લાગુ થશે. કોઈ મમતું (પ્રતિઅંધિત) વસ્તુનો વહેચાર કર્યો તો કદ્દારો વિગેરે તેના ઉપર જ લાજિમ આવશે તેના પર નહીં જેણે તેના તરફથી એહારામ બાંધ્યો અને એહારામ બાંધનાર ખૂદ પણ મુહરમ છે અને ગુનોલ કર્યો તો એક જ જરી વાજિબ થશે, એ નહીં, કે તેનો એક જ એહારામ છે, બીમાર અને સુઈ રહેનાર તરફથી એહારામ બાંધવામાં એ જરી છે કે એહારામ બાંધવાનો તેમણે હુકમ આપ્યો હોય અને એહોશમાં તેની જરૂરત નથી. (રદ્દુલ મુહુતાર)

મસ્ટાલા (૧૬) જે કોઈ શખ્સ હજનાં સધળાં અદ્દાલો અદ્દા કરવા સુધી એહોશ રહ્યો અને એહારામ સમયે હોશમાં હતો અને પોતાની જાતે એહારામ બાંધ્યો હતો તો તેના સાથવાળા તેને સધળા રથગોચે લઈ જય અને જે એહારામના સમયે પણ એહોશ હતો અને તે લોકોએજ એહારામ બાંધી રીધો હતો તો લઈ જવું એહેતર છે. જરી નથી. (હર્યે મુહુતાર, રદ્દુલ મુહુતાર)

મસ્ટાલા (૧૭) કોઈ શખ્સ એહારામ પછી ગાં ડો થઈ ગયો તો હજન સહીં છે અને જુબું કરશે તો “જઆ” લાજિમ થશે.

(રદ્દુલ મુહુતાર)

મસ્ટાલા (૧૮) ના સમજ બાગકે પોતે એહારામ બાંધ્યો અથવા હજના અદ્દાલો અદ્દા કર્યો તો હજ થઈ નહીં બલ્કે તેનો વાલી તેના તરફથી બનવી લાવે પરતુ તવાઈ પછીની એ રકાયો કે બાળક તરફથી વતી ન પઢ્યો, તેની સાથે બાપ અને બાઈ અને હોય તો બાપ અરકાન અદ્દા કરે. સમજવાળો બાળક ખૂદ અદ્દાલે હજ અદ્દા કરે, રમી વિગેરે ટેલીક વાનો છોડી દે તો તેા પર કુર્કદારો વિગેરે લાજિમ નથી, એવી જ રીતે ના સમજ બાળક તરફથી તેના વાલીઓ એહારામ બાંધ્યો અને બાળક કાંઈ મમતું (પ્રતિઅંધિત) કામ કર્યું તો બાપના ઉપર પણ કાંઈ લાજિમ નથી.

(આલમગીરી, રદ્દુલ મુહુતાર, તુસુક)

મસ્ટાલા (૧૯) બાળક તરફથી એહારામ બાંધ્યું તો તેના સિવેલા કપડાં ઉતારી લેવા જોઈએ. ચાદર અને તેલખાં પહેરાવે અને તે સઘળા વાતોથી બચાવે જે મુહરમ (અહરામવાળા) માટે ના જાઈજ છે અને હજને ફસિદ કરી દિધી તો કંઠ વાજિબ નથી જેડ તે બાળક સમજવાળો હોય.

(આલમગીરી)

મસ્ટાલા (૨૦) “લઘ્ફૌક” કેહતી વેગા નિયત કિરાનાં છે તો કિરાન છે અને ઈદ્રાદની છે તો ઈદ્રાદ છે. લસે જુલથી ન કર્યું હોય જે કોઈ શખ્સ હજના ઈરાદાથી ગયો અને એહારામના સમયે નિયત હાજર ન રહી તો હજન છે અને જે નિયત કોઈ ન હતી તો જ્યાં સુધી તવાઈ કર્યે ન હોય તેને અખત્યાર છે કે હજનો એહારામ ફેરવે અથવા ઉમરાનો અને તવાઈનો. એક અદ્દર પણ કરી દીધો છે તો આ એહારામ ઉમરાનો થઈ ગયો. એવી જ રીતે તવાઈથી પહેલા પત્ની સાથે સંબોલ કર્યો અથવા રોકા દેવામાં આવ્યો (નેતે અહસાર કષે છે) તો ઉમરા ડેરવામાં આવે અર્થાત કંઠમાં ઉમરા કરવું કાઢી છે. (આલમગીરી)

મસ્ટાલા (૨૧) જેણે હુજજતુલ ઈસ્લામ ન કર્યું હોય અને હજનો એહારામ બાંધ્યો, ઈરજ તથા નિશ્લના નિયત ન કરી તો હુજજતુલ ઈસ્લામ અદ્દ થઈ ગયું. (આલમગીરી)

મસ્ટાલા (૨૨) જે એ હજનો એહારામ બાંધ્યો તો એ હજ વાજિબ થઈ ગયા અને એ ઉમરાનો બાંધ્યો તો એ ઉમરાલ વાજિબ થઈ ગયા. અને બીજા ઉમરાનો બાંધ્યો તો પહેલો હજ છે અને જો બીજા એહારામમાં પણ કોઈ નિયત ન કરી તો દિરાન એ. (આલમગીરી)

મસ્ટાલા (૨૩) જે લઘ્ફૌકમાં હજ કર્યું અને નિયત ઉમરાની છે અથવા ઉમરા કર્યું અને નિયત હજનાં છે તો જે નિયત છે તે થશે, શખ્સનો

વિશ્વાસ નથી અને લઘ્યોકમાં હજાજ કહું અને નિયત બંનેની છે તો કિરાન છે. (આલમગીરી)

મસ્ટયલા (૨૪) કોઈએ એહરામ બાંધ્યો અને યાદ નથી કે કેનો બાંધ્યો હતો, તો બંને વાજિય છે, અર્થात કિરાનના અફ્ઝાલ બજાવી લાવે કે, પ્રથમ ઉમરો કરે પઢી હજ કરે, પરંતુ કિરાનની કુરખાની તેના માથે નથી. જે એ વરસુઓનો એહરામ બાંધ્યો અને યાદ નથી કે બંને હજ છે કે ઉમરા અથવા હજ તથા ઉમરા તો કિરાન છે. અને કુરખાની વાજિય, જેહજનો એહરામ બાંધ્યો અને એ નિયત નથી કે ક્યા વષે કરેશે તો આ વર્ષનો ગણનામાં લેવામાં આવશે. (આલમગીરી)

મસ્ટયલા (૨૫) જે હોઈએ મનત તથા નિદ્દલ અથવા ઇરજ તથા નિદ્દનો એહરામ બાંધ્યો તો નિદ્દલ છે. (આલમગીરી)

મસ્ટયલા (૨૬) જે એ નિયત કરી કે ઇલાંણાએ જે વરસુનો એહરામ બાંધ્યો એ જ વરસુનો આરો એહરામ છે અને પાછગથી ખખર પડી ગઈ કે તેણે ક્યો વરસુનો એહરામ બાંધ્યો છે તો તેનો પણ એ જ છે. અને ખખર ન પડી તો તવાર્કના પહેલા ઇરાચી અગાઉ જે ઈચ્છે નક્કી કરી લે અને તવાર્કનો એક ઇરો કરી દીધો તો ઉમરાનો થઈ ગયો, એવી જ રીતે તવાર્કથી પહેલા પત્નીથી સંભોગ કર્યો અથવા રોકી હેવામાં આવ્યો અથવા વક્રે અરક્ષનો સમય ન મળ્યો તો ઉમરાનો છે.

(મુન્સીક)

મસ્ટયલા (૨૭) જે હજને બહલ અથવા મનત અથવા નિદ્દનની નિયત કરી બો જે નિયત કરી એ જ છે, જોકે તેણે અત્યાર સુધી હજ ઇરજ ન કરી હોય અને જે એક જ હજમાં ઇરજ તથા નિદ્દલ બંનેની નિયત કરી તો ઇરજ અહી થશે અને જે એ ગુમાન (ધારણા) કરીને એહરામ બાંધ્યું કે આ હજ મારા પર લાજિમ છે અર્થાત ઇરજ છે. અથવા મનત, પાછગથી રપણ ધયું કે લાજિમ ન હતો તો આ હજને પૂર્ણ કર્યું જરૂરી થઈ ગયું.

ફાસિદ કરેશે તો કાજા લાજિમ થશે, નમાજમાં તેનાથી ઉદ્દૃ છે કે ઇરજ સમજને થર કરી હતી પાછગથી ખખર પડી કે ઇરજ પડી લીધી છે તો આ નમાજને પૂરી કરવું જરૂરી નથી ફાસિદ કરેશે તો તેની કમી નથી. (મુન્સીક)

મસ્ટયલા (૨૮) લઘ્યોક કહેવા ઉપરાંત એક ખીજું રવરૂપ પણ એહરામતું છે, જે કે લઘ્યોક ન કહેવું ખુર છે કે સુન્નતનો લાગ છે, તે સુરત એ છે કે “અફનહ” (અર્થાત કુર્બાની માટે ઉંટ અથવા ગાય)ના ગણામાં હાર નાખી હજ અથવા ઉમરા અથવા બંને અથવા બંને પૈકી એક અનિશ્ચિત ઈરાદથી હાંકતો લઈ ચાલ્યો તો મુહરમ (એહરામવાળા) થઈ ગયો જે કે લઘ્યોક ન કહે લલે તે “અફનહ” નિદ્દનનો હોય કે નાજરનો અથવા રિકરનો બહદો અથવા કોઈ ખીજે, જે ખીજના હાથે અફનહ ન મોકલ્યો પઢી પોતે ગયો તો નયાં સુધી માર્ગમાં તેને પામી ન લે મુહરમ થશે નહિ માટે જે મીકાત સુધી ન પામ્યો તો લઘ્યોક સાથે એહરામ બાંધવું જરૂરી છે, હા, જે તમરતો અથવા હજને કિરાનતું જનવર છે તો પામી લેવું શર્ત નથી પરંતુ તેમાં એ જરૂરી છે કે હજના મહીનાઓમાં તમરતો અથવા કિરાનનો “અફનહ” મોકલ્યો હોય અને એજ મહીનાઓમાં પણ નિકલ્યો હોય, અગાઉથી મોકલવું કામ આવશે નહિ. અને જે અફરીને હાર પહેરવી મોકલી અથવા લઈ ચાલ્યો અથવા ઉંટ-ગાયને હાર ન પહેરવ્યો બલ્કે નિશાની માટે કોણ (કેંકો) ચીરી નાખ્યો અથવા ગુલ એઠાંની હીધી તો મુહરમ થયો નહિ (આલમગીરી, દરે સુખતાર)

મસ્ટયલા (૨૯) કેટલાક શાખસો “અફનહ”ની શરીક છે, તેને લઈને જઈ રહ્યા છે, સૌના ફુકમથી એક શખસે નેને હાર પહેરવ્યો, સૌ મુહરમ થઈ ગયા અને જે તેમના ફુકમ વગર તેણે હાર પહેરવ્યો તો તે મુહરમ થયો, તેણો મુહરમ થયા નહિ.

(આલમગીરી)

મસ્ટયલા (૩૦) હાર પહેરવવાનો અર્થ એ

છે કે ઉન અથવા વાળની રાશમાં કોઈ વસ્તુ બાંધીને તેના ગળામાં લટકાવી હે કે લોકોને ખ્યાર પડી જાય કે હરમ શરીરમાં કુરણાની ભાટે (તું જનવર) છે. કે જેથી તેનાથી કોઈ રોકોએ ન કરે અને માર્ગમાં ચાકી ગયો અને જુખ કરી દીધો તો તે જનવરને માલદાર શખ્સ ખાય નહીં. (રદ્દુલ સુહૃત્તાર)

મસ્યદા (૩૧) એ સરતમાં પણ સુન્નત એ ૭ છે કે “બદનહ”ને હાર પહેરાવવા અગાઉ લયણીક કરે. (સુનસિક)

તે વાતો ને એહરામમાં હરામ છે

(૬) આ એહરામ હતો તેના થતાં ૧૨ તે કામ હરામ થઈ ગયા.

(૧) ઔરતથી સેહયત (સંલોગ કરવો) (૨): જીને બોસો (સુંખન) (૩) જીને ભસાસ (મદ્દેન) કરવું. (૪) ગળે વળગાખું (આલિંગન) (૫) તેના ચુમાંગ પર દાઢિપાત, જથારે કે આ ચારે વાતો શહેરત (ક્રમવાસના) સાથે હોય, (૬) જીઓ સામે એ કામતું નામ દેવું. (૭) ફંખશ, ચુનાંડ હુમેશા હરામ હતા હવે વધુ સખત હરામ થઈ ગયા કોઈથા દુનાંથી લગાઈ જાડો, ૧૨ ગલનો શિકાર, તેની પ્રત્યે શિકાર કરવા માટે દેશારો કરવું અથવા કોઈ પ્રકારે ખતાવવું, બંદુક અથવા દાઢાના અથવા તેને જુખ કરવા માટે છરો આપવું, (શિકારમા) તેના ઈંડા તોડી નાખવા, પીછા ઉભેડવા, પગ અથવા પાંખો તોડવી, તેનું દુધ દોહવું, તેનું માસ (જોરત) અથવા ઈંડા પકાવવું, ભનતું, વેચવું-અરંદહું ખાવું, ચોતાના અથવા ખીણના નખ કતરવા, માથાથી પગ સુધી ક્રપાંથી કોઈ વાળ કોઈ પ્રકારે અલગ કરવું, સુખ અથવા માથું કોઈ કપડા વિગરેથી ઢાંકવું. પેરી અથવા કપડાની નાની પોટલી અથવા ગાંસડી માથા

પર સુદ્ધા, સાંદ્રા (અમાંમો) બાંધવું, ઝુરકો, ભૂદે પહેરવું, મોન અથવા જરાયો વિગેરે પહેરવા જે અર્થી પગને ટાંકે (જ્યાં અરખી ઘૂટની દોરી હોય છે) પહેરવું, જે ઘૂટ ન હોય તો મોન કાપીને પહેરે કે તે તસમહની જગ્યા ન છુપાય, સિવેશું કપડું પહેરવું, ઘૂરઘૂવાળા અથવા બફન અથવા કપડાંમાં લગાવવું, મલીધાગારી (ગરુદા) અથવા કુસુમ-કેસર મતલબ કે કોઈ ઘૂરઘૂના રંગલાં કપડાં પહેરવું, જથારે કે હજું સુગંધી આપી રહી હોય, શુદ્ધ ઘૂરઘૂ સુશુક, અંધર, જાંકરાન, જાવંતી, લવિંગ, છલાયચી, દાંચચીના, જનજલીલ (ફુશ્યુદાર વરતુ હોય છે) વિગેરે ખાવું, એવી ઘૂરઘૂનું છેદામાં બાંધવું જેમાં અત્યારે વાસ હોય, દા. ત. સુરક, અંધર, જાંકરાન, મરતક અથવા દાઢાને ખતમાં (શુલાંજીર) અથવા કોઈ ઘૂરઘૂદાર અથવા એવા વરસ્થા દ્વારા જેનાથી જુઓ મરો જાંબા, વસમા (નાલના પાંદા) અથવા મહુંદાનો ખ્યાલ લગાવવું, ગુદ વિંડેથી વાળ જ.માલવું, અધુતું અથવા તલાનું તેલ લલને ઘૂરઘૂ વગરતુ દ્વારા વાળો અથવા ભદ્રનમાં લગાવવું, કોઈ તુ માથું સુદ્ધાનું જે કે તેનું એહરામ ન હોય, જુઓ મારવું, જુ દેંદું, કોઈને તેને મારવાના ઈશારો કરવું, તેને મારવા માટે કાંકું દ્વારા. અથવા તહક્કામા નાંખવું વાળોમાં પારો વિગેરે તેને મારવા માટે લગાવવું, તાત્પર્ય કે જુઓ નષ્ટ કરવા માટે કોઈ ક્રકારે કરણરૂપ થવું.

[૧૦] એહરામના મહકૃદ્ધો

એહરામમાં આ વાતો મહકૃદ્ધ છે. (૧) શર્તરનો મેલ વખોાખવું, (૨) વાળ અથવા શરીર ખળા અથવા સાખુ વિગેરે ઘૂરઘૂ વિંડેના ચીજથી દ્વારા, (૩) ડાંસડો કરવું, (૪) એવી રીતે ખંજવાળવું કે વાળ તુટવા અથવા જૂનાચે પહેરવાની આરાંક હોય, (૫) અંગરખું, કુરોટો, ચુગણ પહેરવાની રીતે ખલાઓ પર નાખવું, (૬) સુગંધીની હુણી આપેલ કપડું કે હજુ સુગંધ આપી રહ્યું હોય, પહેરવું-ઓઠવું, (૭)

ઈરાદાપૂર્વક ખૂશખુસુંધરું, લદે ખૂશખુદાર કેળ અથવા પાંદડું હોય, જેવું કે લીંખું, નારગી, ઝડપિનો, અતરદાઢા, (૮) અતર વેચનારની દુકાન પર એ ગરજથી બેસવું કે ખૂશખુથી હિમાગ સુગંધિત થશે, (૯) માથા અથવા (૧૦) સુખ પર પરી બાંધવું, (૧૧) કા'બાના જિલારની અંદર એવી રીતે પ્રવેસવું કે જિલાને શરીર માથા અથવા સૂર્યને અહે, (૧૨) નાક વિગેરે સુખનો ડોઈ ભાગ કપણથી છુપાવવું, (૧૩) કોઈ એવી વરસુ ખાવું-પૌવું જેમા ખૂશખુ પહેલી હોય અને ન તે પદ્ધતિવામાં આવી હોય ન સુગંધી નષ્ટ થઈ હોય, (૧૪) સિવ્યા વગરનું કપડું, રહુ કરેલ અથવા થીંગું લાગેલ પહેલું, (૧૫) તકણો મોટા પર રાખનો ઉંધા સુઈ રહેવું (૧૬) મહેંદ્રિ સુગંધિને હાથથી સરસાવું જ્યારે કે હાથમાં લાગી ન જાય નહી તો હરામ છે. (૧૭) હાથ (ખાજુ) અથવા ગળા પર તાવીજ બાંધવું. જો કે સિવ્યા વગરનું કપડામાં લપેટેલું હોય તો પણ, (૧૮) ઉઝર વગર જરીર પર પરી બાંધવું, (૧૯) શિંગાર (શણુગર) કરવું, (૨૦) ચાદર એદીને તેના છેડાઓમાં ગાંઠ બાંધવું જેવું ગાંતી બાંધે છે. તેવી રીતે અથવા કોઈ ખાળ રીતે જ્યારે કે ભાથું ખુલ્લું હોય નહી તો હરામ છે. એવી જ રીતે (૨૧) તેહથંદ (ઝુંગી)ના બને છેડાઓમાં ગાંઠ ભારવું, (૨૨) તેહથંદ બાંધાને ક્રમરથંધ (પરા) અથવા દોસાથી કસવું.

[૧૨] આ વાતો એહરામમાં

જાઈજ છે

(૧) અંગરખું, કુરતુ, સુગો સુઈ રહીને ઉપરથી એવી રીતે નાખી લેવું કે માથું અને સૂર્ય ઠંકાય નહી, (૨) આ વરસુએ અથવા પાયનભાતું તેહથંધ બાંધી લેવું, (૩) ચાદરના છેડાઓને તેહથંધમાં જોતાં દેવા. (૪) હુમ્યાની અથવા (૫) પરી અથવા (૬) હંથિયાર બાંધવું (૭) મેલ ઉપેક્ષા વગર હમ્મામ કરવું (૮) પાણીમાં કુલ્લકી ભારવું (૯) કપડાં ધોવું જ્યારે કે જુ ભારવાની ગરજથી ન હોય (૧૦)

મિસ્થાં કરવું (૧૧) કોઈ વરસુના છાંયડામાં એસવું (૧૨) છત્રી ઓદ્ધવું (૧૩) વિંટી પહેલું (૧૪) સુગંધી વગરનો સૂરમેલ લગાવવું (૧૫) દાદ ઉખાંખી (૧૬) હુટલા નખે અલગ કરી દેવું (૧૭) હુમ્લ અથવા ઝોડલી ઝોડવું (૧૮) અતના કરવું (૧૯) ઇસદ (૨૦) વાળ સુંદ્રા વગર પછના (૨૧) આંખમાં જે વાળ નિકો તેને અલગ કરવું (૨૨) મરતક અથવા શરીરને એવી રીતે ઘંનવાળવું કે વાળ તુટે નહીં (૨૩) એહરામથી પહેલા જે ખૂશખુ લગાવી હોય તેનું લાગેલું રહેવું (૨૪) પાલતુ જનવર ઉંટ, ગાય, બકરી, મુરળી વિગેરે જુંહ કરવું (૨૫) પકાવવું (૨૬) ખાવું (૨૭) તેનું દ્વાધ દોષવું (૨૮) તેના ઈંડા તોડવું-શેકું-ખાવું (૨૯) જે જનવરનો જેર મુહરમે શિકાર કર્યા અને કોઈ સુહરમે તેના શિકાર અથવા જુંહ કરવામાં ડોઈ પ્રકારની ભદ્ર ન કરી હોય તેનું ખાવું એ શરતે કે તે જનવર ન હરમનું હોય ન હરમમાં જુંહ કરેલું હોય (૩૦) ખાવા માટે માછલીના શિકાર કરવું (૩૧) દ્વા માટે કોઈ દાર્યાએ જનવરને મારવું. દ્વા અથવા ખારાક માટે ન હોય ખદકે નયા મળોરંજન માટે હોય, જેવી રીતે સોકામાં પ્રચલિત છે તો શિકાર દાર્યાનો હોય કે જંગલનો પાતે જ હુરામ છે અને એહરામમાં સંપત હુરામ (૩૨) હરમના અખારના ધાસ ઉખાલવું અથવા (૩૩) વૃક્ષ કાપવું (૩૪) ચાલ (૩૫) શાગળ (૩૬) ઉદ્ર (૩૭) કાચાંડ (૩૮) દિપકલી (ગરોડા) (૩૯) સાપે (૪૦) વિંછુ (૪૧) માંકડ (૪૨) મબધર (૪૩) મખતરા (૪૪) માંખા વિગેરે ખખાશ તથા મૂળી (હાનિ પહોંચાયનાર) જનવરોનિ મારવું જો કે હરમમાં હોય (૪૫) સુખ અને માથા સિવાય કોઈ ખાજુ જગ્યાએ જખમ પર પરી બાંધવું (૪૬) મરતક અથવા (૪૭) ગાલ ના નાચે તકાયા સુકતું (૪૮) માથા અથવા (૪૯) નાક પર પોતાનો અથવા ખાળનો હાથ સુકતું (૫૦) હાન કપડાથી ઠાંકવું (૫૧) હુદ્દાની નાચે દાઢી પર કપડું આવવું (૫૨) માથા પર ઝુમણો અથવા એરી ઉપાયું (૫૩) જે ખાવાના પાકવામાં સુરક્ષ (કરતુરી)

વિગેરે પડેતા હોય, જે કે સુગંધી આવે અથવા (૫૪) પકાવ્યા વગર જેમાં કોઈ સુગંધી નાખી અને તે સુગંધી આપતી નથી તેનું આવું-પીવું (૫૫) થી અથવા ચરખી અથવા કંડું તેલ અથવા કેપરેલ અથવા બદામ, દુંધી, કંદ (તૃણ)નું તેલ કે સુગાંધિત નક્કું હોય વાળોમાં અથવા શરીરમાં લગાવવું (૫૬) સુગંધીથી રંગેલા કપડાં પહેરવા જ્યારે કે તેમની સુગંધી (વાસ) જરી રહી હોય, પરંતુ કુસુમ કેસરનો રંગ પુરુષ માટે આમે હરામ છે (૫૭) દીન મજબૂત માટે જથુંબું બદકે હાજત અનુસાર ફરજ તથા વાળિય છે. (૫૮) ઝુટ પહેરવું જે પગોના તે સાંજને ન ઢાકે (૫૯) દિવ્યા વગરના કપડામાં લયે-દીને તાવીજ ગળામાં નાખવું (૬૦) આઈનો (દર્શણ) જેવું (૬૧) એવી સુગંધીનો રૂપર્ય કરવું જેમાં હાલમાં મહેક (વાસ) નથી જેવું આગ, લોઆન, સંદર્ભ (સુખુ) અથવા (૬૨) વેનું છેલમાં બાંધવું (૬૩) નિકાંડ કરનું.

(૧૨) એહોરામમાં પુરુષ-

લીના તર્ફાવત

આ મજદૂર મસાધલમાં પુરુષ-થી અને સરખા છે પરંતુ ઔરત માટે ડેટલોક વાતો જઈજ છે, (૧) માથું ઢાંકવું બદકે ના મહરમ સામે અને નમાજમાં ફરજ છે (૨) તો માથા મર-મિસ્તર-પેટી ઉત્ત્વાવવું પણ જઈજ છે (૩) શુંદ વિગેરેથી વાળ જમાવવું (૪) મસ્તક વિગેરે પર પરી બાંધવું, હાથ ગળામાં

તાવીજ બાંધવું ભલે સિવેલું (૫) હોય (૫) કા'ખાન ગિલાંકની અંદર એવી રીતે દાખલ થવું કે માથા પ રહે, મુખ પર ન આવે (૬) હાથ મોણ, (૭) પગ મોણ (૮) સીવેલા કાંપાં પહેરવું (૯) એટલા અવાજીથી લઘ્યોક ન કેલે કે ના મહરમ સાંલણે, હા, એટલો અવાજ દરેકને પદવામાં હંમેશા સૌને જરૂરી જરૂરી છે કે પોતાના કાનો સુધી અવાજ પહેલે.

ચૈતવણી : એહોરામમાં મુખ ઢાંકવું એસ્ત માટે પણ હરામ છે ના મહરમ સમક્ષ કાઈ પણ્યો વિગેરે મુખથી છેટે સામે રાખે.

(૧૩) જે વાતો એહોરામમાં ના જઈજ છે તે જે કોઈ ઉજર (શર્દી કારણ)થી અથવા ભૂલીને થાય તો શુંનોં નથી પરંતુ તેમના ઉપર જે કુરમાનો (૬૪) દેવેલો છે દરેક રીતે આપનો પડણે, જે કે દૂરાદા વગર હોય કે ભૂલથી અથવા અળજબરીએ અથવા નિંદ્રાવસ્થામાં.

(૧૪) તવાએ કુદુમ સિવાય એહોરામના સમયથી જમરહ સુધી જેનો ઉદ્દેશ્ય આગળ આવશે અધિકતમ સમય લઘ્યોકની અસંખ્ય અધિકતા રાખે. ઉકીતા, એસ્તતા, ચાલતા, વુંઝ-બેનુંઝ ફરેક હાલમાં ખાસ કરીને દાળ ચાલતા ઉત્તરતાં, એ છાંલાઓને મળતાં, સવાર-સાંજ, પાછલી રાતે, પાંચે નમાજો પછી, સારાંશ કે હરહાલતના અદલવા પર પુરુષ ઉંચા સ્વરે લઘ્યોક કંદે, પરંતુ ન એટલો ખુલંદ કે પોતાને અથવા ભાનુને તકલીફ થાય અને લીઓ. ધિમા અવાજથી પરંતુ ન એટલો ધિમો કે ખૂદ પણ ન સંભળે.

દાખલીએ હરમ

મક્કા મુકર્રરા તથા મસ્જિદે હરામમાં પ્રવેશ

અદલાહ અન્જતું જદ્દલ ફરમાવે છે. વ ઈજ કાલ ઈથ્રાહીમો રખ્યાનીજાયદ હાજા અલદન આમિનનું વરસુક અહુલહુમિન સસ્મરાતે મનામાન મિનહુમ અધિલાહે વલ્યોમિલામાંએ

કાલ વમન કરે કેદે ઇન્દ્રોમતેઅહુલકીલન સુમદદતરોંહુ ઈલા અજાયિનનારે વ એચસ-દમસીર વ ઈજ યર્દેચો ઈથ્રાહીમુલકવાએદા મિનહૈતે વ ઈસ્ટમાધલો રખ્યાના તકલીફ

મિનના ઈન્નકા અન્તરસમીક્ષા-અલીમ
રણભના વજાયદના મુસલેમીના લકા વ ભિન
કુર્યાયતેના ઉભ્રમતમ્-મુસલેમતલ-લકા વ
અરેના મનાસેકના વ કુતુખ અહીના ઈન્નકા
અન્યુતતતવાર્ધીમ.

તરજુમો : અને જ્યારે (હજરત) ઈખાહીમ
કુઝું હે પરવરદિગાર આ શહેરને અમનવાળું કરી
હે અને તેના રહેવાવાળાઓ પૈકી ને અદ્વાહ અને
પાછવા હિવસ (કયામત) પર ઈમાન લાવે તેમને
કુલોથા રોજ આપ. ઇરમાંયું અને જેણે કુઝ કુઝું
તેને પણ કાઈક વર્તવા માટે આપીશ, પછી તેને
આગના અગ્રાં પ્રતિ વિવશ કરીશ અને તે ખરાબ
કેકાણું છે. અને જ્યારે (હજરત) ઈખાહીમ તથા
ઈરમાઈલ ખાનએ કા'ભાની બુનિયાદો (પાયા) ખુલંદ
કરતાં કહેતા હતા—હે પરવરદિગાર તુ અમારાથી
(આકાભને) કખૂલ ઇરમાવ, બેશક તું જ સાંભળનાર,
નાણનાર છે અને અમને તું તારો ઇરમાઅરદાર (આજા
પાલક) બનાવ અને અમારી ઔલાદમાથી એક ગિરોહ
(વર્ગ)ને પોતાનો ઇરમાઅરદાર બનાવ અને અમારી
ઈખાહતના તરીકા (રીત) અમને દેખાડ અને અમારા
પર ઇલ્યું ઇરમાવ, બેશક તુજ મોટો તૌઓ કુખૂલ
કરનાર, રહેલ કરવાવાળો છે.

અને ઇરમાવે છે : અવ લમ નૌમકિકન
લહુમ હુરમન યોહુચી ઈદોહે સમરાતો કુદલ
શૈધન રિઝકન મિતલહુન વલાકિન અક્સરહુમ
લા યઅલમુન.

તરજુમો : શું અમોએ તેમને અમન (શાન્તિ-
વાળા) હરમમાં કુરેત (શક્તિ) ન આપી કે ત્યાં દરેક
પ્રકારના ઇણ લાવવામાં આવે છે કે અમારા તરફથી
રિઝક (રોજ) છે. પરંતુ ડેટલાએ લોકો નથી જાણતા.

અને ઇરમાવે છે : ઈન્નામા આમિત્રો અન
અયધ્યાદરખ્ય હાંઝેહિલખલદતિલઝી વ
હર્ભમહા વ લહુ કુખદો શૈધન વ આમિત્રો
અન અફુના મિનદમુસલેમીન.

તરજુમો : મને તો એ જ હુકમ થયો કે આં
શહેરના પરવરદિગારની ઈખાહત કરો જેણે તેને હરમ
અનાંયું અને તેના જ માટે હેરેક વસ્તુ છે અને મને
હુકમ થયો કે હું મુસલમાનોમાં રહું.

હૃદીસ (૧-૨) સંહિત બુખારી તથા સહીહ
મુસ્લિમમાં હજરત અન્હુલ્લાહ બિન અયધ્યાસ
રહીયલ્લાહ અન્હોમાથી રિવાયત છે કે રસ્લુલ્લાહ
સલ્લાહ્લાહો અલયહે વસલખમે મજ્જાની ઇટેહના હિવસે
એ ઈરશાહ ઇરમાયો આ શહેરને અદ્વાહ હરમ
(ખુજુર્ગ) કરી દિલ્લું છે. ને હિવસે આકાશ તથા
ધરતીને ઉત્પન્ન કરી તો તે કિયામતના હિવસ
સુધી માટે અલાહના કર્માથી હરમ છે, મારાથી
પહેલા કોઈના માટે તેમાં હત્યા હલાલ ન થયું અને
મારા માટે કેવળ બીધાઢ જ સમયમાં હલાલ થયું,
હવે ઇરથી તે કિયામત સુધી માટે હરામ છે. ન
અહીંયાનું કાપી શક્તાતું વિક્ષેપણ કાપવામાં આવે ન
તેને શિકાર બગાડવામાં આવે અને ન અહીંયાનો
પડી ગમેલો માલ કોઈ ઉદ્ઘાત પરંતુ ને એલાન
કરવા ઈચ્છનો હોય (તેને ઉદાહરણ જાધાર છે) અને
ન અહીંયાનું લીલું ધાસ કાપવામાં આવે, હજરત
અયધ્યાસ રહીયલ્લાહો અન્હોએ અર્જ કરી યા રસ્લુ-
લ્લાહ પરંતુ ધર્જાભિર (એક પ્રકારનું ધાસ છે કે
તેને કાપવાની ઈજનાત આપો) કે તે લુહારો અને
ધર બનાવવાના કામમાં આવે છે. હુજુરે તેની પર-
વાનગી આપી દિલ્લી. તેના જેણું જ અધ્યૂ શુરેહ
અદ્વાહ રહીયલ્લાહો અન્હોથી રિવાયત છે.

હૃદીસ-(૩) ઈધનેમાજ ઔયાશ બિનઅધી રખીએ
માયધ્યમી રહીયલ્લાહો અન્હોથી રાવી કે રસ્લુલ્લાહ
સલ્લાહ્લાહો અલયહે વસલખમે ઇરમાંયું : આ ઉભ્રમત
હુમેશા જૌરની સાથે રહેશે જ્યાં સુધી આ હુરમતની
સંપૂર્ણ તચ્છીમ (આદર) કરતી રહેશે. અને જ્યારે
લોકો તેને નષ્ટ કરી દેશે ત્યારે હલાક થઈ જશે.

હૃદીસ-(૪) તિખાની ઔસતમાં હજરત જાભિર
રહીયલ્લાહો અન્હોથી રાવી કે રસ્લુલ્લાહ સલ્લાહ્લાહો
અલયહે વસલખમે ઇરમાંયું : કા'ભા માટે જીબ અને

હોઠ છે. તેણે શિક્ષયત કરી કે અય મારા રાય મારી પાસે આવનાર અને મારી જિયારત કરનાર ઓળા છે, અલવાહે વહી કીડે હું ખુશ્ય કરનાર, સિજદા કરનાર, આદમીઓને પેંદા કરીશ જે તારી પ્રત્યે એવા આડૃષ્ટ થયે જેવી રીતે કુશ્યતરી પોતાના ઈડાઓ પ્રત્યે આડૃષ્ટ થાય છે.

હૃદીસ-(૫) : સહીહ બુખારી તથા સહીહ મુસ્લિમમાં હજરત ઈસ્પને ઉમર રહીયદવાહો અન્હોભાથી મરતી કે રસૂલુલ્લાહ સહ્લવલ્લાહો અન્યથે વસ્ત્રભર્તા મજૂમાં તશરીફ લાવતા તો “જી નાબા” માં રાત ચુલ્લરતા, જ્યારે સવાર થતી ચુલ્લર કરતા અને નમાજ પઢતા અને દિવસમાં દાખલ થતા અને જ્યારે મજૂમાથી તશરીફ લઈ જતા તો સવાર સુધી જીતુવામાં થોભતા.

હરમમા દાખલ

થવાના આહુકામ

(૧) જ્યારે મજૂમાના હરમની સન્મુખ પહોંચે તો માયુ ઝુકાવી આંખો ચુનાહોની શરમથી નીચી ડિચેલ ખુશ્ય તથા ખુલાયથી દાખલ થાય અને થઈ શકે તો પગપણો ઉંડા પગે અને લણ્ણૌક તથા દુઅની અધિકતા રાખે અને બેહતર એ કે દિવસમાં સ્નાન કરી દાખલ થાય. હેઠળ તથા નિશાસવાળી ઓરતે પણ નહાવું સુસ્તહય છે.

(૨) મજૂમા મોઅઝજ્ઞમાની આસપાસ ડેટલાએ માછલો સુધી હરમનું જ'ગત છે. દરેક બાજુએ તેની હોં અનેલા છે. તે હોંની અંદર તર (લિંગ) ધાસ ઉપેકું. ખુદરન (પોતાની મેળે ઉગેલ) વિશ્વ આપવું, ત્યાંના ભક્ત જનવરોને તકલીફ આપવું હરામ છે, ત્યાં સુધી કે ને કુંક તહકો હોય અને એકજ આડ છે, તેના છાંયામાં હરણ એઠેણું છે તો જાઈજ નથી કે પોતાના બેસવા માટે તેને ઉડાડે અને એ જ'ગતી જનવર હરમ બહારનું તેના હાથમાં હતું. તેને લઈને હરમમાં દાખલ થયો હવે તે જનવર હરમનું થઈ ગયું, ફરજ છે કે તત્કાળ છાંતી હે, મજૂમા મોઅઝજ્ઞમાં જ'ગતી કુશ્યતર અધિકતાથી છે, દરેક

મજૂમનમાં રહે છે, અભરદાર હરગિઝ-હરગિઝ ન ઉડાવે, ન ઉરાવે, ન કોઈ ધજા પહોંચાડે, ડેટલાક આમ તેમના લોહા ને મજૂમાં વસેલા કશુનરોનો અદ્ય નથી કરતા તેમની રીસ ન કરે પરંતુ તેમને પણ ખરાયન કહે કે જ્યારે ત્યાંના જનવરનો અદ્ય છે તો મુસ્લિમાન માનવીનું શું કહેવું. આ વાતો ને હરમ સંબંધે બ્યાન કરવામાં આવી એહરામ સાથે ખાસ નથી બલ્કે એહરામ હોય કે ન હોય દરેક હાલતમાં આ વાતો હરામ છે.

(૧) કહેવામાં આવે છે કે આ કુશ્યતર તે મુખ્યારક જોડાની નસલથી છે. જેણે હુઝૂર રૈઘવે આલમ સહ્લવલ્લાહો અન્યથી વસ્ત્રભર્તા હિજરતના સમયે ગારે શોરમાં ઈંડા મુક્યા હતા. અલવાહે આ જિહ્વતના અહુવામાં તેમને પોતાના હરમે પાકમાં જગ્યા બાસ્ત્રિ.

(૩) જ્યારે મજૂમા મોઅઝજ્ઞમાં દાખિગોચર થાય થોલીને આ દુઆ પદે;— “અદ્દા હુમજુમજુદી બી બેહા કરારંવ વરચુકની શીહા રિઝકન હલાલન.”

તરજુમો—હે અલવાહે તું મને તેમાં યથાવત રાય અને મને તેમાં હલાલ રોજ આપ. અને દુરદ શરીર અધિકતા કરે અને અશેલ એ છે કે સ્નાન કરીને દાખલ થાય અને જનતુલ મોઅઝજ્ઞમાં દ્રદન થઓલાયો. માટે ઝાતેહા પદે અને મજૂમા મોઅઝજ્ઞમાં પ્રવેશતા સમયે આ દુઆ પદે

અદ્દા હુમજુમજુદી વ અન અધ્યાત્મા વદ્ધાલદો બદ્ધાતોડા જોઅતોડા હારેખન મિન્ડા ઈલયડા લે ઓવર્રેંચા ફ્રાઇંડા વ અન્સ્લોયો. રહુમતડા વ અહિતમેસો રિજવાનડા અસઅલોડા મસઅલતલ સુદૃતરોના ઈલયડલ ખાચેશીના અકુભતાડા અસઅલોડા અન તોકલ્યેણીયોમા એ અકુલેડા વ તુદભિદની શી રહુમતેડા વલજનવજ અન્ની એ મગ્નેરતેડા વ તોઈની અલાઅહાયે ફ્રાઅદેડા અદ્દાહુમ્મ નજરેની મિન અજાયેડા વક્તતહલી અણવાખ રહુમતેડા.

તરજુમો : હે અધ્યાત ! તુ મારો રખ છે અને હું તારો બંધો છું અને આ શહેર તારું શહેર છે. હું તારી પાસે તારા અજાભથી લાગીને હાજર થયો કે તારા ફરાઇઝને અદા કરું અને તારી રૈહુમતને તલબ કરું અને તારી રજાને તલાશ કરું, હું તારાથી એવી રીતે સવાલ કરું છું જેવી રીતે વિવશ અને તારા અજાભથી ડરવાવાળા સવાલ કરે છે. (માંગે છે) હું તારાથી માંશું છું કે આજે તુ ચોતાની અદાય (ક્ષમા)ની સાથે મને કુણુલાંડ અને ચોતાની મગફેરત સાથે મારાથી દરશુઅર કર અને કરનેની અદા પર મારી સહાયતા કર, હે અધ્યાત મને ચોતાના અજાભથી મુક્તિ આપ અને મારા માટે ચોતાની રહેમતના દરવાબાચો જોવી હે, અને તેમાં મને દાખલ કર અને શયતાન મરહૂદથી મને પનાહમાં રાખ.

(૪) જ્યારે મુહાયામાં પહોંચે (આ તે જ્યારા છે જ્યાંથી મઝું મોઅજમા દરિયોચર થતું હતું) જ્યારે વચ્ચમાં ઈમારતો આડરપ ન હતી) આ મહાન ઈજનભત તથા સ્વીકરણનો સમય છે. અડીં થોસે અને સાચા દિલથી ચોતાના માટે અને સધળાં સગાં વહાલાં અને મિત્રો માટે મગફેરત તથા આશીર્યત (કુશળતા) માંગે અને વગર હિસાએ જનતાની હુઅા કરે અને ફુરુદ શરીરની અધિકતા આ પ્રસંગે બહુજ મહુવની છે. આ સ્થળે ત્રણવાર અધ્યાતો અકૃષ્ણ અને ત્રણ વખત લાઈલાંડ ઈલ્લાલાંડ કહે અને આ હુઅા પઢે.

‘અદ્વાહુમ રૂખથના આતેના ફીદ હુન્યા હસનતં વિક્રીદયાખેરતે હસનતં વંઘકેના અગ્રાખનાર, અદ્વાહુમ ઇન્ની અસ્થાયોકા મિનહો નથીયકા મુહુમહુન સલસલદ્વાહો ત્યાલા અદૌહે વસલ્લામ વ અદોજોયેકા મિન શારે મસ્તાયાજકા મિનહો નથીયોકા મુહુમહુન સલસલદ્વાહો ત્યાલા અદૌહે વસલ્લામ’.

તરજુમો : હે રખ તુ હુનિયામાં અમને ભલાઈ આપ અને આપેરતમાં ભલાઈ આપ અને જહુનમના અજાણથી અમને બચાવ, હે અધ્યાત ! હું તે જૌર (ભલાઈ)માંથી માંગણી કરું છું જેનો તારા નણી મોહુમદ સહ્યદ્વાહો અલયહે વસદ્વામે તારાથી સવાલ કરો (માંગણી કરી) અને તારી પનાહ માંશું છું તે વસ્તુ-ઓના શરથી જેનાથી તારા નણી મોહુમદ સહ્યદ્વાહો અલયહે વસદ્વામે પનાહ માંગી.

—અને આ હુઅા પણુ પઢે.

“અદ્વાહુમ ! ઇમાનમ-યોકા, વ તશ્વીકમ-યોકિતાયોકા વ વફાયાન એ અહુહેકા વ ઈતોભાયાન એ સુન્નતે નથીયોકા સૌયહના વ મૌલાના મુહુમહુન સલસલદ્વાહો ત્યાલા અદૌહે વસલ્લામ, અદ્વાહુમ ! જિદ્દીતકા હાજા તચાંજીમન વ તશ્વીકન વ માહાખતન વિનિષ્ઠ મિન તચાંજીમેહિ વ તશ્વીકહિ મિન હજાતિન વ અતમરહુ તાચાંજીમન વ તશ્વીકન વ મહાખતન”.

તરજુમો : હે અદ્વાહ તારા પર ઈમાન લાવ્યો અને તારી કિતાબની પુષ્ટિ કરી અને તારા વાયદાને પૂરો કરો અને તારા નણી

મોહમ્મદ સહલલાહે અલયહે વસ્તુભનું અનુસરણ કર્યું, હે અહલાહ તુ પોતાના આ ઘરની તથાજીમ (આદર) તથા શરાફત તથા હૈઅત (ડર) અધિકર અને તેની તથાજીમ તથા તશરીફથી તે શાખસની અજમત (મહાનતા) તથા શરાફત તથા હૈઅત અધિક કર જોણું તેનો હજ તથા ઉમરો કર્યો.

અને જામેએ હુચા ઓછામાં ઓછું ત્રણ વખત આ સ્થળે પઢે.

“અહલાહુમ હાજા બેતોડા વ આના અખહોડા અસાલોકલાકૃવ વલાયાફિયતા ઝીફીને વહુંન્યા વલાયાખેરતે લી વલે વાલેદ્યા વલિલમુ'મેનીના વલમુ'મેનાતે.

તરજુમો : હે અહલાહ આ તાર્દ ધર છે અને હું તારો બંદો છું, અકૃવ તથા આફિયતની માંગ તારાથી કર્દ છું, હીન તથા હુનિયા તથા આખેરતમાં મારા માટે અને મારા માં-આપ અને સધગા મોભિનીન તથા મોભિનાત માટે અને તારા તુરણ બંદો અમજદાલી (આ કિતાબના લેખક) માટે (તથા આ કિતાબના શુજરાતી અનુવાદકો માટે) લિલાહી તુ તેમની મજબૂત મહદ કર. આમીન)

મસ્તાલા (૩૨) જન્યારે મછા મોઅજમા પહેંચી જાય ત્યારે સૌથી પહેલા મસ્તાહુલ હરામમાં જાય, ખાવા-પીવા, કપડાં બદલવા, મહાન લાડે લેવા વિગેર ખીજ કામોમાં મશગૂલ ન થાય. હા, જે ઉજર હોય હા. ત. સામાન સુનો સુકવામાં નષ્ટ થવાનો (ચોરાઈ જવાનો) ડર આશંકા છે તો સુરક્ષિત સ્થળે સુકવામાં અથવા કોઈ જરૂરી કામમાં મશગૂલ

થયો તો વાંધી નથી. અને જો સાથે ખીજ માણુસો પણ હોય તો તેમાંના કેટલાક સામાન ઉત્તરાવવામાં મશગૂલ થાય અને કેટલાક મસ્તાહુલ હરામ શરીરમાં ચાવ્યા જાય.

(મનાસિક)

(૧) ખુદા તથા તેના રસૂલ અને પોતાના અને સથળાં મુસ્લિમાનો માટે ઇલાહે દારેન (બંને જહાનના કલ્યાણની હુચા કરતાં કરતાં અને લગ્નોક કહેતો બાધુસસ્લામ સુધી પહોંચે અને તે આસ્તાનાએ પાકને ચુંબન કરીને પ્રથમ જમણો પગ મુકીને દાખલ થાય અને આમ કહે—“અભિજો બિલલાહી લાયાજીમે વ એવજહેહિલકદીમે વ સુલતાનેહિલકદીમે મિનશ્રીતાનિર્દ્દુલ્મે, બિસ્મીલ્હાલિહિલહુદ્દો લિલાહે વ સસલામો અદા રસ્કુર્લાહે અહલાહુમ સહલેઅલા સૌયદેના મોહમ્મદ-હિંઠવાદી આલે સૌયદેના સુહમહિનમ વ અજવાને સૌયદેના સુહમહિન અહલાહુમનદીરલી જુનુથી વક્તાહુલી અધ્યાધ રહેતાંકો”

તરજુમો : હું ખુદાએ અભીમની પનાહ માંશુ છું અને તેની વજહે કરીમની અને અનંત સહિતનતની, મરહૂદ શયતાનથી, અહીંહાના નામની મહદથી સધળી ખૂબીએ અહલાહ માટે અને રસૂલહલાહ પર સલામ, અય અહલાહ હુર્રદ મોકલ અમારા આડા મોહમ્મદ અને તેમની આલ અને આપની પવિત્ર બીખીએ પર. લિલાહી મારા શુનાહ અખદી હે અને મારા માટે પોતાની રેહમતના દરવાજા ખોલી હે.

આ હુચા ખૂણ ચાદ રાખે, જ્યારે પણ મસ્જિદું હરામ શરીર અથવા બીજુ કોઈ મસ્જિદમાં દાખલ થાય આવી રીતે જ દાખલ થાય અને આ હુચા પણ લિધા કરો. અને તે સમયે વિશિષ્ટતા સાથે આ હુચા સાથે આટલું વધારે મેળવીલે.

“અહ્વાહુમ અન્તસ્સલામ વ મિન્કસ્સલામ વ ઈલોકા યન્નોઓસ્સલામ હુચેના રણખના બિસ્સલામ વ અહ્બિલના દ્વારસ્સલામ તખારકેત રણખના વ તાદીલીત યા અહ્બલાદે વહેઠકરામ અહ્વાહુમ ઈન્ન હાજા હરમકા વ મૌદ્દેઓ અનેકા ઝાહરીમ લહમી વ હમી વ મગજી વ એજામી અલનારે”.

તરજુમો : અય અહ્વાહ તુ સલામ છે અને તારાથી જ સલામતી છે અને તારા જ પ્રત્યે સલામતી પાછી કરે છે. અય અમારા રખ અમને સલામતી સાથે લુંત રાખ અને દ્વારસ્સલામ (જન્નત)માં દાખલ કર. અય અમારા રખ તુ અરકૃતવાણો અને ખુલાંદ છે. અય જલાલ યુજુર્ગીવાળા ઈલાહી આ! તારું હરમ છે અને તારા અમનની જગ્યા છે, મારા માસ-ચામડા અને લોહી અને મગજ અને હાડકાંચોને જહુનમ પર હરામ કરીદે.

અને જ્યારે કોઈ મસ્જિદથી ખાહાર આવે તો પ્રથમ ડાણો પગ અહાર સુકે અને એ જ હુચા પઢે પરંતુ અંતમાં રહમતેકાની જગ્યાએ ઝદ્દેકા કહે અને એટલું બીજું વધારે : વસહહિલ લી અખવાણ રિઝકેકા (અને મારા માટે પોતાના રિઝકના દ્વરબાળ આસાન

કરી છે) તેની અરકૃતો હીન-હુનિયામાં અસંખ્ય છે. અહ્વાહુમહિલાહ.

૧૬) જ્યારે કાણા શરીર પર નજર પડે વણુ વખત લાઈલાહા ઈલિલાહુ વહ્નાહુ અકુથર કહે અને હુરદ શરીર અને આ હુચા પઢે. અહ્વાહુમ જિદ્દુતકા હાજા તચ્છીમન વ તશરીફન વ તકરીમન વ ધિર્રન વ મહાભતન, અહ્વાહુમ અહ્બિલનહજનતા ઐલા હિસાબિન, અહ્વાહુમ ! અસઅલોકા અનતગીરલી લ તરહની વ તકણખલ મંજૂરતી વ તદ્યા વિઝરી એ રહમતેકા યા અરહ-મર્દાહેમન. અહ્વાહુમ ઈન્ન અખહોકા વ આઇરોકા વચ્ચા કુલો મોડીરન હકુમુન અન્ત જોડિરિન ઝેસચાલોકા કુ તહુની વ તકુંક રક્ખનિન મિનનનારે”.

તરજુમો : અય અહ્વાહ તુ ચોતાના આ ધરની અજમત તથા શરાદૃત તથા યુજુર્ગી તથા નેકોઈ લકાઈ તથા હૈબત અધિક કર, અય અહ્વાહ અમને જન્નતમાં વગર હિસાયે દાખલ કર, ઈલાહી હું તારાથી માંગણી કરું છું કે મારી મગફેરત કરી હે અને મારા પર રહેમ કર અને મારી લગજિશ (ભૂલ) દ્વારા કર અને પોતાની રહેમતથી મારા શુનાં હેતું નિવારણ કર અય સૌ મહેરખાનેથી વધારે મહેરખાન ઈલાહી હું તારા બંધો અને તારો જાઈર (દર્શનાર્થી) છું અને જેની જિયારત કરવામાં આવે તેના પર હક હોય છે અને હું સૌથી એહુતર જિયારત કરેલો છે. હું એ સવાલ (માંગણી) કરું છું કે મારા પર રહેમ અને મારી ગરદન જહુનમથી આજાદ કર.

તવાકુ તથા સઈ, સાકુ તથા મરવહ તથા ઉમરાનું અયાન:

અદ્ધાહ અજાજ વ જલ્દ હુરમાવે છે.

વ ઈજિ જાયાનદળણૌતા ભસાયતનનાસે
વ અમનંવ વત્તાએજુ ભિમ મડામે
ઇથાહીમા સુસખદા વ અહિદના ઈલા
ઇથાહીમા વ ઈસ્માઈલા અન તહેડરા
ઔતેયાલેચેઝેઝીના વહયાકેઝીના વર્ડ્ઝુ-
ઇસ્સેઝોજુદ.

તરજુમો : અને યાદ કરે જયારે કે અમોએ ડો'બાને લોડો માટે આશ્રયસ્થાન
અને અમન (શાન્તિતું સ્થળ) બનાયું અને
મડામે ઈથાહીમથી નમાજ પઢવાની જગ્યા
બનાવી અને અમોએ ઈથાહીમ તથા ઈસ્માઈલ
તરફ અહુદ (વાયદો) કર્યો કે મારા ઘરને
તવાકુ કરવાવાળાઓ અને એ'તેકાદવાળાઓ
અને રૂફાચ-સુજુદ કરવાવાળાઓ માટે પાક
કરે અને હુરમાવે છે : “વ ઈજિ અવ્યા’ના
એ ઇથાહીમા મડાનદળોક્તે અદ્દ લા
તુશેરેકા ગી શૈઅન વતહેડરા ઔતેય
લિત્તાચેઝીના વહકાચેમરીના વર્ડ્ઝુદ્ધ-
સ્સેઝોજુદ્ધ વ અઝભિન ઝીનનાસે બિલહજો
યા’તકા રિનલાંવયદા કુદ્દે દામોરંયા’
તીન મિન કુદ્દે ઝેજળુન અમીક દે
યશહુ મનાદ્દેય લહુમ વયાજકોડસમહીાહે
ઝી અચ્યામિભમચલુમાતિન અદ્દ મા
રઝકહુમ ભિમ બાહીમતીલયાન્યામે
કેડોલુ મિનહત વ અત્યેમૂદયાઈસિધ્યકીર
સુરમ લે યકૃદ (થી) ઈન્દ્રા રખણેહિ”.

(કુચીન શરીરિ)

તરજુમો : અને જયારેકે અમોએ ઈથા-
હીમને પનાહ (આસરો) આપી ખાનએ ડાબા’ની
જગ્યામાં, એમ કે મારી સાથે કોઈ ચીજને
શરીર ન કર અને મારા ઘરને તવાકુ કરવા
વાળાઓ અને કેયામ કરવાવાળાઓ અને
રૂફાચ-સિજદા કરવાવાળાઓ માટે પાક કર
અને લોડોમાં હુજુનું એલાન કરી હે લોડો
તારી પાસે પગધાળા આવશે અને અશક્તા
ઉંટણીઓ પર કે ફરેક હુરના માગંચી આવશે
કે જેથી ચોતાના લાલની જગ્યામાં હાજર
થાય અને અદલાહુના નામને ચાહ કરે, જાણીતા
દિવસોમાં તેના પર કે તેમને ચોપગાં જાનવર
અતા કર્યો તો તેમનામાંથી આવ અને નિરાશા
ક્રીર (નિર્ધન)ને અવડાવો, પછી ચોતાનો
મેલ-કુચેલ ઉતારે અને ચોતાની મનનો સુરી
કરે અને તે આજાદ ઘર (ડો'બા)નો તવાકુ
કરે, વાત આ છે અને કે અદ્ધાહુના હુરમાત
(પ્રતિષ્ઠાઓ) (અભમતવાળી વસ્તુઓ)ની તચ-
અભીમ (આદર) કરે તો તે તેના માટે તેના
રહણની નિકટ જોહતર છે અને હુરમાવે છે.

“ઇન્સસક્રા વહમર્વતા મિન શાચાઈ-
રિદ્ધાહે ઝેમન હુજુજલણૌતા અયેચતંમર
ક્રલા જેનાહા અલોહે અંચ્યતંવક્રા બેહેમા
વ મન તતચ્યા પૌરન ઝેઝનનલાહા
શાકિરન અલીમ” (કુચીન પાક)

તરજુમો : એશક સંક્રા તથા મરવહ
અદલાહુની નિશાનાઓ પૈકી છે. જેણે ડો'બાને
હુજુજ અચ્યવા ઉમરો કર્યો તેના પર તેમા
શુનોહ નથી કે તે દિવસોનો તવાકુ કરે જેણે
અધિક જૌર કર્યું તો અદલાહુ બહદો આપ-
નાર ઈલમવાળો છે.

હદીસ (૧) સહીહ પુખારી તથા સહીહ મુસ્લિમમાં ઉસુલ મોભિનીન આઈશા સિદ્દીકા રહીયદ્વાહેા અન્હાથી રિવાયત છે, કૃમાવે છે કે જ્યારે નથી સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમે હજુ મારે મજ્જામાં તશરીઝ લાગ્યા, સઘળાં કાગેથી પહેંચા તુર્દ કરીને બયતુદ્વાહનો તવાફ કર્યો.

હદીસ (૨) સહીહ મુસ્લિમ શારીકમાં ઈધને ઉમર રહીયદ્વાહેા અન્હાથી રિવાયત છે કે, રસૂલુદ્વાહ સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમે હજુ રે અસ્વદથી હજુ રે અસ્વદ સુધી ત્રણ ઝેરાઓમાં રમલ કર્યું અને ચાર ઝેરા ચાલીને કર્યા અને એક રિવાયતમાં છે પછી સક્ષા મરવહ દરમિયાન “સહી” કરી.

હદીસ (૩) સહીહ મુસ્લિમમાં જાબિર રહીયદ્વાહેા અન્હાથી રિવાયત છે કે રસૂલુદ્વાહ સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમે જ્યારે મજ્જામાં પદ્ધાર્યો તો “હજુ રે અસ્વદ”ની પાસે આવીને તેને જોસો (ચુંબન) આપ્યો પછી જમણી બાજુએ ચાદવા અને ત્રણ ઝેરાઓમાં “રમલ” કર્યું.

હદીસ (૪) સહીહ મુસ્લિમમાં અખૂદ તુક્યદ રહીયદ્વાહેા અન્હાથી રિવાયત છે કે મેં રસૂલુદ્વાહ સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમને બયતુદ્વાહનો તવાફ કરતા જેથા અને હુઅરના પવિત્ર હાથમાં લાડકી હતી તે લાડકીને હજુ રે અસ્વદને સ્પર્શીને (અડકાડીને) જોસો આપતા.

હદીસ (૫) અખૂદાઉદે, અખૂદુરયરહ રહીયદ્વાહેા અન્હાથી રિવાયત કરી કે, રસૂલુદ્વાહ સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમે મજ્જામાં

હાયત થયા તો હજુ રે અસ્વદ પ્રયે ધ્યાનિત થયા અને તેનું ચુંબન કર્યું, પછી તવાફ કર્યો. પછી સક્ષા (પહાડી) પાસે આવ્યા અને તેના પર ચઠયા, ત્યાં સુધી કે બયતુદ્વાહ ટ્રાઇગેચર થવા લાગ્યું, પછી હાથ ડાઢાવી જિકે હલાદીમાં મશગૂલ રહ્યા. જ્યાં સુધી ખુદાએ ચાહ્યું અને હુયા કરી.

હદીસ (૬) ધમામ અહુમદે ઉણોદ બિન ઉમૈરથી રિવાયત કરી તે કહે છે મેં ઈધને ઉમર રહીયદ્વાહેા અન્હામાને પૂછ્યું શું કારણ છે કે આપ હજુ રે અસ્વદ અને દૂકને યમાનીને જોસો આપો છો. જવાબ આપ્યો કે, મેં રસૂલુદ્વાહ સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમને કૃમાવતા સાંભળ્યા કે, તેમને જોસો આપવું જુતાઓ (શુનાડો)ને ખાંગેરી નાંદે છે અને મેં હુઅરને કૃમાવતા સાંભળ્યા જેણે સાત ઝેરા તવાફ કર્યો એવી રીતે કે તેના આદાનો જ્યાલ રાજ્યો અને એ રક્યત નમાજ પઢી તો તે ગર્દન આજાદ કરવા (શુલાનીમાં ત્થા જહુનમથી સુઝા કરવા)ના અનુરૂપ છે, અને મેં હુઅરને કૃમાવતા સાંભળ્યા કે તવાફમાં દરેક કદમને ઉપાડે છે અને સુકે છે તેના પર દસ નેકીઓ લખવામાં આવે છે અને દસ શુનાફ નાટ કરવામાં આવે છે અને દસ દરજન ખુલાંદ કરવામાં આવે છે. તેના જેવું જ તિરમિઝી, હાડિમ તથા ઈધને ખુજીમહ વિગેએ પણ બયતુદ્વાહ કર્યું.

હદીસ (૭) તિરાની કષીરમાં મોહુમદ બિન સુનહિરથી રાવી, તેઓ જોતાના વાલિદ્ધી રિવાયત કરે છે કે, રસૂલુદ્વાહ સંદેહીદ્વાહેા અલયહે વસ્તુમે કૃમાંદુંને “અયતુદ્વાહ”

ના સાત ઝેરા તવાદું કરે અને તેમાં કોઈ લગ્ન (નિરથ્ડક) વાત ન કરે તો એવો છે જેવું કે ગર્દન અજાહ કરી (કોઈને શુલાભીમાંથી છાડાયો).

હફીસ (૮) ધસણહાની, અખુલલાહ બિન અખ બિન આસ રહીયલાહો અન્હોમાંથી રાવી, કહે છે, જેણું કામિલ લુઝુ કર્યું પછી “હજરે આસુલા” પાસે એસો હેવા માટે આવ્યો તે રહેમતમાં દાખલ થયો, પછી એસો આપ્યો અને આ પદ્ધું.

“અસ્તિમદલાહે અલલાહો અકુખર અશાહો અલલાહિલાહો ઈલલલલાહુ વહદાહુ લાશરીકલહુ વરહદુ અજ મોહમ્મદન અખુલ વરસુલુહ. તેને રહેમતે ઢાંકા લિયો, પછી જ્યારે બયતુલલાહનો તવાદું કર્યો તો દરેક કદમના બહલામાં સિરોર હળાર નેકીએ લખવામાં આવશે અને સિરોર હળાર શુનાહ નાટ કર્યા હેવામાં આવશે અને સિરોર હળાર દરજા યુલાંદ કરવામાં આવશે અને પોતાના ઘરવાળાઓમાં સિરોરની શક્કાઅત કરશે પછી જ્યારે જ્યારે મહામે ઈથ્રાહીમ પર આવ્યો અને ત્યાં એ રક્યાત નમાજ ઈમાનના ડારણે અને સવાખની તલખ માટે પઢી તો તેના માટે ઔદાહે ઈસ્માઈલમાંથી ચાર શુલામ આજાહ કરવાનો સવાખ લખવામાં આવશે અને તે શુનાહોથી એવો નિકળી જશે જેવો આજે પોતાના માના પેટમાંથી પૈંડા થયો.

હફીસ (૯) બયહુકી ઈધને અણખાસ રહીયલાહો અન્હોમાંથી રાવી કે, રસુલુલલાહ સહલલાહો અલયહે વસદ્દલમે દૂરમાંથું : જેણું પચાસ વખત તવાદું કર્યો શુનાહોથી એવી શીતે નિકળી ગયો જેવો આજે પોતાના માના પેટમાં પૈંડા

દરરોજ અદલાહુતાલા એકસો વીસ રહેમત નાજિક કરે છે, સાઈઠ તવાદું કરવાવાળાઓ માટે અને ચાલીસ નમાજ પદવાવાળાઓ માટે અને વીસ (કાણા ઉપર) નાર કરવાવાળાઓ માટે.

હફીસ (૧૦) ઈધનેમાન અખૂ હુરેયરહ રહીયલાહો અન્હોમાંથી રાવી કે નણી સદ્દુલ્લાહો અલયહે વસદ્દલમે દૂરમાંથું દૂકને યમાની પર સિરોર દૂરિશ્તા સુવચ્છિલ (નિયુક્તા) છે, જે તવાદું કરનાર આ હુએ પઢે છે: આજ્ઞા હુભમા ઈન્ની અસઅલુકુલાઝેલ વ વદ્દ આક્રિયતા ઝીદુનિયા વદ્દ આભિરતે, રહેયના આતેના ઝીદુનિયા હસનતાંલ હસનતાંલ વર્ઝીલ આભિરતે હસનતાંલ વર્કેના અજાથનાર” તે દૂરિશ્તા આમીન કહે છે. અને જે સાત ઝેરા તવાદું કરે અને આ પદ્ધતો રહે સુષ્ણાનલલાહુ વહદાહુલિલાહે લાધલાહો ઈલલલલાહુ વહદાહુ અકુખર, વદાહૌલ વદ્દ કુદ્વતા ઈલલાબિલલાહ તેના દસ શુનાહ નાટ કર્યા હેવામાં આવે છે. આવશે અને દસ નેકીએ લખવામાં આવશે અને દસ દરજા યુલાંદ કરવામાં આવશે અને જેણું તવાદું એ જ સંધો પદ્ધા તો તે રહેમતમાં પોતાના પગે ચાલી રહ્યો છે. જેવું કોઈ પાણીમાં પગોથી ચાલે છે.

હફીસ (૧૧) તિરમીઝી ઈધને અણખાસ રહીયલાહો અન્હોમાંથી રિવાયત કરી કે. રસુલુલલાહ સહલલાહો અલયહે વસદ્દલમે દૂરમાંથું : જેણું પચાસ વખત તવાદું કર્યો શુનાહોથી એવી શીતે નિકળી ગયો જેવો આજે પોતાના માના પેટમાં પૈંડા

થયો. (નોટ : એક તવારું ખાનએ કાખાના સાત ચક્કરનો હોય છે).

હદીસ (૧૨) તિરમિઝી, નિસાઈ તથા દારોમી તેમનાથી જ રાવી કે રસુલુલ્લહ્બાહ સહલલાહો અલયહે વસ્તલમે ફરમાઓયું બયતુલ્લહાહની આસપાસ તવારું (કરવું) નમાના અનુરૂપ છે. તદ્વાત એટલો કે તમે આમાં કલામ (વાતચીત) કરો છો તો જે કલામ કરે ઔર (સારો કલામ) સિવાય હરગિજ કોઈ વાત ન કરો.

હદીસ (૧૩) ધમામ અહેમદ તથા તિરમિઝી તેમનાથી જ રાવી કે, રસુલુલ્લહ્બાહ સહલલાહો અલયહે વસ્તલમ ફરમાવે છે. હજરે અસ્વદ જ્યારે જનતથી નાજિલ થયો હુધ કરતા અધિક સાણેદ હતો; બની આદમની અતાઓએ તેને કાળો કરી હીથો.

હદીસ (૧૪) તિરમિઝી ધિને ઉમર બદીયલાહો અનહોથી રાવી, કહે છે કે મેં રસુલુલ્લહ્બાહ સહલલાહો અલયહે વસ્તલમને ફરમાવતા સાંલજ્યા કે, હજરે અસ્વદ તથા ભક્તિમે ઈથાડીમ જતતના યાકૃત છે. અદ્વાહે તેમના નૂરને નષ્ટ કરી નાંખ્યું અને જે નષ્ટ ન કરતો તો જે કાંઈ પૂર્વો તથા પશ્ચિમની વદ્યે છે સૌને રોશાન (પ્રકાશિત) કરી હેતા.

હદીસ (૧૫) તિરમિઝી, ધિને માલ તથા દારોમી ધિને અણાસ રદીયલાહો અનહોથી રાવી કે રસુલુલ્લહ્બાહ સહલલાહો અલયહે વસ્તલમે ફરમાઓયું, વલાહ હજરે અસ્વદને ડિયામતના હિવસે અદ્વાહુતઆલા એવી રીતે ઉણવશે કે તેની આંગો હુશે

જેનાથી જેશે અને જુલ હશે જેનાથી વાત કરશે, જેણે હક (સત્યતા) સાથે તેને જોસો આપશો છે તેના માટે સાક્ષી આપશો.


મસ્તિજુહે હરમના અહેકામનું

વિધાન

મસ્તિજુહુલ હરામ શરીરીમાં દાખલ થવા સુધીના અહેકામો જાણી લીધા હુદે મસ્તિજુહુલ હરામમાં દાખલ થયો. જે જમાઅત કાયમ હોય (અને સુન્ની ધમામ હોય તો, અનુ) અથવા ફરજની નમાજ અથવા વિત્ર અથવા જનાઓની નમાજ અથવા સુન્નતે મોઅફદા ચાચી જવાનો ડર હોય તો પહેલા તેને અદ્દ કરે, નદીતો ણધા કંમોથી પહેલા, તવારુંમાં મશગૂલ થાય કા'ભા'શરૂઆત હે અનેતુ પરવાનો (પતંગીયો), જેતો નથી કે પરવાનો શરૂઆની આસપાસ કેવી રીતે કુરખાન થાય છે, તું પણ આ શરૂઆત પર કુરખાન થવા માટે તત્પર થઈ જા, પ્રથમ આ પ્રવિત્ર રૂથળાનો નકરો. જુઓ કે જે વાત કહેવામાં આવે સારી રીતે સમજમાં આવી જાય.



પચ્ચિમ



મસ્જિદુલ હુરામમાં એક ગોળ વિસ્તૃત ક્ષેત્ર છે, જેના કિનારે કિનારે અધિકતાથી દાલાન અને આવવા જવાના દરવાજે છે અને વચ્ચે મતાડે (તવાફ કરવાની જગ્યા) છે. મતાડે એક ગોળ બર્તુંણ છે જેમાં સંગી ભરમર પાથરેદી છે તેની વચ્ચે ડા'બા મોઅઝમા છે, હુંઝુરે અકદસ સહીદ્વાહી અવયહે વસ્તુમના જમાનામાં મસ્જિદુલ હુરામ એ જ પ્રમાણે હતી. તેની જ હુદ પર બાયુસલામ પૂર્વીય પ્રાચીન દરવાજે આવેદો છે, ઇકને મહાનનો ખૂણ્ણુમાં તેની એ હીવાદો મળે છે જેને

જાવિયા કહે છે આવી રીતે અ—અભ-ક બને હીવાદો બ સ્થળ પર મળી છે, આ ઇકન તથા જાવિયા છે. ડા'બા મોઅઝમાના ચાર ક્રેન છે.

ઇકને અસ્વદ : દક્ષિણ તથા પૂર્વના આ ખૂણ્ણુમાં એ જ અમીનથી ઉંચો “સુ” એ અસ્વદ” સ્થાપિત છે.

ઇકને ઈરાકી : પૂર્વ તથા ઉત્તરના ખૂણ્ણુમાં છે, ડા'બાનો દરવાજો એ જ એ ઇકનોની વચ્ચેની પૂર્વીય હીવાદમાં અમીનથી

ઘણો જ યુકં છે. “સુલતાંગ” એ જ પૂરીંય હીવાલનો તે હુકડો જે જે રૂકને અસ્વદથી ડા'બાના દરવાજા સુધી છે.

રૂકને શામી : ઉત્તર અને પશ્ચિમના ખૂણામાં છે. મીઓએ રહુમત સોનાતું પરનાદા (નીમણ)ના રૂકને ઈરાકી તથા શામીની વચ્ચેની ઉત્તરી હીવાલ પર છતમાં સ્થાપિત છે. હતીમ પણ એ જ ઉત્તરી હીવાલ તરફ છે. આ અમીન ડા'બા મોઅઝમાની જ હતી. (દક્ષિણી ઉત્તરીય છ હાથ ડા'બાની અમીન છે અને કેટલા ઉદ્ભા કંઠે છે કે સાત હાથ અને કેટલાનો જ્યાલ છે કે સમય હુતીમ) જાહીલિયતના જમાનામાં જ્યારે કુરયથે ડા'બા નવેસરથી તથભીર કયું ત્યારે ખરચની કમી (તંગી)ના કરણે આટકી અમીન ડા'બા મોઅઝ-જમાથી બહાર છેડી હિંદી, તેની આસપાસ એક ડૈંસના આકારની નાનકદી હીવાલ જેંચી લીધી, અને બંને તરફ આવનભવનનો દરવાજો છે, અને આ મુસ્લિમાનોની ખૂશનસીબી છે કે તેમાં દાખલ થવું ડા'બા મોઅઝમાંજ દાખલ થવું છે. જે ઐહેજ્હોલિંગાહે આસાનીથી પ્રાપ્ત થાય છે.

રૂકને યમાની : પશ્ચિમ અને દક્ષિણના ખૂણામાં સુસ્તળબ રૂકને યમાની તથા શામીના વચ્ચેની પશ્ચિમી હીવાલનો તે હુકડો જે સુલતાંગની સામે જ સુસ્તળબ રૂકનેયમાની તથા રૂકને અસ્વદની વચ્ચે જે હીવાલ દક્ષિણી છે, અણીંયા સિટોર હાલર ફરિશતા ફુઆ પર આમીન કહેવા માટે સુરક્ષર છે. એટલા માટે તેનું નામ સુસ્તળબ રાખવામાં આંધુ.

મહામે ઈંદ્રાહીમ : ડા'બાના દરવાજાની સામે એક કુળખામાં તે પથર છે જેના પર ઉસા રહીને સૈયેદના ઈંદ્રાહીમ અલીહુલ્લાહ અલયહિસ્સલાતો વસ્તસામે ડા'બા જનાંધું હંતું, તેમના “કંદમેપાક”નું તેના ઉપર નિશાન થઈ ગયું જે અત્યાર સુધી મૌજુદ છે. અને જેને અલાહાતાવાએ “આયાતુમ જીયનાતુન” (અર્થ: અલાહાની ઉધારી નિશાનીએ) ઇરમાંધું. (સુખણાનદ્વારા)

નેંધુ : આપણા નણી સહેલ્લાહે અલયહે વસ્તુમના કંદમેપાકના નિશાન (ચિનહે)માં એ કંદર અને એ અદભ દોડો ચંચુપાત કરે છે. આ મોઅઝેજીએ ઈંદ્રાહીમી હજારો વર્ષથી સુરક્ષિત છે, તેનો પણ ઇન્કાર કરી હો ?

અમઝમ શરીરેનો કુળખો મહામે ઈંદ્રાહીમાથી દક્ષિણે મસ્જિદ શરીરેનું આવેદો છે અને તે કુળખાની અંદર અમઝમનો કુવો છે.

બા'યુસ્ક્રો : મસ્જિદ શરીરેના દક્ષિણી દરવાજામાં એક દરવાજે છે. જેમાંથી નિકળી સામે ડેંછે સફા (સફાની પઢાડી) છે. સફા પહ્યાડી ડા'બા મોઅઝમાંથી દક્ષિણે છે, અણીંયા આચીન સમયમાં એક ટેકરી હતી કે ધરતીમાં છુપાઈ (હળાઈ) ગઈ છે. હવે ત્યાં કિણલાંખ એક હાલાન જેવું બનેલું છે, અને ચઠવા માટે ચીડીએ છે. (હમણું તેના પર એ માણની ઈમારત બની ગઈ છે. ત્યાંથી સર્જ કરવાના આવે છે).

મરવા : બીજી ટેકરી સફાથી પૂર્વ દિશાએ હતી અણીંયા પણ હવે કિણલાંખ એક હાલાન જેવું છે. અને ચીડીએ છે સફાથી મરવા સુધી જે અંતર છે, (ત્યાં એ

માળની વિશાળ ઈમારત જનાવી સુધી છે. અહીં સઈ કરવામાં આવે છે.) ડાળા હાથે મસ્જિલહુલ હરામનો એડાતો (હદ) છે.

મીલોને અખદારોને : તે અંતરની વર્ણને જે સક્ષાથી મરવા સુધી છે હરમ શરીરની દીવાચમાં એ લીલા (થીન) માર્ગિતસ્ટોન સ્થાપિત છે જેવું માર્ગિતના અંતમાં પથર લગાવેલો હોય છે.

મરણા : (“સઈ” કરવાનું સ્થળ) તે અંતર કે આ બંને થીન મીલો (પદ્ધો)ની વર્ણને છે.

આ સધણી વસ્તુઓ કિતાબમાં વારંવાર વાંચીને સારી રીતે મગજમાં ઉતારી લો કે ત્યાં પહોંચીને પૂછવાની જરૂરત ન પડે, અજણું માનવી આંધળાની જેમ ડામ કરે છે અને જેણું સમજ લિધું તે આંગોવાળો છે. હવે પોતાના રઘુનું નામે પાક લઈને તવાઝ કરો.

તવાઝનો તરીકો અને હુયાઓ

(૧) જ્યારે હજરે અસ્વદની નિકટ પહોંચો તો આ હુયા પઢો.

લાઈલાહા ઈલ્લિલાહો વહદહુ સદકા વઅહુ વનસર અહુ વ હજમહયાહ-બાળ વહદહુ લાઈલાહા ઈલ્લિલાહો વહદહુ લાશરીકાલહુ લહુલહુદમુહુકો વહુહુલહુહો વહેલા અદા કુલો શૈધિન કહીર.

તરજુમો : અહલાહ સિવાય કોઈ મઅખૂદ નથી. તે એકલો છે, તેનો કોઈ શરીર (ભાગીદાર) નથી. તેણે પોતાનો વાયરો સત્ય ડેર્યો. અને પોતાના અંદાની મદદ કરી અને એકલા તેણે જ કુદ્દારની જમાઅતોને પરાજ્ય આપ્યો. અહલાહ સિવાય કોઈ મઅખૂદ

(પૂર્ણ) નથી તે એકલો છે તે એકલો છે તેનો કોઈ શરીર નથી, તેના માટે જ મુલ્ક (બાદશાહત) છે અને તેનાજ માટે હમદ (સ્તુતિ) છે અને તે હરેક વસ્તુ પર કાદિર (પ્રભુત્વશાળી) છે.

(૨) તવાઝ શરીર કરતા પહેલાં પુરુષ ‘હજતેણાયા કરી લે અર્થાત ચાદરને જમણી બાગલના નીચેથી કાઢે કે, જમણું ખલો ખુલ્લો રહે અને બંને છેડા ડાળા અભા પર નાંખો.

(૩) હવે કા'ણા તરક મુખ કરીને હજરે અસ્વદની જમણી બાજુએ રૂક્ને યમાનીની દ્વિશાચે સંગે અસ્વદની નિકટ એવી રીતે ઉલા રહે કે તમામ પથર પોતાના જમણું હાથ તરફ રહે પછી તવાઝની નિયત કરે.

“અહલાહુમહિની ઓશીહો તવાઝા જીતેકલમુહર્રમ ફ્યાસિસરહોલી વતક-અખદહો મિન્ની”.

(૪) આ નિયત પછી કા'ણા તરફ મુખ રાખી પોતાની જમણી બાજુએ ચાલો જ્યારે સંગે અસ્વદના સામે આવો (અને આ વાત સાધારણું હુલનચલનમાં પ્રાપ્ત થઈ જશે) કરો સુધી હાથ એવી રીતે ઉઠાવો કે હથેળીએ હજરે અસ્વદ પ્રત્યે રહે અને કહો બિસ્તિમ-હલાહિ વલહમુહલિલાહિ વહીાહુ અકખર અસ્સલાતુ વસ્સલાસુ અદા રસુલિલાહિ અને નિયત સમયે હાથ ન ઉઠાવો, જેવું કેટલાક તવાઝ કરવાચાળા કરે છે કે આ પિદાત છે.

(૫) પ્રાપ્ત થઈ શકે તો હજરે અસ્વદ પર બંને હથેળીએ અને તેમની વર્ણને મુખ સુકીને એવી રીતે આસો આપો કે અવાજ

ઉત્પન્ન ન થાય, ગ્રંથ વખત આવું જ કરેા, આ પ્રાસ થાય તો મહાન સહસ્રાય છે: નિઃશાંક તમારા મહેષુધ તથા મૌકા મોહમ્મદ રસુલુલ્લાહ સહલલાહો અલયહે વસ્તુભરે તેને એસો આપો અને પવિત્ર ચેહેરો તેના પર મુક્યો. સહસ્રાય કે તમાડાં મોહું ર્યા સુધી પહોંચે અને લીઇના કારણે ન થઈ શકે તો ન બીજાઓને કષ્ટ પહોંચાડો ન પાતે દળાવ-કુચડાવ બદકે તેના બદલે હાથથી ર્યપર્શ કરીને તેને ચુમ્બી દો અને હાથ ન પહોંચે તો લાડકીથી ર્યપર્શ કરીને તેને ચુમ્બી દો અને તે પણ ન થઈ શકે તો હાથથી તેની પ્રચે કશારો કરીને તેમને એસો આપોડો. હુઝુર મોહમ્મદર્સસુલ્લાહ સહલલાહો અલયહે વસ્તુભરે સુખ મુક્યવાના સ્થળપર દિલિયો પડી રહી છે એ જ શું એછું છે અને હજરને એસો આપવા અથવા હાથ અથવા લાડકીથી ર્યપર્શ કરીને ચુમ્બી દેવા અથવા ઈશારો કરીને હાથને એસો આપવાને “ઇસ્લિલામ” કહે છે. ઇસ્લિલામના સમયે આ હુચા પઢે.

“અણ્ણાહુમમજીરલી જુનુથી વ તહિર લી કલ્યાં વ શરૂહલી સદ્રી વ યસ્સીરલી અમ્રી વ આઝેની ઝીમન આફૈતા”

તરજુમો : ઈલાહી તુ મારા ગુનાહ ખરથી હે અને મારા દિલને પાડ કર અને મારા સીના (હદ્દ્ય)ને એલી હે અને મારા કામને આસાન કર અને મને આદ્ધ્યિત (કુશળતા) આપ તે દોકાં જેમને તે આદ્ધ્યિત આપી.

હુદીસમાં છે ક્યામતના દિવસે આ પત્થર ઉઠાવવામાં આવશે તેની આંચો હશે જેનાથી દેખશે. જુલ હશે જેનાથી કલામ કરશે. જેણે સત્યતા સાથે તેને જોસો દિધો અને ઇસ્લિલામ કર્યો તેના માટે સાક્ષી આપશે.

(૧) અણ્ણાહુમમ ઈમાનમ એકા વ તસ્હીકમ એ કિતાબેકા વ વક્ફાયાન એ અહેકા વ ઈતોબાયાન એ સુન્નતે નખીયેકા સુહમદિન સહિલ્લાહો તાલા અહોઝે વસ્તુભરે અરહુદો અલલાહિલાહો ઈલ્હિલ્લાહો વહદદુ લાશરીકા લહુ વ અરહુદો અન્ન સુહમદિન અહોઝુ વ રસૂલોઝુ. આમન્તો બિલ્લાહો વ કુફરતો બિલજુઅતો વત્તાઝૂતો.

તરજુમો : અય અહલાહ તારા પર ઈમાન લાવતાં અને તારી કિતાબની પુષ્ટ કરતા અને તારા વાયદાને પૂરો કરતાં અને તારા નખી મોહમ્મદ સહલલાહો અલયહે વસ્તુભરે અનુસરણ કરતા હું ગવાહી આપું છું કે અહલાહ સિવાય કોઈ મચાદૂહ (પૂજય) નથી. જે એકદે છે, તેનો કોઈ શરીર નથી અને ગવાહી આપું છું કે મોહમ્મદ સહલલાહો અલયહે વસ્તુભરે તેના ણંદા અને રસૂલ છે અહલાહ પર હું ઈમાન લાગ્યો અને જુણથી અને શયતાનથી મેં ઈન્કાર કર્યો.

એમ કહેતાં કા'ખાના દરવાજ તરફ આગળ વધો, જ્યારે હજર મુખારેકની સામેથી પસાર થઈ જાવ, સીધા થઈ જાવ, ખાનથે કા'ખાને પોતાના ડાખા હાથ તરફ રાખીને જેવી રીતે ચાલો કે કોઈને તકલીફ ના આપો.

(૭) પ્રથમ ત્રણ ઈશામાં પુરુષ “રમલ” કરતો ચાલે અથોત જરૂરી જરૂરી નાના કઢમ સુકરો, અલા હુલાવતો, જેવા રીતે શક્તિશાળી અને બહારુર લોકો ચાલે છે. ન જડપણે દોડતો જ્યાં અધિક લીડ થઈ જાય અને રમલમાં ચોતાને અથવા બીજાને કણ થાય તો એટલીવાર રમલ ત્યજી હે. પરંતુ રમલ માટે રોકાય નહીં, બદકે તવાદમાં મશગૂલ રહે, પછી જ્યારે મોકો મળી જાય તો જેટલી વાર સુધી માટે મળે રમલ જાથે તવાદ કરે.

(૮) તવાદમાં કંઠલું પણ ખાનાએ કા'ભાની નિકટ હોય બેહુતર છે. પરંતુ ન એટકો કે વીચાળની પીડપર શરીર લાગે અથવા કપડું અને નિકટતામાં લીડની અધિકતાના ડારણે રમલ ન થઈ શકે તો છેઢું બેહુતર છે.

(૯) જ્યારે સુલતજિમનો સામે આવે આ હુઆ પઢે છે.

અદ્ધારુમાં હાજરણીતો, જૌતોકા વલહરમો, હરમોકા વદ્યમને અમનોકા વ હાજારસુકામો આચેઝોબેકા મિનારે અદ્ધારુમાં કન્નેચનીયેમા રાજકુતની વ ભારિકલી ઝીછે વખલું અલા કુંદે ગાચેભતિન બેઘેરિન લાઈલાહા ધ્વિધ્વાહેા વહુદહું લા શરીરકલહું લહુલસુંકો વ લહુલહુંહો વહુવા અલા કુંદે શૈધિન કદીર

તરજુમો : અય અદ્દાહ આ ધર તાર ધર છે અને આ હરમ તાડું હરમ છે અને અમન તાડું જ અમન છે અને જહુનનમથી તારી પનાહ માંગનારની આ જગ્યા છે. તુ મને જહુનમથી પનાહ આપ અય અદ્દાહ

ને તો મને આપ્યું મને તેના પર સંતુષ્ટ કરી હે અને મારા માટે તેમાં બરકત આપ અને દરેક ગાયથ પર જોરની સાથે તુ ખુલીદ્દ થઈ જા, અદ્દાહ સિવાય કોઈ મઅધ્યૂહ નથી ને એકદો છે, તેનો કોઈ શરીર નથી. તેના માટે જ દેશ છે અને તેના માટે જ હુંદું છે, તે દરેક વર્ષ પર કાદિર(પ્રભૂત્વશાળી)છે.

અને જ્યારે ઇકેને ઈરાકીની સામે આવે તો આ હુઆ પઢે.

“અદ્ધારુમા હન્ની અભિજો એકા મનદશકુકે વશશીકો વશરોકાકે વનનીક્રાકે વ સુઈદાખદાકે વ સુઈલ સુન્કલબે ઝીદમાલે વદ્યમાલે વલખલદે”.

તરજુમો : અય અદ્દાહ હું તારી પનાહ માંગુ છું શાંકા અને શિક્ષ અને મતલેદ તથા નિક્ષાક્યી અને માલ તથા અહલ તથા ઔદાહમાં પાછા જઈને હુએ વાત જોવાથી.

અને જ્યારે “મિઅબે રહમત” (પરનાળું છે તે)ની સામે આવે તો આ હુઆ પઢે.

અદ્ધારુમા અભિદ્ધાની તાહતા જિદ્દે અર્શેકા યૌમા લા ઝિદ્ધા ધિદ્ધા અદ્દોકા વદ્ય બાડી ધિદ્ધા વજહોકા વ અસ્કેની મિન હોહે નખીયેકા સુહમદિન સલ્લાદ્વાહે તાદા અદોહે વસ્તુદ્વામ શરથતન હનીઅતન લા અગ્રભાયો અગ્રદ્ધામ અથદા”.

તરજુમો : ધિદ્ધાહી તુ મને ચોતાના અર્થના છાંયડામાં રાખ, ને દિવસે તારા છાંયડા સિવાય કોઈ છાંયડા નથી. અને તારી જત સિવાય કોઈ બાડી નથી અને ચોતાના નથી મોહરમહ સલ્લાદ્વાહે અલયહે વસ-

હવમના હોંથી અને રૂગ્યિકર પાટી એવડાવ કે તેના પછી કયારેચે પ્રયાસ (તૃપ્તા) ન લાગે. અને જ્યારે “રૂક્ને શામી”ના સામે આવે આ હુઆ પણ.

અહ્લાહુમસ જ ગાંડો હજજન મધ્યરન વિસરયન મરફુર વિભાગ મ-મરુરે વિનિરતન અન તસુર યા આલિમો માઝીસસુહ્રે આપણીજની જિનજોલોમાતે ઇલિન્નૂરે.

તરજુમો : અય અહ્લાહ ! તુ આને હજજો મધ્યર કર અને સાઈ મરફુર (આભારી) કર અને શુનાડુને બખ્શી હે અને તેને તે વેપાર કરી હે જે નષ્ટ ન થાય, અય હિદ્યોની વાતો જાણુનાર અને તિમિરતાઓ (અંધડાર)થી નૂર (પ્રકાશ)ની તરફ બઢાર કાઢ.

(૧૦) જ્યારે “રૂક્ને યમાની” પાસે આવે તો તેને અંને હાથ અથવા જમણું હોથથી તબર્ડીકન સ્પર્શ કરો ન કેવળ ડાળા હોથથી. અને હંદળો તો તેને જોસો પણ આપો અને તેમ ન થઈ શકે તો અહીંથા લાકડીથી સ્પર્શ કરવું અથવા હંથારી કરીને હાથ ચુમણું નથી અને આ હુઆ પણ.

“અહ્લાહુમ ઇન્ની અસાલુકલ અક્ષવ વલ આફ્યતા ઝીદ્દીને વદ્દહનિયા વલ આભિરતે” અને રૂક્ને શારી અથવા ઇરાક્ષને સ્પર્શ કરવું અથવા જોસો આપવું કાંઈ નથી.

(૧૧) જ્યારે તેનાથી આગળ વધો તો તે “સુસ્તાળથ” છે જ્યાં ચિત્તેર હજર ફેરિશ્તા હુઆ પર આમીન કહેશે, એ જ

બાબેએ હુઆ પણ. “રખણના આતેના ઝીદ હુનિયા હસનતંવ વક્ષીલ આભિરતે હસન તંવવર્કિના અભાનનાર” અથવા પોતાના અને સધગા રાંબધિઓ તથા સુસ્થિલગીન એનો આ હક્કીર વક્ષીર (વેખક સાંપાદક, તથા અનુચાદકો)ની નિયતથી કેવળ હરેદ શરીર પણ કે તે માઝી તથા વાહી છે, હંથાઓ યાદ ન હોય તો તે ધારણ કરે કે હજરત મોહમ્મદર્રસુલુલ્લાહ સુલ્લાહો અલયહે વસ્તુભના સાચા વાયદાથી સધળી હુચ્ચાઓથી ઉત્તમ તથા અદ્દજલ છે અર્થાત અહીંથા અને સધગા પ્રસંગેઓ પોતાના માટે હુઅના બદલે ઝુઝુરે અકદસ સંદ્રભાંહો અલયહે વસ્તુભ પર હરેદ શરીર મોકલે. રસુલુલ્લાહ સદ્દલદાંહો અલયહે વસ્તુભમે ઇરમાનસું કેંચેલું કરેલું તો અહીંથા તારા સધળા કામ બનાવી હેશે અને તારા શુનાહ માઝી કરી હેશે.

(૧૨) તવાઈમાં હુઆ અથવા હરેદશરીર પદવા માટે અટકો નહીં બદકે ચાલતા ચાલતા પણ.

(૧૩) હુઆ તથા હરેદ ધાંટા પાઈને (મોટા સ્વરે) ન પણ જેવું કે તવાઈ કરવા-વાળા પણ કરે છે. બદકે ધીમે પણ એવી રીતે કે ચોતાના ડાન સુધી અવાજા આવે.

(૧૪) હવે જે ચારે તરફ ધુમીને હજરે અસ્વદની પાસે પહોંચ્યો આ એક ઝેરો થચો અને તે વખતે પણ હજરે અસ્વદને જોસો આપે અથવા એ જ પ્રથા વર્તે બદકે દરેક ઝેરાના (ચક્કરના) અંતે એમ કરે. એવી રીતે સાત ઝેરા કરે પરંતુ બાકીના ઝેરાઓમાં

નિયત કરવું નથી કે, નિયત તો શરૂમાં
થઈ ગઈ અને રમણ કેવળ આગતો ત્રણ
કેરાઓમાં છે. બાકીના ચારમાં ધીમેથી ખલા
હુલાંયા વગર સાધારણ ચાલ ચાલે.

(૧૫) જયારે સાતે ફેરા(ચક્કર) પૂરા થઈ
નય અંતમાં કરી હજરે આસ્વદને યોસો આપે
અથવા એ જ રીતે હાથ અથવા લાડકી ક્ષાર
વર્તે. આ તવાઝને “તવાઝ કુદ્દમ” કહે છે
અથીત દરખારની હાજરીને સુજરો આ
ખાંબારવાળાઓ માટે મસનૂન છે અથીત તેમના
માટે જે મીકાતની ખાંબારથી આંદ્રા
મઝ્જવાળાઓ અથવા મીકાતની અંદર
રહેવાવાળાઓ માટે આ તવાઝ નથી. હા,
ને મઝ્જવાળામીકાતની ખાંબાર ગયો તો તેને
પણ તવાઝ કુદ્દમ મસનૂન છે.

તવाइना મસાઈલ

મહાયદ્રા (૧) તવાકુમાં નિયત ઇરજ
છે, વગર નિયતે તવાકુ નથી પરંતુ એ શરત
નથી કે કોઈ નિશ્ચિત તવાકુની નિયત કરે
બલ્કે હરેક તવાકુ સર્વર્થા તવાકુની નિયતર્થી
અહા થઈ જાય છે બલ્કે જે તવાકુને કોઈ
સમયમાં નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે જે
તે સમયે કોઈ બાળ તવાકુની નિયતર્થી કર્યો
તો આ ખીને તવાકુ ન થશે બલ્કે તે તવાકુ
થશે જે નિશ્ચિત છે. દા. ત. ઉમરાનું એહારામ
બાંધીને બહારથી આવ્યો અને તવાકુ કર્યો
તો આ ઉમરાનો તવાકુ છે જે કે નિયતમાં
એ ન હોય. એવી જ રીતે હજનો એહારામ
બાંધીને બહારવાળો આવ્યો અને તવાકુ કર્યો
તો તવાકુ કુદ્રભ છે અથવા કિરાનનો એહારામ

બાંધીને આવ્યો અને એ તવાદુ કર્યો તો
પહેલે તવાદુ ઉમરાનો છે અને બીજે તવાદુ
કુદ્દમ અથવા દસ્તમી તારીખે તવાદુ કર્યો તો
તવાદુ જિયારત છે ને કે આ સૌમાં નિયત
કોઈ બીજાની હોય. (મનાસ્ક)

મહાયાદ્વા (૨) તવાકુનો જે આ તરીકો
મજુકુર થયો ને કોઈએ તેના વિરુદ્ધ તવાકુ
ક્યો. હા. ત. ડાખી બાળુએથી શરૂ ક્યો કે
કો'બા મોઅભમા તવાકુ કરવામાં જમણી
બાળુએ રહ્યો અથવા કો'બા મોઅભમાને
મોહું અથવા પીઠ કરીને આડો તવાકુ
ક્યો અથવા હજરે અસ્વદથી શરૂ ન ક્યો
તો જ્યાં સુધી મહ્કા મોઅભમામાં છે આ
તવાકુનું પુનરાવર્તન કરે અને ને પુનરાવર્તન
ન કર્યું અને ત્યાંથી ચાલ્યો આવ્યો તો
“હમ” વાજિબ છે. એવી જ રીતે હતીમની
અંદરથી તવાકુ કરવું નાભાઈજ છે. માટે તેનું
પણ પુનરાવર્તન કરે. કરવું તો એ બેઇએકે
સમય તવાકુનું જ પુનરાવર્તન કરે અને ને
કેવળ હતીમનો સાત વખત તવાકુ કરી લીધો
કે ઝડકને દરિાકીથી ઝડકને શામી સુધી હતીમની
બહાર ગયો અને પાછો આવ્યો, એવી જ
રીતે સાત વખત કરી લીધું તો પણ કાઢી
છે, અને આ સૂરતમાં અક્ષાલ એ છે કે
હતીમની બહાર-બહાર પાછો આવે અને
અંદરથી પાછો ઝડ્યો તો પણ જાઈજ છે.

(ਕੁਰੈ ਸੁਖਤਾਰ, ਰਹਦੁਲ ਸੁਖਤਾਰ)

મરણદા (૩) તવાકું સાત ચઢ્યારો ૫૨
અતમ થઈ ગયો હુંવે જો આડમો ચઢ્યાર ભાણી
બેઠને ધરાદા પૂર્વક શરૂ કરી હૃદ્યા તો આ
એક નવો તવાકું શરૂ થયો, તેને પણ હુંવે

સાત ચક્કર કરીને અતમ કરે, એવી જ રીતે ને કેવળ વહેમ-વસવસાના આરણે આડમો ચક્કર શરૂ કર્યો કે કહાચ હુમણું છ જ થયા હાય, તો પણ તેને સાત ચક્કર કરીને અતમ કરે, હા ને આ આડમા ફેરાને સાતમે ફેરા ધારણા કર્યો. પાછળથી અખર પડી કે સાત ફેરા થઈ ગયા છે તો ત્યાંજ અતમ કરી હે, સાત પૂરા કરવાની જરૂરત નથી.

(હુર્રે સુખતાર, રહુલ સુહતાર)

મસ્ટાકા (૪) તવાઇના ફેરાઓમાં શાંકા ઉલ્લિ થઈ કેટલા થયા તો ને તવાઇ ફરજ અથવા વાનિય છે. તો અત્યારથી સાત ફેરા કરે અને ને કોઈ એક આદિલ (જે ક્ષાસિક ના હોય તે) શાખસે અતાંયું કે આટલા ફેરા થયા તો તેના કથન પર અમલ કરી લેવું ખેહતર અને એ આદિલોએ અતાંયું તો તેમના ફેંવા પર અવશ્ય અમલ કરે અને ને તવાઇ ફરજ અથવા વાનિય નથી તો ધારણાની ખાત્રી પર અમલ કરે. (રહુલ સુહતાર)

મસ્ટાકા (૫) તવાઇ કા'બએ મોઅઝમા મસ્ઝિહુલ હરામ શરીરની અંદરથી થશે ને મસ્ઝિદના બહારથી તવાઇ કર્યો તો તવાઇ થયો નહીં. (હુર્રે સુખતાર)

મસ્ટાકા (૬) કોઈ શાખસ ને એવો ભીમાર છે કે પોતે તવાઇ કરી શકતો નથી અને સુઈ રહ્યો છે, તેના સાથીએ તવાઇ કરાયો, ને સુઈ રહેવાથી પહેલા હુકમ આપ્યો હતો. તો આ તવાઇ સહીહ છે, નહીં તો સહીહ નથી. (આલમગીરી)

મસ્ટાકા (૭) ભીમારે પોતાના સાથી-ઓને છુંં કે મજુર હોલાવી મને તવાઇ

કરાવી હો, પછી સુઈ ગયો, ને તહેણ મજુર લાવીને તવાઇ કરાવી હીથો તો તવાઇ થઈ ગયો અને ને બીજા કામમાં લાગી ગયા, વાર થએ મજુર લાંયા અને સુવામાં તવાઇ કરાયો તો તવાઇ થયો નહીં પરંતુ મંજુરી ફરહાલતમાં લાન્જિમ છે. (આલમગીરી)

મસ્ટાકા (૮) ભીમારને તવાઇ કરાયો અને પોતાના તવાઇની પણ નિધયત છે તો બંનેના તવાઇ થઈ ગયા, ને કે બંનેના એ પ્રકારના તવાઇ હોય. (આલમગીરી)

મસ્ટાકા (૯) તવાઇ કરતાં કરતાં જના-જાની નમાજ અથવા ફરજ નમાજ અથવા બુશ્ર કરવા માટે ચાહ્યો ગયો તો પાછા આવી એ જ પહેલા તવાઇ પર બિના કરે અથોંત કેટલા ફેરા રહી ગયા હોય તેમને પુરા કરી બે, તવાઇ પૂરૈ થઈજશો, ફરીથી શરૂ કરવાની જરૂરત નથી અને ને ફરીથી કર્યો તો પણ વાંધો નથી અને આ સુરતમાં તે પ્રથમવાળાને પૂરૈ ફરબું જરૂરી નથી અને બિનાની સૂરતમાં જ્યાંથી છોડાયો હતો. ત્યાંથી જ શરૂ કરે, હજરે અસ્વદથી શરૂ કરવાની જરૂરત નથી, આ સંઘળું તે સમયે છે જ્યારે કે પહેલા ચાર ફેરાથી એછા ફર્યા હતા અને ને ચાર ફેરાથી વધારે કર્યા હતા તો બિના જ કરે. (હુર્રે સુખતાર, રહુલ સુહતાર)

મસ્ટાકા (૧૦) તવાઇ કરી રહ્યો હતો. કે જમાયત કાયમ થઈ અને જાણે છે કે ફેરા પૂરૈ કરશે તો રકાત ચાલી જશે અથવા જનાજો આવી ગયો છે, ઇન્તેચાર થશે નહીં તો ત્યાંથી જ તવાઇ છોડાને નમાજમાં શરીક થઈ જાય અને વગર જરૂરતે છોડાને ચાહ્યા

જતું મકઢુહ છે, પરંતુ તવાઇ બાતથી થશે
નહીં અર્થાત આવીને પૂરો કરી લે.

(રહ્યદુલ સુહતાર)

મસ્તાકા (૧૧) મઅગૂર શખ્ખ તવાઇ
કરી રહ્યો છે, ચાર ફેરાઓ પણી નમાજનો
સમય જો: જો: ૨૫થો તો કરે તેને હુકમ
છે કે વુદ્ધ કરીને તવાઇ કરે કેમકે નમાજનો!
સમય આરિજ થઈ જવાથી મઅગૂરનું વુદ્ધ
જતું રહે છે અને વુદ્ધ વગર તવાઇ કરવો
હરામ છે. હવે વુદ્ધ કર્યા પણી ને તવાઇ
આડી છે તેને પૂરો કરે અને ચાર ફેરાઓથી
પહેલા સમય પૂરો થઈ ગયો તો પણ વુદ્ધ
કરીને આડીને પૂરા કરે અને આ સુરતમાં
અફ્જલ એ છે કે આરંભથી કરે. (મનાસિક)

મસ્તાકા (૧૨) રમલ કેવળ ગણુ પહેલા
ફેરાઓમાં સુનત છે. સાતે ફેરાઓમાં કરવું
મકઢુહ છે, માટે જે પહેલા ફેરામાં ન કર્યું
તો કેવળ બીજી અને ત્રીજીમાં કરે અને
પ્રથમના ગણુમાં ન કર્યું તો આડીના ચારમાં
ન કરે અને જે લીડના કારણે રમલનો મોકો
ન મળે તો રમલ ખાતર રોકાય નહીં, રમલ
વગર તવાઇ કરી લે અને જ્યાં જ્યાં મોકો
હાથ આવે એટાં હુર રમલ કરી લે અને જે
હજુ શરૂ નથી કર્યો અને જ્યાં છે કે લીડના
કારણે રમલ કરી શકશે નહીં અને એ પણ
ખબર છે કે થાલવાથી મોકો મળી જશે તો
ઈન્ટેજાર (પ્રતીક્ષા) કરે. (હુરો સુહતાર,
રહ્યદુલ સુહતાર)

મસ્તાકા (૧૩) રમલ તે તવાઇમાં

સુનત છે જેના પણી સર્જ હોય, માટે જે
તવાઇ કુદ્દમની પછીની સર્જ તવાઇ જિયારત
સુધી વિસંબિત કરે તો તવાઇ કુદ્દમમાં રમલ
નથી. (આદમગીરી)

મસ્તાકા (૧૪) તવાઇના સાતેદ્વારા
(ચક્કરો)માં ઈજુતિખાય સુનત છે. અને
તવાઇ કરી લીધા પછી ઈજુતિખાય (જમણો
ખસો એહરામમાં ઉધાડો રાખવો તો) ન કરે
ત્યાં સુધી કે તવાઇના પછીની નમાજમાં જે
ઈજુતિખાય કર્યું તો મકઢુહ છે. અને ઈજુતિ
ખાય કેવળ એ જ તવાઇમાં છે જેના પછી
સર્જ હોય અને જે તવાઇ પછી સહ ન હોય
તો ઈજુતિખાય પણ નથી (મનાસિક) માં કેટલાડ
તવાઇ કરવાનાને જોયા કે હુલજને એહ-
રામના સમયથી હિંદાયત કરે છે કે ઈજુતિખાય
કરતા રહે ત્યાં સુધી કે નમાજે એહરામમાં
ઈજુતિખાય કરેલા હતા. જો કે નમાજમાં ખસો
ઉધાડો રાખવું મકઢુહ છે.

મસ્તાકા (૧૫) તવાઇની હાલતમાં
વિશિષ્ટતા સાથે એવી વાતોથી પરહેઝ રાખો
જેમને શરીરાતે પાક પસંદ કરતી નથી, હા.
ત. પુરૂષ ણીજી લીધો પ્રત્યે ખરાખ દસ્તી કરે
નહીં, કેચુમાં જે કાંઈ એખ (ખોડ) હોય
અથવા તે ખરાખ હાલતમાં હોય તો ઘિઝારની
દર્શિથી તેને ન જુવે બદકે તેને પણ મુણ્ણાની
દર્શિએ ન જુવે કે પોતાની નાદાનીના
કારણે અરકાન બરાબર અહા નથી કરતો
બદકે એવા શાખસને બહુ જ નરમી સાથે
સમજવી હે.

ન માજે તવાફ

તવાફ પછી મકામે ધ્યાણીમાં આવીને આયતે કરીમા વત્તએચુ ભિમ મકામે ઈથ્યાણીમા સુસદક્ષા (અને મકામે ધ્યાણીમને નમાજની જગ્યા બનાવો) પછીને એ રકાત નમાજે તવાફ પછે અને આ નમાજ વાજિબ છે. પહેલી રકાતમાં કુલ યા અઈચુહલ કાફ્ફેન અને બીજુમાં કુલહોવલ્લાહો અહં પછે એ શરતે કે કરાહતનો સમય નેવો કે સુચેદાયથી સૂરજ ઉંચા ચઢવા સુધી અથવા બપોર અથવા અસ્તરની નમાજ પછી સૂર્યાસ્ત સુધી ન હોય. નહીં તો કરાહતનો સમય નિકળી ગયા પછી પછે. હૃદ્દિસમાં છે, જે શાખસ મકામે ધ્યાણીમની પાછળ એ રકાતો પછે તેના આગલા-પાછલા શુનાડ બાધી હેતુમાં આવશે અને કયામતના હિવસે અમનવાળાઓમાં તેનો હશર થશે. આ રકાતો પછીને હુઅા માંગે. અદીંચા હૃદ્દિસમાં એક હુઅા ધરશાદ થઈ, જેના દ્વારા આવશે અજમત એ શુમાર છે તે આ હુઅા છે : 'અદ્દલાહુમ' ! ઈન્નકા તચ્છલમો સિરીં વ અદાનીયતી ઝુઅકુણીલ મચ્જેરતી વત્તચ્છલમો હાજીતી ઝુઅચાતેની સોવાલી વ તચ્છલમો માઝી નફ્સી ઝુફ્ફીરલી ઓનૂઠી. અદ્દલાહુમ ઈન્ની અસ્યાદોકા ઈમાનંદ્યોણાશેરો કદ્દથી વ યકીનન સાહિકન હતા અચ્છલમો અન્નદુ લાયોસીધની ઈદ્દલા મા કનખત લી રહેયા (મનંમદીશતે ઐમા કસગત લી યા અહીંમરહીમીન.

તરજુમો : અય અદ્દલાહ ! તુ મારા શુષ્ટ અને જહેરને જણે છે. તુ મારી ક્ષમાને

કષ્યૂત કર અને તુ મારી હાજતને જણે છે, મારો સવાલ (માંગણી) મને અતા કર અને જે કાંઈ મારા નક્ષસમાં છે તુ તેને જણે છે, તુ મારા શુનાહોને બધારી હે. અય અહીંથી ! હું તારાથી તે ઈમાનનો સવાલ કરું છું જે મારા ઉદામાં પ્રવિષ્ટ કરી જય અને સાચું યકીન માંણું છું કે જેથી હું જણી લઉં કે મને એ જ પહેંચશે જે તે મારા માટે લખ્યું છે. અને જે કાંઈ તે મારી કિસ્મતમાં કર્યું છે તેના પર રાશી રહું. અય સૌ મહેરણાનોથી અધિક મહેરણાન.

હૃદ્દિસમાં છે કે, અદ્દલાહ અજીવ વ જહી ઝરમાવે છે, જે શાખસ આ હુઅા કરશો હું તેની ખાતા (ભૂલ) બધારી દાદિશ, ગમ હુર કરી દાદિશ, મોહતાળ તેનાથી કાઢી લઈશ, દરેક વેપારીથી વધીને તેનો વેપાર રાખીશ, હુનિયા લાચાર તથા મજઘૂર (અની) તેની પાસે આવશે જે કે તે તેને ન ચાહે. આ સુઅમ પર કેટલીક બીજી હુઅાઓ મજકૂર છે. દા. ત.

અહીંથુમ ઈન્ન હાઝ્રા ખલદોકલહરામો વ મસજુદોકલહરામો વ જૈતોકલહરામો વ અના અખોડા વ ઈધનો અખોડા વ ઈધનો અમતોકા અતોકા એ ઝુનુધિન કસીરતિન વ ખતાયા ઝુમતિન વ વ અચ્છાલિન સૈચેઅતિન વ હાઝ્રા મકામુદ્દાધેષોકા મિનનનારે અહીંથુમ આઝેના વ અચ્છોઅના વગ્ફીરલના ઈન્નકા અન્તલગુરુર્દીમ.

તરજુમો : અય અદ્દલાહ આ તારું ઈજાતવણું શહેર છે અને તારી ઈજાતવાળી

મસ્તિજ્જદ છે અને તારું ધજકતવાળું ઘર છે અને હું તારો બંધો છું અને તારા બંધો અને તારી ભાંઠી (દાઢી)નો પુત્ર છું, કેટલાએ શુનાડો અને મોટી ખતાએ અને પુરા આ'માલ સાથે તારા હુંજુર (સમક્ષ) હાજર થયો છું અને જહુનનમથી તારી પનાડું માંગનારની આ જગ્યા છે. અથ અદ્વાદ તુ અમને આદ્ધિયત (કૃગ્રાગતા) આપ અને અમને મારું કર અને અમને બંધી હો, એશક તુ મોટો બંધનાર મહેરભાન છે.

મસ્તાદા (૧) જે ભીડના આરણે મકામે હથાડીમાંના નમાજ ન પડી શકે તે। મસ્તિજ્જદ શરીરક્રમાં કોઈ બીજી સ્થળે પડી લે. અને મસ્તિજ્હુલ હરામ ઉપરાંત ક્યાંક બીજે પડી તે પણ થઈ જશે. (આદમગીરી)

મસ્તાદા (૨) મકામે હથાડીમ પછી આ નમાજ માટે સૌથી અદ્દજલ કા'ઓ મોઅ-જમાની અંદર પઢવું છે, પછી 'હતીમ'માં મીઓએ રહુમતની નીચે, તેના પછી હતીમમાં કોઈ બીજી જગ્યાએ પછી કા'ઓ મોઅ-જમાની નિકટતમ જગ્યામાં, પછી મસ્તિજ્હુલ હરામમાં કોઈ જગ્યા પર હરમે મઝાની અંદર જગ્યાં પણ હોય, (લખાય)

મસ્તાદા (૩) સુન્નત એ છે કે કે કરાહતનો સમય ન હોય તો તવારું પછી તુરેત જ નમાજ પઢે. વચ્ચેનાં અંતર ન હોય, અને જે ન પડી તે જિંદગીભરમાં જ્યારે પઢે અદ્દજલ છે, કંનો નથી, પરંતુ ખૂરું કર્યું કે સુન્નત હૈત થઈ. (મનાસિક)

મસ્તાદા (૪) કરજ નમાજ આ રકમતોના ફાયમ સુધામ થઈ શકતી નથી. (આદમગીરી)

(૧૭) સુલતાંજિમથી લિપટવું

નમાજ તથા હુથાથી કારેગ થઈને સુલતાંજિમની પાસે જય અને હજરની નિકટ તેનાથી લિપટે (બાથલીડ) અને ગોતાની છાતી અને પેટ અને ક્યારેક ડાંબો ગાલ તેના પર સુકે અને બંને હાથ માથાથી ડંચા કરીને હીવાલ પર ફેલાવે અથવા જમણો હાથ કા'ઓના ફરવાન અને ડાંબો હાથ હજરે અસ્વદ પ્રત્યે ફેલાવે. અડીંયાની હુઅ આ છે. યા વાજેદો યા માજેદો લાતોઅંજ અન્ની નેઅમતન અનુચ્ચત અહોયા.

તરજુમો : અથ કુદરતવાળા, અથ ખુશુર્ગ તેં મને જે નેઅમત આપી તેને મારાથી નિષ્ઠ ન કર.

હુદીસમાં કરમાંયું જ્યારે હું છંચ્છુ છું ક્રિયાર્જને નિકાળું છું કે, સુલતાંજિમને લિપટેલા આ હુઅ કરી રહ્યા છે: અતિથય ખુશુર્ગ તથા ખુશુઅ (એકાથતા) તથા આજિબી તથા વિનઅતા સાથે હુઅ કરે અને હૃદ શરીર પણ પઢે અને આ સ્થળની એક હુઅ આ પણ છે.

'હુદીસી વક્ફેટો બેખાણેકા વલતઅર્ભતો એ અચતાણેકા અજુ' રહુમતકા વ અપરા એકાથકા અદ્વાહુમ હર્દિમ શાચરી વ જસહી અલશારે અદ્વાહુમ કમા સુન્નત-વજણી અનિસ્સોજુદે લે ગૈરેકા કેસુન અન મસાઅવતિન ગૈરકા અદ્વાહુમ યા સખ્ખલ્યોતીલાયતીક અચતીક રિકા-ખના વ રેકાય આખાયેના વ ઉમહાતેના

મિનનારે યા કરીયો યા એગીઝો યા જઘણારે રઘણના તકણખલ મિનના ઈન્નકા અનતસસમીકૃતદ્વારીમ. વતુખ અદૌના ઈન્નકા અનતસસમીકૃતદ્વારીમ અદ્વાહુભુ રઘણ હાયલ્લોકૃતદ્વારીકે આ તીક રિકાબના મિનનારે વ આઈદિના મિનશ્રીતાનિર્જલુમ વ અકેદીના કુદ્દી સુઈન વકુનેચના બેમા રજકના વ બાદર કુલના ઝીમા અચ્છતૌતના અદ્વાહુભુમજાઅલના મિન અકેરમિ વક્ષેદેકા અદૌકા અદ્વાહુભુ લકુલહુદો અલા નામાચોકા વ અદ્વાહુલો સલાતોકા અલા સૌયહે અરથેયાઈકા વ જભીયો રોસોલેકા વ અસ્ફેયાચોકા વ અલા આલેહિ વ અસહા ઘેહિ વ અવલિયાચોકા'

તરજુમો : ઈલાહી હું તારા દરવાળ પર ઉલો છું અને તારા આસ્તાનાથી ચીપરી ગયો છું. તારી રહેમતનો ઉમેદવાર અને તારા અગાખથી ડરનાર, અય અદ્વાહ મારા વાળ અને શરીરને જહુનનમ પર હરામ કરી હે, અય અદ્વાહ જેવી રીતે તે મારા ચહેરાને ચોતાના ગેર માટે સિજદો કરવાથી સુરક્ષિત રાખ્યો એવી જ રીતે મને એનાથી સુરક્ષિત રાખ કે તારા જૈરથી સવાલ કર્દું. અય અદ્વાહ, અય આ આજાહ ધરના માલિક તુ અમારી ગરદનોને અને અમારા બાપ હાદા અને અમારી માંચોની ગરદનોને જહુનનમથી આજાહ કરી હે. અય ડરીમ, અય અખણાવાવાળા, અય ગાલિભ, અય જઘણાર, અય રઘણ! તુ અમારાથી ડખૂલ કર એશક તુ સાંસણનાર, જાણુનાર છે અને અમારી તૌખા ડખૂલ કર.

એશક તુ તૈણા ડખૂલ કરનાર મહેરણાન છે. અય અદ્વાહ, અય આ આજાહ ધરના માલિક, અમારી ગરદનોને જહુનનમથી આજાહ કર અને શયતાન મરહુમથી અમને તારી પનાહ આપ ને હરેક ખુરાખથી અમને સુરક્ષિત રાખ અને જે કાઈ તેં આપણું તેના પર સંતુષ્ટ કર અને જે આપણું તેમાં બરકત આપ અને ચોતાના ઈઅજતવાળા વક્ષદ (ગિરોહ)માં અમને કરી હે. ઈલાહી તારા માટે જ હુરદ (સ્તુતિ) છે, તારી નેઅમતો પર અને અદ્વાહ હુરદ અભિયાચોના સરહાર પર અને તારા સધળાં રસૂલો અને બરગુજીદા (શ્રેષ્ઠ) લોકો પર અને તેમની આલ-ઔલાહ તથા અસહાખ અને તારા ઔલિયા પર.

મસ્તાલા (૧) 'મુલતાજિમ' પાસે તવા-ઇની નમાજ પછી આવવું તે તવાક્રમાં છે જેના પછી (સક્રા મરવાની) સર્જ છે અને જેના પછી સર્જ ન હોય તેમાં નમાજથી પહેલા મુલતાજિમથી લિપટે પછી મહામે ઈદ્ધાહીમની પાસે જઈને જે રકમત નમાજ પછે, (મનાસેક)

(૧૮) અમજમ તરફ હાજરી

પછી અમજમ પર આવો અને થઈ શકે તો ખૂબ ચેક ડોલ જેંચો નહી તો ભરનારથી લઈ લો અને કા'બા પ્રતિ મોં ઈદીને ત્રણ શાસમાં ચેટ લરીને જેટલું પી શકાય ઉલા થઈને પીએ, દરેક વખત અદ્વાહથી શરૂ કરો અને અદ્વાહમુલિદ્વાહ પર ખતમ કરો અને દરેક વખત કા'બા મોઅજજમા પ્રતિ નજરો ઉપાડીને જોઈ લો. બાડીનું વધેલું પાણી શરીર પર નાખી લો અથવા

મુખ અને મસ્તક અને શરીર પર તેનાથી મસહ કરી દો. અને પીતી વેળા હુઅા કરો કે તે હુઅા કુણૂલ છે. રસુલિદ્વાહ સહૃદ્વાહો અલયહે વસ્તુમ ફરમાવે છે ‘‘અમઝમ’’ ને સુરાદથી પીવામાં આવે તેના જ માટે છે (એટથે તે સુરાદ પુરી થશે) તે સમયની હુઅા આ છે “અદ્વાહુભુ ઈન્ની અસ્તયદોકા ઈદમન નાફ્યાંધ્વ રિઝકન વાસેયાંધ્વ ક્ષયમલમ સુતકણયલન વ શિક્ષાઅમ મિન કુલ્લે દાઈન”

તરજુમો : અય અદ્વાહ હું તારાથી લાલ આપનાર ઈદમ અને વિસ્તૃત રિઝક (રેલ) અને મકણૂલ અમત અને દરેક બીમારીથી શિક્ષાનો સવાલ કરું છું (માંથું છું).

અથવા એ જ જગેય હુઅા પઢો અને મજ્જા મોઅગ્જમાની હાજરી સુધી તો અનેક વાર અમઝમ શરીર પીવું પ્રાસ થશે. ક્યારેક ક્યામતની તૃપથી બચવા માટે પીઓ. ક્યારેક કુણ્ણના અગાબથી સુરક્ષા માટે, ક્યારેક રસુલિદ્વાહ સહૃદ્વાહો અલયહે વસ્તુમની મહોષખત વધવા માટે ક્યારેક રોળની વ્યાપકતા માટે. ક્યારેક બીમારીએની શિક્ષા માટે ક્યારેક ઈદમ પ્રાપ્તિ વિગેરે ખાસ ખાસ સુરાદો માટે અમઝમનું પાણી પીઓ.

(૧૯) ત્યા જ્યારે પીઓ પેટ ભરીને પીઓ. હઠીસમાં છે કે અમારામાં અને સુનાઝીકોમાં એ તફાવત છે કે તેઓ અમઝમને પેટ ભરીને પીતા નથી.

(૨૦) અમઝમના કુવાની અંદર અંઘો (અંઘીને નમીને જુઓ) કે હઠીસના હુકમથી (તે કુલ્ય) નિકાને દેહે કરનાર છે.

(૬૧) સફ્ફા તથા મરવાની સર્ધ

હવે જે થાક વિગેરેનું કોઈ ઉઝર (આરણ) ન હોય તો હમણાં નહી તો, આરામ લઈને, સર્શ-મરવામાં સર્ધ માટે દરી હજરે અસ્વધની નિકટ આવો અને એવી જ રીતે તકણીર વિગેરે કદ્દીને ચુમો અને ન થઈ શકે તો તેના પ્રયે સુખ કરીને અદ્વાહો-અકુભર વલાઇલાહા ઈલલલાહુ વલાહરહુલિલાહિ અને હરેક શરીર પદતાં તુરત જ “બાબે શફ્ફા”થી સફ્ફાની દિશાએ રવાના થાવ, મરિજદના દરવાનથી ડાળો પગ પહેલાં કાગે અને જમણો પગ પહેલાં ખુટમાં નાણો અને આ અદ્વા દરેક મરિજદથી આવતા હુમેશા ધ્યાનમાં રાણો અને એજ હુઅા પઢો જે મરિજદથી નિકળતી વખતે પદવા માટે મજકૂર થઈ ગઈ છે.

મસ્તયદા (૧) : ઉજર (શર્દી કારણ) વગર તે સમયે સર્ધ ન કરવું મકદૂહ છે કે સુનનતાના વિરુદ્ધ છે.

મસ્તયદા (૨) : જ્યારે તવાદ્ર પછી સર્ધ કરવી હોય તો પાછા આવીને હજરે અસ્વધનું ઈસ્તિલામ (હજરે અસ્વધને ઓસો હોવો અથવા તેને હુયેલીએ લગાવીને તેને ચુમણું વિ.) કરીને સર્ધ માટે જગ અને સર્ધ ન કરવી હોય તો ઈસ્તિલામની જરૂરત નથી. (આદમગીરી)

મસ્તયદા (૩) : સર્ધ માટે બાબે સફ્ફાથી જવું સુસ્તહણ છે અને એજ આસાન પણ છે અને જે કોઈ બીજા દરવાનથી જરો તો પણ સર્ધ અદા થઈ જશે.

(૨૨) જિક તથા દૃઢમાં મશગુલ સર્જાની સીડીઓ પર એટલા ચઠો કે કા'બા મોઅ-અમા નજરે પડે અને આ વાત અહીંયા પ્રથમ જ સીડી પર ચઠવાથી પ્રાપ્ત છે. અથોત જે મડાન અને હીવાદો વરચે ન હોત તો કા'બા મોઅજમા અહીંયાથી હેખાત, તેનાથી ઉપર ચઠવાની હાજરત નથી બદકે અહેવે સુનનત વજમાયતના મજહુબની વિદ્ધય અને બદમજહુણો અને જાહેરાનો ફેલ છે કે સાવ ઉપરની સીડી સુધી ચરી નાય છે. અને સીડી પર ચઠવાથી પહેલા આ પણ :

અણદચો બેમા બદાદાહોષેહિ ઈન્નસસર્જા વભમરવતા (મન શાયાએ-રિલાહે ઝેમન હજજદફૌતા અચેચતમર ઝ્લા જેનાહા અદૌહે અંચ્યસવઙ્ગા બેહા વમન તતવ્યચ ઘૈરન ઝેઠનહીંહા શાકિરન અદીમ.

તરજુમો : હું તેનાથી શરૂ કરું છું જેને અહીંહે પ્રથમ જિક કર્યું. બેશક સર્જા તથા મરવા અદલાહની નિશાનીઓ ગૈકી છે. જેણે હજજ અથવા ઉમરો કર્યો તેમના તવાઝમાં શુનોહ નથી અને જે શાખસ નેક કામ કરે તો બેશક અદલાહ બદલો આપનાર, જાણુનાર છે.

પછી કા'બા પ્રત્યે સુખ કરીને બને હાથ ખલાઓ સુધી હુઅના જેમ પહેલા રાખી ઉચ્ચા કરે. અને એટલીવાર સુધી થેલો જેટલીવારમાં સૂરતો સુક્ષ્મસલની કોઈ સૂરત અથવા સૂરતો બહની પચાસ આયતોની તિલાવત કરવામાં આવે અને તરફીહ તથા

તહુદીલ તથા તકારીર તથા હુદે શરીર પઢો અને ચોતાના માટે, ચોતાના મિત્રો માટે અને બીજા સુસલમાનો માટે હુઅા કરો કે અહીંયા હુઅા કુળુલ થાય છે. અહીંયા પણ હુઅાએ જામેયા” પઢો, અને આ પઢો.

અદલાહો અકબર, અદલાહો અકબર, લાઈલાહો ઈલિલાહો વલલાહો અકબર વ લિલલાહિલહુદ, અલહમો લિલલાહે અદા મા હુદાના અદા હુદો લિલલાહે અદા મા અચતાના અલહમો લિલલાહે અદા મા અલહમા અલહમો લિલલાહિલહજી હુદાના લેહાંા, વમાકુના લે નહતદેયા લૌલા અન હુદાનલાહ, લાઈલાહો ઈલિલલાહો વહદુ લાશરીકા લહુ લહુલમુલકો વ લહુલહુદો ચોહયી વ ચોમીતો વહુવા હુયુન લાયમૂતો, હેયહેહિલ હૌરે, વહોવા અદા કુલ્લે શૈધિન કહીર લાઈલાહો ઈલ્હિલાહો વહદુ સદક વચ્છુ વનસર અણદુહુ વ અગલખજુનહુ વ હસુમલયાહાઅ વહદુ, લાઈલાહો ઈલ્હિલાહો વદા નાયમોહો ઈલ્લા ઈલ્લાહો સુખલે-સીના લહુદીન, વ લખ કર્દહ કાકેરેન સુખહુનહીંહો હીના તુસુના વ હીના તુસ્થેહુન, વલહુ હુદો ઝીસસમાવાતે વહાર્દ વ અશીયંવ હીના તુખહેરેન. યપરેજુદ્ધૈય મિનદમૈયિતે વ ચુગરેજુલ મૈયિતા મિનદહૈયે ચોહયોલયાર્દ અચા મૌતેહા વકાલિકા તુપરજુન અહીંહુસુ હુદે તની લિલિલામે અસથાલોકા અન લા તનુઅન્નેઅહુ મની હતા. તવક્કુની

અના સુરતેસુન સુખદાનદ્વારે વદ્ધભર્તો
લિંગાંહે વ લાઈલાહા ઈલ્લિલાહે વદ્ધાહે
અકભર વત્તા હૌલા વત્તા કુંબતા ઈલ્લા
બિલ્લાહિદ્વાલીચીઃઅજીમ

આદ્વાહુભમ આહ્યેની અદા સુનતે
નથીયેકા સુહુમદિન સલલદ્વાહે
ત્યાદા અદોહે વસલદમ વ તવક્કેની
અદા (મદ્વાતેહિ વ અહંદની) મન
સુદાલાતેચુક્કિતિન અદ્વાહુભમ અજાલ
મિરમંચ્તો હિણખોકા વ ચોહિણો
રસ્લુકા વ અગ્નેયાચેકા વભાલાચેકતેકા
વ ઈખાહે કેસસાલેહીન અદ્વા હુભમ
યસ્સીરલી લિલુસરા વ જન્નીઝનીદિલુસરા,
અદ્વાહુભમ આહ્યેની અદા સુનતે
રસ્લુકોકા સુહુમદિન સલલદ્વાહે ત્યાદા
અદોહે વસલદમ વ તક્કેની સુર્લેમન
વલહીકની બિસસાલેહીન વજચાલની
મિંદ્વરસતીદળનતી નન્દમે વઙ્ક્રીરલી
અતીઅતી થોરિદાને, અદ્વાહુભમ !
ઈના નરઅદોક ઈમાનન કામિલન વ
કલથન ખાંસાન વ નરઅદોકા
ઈદમન નાદેયન યડીનન સાદીકન
વ દીનન કુંઘેમન વ નશઅદો
કલાક્રવ વલચાક્કીયતા (મન કુંદે
નહીંયતિન વનરઅદોકા તમામણ
આક્કીયતે વનરઅદોકા) દવામતિલ
આક્કીયતે વ નરઅદોકસશુકર અદાણ
આક્કીયતે વનરઅદોકલ્લોના અનિનનાચો
અદ્વા હુભમ સલલે વસલદમ વધારિક
અદા સૌથેદેના સુહુમદિંદ્વાદા આદોહિ
વ અસહાયેહિ અદદ અદકા વરેહાચો
નક્કેસેકા વ જીનતે અર્ણોકા વ મિદાહે

કલેમાતોકા કુલ્લમા અકરકાજાકેદ્રન
વ ગરૂલ અન જિકેકદગાકેદ્રના.

તરજુમો : હુમદ છે અદ્વાહ માટે કે
તેણે અમને હિદાયત આપી, હુમદ છે અદ્વાહ
માટે કે તેણે અમને આપ્યું. હુમદ છે અદ્વાહ
માટે કે તેણે અમને ઈલ્લામ કચું. હુમદ છે
અદ્વાહ માટે જેણે અમને તેની હિદાયત
કરી અને જે અદ્વાહ હિદાયત ન આપ્તો
તો અમે હિદાયત ન પામતા, અદ્વાહ
સિવાય કોઈ મન્દુદ નથી જે એકદો છે,
તેનો કોઈ શરીક નથી, તેના માટે સુલ્ક
હિકમત છે અને તેનાજ માટે હુમદ છે, એજ
લુંતા કરે અને મારે છે અને તે ખુદ
લુંતાં છે, મરતો નથી, તેનાજ હાથમાં
જૌર (ભલાઈ) છે અને તે દરેક શાય પર
કાદિર છે, અદ્વાહ સિવાય કોઈ મન્દુદ
નથી જે એકદો છે. તેણે ચોતાનો વાયદો
સાચો કંચો, ચોતાના બંધાની મહદ કરી
ચોતાના લશકરને ગાલિય કચું અને કાદિરાની
જમાઅતોને તેણે એકદાચે પરાજ્ય આપ્યો
અદ્વાહ સિવાય કોઈ મન્દુદ નથી અમે
તેનીજ ઈખાહત કરીએ છીએ. તેના જ માટે
દીનને શુધ્ય કરીએ છીએ લલે કાદિરા
ખુર્દ માને, અદ્વાહની પાકી છે, સવાર-
સાંજ અને તેના માટેજ હુમદ છે, આસમાનો
અને ધરતીમાં, અને ત્રીજ પહોરે અને
તોહરના સમયે, તે લુંતાને સુદીથી કાઢે
છે અને સુદીને લુંતાથી કાઢે છે. અને
ધરતીને તેના મરી ગયા પછી લુંતાં કરે
છે અને એવી જ રીતે તમે કાઠવામાં આવશો.
ઈલાહી તેં જેવો રીતે મને ઈસ્લામ પ્રત્યે
હિદાયત આપી, તારાથી સવાલ કરું છું કે

તેને મારાથી જુદી ન કર જે, ત્યાં સુધી કે મને ધૂસ્લામ પર મૃત્યુ આપે અડવાડ માટે કુમદ છે અને અડવાડ સિવાય ડોઈ મઅારૂં નથી અને અડવાડ બહુ મોટો છે. અને ગુનાહુણી ફરવું અને નેકીની તાકત નથી પરંતુ અડવાહુણી મદદથી જે ભરતર તથા બુઝું છે. ઈલાહી તુ મને પોતાના નાં મોહમ્મદ સંદેહિણી અન્યથે વસ્તુભરમની સુન્નત પર લુંબં રાખ અને તેમની મિલ્ખત પર વદ્ધત આપ અને દ્વિતીની ગુમરાહીઓથી બચાવ, ઈલાહી તુ મને તે લોકોમાં કર જે તારાથી મહોષ્યત ધરાવે છે અને તારાં રસૂલ તથા અંબિયા તથા મલાઈકા અને નેક બંધાઓથી મહોષ્યત રાખે છે. ઈલાહી મારી માટે આસાની ઉપલબ્ધ કર અને મને સખીઓથી બચાવ, ઈલાહી પોતાના રસૂલ મોહમ્મદ સંદેહિણી અન્યથે વસ્તુભરમની સુન્નત પર મને લુંબં રાખ અને સુસલમાન તરીકે મૃત્યુ અને નેક લોકોની સાથે મેળવ અને જનનુલનાં મને વારિસ કર અને ક્યામતના દિવસે મારી ખતા બખરી હે. ઈલાહી તારાથી ઈમાને ડામિલ અને આનિશ્ચી કરનાર હંદ્યાનો અમે સવાલ કરીએ છીએ. અને અમે તારાથી લાલ આપનાર ધૂદમ અને સાચું યદ્રીન દ્રઠ હીનનો સવાલ કરીએ છીએ. અને દરેક બદાથી અદ્વિત તથા આદ્વિતનો સવાલ કરીએ છીએ અને પૂરી આદ્વિત અને આદ્વિતની નિરંતરતા અને આદ્વિત પર શુંકનો સવાલ કરીએ છીએ અને આદ્વિતની નિરસ્પૂર્ણતાનો સવાલ કરીએ છીએ. ઈલાહી તુ હંદ્યો સલામ તથા બરકત નાજિલ કર અમારા સરહાર મોહમ્મદ

સહૃદ્યાહો અલયહે વસ્તુભરમ અને તેમની આલ તથા અસ્ફાધ પર, તારી મખલ્કુની ગણના જેટલું અને તારીરા અને તારા અર્થના વજન જેટલું અને તારા ક્રેમાતની લંબાઈ જેટલું, જ્યાં સુધી જિકે કરનાર તારો જિકે કરતા રહે અને જ્યાં સુધી ગાંધીલ તારા જિકથી ગાંધીલ રહે.

હુઆમાં હુથેળીએ આકાશ તરફ રહે, ન એવી રીતે કે જેવું કેટલાક જહિલેા હુથેળીએ કા'બા તરફ કરે છે, અને અકસ્મ તવાફ કરવાળાણો હાથ ડાનો સુધી ઉઠાવે છે પછી છીણી હોય, આવી જ રીતે ત્રણ વખત કરે છે. તે પણ ગલત તરીકો છે. બદ્દકે એક વખત હુઆ માટે હાથ ઉઠાંયા અને જ્યાં સુધી માંગે અદ્ધર રાખે જ્યારે હુઆ ખતમ થઈ જાય હાથ લટકાવીહે પછી સઈની નિર્ધયત કરે, તેની નિર્ધયત આવી રીતે છે.

અડવા હુમ્મા ઈન્ની ઉરીહુસ સઈ બયનસસજ્ઞા વલમર વતાફ યસ્સિસરહુલી વ તકાખબલહુ અન્નની

(તરજુમો : હે મારા અદ્ધાડ ! હું સફ્રા મરવાની સઈનો ઈરાહો કરું છું : તે મારા માટે આસાન કરી હે).

(૨૩) પછી સક્ષાથી ઉત્તરી મરવા તરફ જાય, જિક તથા હુરદ બરાબર ચાલુ રાખે, જ્યારે પ્રથમ માઈલ આવે (અને આ સક્ષાથી થોડાક જ અંતરે છે ડાબા હાથે લીલા રંગનો માઈલ (પદો) મરિઝાં શરીરની હીવાલની

સમીય છે) અહીંથાથી દોડવું (જડપી ચાલ) શરૂ કરે (પરંતુ ન હદ્ધી વધારે ન કોઈને કુઠ આપીને ત્યાં સુધી કે બીજા માઈલ (લીલા રંગના પણ) થી નિકળી જાય. અહીં પછિનાની હુએ આ છે.

રણખગઝીર વરાહમ વતનાન અમભા
તાં લમો માલાનાનચલમો ઈન્નકા અન્તદ-
અઠિઅનુભવકરમ અદલાહુમભ જાયદાહ
હજજાન મણ્ણરંબ વસાયમ મશ્ફૂરંબ
અણમણમણકરન અદલાહુમગઝીરલી વલે-
વાલેદીયા વલિદમુખમેનીના વલમુખમેનાતે
યામુજુખદયથાતે રણખના તકણખદ
મિનના ઈન્નકા અન્તસ્સમીજલ અલીમ
વ તુખ અદૌના ઈન્નકા અન્તસ્સાંવાયુ-
ર્ધીમ. રણખના આતેના ઝીદહુન્યા
હસનતંબ ઝીદહાયાખેરતે હસનતંબકેના
અગાખનાર

તરજુમો : અય પરવરદિગાર અખશ
અને રહેમ કર અને દરગુજર કર તેનાથી
જેને તુ જણે છે અને તુ તેને જણે છે અમે
જાણુતા નથી, એ શક તુ ઇજાત તથા દયાવાળો
છે, અય અદ્ધાહ તુ તેને હજજે મણ્ણર કર
અને સર્જ મશ્ફૂર કર અને શુનાહ અખશ,
અય અદ્ધાહ મને અને મારા મા ભાપ અને
તમામ મોમિનીન તથા મોમિનાતને ણાજશી
હે, અય હુઅચોનો સ્વીકાર કરનાર અય
રણખ અમારાથી તુ કણૂલ કર એશક તુ
સાંભળનાર જાણુનાર છે. અને અમારી તૌખા
કણૂલકર, એ શક તુ તૌખા કણૂલ કરનાર
મહેરભાન છે, અય રણખ તુ અમને હુનિયામાં
લલાઈ આપ અને આભિરતમાં લલાઈ આપ
અને અમને જહીનમના અગાખથી બચાવ)

(૨૪) બીજ લીલા રંગના પણ માઈલથી
નિકળી ધીમા પડી જાય અને આ હુએ
વારંવાર પઢતા પઢતા. લાઈલાહુ ઈંધીાંધાહુ
વહદહુ લાશરીકલહુ લહુલમુલુ યુહુથી
વચુમીતુ વહેાય હચુલલાયમુતુ ઐયહિહિલ
ખયર વહુવા અચા ઇલ્લે શીધન કરીર.
મરવા પહાડી સુધી પહોંચ્યો. અહીં પ્રથમ
ચીડી પર ચઢવા બદકે તેના નિકટ જમીન
પર ઉલા રહેવાથી મરવાહ પર ચઢવું થઈ
ગયું. માટે જિલકુલ હીવાતની સમીપન થપ
જાય કે તે જાહુદોને તરીકો છે. અહીં પણ
જે ઈમારતો બની (બાંધકામ થપ) જવાથી
કા'આ નજરે પડતો નથી પરંતુ કા'આ પ્રયે
મુખ કરીને જેવું સદ્ગુરુ પર કચ્છું હતું તસ્થીહ
તથા તકખીર તથા હમ્બો સના તથા હૃદો
હુએ અહીંચા પણ કરો. આ એક ઝેરો
(ચક્કર) થયો.

(૨૫) પછી અહીંથાથી સદ્ગુરુ તરફ જિંકો
હર્દાદ અને હુએચો પઢતા જાવ. જયારે લીલા
માઈલની પાસે પહોંચ્યા એવી જ રીતે દોડા
અને બંને માઈલો (પથર)થી પસાર થઈને
ધીમા પડી જાવ. ઝરી આવો ઝરી જાવ, ત્યાં
સુધી કે સાતે ચક્કર મરવહ પર પૂરા થાય
અને દરેક ઝેરામાં એવી જ રીતે કરો. આતુ
નામ સર્જ છે. બંને માઈલો (લીલા રંગના
પણાચો)ની વચ્ચે જે હોડીને ન ચાલ્યા
અથવા સદ્ગુરુ સુધી હોડીને ગયા
તો ઓઢું કચ્છું કે સુન્દર તર્ક થઈ પરંતુ
દમ અથવા સદ્ગુરુ વાજિબ નથી. અને સર્જમાં
ઇજાતેથાય (ચાહરને જમણું ખલાની નીચે
રાખવી અને ખલો ઉઘાડા રાખવો તે) નથી.
જે લીડના લિધે માઈલોની વચ્ચે હોડવાથી

વિવશ છે તો થોડીકવાર થોલી જાય કે લીડ ઓછી થઈ જાય અને હોડવાને મોકો મળી જાય. અને જો થોડીકવાર થોલવાથી લીડ ઓછી થશે નહી તો હોડવાવાળાઓની જેમ ચાલે અને કોઈ ઉભરના કારણે જનવર પર સવાર થઈને સર્જ કરે છે તો તેમની વચ્ચે જનવરને અહયથી ચલાવે પરંતુ તેનો જ્યાલ રહે કે કોઈને ધર્મા ન થાય કે આ હુરામ છે.

મરુઅદા : (૧) જો મરવાથી સર્જ શરૂ કરી તો પહેલો ચઙ્ગર કે મરવહથી સંક્રાનો થયો, ગણ્યવામાં આવશે નહી. હવે સંક્રાથી મરવહ જરૂરો, આ પહેલો ફેરો (ચઙ્ગર) થયો.

(ફુરો સુખતાર, આલમગીરી)

મરુઅદા (૨) ને શખ્સ એહુરામથી પહેલા એ હોશ થઈ ગયો છે અને તેના સાથીઓએ તેના તરફથી એહુરામ બાંધ્યો છે તો તેના તરફથી તેના સાથી નાયા તરીકે સર્જ કરી શકે છે. (મનાસિક)

મરુઅદા (૩) સર્જ માટે શરત એ છે કે પૂરા તવાદું અથવા તવાદના અકસર હિંસાની પછી થાય માટે જો તવાદુંથી પહેલા અથવા તવાદના ત્રણ ફેરો પછી સર્જ કરી તો સર્જ થઈ નહી. અને સર્જના પહેલા એહુરામ હોવું પણ શરત છે. લદે હજનો એહુરામ હોય કે ઉમરાનો. એહુરામથી પહેલા સર્જ થઈ શકતી નથી. અને હજની સર્જ જો લુકુદે અરકાની પહેલા કરે તો સર્જના સમયમાં પણ એહુરામ હોવું શરત છે અને વહુદે અરકા પછી હોય તો સુજ્ઞત એ છે કે એહુરામ

ઓલી નાખ્યું હોય અને ઉમરહની સર્જમાં એહુરામ વાજિબ છે અર્થાત જે તવાદું પછી માથું સુંડાવી લીધું પછી સર્જ કરી તો સર્જ થઈ ગઈ પરંતુ કેમકે વાજિબ તર્ક થયું માટે દમ વાજિબ છે. (લભાય)

મરુઅદા (૪) સર્જ માટે તહોરત શર્તોનથી, હૈઅવાળી ઔરત અને જનાખતવાળોના પર શુસ્ત કરવું વાજિબ હોય તે) પણ સર્જ કરી સકે છે. (આલમગીરી)

મરુઅદા (૫) સર્જમાં ચેદલ (પગપાળા) ચાલવું વાજિબ છે. જ્યારે કે ઉભર ન હોય માટે જો સવારી અથવા ડાલી વિગેર પર સર્જ કરી અથવા પગોથી ન ચાલ્યો બદકે ઘસ્તાતો ગયો તો ઉભરની હાલતમાં માદ્દ છે અને ઉભર વગર એવું કર્યું તો દમ આપવો વાજિબ છે. (લભાય)

મરુઅદા (૬) સર્જમાં સતરે ઔરત સુજ્ઞત છે અર્થાત જે કે સતરનું છુપાવવું કરજ છે પરંતુ એ હાલતમાં કરજ ઉપરંત સુજ્ઞત પણ છે કે જે સતર ખુલ્લું રહ્યું તો તેના કારણે કષ્ટકારી વાજિબ નથી પરંતુ એક શુનોહ કરજના તર્કનો થયો. બીજો શુનોહ સુન્નત ત્યાગનો (મનાસિક) કેટલીક આરતોને જોવામાં આવે છે બહુ જ એભાકીથી સર્જ કરે છે કે તેમના ડાંડા અને ગગા ખુલ્લા રહે છે અને એ જ્યાલ નથી કે મજ્જા મોઅજમામાં અપરાધ કરવું બહુ જ સખત (હુંઠ) વાત કે અહીંચા જેવી રીતે એક નેકી લાખ નેકીની બરાબર છે એવી જ રીતે એક શુનોહ લાખ શુનાહની બરાબર છે બદકે અહીંચા તો શું પરંતુ

કા'ખા મોઅમ્ભાની સામે પણ તેઓ એ જ હાલતમાં રહે છે બદકે એ જ હાલતમાં તવાઝ કરતાં જેવામાં આવે છે જે કે તવાઝમાં સતરનું છુપાવવું તે કાયમી ઇરજ ઉપરાંત વાજિબ પણ છે તો એક ઇરજ ધીજા વાજિબના તર્કેથી એ ગુનાહ કર્યા તે પણ કયાં, બયતુદવાહની સામે અને ખાસ તવાઝની હાલતમાં બહદું કેટલીક ઓારતો તવાઝ કરવામાં ખાસ કરીને હજરે અસ્વહને આસો આપવામાં પુરણો (ની લીડ)માં ધૂસી જાય છે અને તેમનું શરીર પુરણોના શરીરથી સ્પર્શ થતું રહે છે પરંતુ તેમને તેની કોઈ પરવા નથી જે કે તવાઝ અથવા હજરે અસ્વહના આસો વિગેર સવાખ માટે કરવામાં આવે છે પરંતુ તે ઓારતો સવાખના બદલે ગુનોહ ખરીદી કે છે માટે તે કાચોની તરફ હાજુ એચે વિશિષ્ટતાથી ધ્યાન આપવું જોઈએ. અને તેમની સાથે એ ઓારતો હોય તેમને તાકીદથી એવી હુક્કતોથી મનાઈ કરવી જોઈએ.

મસ્ટાદા (૭) સુસ્તહણબ એ છે કે બા બુઝું સર્જ કરે અને કપડાં પણ પાક હોય અને શરીર પણ ફરેક પ્રકારની નાપાકીથી પાક હોય અને સર્જ શુદ્ધ કરતી વેળા નિયત કરી લે.

મસ્ટાદા (૮) મકર્ષહ સમય ન હોય તો સર્જની પછી એ રક્ખત નમાજ મસ્તિષ્ઠ શરીરમાં જઈને પદબું એહતર છે. (હુર્દું સુખતાર) ઈમામ અહુમહ, ઈધને માન તથા ઈધને હૃદ્યાન સુતલિણ બિન વહાઅથી રાવી તે કહે છે કે, મેં રસુલુલ્લાહ સલ્લાલ્લાહો અલયહે વસલ્વમને જેયા કે જ્યારે સર્જથી ફારેગ થયા તો હજરની સામે તશરીઝ

લાવીને મતાઝના હાશિયામાં એ રક્ખત નમાજ પડી.

મસ્ટાદા (૯) સર્જના સાતે ફેરા (ચક્કર) એક પછી એક કરે જે વિલિન્ન પ્રકારે કર્યા તો પરિવર્તન કરે અને હવેથી સાત ફેરા કરે કે એક પછી એક ન થવાથી સુન્નત તર્ક થઈ ગઈ, હા, જે સર્જ કરતામાં જમાઅત ઉભી થઈ અથવા જનાઓ આવ્યો તો સર્જ છાડીને (જે સુન્ની અકીદાનો ઈમામ હોય તો) નમાજમાં શામેલ થાય, નમાજ પછી જ્યાંથી છાડી હતી ત્યાંથી જ પૂરી કરે.

(આલમગીરી)

મસ્ટાદા (૧૦) સર્જની હાલતમાં બધ્ય તથા એકાર વાતો સખત અનુચિત છે કે એ તો આમે ન લેધુંએ, ન કે તે સખ્યે ઈખાદતમાં મશગૂલ છે. યાદ રાખો કે ઉમરો કેવળ એજ કાચો તવાઝ તથા સર્જનું નામ છે. કિરાન તથા તમતોઅવાળા માટે એ જ ઉમરો થઈ ગયો, અને ઈશ્વરાદવાળા માટે આ તવાઝ, તવાઝ કુદ્દમ અર્થાત દરખારની હાજરીનો સુજરો.

મસ્ટાદા (૧૧) હજર કરનાર મછામાં જતાં પહેલાં અરદ્ધાતમાં પહેંચ્યો. તો, 'તવાઝ કુદ્દમ' સાકિત (૨૬) થઈ ગયો, પરંતુ ખરાખ કસું કે સુન્નત હૈત (છુટી) થઈ જઈ અને દમ વિગેરે વાજિબ નથી (જવહિર્ખ રદ્દુલ સુહતાર)

(૨૬) કારિન અર્થાત જેણું કિરાન કસું છે તેના પછી તવાઝ કુદ્દમની નિયતથી એક તવાઝ તથા સર્જ અજલી લાવે.

(૨૭) કાહિન અને સુર્કરિદ અર્થાત જેણું કેવળ હજરનો એહરામ બાંધ્યો હતો, લણ્ણોક

કહેતો મજ્જામાં થોલે. તેમની લખાએ દસમી તારીખે જમરહણી રમી (શૈતાનને કાંકરીઓ મારવી) ના સમયે ખતમ થશે અને એજ વેળા એહુરામથી નિકળશે. જેનો ઉદ્દેશ ઈન્શાઅદ્દીં આગળ આવે છે. પરંતુ સુતોએ અર્થાત જેણે તમતોઓ કચેરો છે, તે અને સુતમિર અર્થાત નચોરો ઉમરો કરનાર શરૂ તવાઇ ક'બા મોઅઝમાથી સંગે અસ્વદ શરીર નો પ્રથમ ખોસો લેતાં જ લખાંકે છોડી હે અને તવાઇ તથા સઈ મજફુરની પછી હલક કરે અર્થાત સંધળું માથું સુંડાવી નાખે અથવા તકસીર અર્થાત બાલ કટરાવે અને એહુરામથી બહાર આવે. ઓરતોએ વાળ સુંડાવલું હુરામ છે. તે ડેવળ એક ટેરવા (પોરા) ખરાખર વાળ કટરાવી લે. અને પુરુષોને અખત્યાર છે હલક કરે અથવા તકસીર અને ખોહતર હલક છે કે હુંઝુરે અકદસ સંદર્ભાંદો અલયહે વસદલમે હજાતુલ વિદ્ધામાં હલક કરાયું. અને માથું સુંડાવવાવાળાઓ માટે ત્રણ વખત હુઅાએ રેહમત કરમાણી અને કટરાવવાવાળાઓ માટે એક વખત અને જો સુતમતોએ મિનાની કુરબાની માટે જનવર સાથે લઈ ગયો છે તો ઉમરા પછી એહુરામ ખોલવું તેના માટે જાઈજ નથી બહકે કારિનની જેમ એહુરામમાં રહે અને લખાંકે કહ્યા કરે. ત્યાં સુધી કે દસમીની રમીની સાથે લખાંકે છોડ પછી કુરબાની પછી હલક અથવા તકસીર કરીને એહુરામથી બહાર થાય. પછી સુતમતોએ છબ્બે તો આઠમી જિલ્હાજલ સુધી એહુરામ વગર રહે પરંતુ અદ્દજલ એ છે કે જદ્દી હજાજનો એહુરામ ખાંધી લે જો એ ખ્યાલ ન હોય કે દિવસો

વધારે છે, એહુરામની પાખાંદીઓ નથી શકશે નહીં.

(૨૮) ચેતવણી : ‘તવાઇ કુદ્દમ’ માં ઈજટેણાએ તથા રમલ અને તેના પછી સંક્ષિપ્ત અનુભાવમાં સઈ જરૂરી નથી, પરંતુ હવે ન કરશે તો તવાઇ જિયારતમાં કે હજાજનો તવાઇ ફરજ છે. જેનો ઉદ્દેશ ઈન્શાઅદ્દલાહ આગળ આવે છે, આ સંઘળા કામ કરવા પડશે અને તે સમયે લીડ બહુ હોય છે, અજખ નથી કે તવાઇમાં રમલ અને સઈમાં હોડખું ન થઈ શકે. અને અત્યારે થઈ ગયું તો તે તવાઇમાં આ ચાંનોની હાજરત ન થશે માટે અમોએ તેમને સર્વથા તરકીખમાં ફાખલ કરી દીધું.

(૨૯) ઈકામતના દિવસોમાં શું કરે

સુરેરિદ તથા કારિન તો હજાના રમલ તથા સઈથી તવાઇ કુદ્દમમાં ઝારેગ થઈ ગયા પરંતુ સુતમતોએ એ જે તવાઇ તથા સઈ કર્યા તે ઉમરાના હતા. હજાજના રમલ તથા સઈ તેનાથી અહા ન થયા અને તેના ઉપર તવાઇ કુદ્દમ જ નથી કે કારિનની જેમ તેમાં આ કાચો કરીને સુક્તિ પામો લે માટે જે તે પણ પહેલાથી ઝારેગ થઈ જવા છંછે તો જન્યારે હજાજનો એહુરામ ખાંધી તેના પછી એક નિદલ તવાઇમાં રમલ તથા સઈ કરી લે હવે તેને પણ તવાઇ જિયારતમાં આ કાચોની હાજરત થશે નહીં.

(૩૦) હવે આ સંઘળા હાળુંઓ (કારિન, સુરેરિદ કોઈપણ હોય) મિના જવા

માટે મજ્જા મોઅઝમમાં આડમી તારીખનો ઇન્ટેગાર કરી રહ્યા છે. ઈકામતના દિવસોમાં જેટલા પ્રમાણુમાં થઈ શકે નર્યો તવાફ, ઈજાતેખાઅ તથા રમલ તથા સઈ વગર કરતા રહે કે, બહારવાળાઓ માટે આ સૌથી એહતર ઈબાદત છે. અને દરેક સાત ઝેરાઓ પર મજામે ઈથાહીમ (અલયહિસ્સલાતો તસ્લીમ) માં એ રક્ખાત નમાજ પડે.

(૩૧) અધિક સાવધાની એ છે કે એારતોને તવાફ માટે રાતના દસ-અગ્નીયાર વાગે જ્યારે લીડ એાછી થઈ હોય લઈ જાવ, એવું જ સદ્ગુરુના તથા મરવાની સઈ માટે કરો.

(૩૨) એારતો નમાજ પોતાના ઉત્તારમાં (જે ઘરમાં સુકામ કર્યો હોય તે) જ પણ, નમાજ માટે જે બને મસ્જિદ કરીમ (મસ્જિદ હુશમ અને મસ્જિદ નભવી)માં હાજર થાય છે, જહાલત છે કે, હેતુ સવાળનો છે અને ઝુદ હુશુરે અનવર સહલદલાહો અલયહે વસલબમે ઝરમાંયું કે, એારતોને મારી મર્ગિજદમાં નમાજ પદ્ધતા કરતાં અધિક સવાખ ઘરમાં પદ્ધતામાં છે. હા, એારતો મર્ગા-મોઅઝઝમામાં દરરોજ એક વખત રાતમાં તવાફ કરી લે અને મહીના તથેખાહમાં સવાર-સાંજ સલાતો સલામ માટે હાજર થતી રહે.

(૩૩) હવે અથવા મિનાથી પાછા કર્યો પણી જ્યારે પણુ રાત દિવસમાં જેટલી વખત કા'લા મોઅઝમા પર નજર પડે. લા ઈલાહા ઈલદલાહો વલદાહો અકુભર ગ્રણુ વખત કહે અને નબીએ ડરીમ સહલદલાહો અલયહે વસલબમ પર હુદ્દ મોકલે અને હુઅા કરે કે સ્વીકરણુનો સમય છે,

(૩૪) તવાફમાં આ વાતો હરામ છે.

તવાફ જે નક્કલ હોય તેમાં પણ આ વાતો હરામ છે. (૧) એવું તવાફ કરવો (૨) કોઈ અવયવ ને સતરમાં ગણ્યાય છે તેના ચોથા લાગનું ઝુલ્લું હેલું એવું કે સાથળ અથવા આગાહ એરતનો કાન અથવા કાંડું (૩) મજબુરી વગર સવારી પર અથવા ખલાઓ ઉપર તવાફ કરવો (૪) ઉઝર વગર એસીને સરકલું અથવા દુંટણો પર ચાલવું કા'લાને જમણી બાજુ પર રાખી ઉદ્દો તવાફ કરવું. (૬) તવાફમાં હુતીમની અંદર થઈને પસાર થવું (૭) સાત ચષ્ઠરોથી એાછા ઝરવા.

(૩૫) તવાફમાં આ ૧૫ વાતો માંડેંદ છે.

આ વાતો તવાફમાં માંડેંદ છે. (૧) ઝુલ્લા વાતો કરવું (૨) વેચવું (૩) ખરીદવું (૪) હુદ્દ તથા નઅત તથા મનકબત સિવાય કોઈ શેઅર પદ્ધતું (૫) જિંક અથવા હુઅા અથવા તિલાવત અથવા કોઈ કલામ ઝુલંદ અવાજથી કરવું (૬) નાપાક કપડામાં તવાફ કરવું (૭) રમલ અથવા (૮) ઈજાતેખાઅ અથવા (૯) સંગે અસ્વદનો એસો જયાં જયાં તેનો હુકમ છે તર્ફ કરવું (૧૦) તવાફના ચષ્ઠરોમાં અધિક અંતર કરવું અથીત કેટલાક ચષ્ઠર કરી લીધા પછી લાભા સમય સુધી થોલી ગયા અથવા બીજી કોઈ કામમાં લાગી ગયા. બાકીના ઝેરા પછીથી કર્યો પરંતુ હું જતું રહ્યું છે તો કરી આવે અથવા જમાઅત ઉભી થઈ ગઈ છે અને તેણે હણું નમાજ

પઢી નથી તો શરીક થઈ જય બદકે જનાની નમાંનમાં પણ તવાક્ર છોડીને મળી શકે છે. જ્યાંથી બાકી છોડ્યા હતા આવીને પૂરા કરી લે, એવી જ રીતે ચેશાબ-પાખાનાની જરૂરત હોય તો ચાહ્યો જય, વુંજુ કરીને બાકીના હેરા પૂરા કરે, (૧૧) એક તવાક્ર પછી જ્યાં સુધી તેની રકાતો ન પઢી લે બીજે તવાક્ર શુરૂ કરી હેઠું પરંતુ જ્યારે કે નમાની કરાહુતનો સમય હોય, હા. ત. સુધુ સાહિકથી સૂર્ય ઉંચો આવવા સુધી અથવા અસરની નમાજ પદ્ધા પછીથી સૂર્યાસ્ત સુધી કે તેમાં અનેક તવાક્ર અંતર વગર નમાજ જઈએ છે. કરાહુતનો સમય નીકળી જય તો દરેક તવાક્ર માટે એ રકાત અદ્દ કરે અને ને ભૂલથી એક તવાક્ર પછી નમાજ પદ્ધા વગર બીજે તવાક્ર શરૂ કરી દ્વિધો તો ને હજુ એક હેરા પૂરો ન કર્યો હોય તો છોડીને નમાજ પઢે અને હેરા પૂરો કર્યા લીધી છે તો આ તવાક્રને પૂરો કરીને નમાજ પઢે. (૧૨) ઈમામના ખુલ્લા સમયે તવાક્ર કરવું (૧૩) ઇરાજ જમાઅત વખતે કરવું, હા ને ચાતે પ્રથમ જમાઅતમાં નમાજ પઢી લીધી છે તો બાકી જમાઅતોના સમયે તવાક્ર કરવામાં વાંધો નથી. અને નમાશીઓની સામેથી પસાર પણ થઈ શકે છે કે, તવાક્ર પણ નમાનના અતુરૂપ છે. (૧૪) તવાક્રમાં કાંઈ ખાલું (૧૫) ચેશાબ-પાખાના અથવા પાદથુના તકાજામાં તવાક્ર કરવું મકરુહ છે.

(૧૬) આ વાતો તવાક્ર તથા સઈ બંનેમાં જાહેર છે

આ વાતો તવાક્ર તથા સઈ બંનેમાં

મુખાહ (ઉચિત) છે. (૧) સલામ કરવું (૨) જવાબ આપવો (૩) હાજત માટે વાત કરવું (૪) ઇતવો પુછવું (૫) ઇતવો આપવું (૬) પાણી પીવું (૭) હરદ તથા નઅત તથા મનકષ્ટતના અશાયાર ધ્રીમિથી પઠવું અને સઈમાં આણું પણ ખાઈ શકે છે.

(૧૭) સઈમાં આ વાતો મકરુહ છે

સઈમાં આ વાતો મકરુહ છે (૧) હાજત વગર તેના હેરાએમાં અધિક અંતર આપવું પરંતુ જમાઅત કાયમ થાય તો ચાહ્યો જય એવી જ રીતે જનાજામાં શિરકત અથવા વુંજુની પુનરાવતી માટે જવું ને કે સઈમાં વુંજુ જરૂરી નથી, (૩) અર્દા, (૪) વેચાણું, (૫) કુશુલ વાત, (૬) સંક્રા અથવા (૮) મરવા પર ન ચથવું, (૭) પુરૂષનું સઈમાં ઉજર વગર ન હોડવું, (૮) તવાક્ર પછી બહુ જ વિલાંબ કરીને સઈ કરવું, (૯) સ્તરે ઓરત ન હોલું, (૧૦) પરેશાન નજરી અથીત (ડાક્ષોળીઆ મારવું) આમરોમ નિર્થીક નેત્સું. સઈમાં પણ મકરુહ છે અને તવાક્રમાં અધિક મકરુહ છે.

(૧૮) તવાક્ર તથા સઈના મસાઈલમાં પુરુષ-સ્ત્રીના તર્ફાવત

તવાક્ર તથા સઈના સધળા મસાઈલમાં ઓરતો પણ શરીક છે. પરંતુ (૧) ઈજ્રતેબાઅ (૨) રમલ (૩) સઈમાં હોડવું આ ત્રણે વાતો ઓરતો માટે નથી. (૪) વિધી સાથે સંગે અસ્વાનો ઓસો અથવા (૫) ઝેણે યમાનીને સ્પર્શ કરવું અથવા (૬) ડાંબાથી નિષ્ઠ

થતું અથવા (૭) અમગમની અંદર નજર કરવું અથવા (૮) ચોતે પાણી ભરવાની કોશીશ કરવું. આ વાતો ને એવી રીતે થઈ શકે નામહરમથી શરીરનો સ્પર્શ ન થાય તો જૌર નહીં તો અલગ અલગ રહેવું તેમના માટે સૌથી બહેતર છે.

મિનાની રવાનગી અને અરક્ષાનો લુકુરે

અહ્લાહૃતાલા કરમાવે છે : સુરમા અદ્ધીદ્ધું મિનહુસો અદ્ધાહનાસો વસ્તત-ગૃહેદ્વાહ, ઈનનદ્વાહ ગૃહેદ્વર્હીમ.

તરજુમો : પછી તમે પણ ત્યાંથી પાછા હરો જયાથી ધીન લોકો પાછા આવ્યા (અથીત અરક્ષાતથી) અને અહ્લાહૃથી મગ-ક્રત માગો, જેશક અહ્લાહ બધનાર, રહેમ કરનાર છે).

હદીસ (૧) સહીહ યુખારી તથા સહીહ સુસ્તિલમમાં ઉમ્મુલ મોમિનીન હજરત સિદ્દીકા રહીયહ્લાહો તાલા અનહાથી રિવાયત છે કે કુરેશ અને જે લોકો તેમના તરીકા પર હતા સુઅદ્ધલક્ષમાં લુક્કુર કરતા અને સંઘળા અરણો, અરક્ષાતમાં લુક્કુર કરતા, જયારે ઈસ્લામનું આગમન થયું અહ્લાહ અજવ જલ્દે નણાંએ કરોમ સહ્લલલાહો અલયહે વસ્તલમને આશા આપી કે અરક્ષાતમાં જથ્ને લુક્કુર કરે, પછી ત્યાંથી પાછા આવે.

હદીસ (૨) સહીહ સુસ્તિલમ શરીરીઝમાં જાખિર બિન અહ્લુલ્લાહ રહીયહ્લાહો તાલા અનહોમાંથી હજજતુલ વિદાય શરીરની હદીસ મરવી છે, તેમાંજ છે કે યૌમુત્તરવીયહ (આઠમી

જિલહિજજહ)એ લોકો મિના માટે રવાના થયા અને હુજુરે અકદસ સહ્લલલાહો અલયહે વસ્તલમે મિનામાં જોહર, અસર, મગરિય, ઈશા તથા ઇજરની નમાજો પઠી, પછી થોડોક વિલંબ કર્યો ત્યાં સુધી કે સૂર્યોદિય થયો અને હુક્મ કરમાંયો કે, નમરહુ (અરક્ષાતમાં એક સ્થળ છે)માં એક કુણ્ણો સ્થાપિત કરવામાં આવે, તે પછી હુજુર અહીંયાથી રવાના થયા અને કુરેશનું એ ગુમાન (ધારણા) હતું કે સુઅદ્ધલેક્ષમાં લુક્કુર કરમાવશે જેવું કે જાહીલિયતમાં કુરેશ કયો કરતા હતા, પરંતુ રસુલુલ્લાહ સહ્લલાહો અલયહે વસ્તલમ સુઅદ્ધલેક્ષાથી આગળ ચાલ્યા ગયા, ત્યાં સુધી કે અરક્ષાતમાં પહોંચ્યા, અહીંયા નમરહુમાં કુણ્ણો (તંબુ) સ્થાપિત થઈ ગયો હતો, તેમાં બિરાજમાન થયા ત્યાં સુધી કે જયારે સૂર્ય ઢળી ગયો, સવારી તૈયાર કરવામાં આવી, પછી અતનવાદીમાં તશરીઝ લાવ્યા અને ખુરણો પદ્ધોએ. હજરત ફિલાલ : ૬૨૧૬૬૬ : તાલા અનહોએ અજાન તથા ઈકામત કઢી, હુજુરે જોહરની નમાજ પઠી, કરી ઈકામત થઈ અને અસરની નમાજ પઠી અને બંને નમાજો દરમિયાન કાંઈ પણયું નહીં. પછી સુઅદ્ધ (થોલવાનું સ્થળ)માં તશરીઝ લાવ્યા અને લુક્કુર કયું, ત્યાં સુધી કે સ્લેર હુખી ગયો.

હદીસ (૩) સહીહ સુસ્તિલમમાં જાખિર રહીયહ્લાહો તાલા અનહોથી રિવાયત છે કે રસુલુલ્લાહ સહ્લલલાહો અલયહે વસ્તલમે કરમાંયું કે મેં અહીંયા લુક્કુર કયું અને સમય અરક્ષાત લુક્કુર સ્થાન છે અને મેં આ

સ્થળે પુકુર કર્યું અને સમય મુજદેશા વુકુરની જગ્યા છે.

હદ્દીસ (૪) મુસ્લિમ, નસાઈ, ઈધનેમાણ તથા રજીન ઉત્તુલ મોમિનીન બીજી આઈશા સિદ્દીકી રહીયદાહા અન્હાથી રાવી કે, રસુલુલ્લાહ સલ્લાલ્લાહ અલયહે વસ્તુલમે ઇરમાન્યું-અરક્ષાથી અધિક કોઈ દિવસમાં અદ્વાહ તથાલા પોતાના બંદાઓને જહનમથી આજાડ (મુક્ત) નથી કરતો, પછી તેમની સાથે ઇરિશ્તાઓ પર ગવ્ય કરે છે.

હદ્દીસ (૫) તિરમિશીમાં હજરત અભ્રબિન શુઅયબ અને તે પોતાના બાપથી અને તે પોતાના બાપ (દાદા)થીની રિવાયતથી ભર્યી કેયરસુલુલ્લાહ સલ્લાલ્લાહ અલયહે વસ્તુલમે ઇરમાન્યું અરક્ષાની રાત્રીથી બંદેતર હુએ અને તે ને મેં અને મારાથી અગાઉના અંબિયાએ કરી આ છે : લાઈલાહા ઈલ્હિલ્લાહુ વહદાહુ લાશરીકલાહુ હુલ્લાલસુદુકુ વલુહુલ-હમુકુ વહુ વ અદા કુદ્દે શાઈથીન કહીર.

હદ્દીસ (૬) ઈમામ માલિક સુરસલન તવહાબિન ઉળૌહુલ્લાહથી રાવી કે રસુલુલ્લાહ સલ્લાલ્લાહ અલયહે વસ્તુલમે ઇરમાન્યું : અરક્ષા કરતાં અધિક કોઈ દિવસમાં શયતાનને અધિક નાનો, અલીલ, તુરણ અને કોધમાં ભરાએલો જેવામાં આવ્યો નથી અને તેનું કારણ એ છે કે તે દિવસમાં રેહમતતું ઉત્તરાણ અને અદ્વાહના બંદાઓના મોટા મોટા શુનાહ માર્દ કરવું શયતાન નિરખે છે.

હદ્દીસ (૭) ઈધનેમાણ તથા બયદુકી અણ્ણાસ જિન મિરદાસ રહીયદાહા તથાલા અન્હાથી રાવી કે, રસુલુલ્લાહ સલ્લાલ્લાહ

અલયહે વસ્તુલમે અરક્ષાની સાંજે પોતાની ઉમત માટે મગદીરતની હુએ માંગી અને તે હુએ મકખૂલ થઈ. અહલાહે ઇરમાન્યું-મેં તેમને બાળી દિધા સિવાય હુકુમાણ ધ્યાદાના કે મજલૂમ (પીડિત) માટે જાલિમથી પકડ કરીશ, હુઝુરે અર્જ કરી : હે ૨૪૦ ! નો તુ ધચ્છે તો મજલૂમને જન્મત અતા કરી હે અને જાલિમની મગદીરત ઇરમાવી હે. તે દિવસે આ હુએ મકખૂલ ન થઈ, ઇરી મુજદેશામાં સવારના સમયે હુઝુરે એ જ હુએનું પુનરાવર્તન કર્યું, તે સમયે આ હુએ મકખૂલ થઈ આ વાત પર રસુલુલ્લાહ સલ્લાલ્લાહ અલયહે વસ્તુલમે તખસુખ (સ્વિમિત) કર્યું. હજરત સિદ્દીકે અક્ષયર તથા કાર્ડે આજમ રહીયદાહા તથાલા અન્હામાએ અર્જ કરી અમારા માં બાપ હુઝુર પર કુરબાન થાય, અત્યારે તખસુખ કરવાનું કર્યુ કારણ છે ? આપે ધરશાદ ઇરમાયે કે, ખુડાના હુશમન ઈલ્હીસને જ્યારે એ અખર પડી કે અહલાહ અભજવ જહે મારી હુએ કુખૂલ કરી અને મારી ઉમતની બાળીશ ઇરમાવી તો તે પોતાના માથા પર ધૂળ ઉડાડવા લાગ્યો અને હાંડાકાર કરવા લાગ્યો, તેની (શેતાનની) આ ગલરાહટ જેધને મને હસલું આયું.

હદ્દીસ (૮) અખુયઅદા તથા બન્ધીર તથા ઈધને ખુજ્જે મા તથા ઈધને હણ્ણાન જાનીર રહીયદાહા તથાલા અન્હાથી રાવી કે, રસુલુલ્લાહ સલ્લાલ્લાહ અલયહે વસ્તુલમે ઇરમાન્યું—જિલહિજજહના દસ દિવસોથી કોઈ દિવસ અહલાહની નજીહીક અઝજવ નથી એક શખસે અર્જ કરી યા

રસુલુલ્લાહુ, તે અફુલ છે કે એટલા દિવસોમાં અલ્લાહની રાહમાં જેહાદ કરવું. આપે કુરમાંયું— અલ્લાહની રાહમાં આ સંખ્યામાં જેહાદ કરવા કરતાં પણ આ અફુલ છે અને અલ્લાહની નજીબ અરકુથી અધિક કોઈ દિવસ અફુલ નથી. અરકાના દિવસે અલ્લાહ તખારક વ તથાલા આસમાને હુનિયા પ્રત્યે ખાસ તજ્જ્ઞાની કુરમાવે છે અને ધરતી વાળાઓની સાથે આકાશવાળાઓ. પર ગવ્ર કરે છે, તેમને કુરમાવે છે મારા બંદાઓને જુવો કે વિભરાઓનાં વાળો, ધુળથી ખરંઘાલા મસ્તકે, તડકો વેઠતા હુર હુરથી મારી રૈહમતના ઉમ્મીદવાર હાજર થયા તો અરકુથી અધિક જહેનનમથી આજાદ થનાર કોઈ દિવસમાં જોવામાં ન આવ્યા. અને બયહુકીની રિવાયતમાં એ પણ છે કે, અલ્લાહ અગ્ર વજન કુરિશ્તાઓને કુરમાવે છે— હું તમને ગવાહ કરું છું કે મેં તેમને બધાથી દીધા. “કુરિશ્તા કહે છે તેમનામાં કુલાણ્યા-કુલાણ્યા હરામ કામ કરનાર છે. અલ્લાહ તથાલા કુરમાવે છે—મેં સૌને બધાથી દીધા.

હદ્દીસ (૬) ઇમામ અહુમદ તથા તિથાની અષ્ફુલ્લાહ બિન અષ્ભાસ રહીયલાહો તથાલા અન્હોમાથી રાવી કે એક શાખસે અરકાના દિવસે ઓરતો પ્રતિ દર્શિત કરી—રસુલુલ્લાહ સલ્લાલ્લાહો અલ્યાહે વસ્તુલ્લાહે કુરમાયું—આજે તે દિવસ છે કે જે શાખસ કાન આંખ અને જુલને કાયુમાં રાખે તેની ભગ્નેરત થઈ જશે.

હદ્દીસ (૧૦) બયહુકી જાનિર બિન અષ્ફુલ્લાહ રહીયલાહો અન્હોમાથી રાવી કે,

રસુલુલ્લાહ સહીલ્લાહો અલ્યાહે વસ્તુલ્લાહે કુરમાયું—ને મુસ્લિમાન અરકાના દિવસે પાછલા પહેરે (વુકુર સ્થળે) વુકુર કરે પછી સો વખત કહે—લાઈલાહો ઇલ્લાહુલ્લાહો વહૃદાહુ લાશાઈકલાહુ લહુલસુદુંકુ વહૃદાહુ હમું ચુહથી વયુમીતુ વહુથ અલા કુલ્લે શૈધિન કદ્દીર અને ૧૦૦ વખત કુલ્લાહો વહૃદાહો આહદ....પછે પછી ૧૦૦ વખત દર્દ પછે અલ્લાહુમ્મા સહ્લેઅલા સુહુમ્મહિન કમા સહ્લીયતા અલા ઈથાહીમા વઅલા આલે ઈથાહીમા ઈન્નકા હમીદુમ મળુદ્દન વ અલ્યના માઝુમ. અલ્લાહ અનજીવ જહેલ કુરમાવે છે. અય મારા કુરિશ્તાઓ મારા તે બંદાને શું સવાળ આપવામાં આવે જેણે મારી તસ્ખીલ તથા તહીલીલ કરી અને તકબીર તથા તઅબીમ કરી, મને ઓળખયો. અને મારી સના કરી અને મારા નયી પર હુરદ મોાફલ્યું. અય મારા કુરિશ્તાઓ ગવાહ રહ્ણો કે, મેં તેને બધાથી દીધ્યો અને તેની શક્તાત ખુફ તેના હુકમા કખુલ કરી અને જો મારો આ બંદા મારાથી સવાલ કરે, તો તેની શક્તાત ને અહીંયા છે સૌના હુકમાં કખુલ કરું.

હદ્દીસ (૧૧) બયહુકી અય સુલેમાન દારાનીથી રાવી કે અમીરુલ મોનિનીન મૌતા અની કુરમાલ્લાહ વજહાથી વુકુર સંબંધે સવાલ થયો. કે, તે આ પહોંચમાં કેમ સુકર્રે થયો, હરમનાં કેમ ન થયો. કુરમાયું કે ડા'બા બયતુલ્લાહ છે અને હરમ તેનો દરવાનો, તો જ્યારે લોકો તેની જિયારતના વિચારથી આવ્યા, હરવાળ પર જ્લા રાખ્યામાં

આંથો કે તબર્દીખ (આર્કંદ) કાડલુદિ કરે, અર્જ કરી યાચમીડલ મોભિનીન તો પછી સુઅદલક્ષણા વુદ્ધુદેનું શું કારણ છે. આપે ક્રમાંયું, કે જ્યારે તેમને આવવાની પરવાનગી મળી તો હવે તે બીજુ હેવઠી પર રેઝવામાં આંથો. પછી જ્યારે તબર્દીખ (કાડલુદિ) અધિક થયું તો હુકમ થયો કે મિનામાં કુરબાની કરે, પછી જ્યારે જ્યારે ચોતાનો મેલ્લ-કચરો ઉતારી લિધો અને કુરબાનીએ કરી દીધી અને શુનાહોથી પાક થઈ ગયા તો હવે તહારત સહિત જિયારતની તેમને પરવાનગી મળી, અર્જ કરવામાં આંયું: યા અમીડલ મોભિનીન તશરીકના હિવસોમાં રેઝા કેમ હરામ છે! આપે ક્રમાંયું કે તે લોકો અદ્દાહના જીવાર (દર્શનાથીએ) તથા મહેમાન છે, અને મહેમાનને મેળબાનની રજા વગર રેઝો રાખવું જરૂર નથી. અર્જ કરવામાં આવી યા અમીડલ મોભિનીન કાંખાના ગિદ્ધાઙ્કથી લિપટું શા માટે છે! આપે ક્રમાંયું: તેનું દણાત એ છે કે કોઇએ ભીજનો શુનોહ કર્યો છે, તે તેના કપડાંથી લિપટે છે અને આંકિઝી કરે છે કે તેને માદી કરી હે, જ્યારે વુદ્ધુદના સવાખથી જણુકાર થયા તો હવે શુનાહોથી પાકસાદ થવાનો સમય નિકટ આવ્યો, તેના માટે તૈયાર થઈ જવ. અને હિદાયતો પર અમલ કરો.

(૧) સાતમી તારીખે મસ્કિદે હરામમાં ઓહર પછી હુમામ ખુતખો પદ્ધો તેને સાંસળો, આ ખુતમામાં મિના જવા અને અરક્ષાતમાં નમાજ અને વુદુર અને ત્યાંથી પાછા ક્રવાના મસાઈલ બયાન કરવામાં આવશે.

(૨) યૌસે તરવીહામાં કે તે આડમી તારીખ (ચાંદ)નું નામ છે, જેણે એહરામ ન બાંધ્યો હોય તે બાંધી લે, અને એક નિકલ તવાઇમાં રમલ તથા સર્જ કરી લે જેણું કે ઉપર આવી ગયું છે, અને એહરામ સંબંધી ને આદાખ આગળ બયાન કરવામાં આંથો છે. દા. ત. શુસ્ત કરવું, ખૂશખૂ લગાવવું તે અદીંચા પણ દિનગત રાખે અને નહાધ્યાધ્યાને મસ્કિદે હરામ શરીરમાં આવે અને તવાઇ કરે, તે પછી તવાઇની નમાજ નિયમાતુસાર અદા કરે, પછી એ રકમત સુનત એહરામની નિયતથી પઢે, તે પછી હજજની નિયત કરે અને લખણીક કહે.

(૩) જ્યારે સૂરજ નિકળી આવે મિના જવા માટે ચાલો, જે સૂર્ય નિકળવાથી પહેલાં જ ચાલી નિકળ્યો તો પણ જરૂર છે પરંતુ પછીથી નિકળવું એહતર છે, અને જવાલ પછી પણ જરૂર શકે છે. પરંતુ ઓહરની નમાજ મિનામાં પઢે અને થઈ શકે તો પગપાળા જવ કે જ્યાં સુધી મછ્જો મોઅજમા પાછા આવશો દરેક કદમ પર સાત કરોડ નેકીએ લખવામાં આવશે. આ નેકીએ ૭૮ ખરખ, ચાલીસ અરબ, આવે છે અને અદ્દાહનો ક્રબ્લ હુદુર સદ્વલદાહો અલયહે વસદ્વલમના સદ્કામાં આ ઉમ્મત પર બેશુમાર છે.

(૪) માર્ગભર લખણીક તથા હુદ્દા તથા સનાની અધિકતા કરો.

(૫) જ્યારે મિના હેખાય આ હુદ્દા પઢો અદ્દાહુદ્દમ હાજેહિ મિના ફૂલનું અહૌયા ઐમા મનન્તા અદા અવલિયાસેકા,

(તરજુમો : ઈલાડી આ મિના છે, મારા પર તુ એ એહસાન કર જે ચોતાના ઔલિયા પર તે હ્યો.)

(૬) અહીંયા રતે થાલો, આજે જોહરથી નવમીની સવાર સુધી પાંચ નમાજો અહીંયા મસ્જિદે જોઈમાં પઢો. આજકાલ કેટલાક મુતુંવીક્ષા (માયદીમો)એ (તવાદ કરાવના-રાઓ)એ એ કાદ્યું છે કે આડનીએ મિનામાં થાલતા નથી. સીધા અરકણ પહોંચે છે. તેમની વાત ન માનો અને આ મહાન સુન્નતને હરગિજ ન છોડો, કાદ્યલાના આથ-હૃથી તેમને પણ મજબૂર થવું પહોંચો.

(૭) અરકણની રતે મિનામાં જિક્ક તથા ઈખાહત સાથે જગ્નિને સવાર કરો, સુઈ રહેવા માટે બહુ દિવસ પડ્યા છે. ધીજુ ન થાય તો ઓછામાં ઓછુ ઈશા તથા સવારની નમાજ (સુન્ની ઈમામ હોય તો) જમાયતે ઉક્કાથી પઢો કે શખેદારીનો સવાલ ભગશો અને ખાવું સુઈ રહો કે ઇહ અર્શ સુધી ખુલંદ થશો. હજરત અધુલાહ જીન મસ્જિદ રહીયલાહો અનહોથી અથહકી તથા તિથાની વિગેરએ રિવાયત કરી કે રસુલુલાહ સહલ-લાહો અલયહે વસ્તુલમે ઝરમાંયું કે, જે શખ્સ અરકણની રાતમાં આ હુઅઓ. હજર વખત પડે તો જે ઝાઈ અસ્કાહતાલાથી માંગશો, પામશો, જયારે કે ગુનાહ અથવા સંખધીઓથી સંખધ તોઠવાનો સવાલન કરે.

સુખણાનન્દાજી ઈસ્સમાચે અરોહુ સુખણાનન્દાજી ઈલાયદો હોકુમતહુ કુસુખણાનન્દાજી ઈલાયસરે સથીલોહુ સુખણાનન્દાજી ઈનારે સુલતાનોહુ સુખણ-

નન્દાજી ઈલાયનતે રહમતોહુ સુખણાનન્દાજી ઈલાયરે કદાચોહુ સુખણાનન્દાજી ઈલાયાએ રહોહુ સુખણાનન્દાજી રહીયસ્સમાચું સુખણાનન્દાજી વહાયદાર્દી સુખણાનન્દા-જી લા મહજઆ વલા મનજઆ મિન્ડો ઈન્દ્રી ઈન્દ્રીને.

(તરજુમો : પાક છે તે જેતું અર્શ ખુલંદીમાં છે, પાક છે તે જેની હુકુમત જમીનમાં છે. પાક છે તે દરિયામાં તેને રસ્તો છે. પાક છે તે કે આગમાં તેની સહતનત છે. પાક છે તે કે જન્નતમાં તેની રહેમત છે. પાક છે તે કે ઇથીમાં તેનો હુકમ છે. પાક છે તે કે હવામાં જે રહો છે તેની મિલ્ક છે. પાક છે તે જેણે આકાશને ખુલંદક્યું. પાક છે તે જેણે ધરતીને પસ્ત કરી, પાક છે તે કે તેના અઝાબથી પનાહ તથા નજાતની કોઈ જગ્યા નથી પરંતુ તેની તરફ).

(૮) સવારે સુસ્તાહબ સમયે નમાજ પડીને લઘૌક તથા જિક્ક તથા હરેદ શરીરીમાં મશગૂલ રહે ત્યાં સુધી કે સ્થૂર્ય સથીર પવીત પર કે મસ્જિદે જોઈશરીરીની સામે છે. યમકે, હવે અરકણ તરફ ચાલો. દિલને જ્યાદો વિગેરથી પાક કરવાની કોશીશ કરો કે આજે તે દિવસ છે કે કેટલાકોને હજર સ્વીકારશે અને કેટલાકોને તેમના સદકામાં બખશી દેશો. મહેરમ તે જે આજે મહેરમ રહ્યો. વસવસા આવે તો તેમનાથી લડાઈ ન બાંધો કે આમે હશમનનો મતલબ પ્રાપ્ત છે. તે તો એ જ ધરછે છે કે તમે ધીન જ્યાદોમાં પરોવાઈ જવ, લડાઈ બાંધી તો પણ ધીન જ્યાદામાં પડ્યા અલ્કો વસવસાઓ પ્રત્યે ધ્યાન જ કરો.

નહીં, એમ સમજુ લે કે કોઈ બીજું અસ્તિત્વ છે કે તેને ખ્યાલો કરી રહ્યું છે, અને મારા રજ્યથી જામ છે, આવી રીતે ધનશાઅલાહ તે મરદ્દ નિષ્ઠા પાછો જશો.

મરદ્દા (૩) ને અરક્ષાની રાત મજ્જામાં પસાર કરી હીથી અને નવમી તારીખે ફૂજરની નમાઝ મળીને મિના થઇને અરક્ષાતમાં પહેલાંચ્યો તો હજા થઈ જશે. પરંતુ બુર કચ્છું કે સુન્નતનો ત્યાગ કર્યો, એવી જ રીતે જે રાતે મિનામાં રહ્યો પરંતુ સુધ્ધ સાંદ્રિક થવાથી પહેલા અથવા ફૂજરની નમાજથી પહેલા અથવા સૂર્યોદયથી પહેલા અરક્ષાતમાં ચાલ્યો ગયો તો બુર કચ્છું અને જે આઠમી તારીખે જુગાનો હિલસ છે તો પણ જવાલથી પહેલા મિના જઈ શકે છે, કે તેના પર જુગાના ફૂજજ નથી અને જુગાનો વિચાર હોય તો મિનામાં પણ જુગાના થઈ શકે છે, જ્યારે કે મજ્જાનો અમૌર ત્યાં હોય અથવા તેના હુકમથી જુગાના કાયમ કરવામાં આવે.

(૪) માર્ગિલર જિડે તથા હુકમાં વ્યસ્ત રહો જરૂરત વગર કાંઈ વાત કરો નહીં, લાઘ્યોડતું અસંખ્ય વાર રટણ કરતા રહો અને મિનાથી નિકળીને આ હુણા પઢો.

“અણ્ણાહુચ્ચમ ઈંડોકા તવજજહતો વ અદીકા તવજીદતો વલે વજહેફુકદીમ અરહતો ફૂજાલ જમણી મગજુર વખજળ મખૂર વખરહની વલા તખૈયિણી વ ખારિક લી ઝી સફુરી વકૃહે એ અરક્ષાતાન હાજતી ઈન્નકા અદા કુદ્દે શૈંન કદ્મીરઅણ્ણાહુચ્ચમજાઅણ્ણા અકુરય ગાંધુ-તિન ગાંદીતોઢા મિર્દ્દ્વાનેકા વ ઝદીદ્દા

મિન સાખતોકા અણ્ણાહુચ્ચમ ઈલયકા ગાંદીતો અદીકા અસ્તમદતો વ વજહકા અરહતો ફૂજાણી મિમન તોણાહી એહિલયોઆ મન હોવા જૈદન મિનની વ અફુદ્દો અણ્ણાહુચ્ચમ ઈન્ની અસચાલોકદાસુન્ન વદ્દાએયતા વદ્દસુચાણીતદાએમતા ઝીદુન્યા વદ્દાએરતે વ સદ્ગાંધા ત્યાલા અદા જૌરા ખદેહિ સુહમા-હિંવચાલેહિ વ સહખેહિ અજમદિન”.

(તરજુમો : અય અલલાહ હું તારા જાત્યે ધ્યાનિત થયો અને તારા પર મેં જારોસ્થો કર્યો અને તારી કૃપાળુ જતનો ધરાહો કર્યો, મારા ગુનાહ બખ્યા હે અને મારી હજાને મગજર કર અને મારા પર રહેમ કર અને મને તોટામાં ન નાખ અને મારા મારી મારી અફ્રમાં બરકત આપ. અને અરક્ષાતમાં મારી હાજરત પુરી કર. બેશક તુ ફરેક વરતુ પર કાદિર છે. અય અલલાહ ! મારું ચાલખું પોતાની પ્રસન્નતાથી નિકટ કર અને પોતાની નારાણુથી ફૂર કર. ઈલાહી હું તારી તરફ ચાલ્યો અને તારા પર જ વિશ્વાસ કર્યો અને તારી જાતનો ધરાહો કર્યો તો મને તેઓ પૈકી કર જેમની સાથે કિયામતના રહિવસે પુરાણે કરસે, જે મારાથી બહેતર તથા અદ્ભુત છે. ઈલાહી હું તારાથી ક્ષમા તમા આદ્ધ્યાત્મનો સવાલ કર્યે છે. અને તે આદ્ધ્યાત્મનો જે હનિયા તથા આભિરતમાં હુમેશા રહેવાવાળી છે અને અલલાહ હુરેદ મોકદે બહેતરીન મખલૂક માહમદ સદ્ગાંધાને અલયહે વસ્તુમ અને તેમની આત તથા અસહાય સૌ પર.

(૧૦) જ્યારે જષદે રહેમત પર દૃષ્ટિ પડે તે જાયોમાં વધુ અધિક પ્રયત્ન કરો કે

ઈન્શાઅલાહતચાલા કષુલીયતનો સમય છે.

(૧૧) અરક્ષાતમાંતે પહોડની પાસે અથવા લયાં જગ્યા મળે જન માર્ગ છોડીને ઉત્તરો.

(૧૨) આજની ભીડમાં કે લાખો લોડો ફળારો તંધૂઓ હોય છે ચોતાના તંધુથી જઈને પાછા ફરતાં તેનું મળવું સુશ્કેલ હોય છે એટલા માટે એણાખતું નિશાન તેના ૫૨ સ્થાપિત કરીદો કે ફરથી દેખાય.

(૧૩) ઔરતો સાથે હોય તો તેમના ખુરાઓ ઉપર પણ ડોર્ઝ આસ ચિનહેવાણું ચમક્તા રંગનું ક્રેપડું લગાવી હો કે ફરથી જોઈને એણાખી શકો અને દિલ ચિંતિત ન થાય.

(૧૪) બપોર સુધી અધિક સમય અદ્ધાહુની ફુલુર રૂધન અને શુદ્ધ નિયયતથી શક્તિ અનુસાર સદકા તથા ઔરાત તથા જિક્ક તથા લણ્ણોક તથા હૃદ તથા હુઅ તથા ઈસ્તિતગફાર તથા કદમ્બે તૌહીદમાં મશશુલ રહે. હફીસમાં આંદ્રું છે. નખીએ ડેરીમ સદ્ધીલાહો અલયહે વસ્તુના રૂપમાં છે “સૌથી બહેતર તે વસ્તુ જે આજના દિવસે મેં અને મારાથી પહેલાના અંબિયાએએ કહી છે તે આ છે. લાઈલાહો ઈલ્જિલાહો. વહદુલ લા શરીરલાહુ લલુલ સુદુલ વલલુલ હસુલ યુહરી વચુમીતુ વહુલ હૈચુલ લા યમુનુ, એયદિહિલાખયર, વહુવા અલા કુલે શૈધન કુહીર.

અને ઈન્ધિ તો તેની સાથે આ પણ પણો:

લા નચાદોહો ઈલ્જા ઈચ્ચાહો વલા નચરેકો. રખાન સિવાહો અદ્ધાહુનું જયલ કી કદથી તુરન વ કી સમદી તુરન વ કી બસદી તુરન. અદ્ધાહુનું મશરર

કી સહરી વ યસ્તિસર લી અમૃતી વ અભિજોબેકા મિન વસાવેસીસદરે વ કેશીયતિદાચરે વ અભાબિદુષ્યે અદ્ધાહુનું ઇન્ની અભિજો બેકા મિન શરે માયલેને ક્રીડેલે શરે માયલેને ક્રીનાડારે વ શરે મા તહખ્યો બેહિર્ણીંદો વ શરે બવાઈકીદારે અદ્ધાહુનું હાંજા મકામદસુ રતજીલાચાધિઅ મિનનારે અળુની મિનનારે વ બેચાફુલેકા વ અહિઅદનીદળનતા એ રહમતેકા યા અહિરહેભીન. અદ્ધાહુનું ઈજ હદ્યતયત ઈસ્તલામ ફ્લા તન્જેચાહુ અન્ની હતા તકણિદની વ અના અહોકે

(તરજુમો : તેના સિવાય અમે કોઈની ઈબાદત કરતા નથી અને તેના સિવાય કોઈને રહણ સમજતા નથી. અય અલલાહ તુ મારા દિલમાં નૂર કર અને મારા ડાન અને દાયિમાં નૂર કર, અય અલલાહ મારા સીના (છાતી)ને જોલી હે અને મારા ડામને આસાન કર અને તારી પનાહ માંશુ છું સીનાના વસવસાએ. અને ડામની વિચિનતા અને કથના અબાધથી, અય અલલાહ હું મારી પનાહ માંશુ છું તેના શર (ઉપદ્રવ)થી જે રાતમાં દાખલ થાય છે અને દિવસમાં પણ દાખલ થાય છે અને તેના શરથી જેની સાથે હવા ચાલે છે અને જમાનાની ચાક્રતના શરથી અય અલલાહ આ અમનના તાલિય અને જહુનનમથી પનાહ માંગનારાના ઉલા રહેવાની જગ્યા છે, ચોતાની ક્ષમા સાથે મને જહુનનમથી અચાવ અને ચોતાની રહેમતથી જહુનતમાં દાખલ કર, અય સૌ મહેરખાનોથી અધિક મહેરખાન, અય અલલાહ ! જયારે તે મને ઈસ્તલામ પ્રત્યે

હિંદાયત કરી તો તેને મારાથી અલગ ન કરજો, ત્યાં સુધી કે મને એ જ ઈસ્લામ પર વદ્દાત આપજો).

(૧૫) બખોરથી પહેલાં ખાવા પીવા વિગે રેથી ઝારેગ થઈ સો કે હિંદ કોઈ તરફ લાગેલું ન રહે. આજના દિવસે જેવી રીતે હાળચે રોજો રાખવું હુચિત નથી કે હુચામાં અશીકું થશે તેવી જ રીતે ચેટ ભરીને ખાવું સખત વિષ અને ગક્કલત તથા સુસ્તીના કરણું છે, ત્રણું રોટીની ભૂખવાનો એક જ રોટી ખાય, નણી સહલદવાહો અલયહે વસ્ત્વમે તો હમેશા માટે એ જ હુકમ આપ્યો છે અને ખૂદ હુનિયાથી તશરીફ લઈ ગયા અને જવની રોટી કથારેચ ચેટ ભરીને ન ખાધી, જે કે અણીઠના હુકમથી સમસ્ત જગત અગત્યારમાં હતું અને છે. અન્વાર તથા બરકત લેવા ઈચ્છે તો ન કેવળ આજે બદકે હરગૈન શરીરક્ષયનમાં જ્યાં સુધી હાજર રહો ગીજ લાગના ચેટથી અધિક હરગિજ ન ખાવ, માનશો તો તેનો ઝાયદો અને ન માનશો તો તેનું તુકશાન આંણો વડે લેધ લેશો, એક અઠવાડિયું તેનો અમલ કરી તો જુઓ, આગણની હાલતથી તદ્વાત ન પામો તો કહેનો, ખાવા પીવાના ખરું દિવસો છે. અહીંયા તો નૂર તથા એક માટે જ્યાં ખાલી શાખો, લારેલું વાસણું કરીથી શું લરાસે.

(૧૬) જ્યારે બખોર નિકટ આવે નહાવકે સુન્નતે મોઅહદા છે અને ન થઈ શકે તો કેવળ વુલુ કરી લો.

અરક્ષાતમાં જોહર તથા અસરની નમાજ

(૧૭) બખોર લેતાં જ બદકે તેના

પહેલાં કે ઈમામની નિકટ જગ્યા મળે મસ્જિદે તુમરહ જલ, સુન્નતો પઢીને ખુત્બો સાંસણીને ઈમાનની સાથે જોહર પડો, તે પછી વિવંખ કર્યા વગર અસરની તકખીર થશે તુરત જ જમાયતથી અસર પડો, બચમાં સલામ ડ્લામતો શું સુન્નતો પણું ન પડો અને અસર પછી નિકલ નથી, આ જોહર તથા અસર મેળળીને પદવું જ્યારે જ જાહેર છે કે નમાજ સુલ્તાન પઢવે અથવા તે જે હજામાં તેનો નાયથ થઈને આવે છે, જેણે જોહર એકલા અથવા પોતાની ખાસ જમાયતથી પઢી તેણે સમયથી પહેલાં અસર પદવું જાહેર નથી અને જે હિક્મત માટે શરીરાતે અહીંયા જોહરની સાથે અસર મેળવવાનો હુકમ આપ્યો છે અર્થાત સ્રયાસ્ત સુધી હુા માટે સમય ખાલી મળાવો તે જતો રહેશે.

મસ્યાદા (૧) (જોહર-અસર) મેળવી બંને નમાજો જેમ અહીં એક સમયમાં પઠવાનો હુકમ છે તેમાં પૂરી જમાયત મળવું શરત નથી બદકે હા. ત. જોહરના અંતમાં શરીરક થયો અને સલામ પછી જ્યારે પોતાની નમાજ પૂરી કરવા લાગ્યો તો એટલામાં ઈમામ અસરની નમાજ અતમ કરવાની નિકટ થયો, આ સલામ પછી અસરની જમાયતમાં શામેલ થયો તો પણ થઈ ગાધ.

(રહેલું સુહતાર)

મસ્યાદા (૨) આ નમાજો (જોહર અસર) મેળવીને પઠવામાં એ પણ શરત છે કે બંને નમાજોમાં એહરામથી હોય, જે જોહરની નમાજ પઠવા પછી એહરામ આપાયો તો અસર મેળવીને પઢી શકતો નથી, તથા ઉપરાત એ શરત છે કે તે એહરામ હજામનો,

છોય, જો ઓહરમાં ઉમરાનો અને અસરમાં હજુનો તો પણ મેળવી શકતો નથી.

(હર્દે સુખતાર, આલમગિરી)

(૧૮) વિચાર કરો કે જ્યારે શરિએતે આ સમય હુઅા માટે કારેગ કરવાનો આઠલા પ્રમાણમાં પ્રભંધ છે કે અસરને ઓહર સાથે મેળવીને પઢવાનો હુકમ આપ્યો તો તે સમયે બીજા ડામોમાં મથગૂલ થું કેટલું બહું છે. કેટલાક ઈમાનોને જેવામાં આવ્યા છે કે, ઈમામ તો નમાઝમાં છે. અથવા નમાજ પડીને સુઝિક્રિમાં ગયો અને તે ખાવા પીવા, હુઝા, ચા ઉકાડવામાં છે, ખખરદાર એવું ન કરો, ઈમામ સાથે નમાજ પઢતાં જ તુરત જ મૌક્કિક (અર્થાત અરક્ષાતમાં થોકવવાતું સ્થળ કે નમાજ પણીથી સૂરજ હુબવા સુધી ત્યાં રહીને જિંક તથા હુઅાનો હુકમ છે તે જગ્યાએ) રવાના થઈ જવ અને શક્ય હોય તો ઉંટ પર જવ કે સુન્નત પણ છે અને લીડમાં હખવા-કચડાવાથી રક્ષણું પણ છે.

અરક્ષણો વડું

(૧૯) કેટલાક તવાક કરનારાએ આ સમુહમાં જવાની મના કરે છે અને જલભાતની વાતોથી હરાવે છે, તેમનું સાંસળો નહીં, કે તે ખાસ રહમતે આમના તુંઝુલની જગ્યા છે, હા એારતો અને કમનેર પુરુષ અહીંયાથી જ ડલા રહીને હુઅામાં શામેલ થાય કે અતને અરના (અતને અરના અરક્ષાતમાં હરમના નાગાએ પૈકી એક નાળું છે. મસ્જિદે નમરાની પદ્ધિમ દિશાએ અથોત કા'ખા મોઅજમા પ્રતિ ત્યાં વુંઝક નાજાઈજ છે.) સિવાય આ સધળું

મેદાન મૌક્કે છે અને આ લોકો પણ એ જ કદ્યે કે અમે તે સમૂહમાં હાજર છીએ, ચાતાંની હોઠ ઈંટની જગ્યાને અલગ ન સમજે તે સમુહમાં નિઃશાંક અધિકતમ ઔદ્ઘિયા બદ્કે હજરત ઈદ્વિયાસ્ત તથા ખિજર અલયહિસ્સલામ એ નથી પણ હાજર છે. તે કદ્વપના કરો કે અનવાર તથા બરકાત ને તે સમૂહમાં તેમના પર ઉતરી રહ્યા છે તેમનો સદ્કો અમે લીખારીએને પણ પહોંચે છે, આવી રીતે અલગ રહીને પણ શામિલ રહેશો અને જેનાથી થઈ શકે તો ત્યાંની હાજરી છોઠવા જેવી વસ્તુ નથી.

(૨૦) અરક્ષલ એ છે કે ઈમામથી નિકટ જખલે રહેમતની નિકટ જ્યાં ડાળા પદ્થરતું દ્રશ્ય છે, કિંલાડખ ઈમામની પાછળ ઉલો રહે જ્યારે કે આ કુઝાઈલની પ્રાસિમાં સુરક્ષાલી અથવા કોઈને તકલીફ ન થાય નહીં તો જ્યાં અને જેવી રીતે થઈ શકે વુંઝક કરે. ઈમામની જમણી ખાજુ અને ડાળી ખાજુ રૂખરૂ કરતાં અરક્ષલ છે. આ વુંઝક જ હજુનો આત્મા (હજુની જાન) અને તેનું મેદું ઝડન છે. વડું માટે ઉલા રહેવું અરક્ષલ છે શર્તો કે વાનિખ નથી. એમી રહ્યો તો પણ વુંઝક થધ ગયું. વુંઝકમાં નિયત અને કિંલાડખ હોતું અરક્ષલ છે. વુંઝકમાં આ ડાયો સુન્નત છે. (૧) શુસ્લ, (૨) બંને ખુલ્બાએની હાજરી. (૩) બંને નમાજોને મેળવીને થબું, (૪) રૈઅા વગર હોવું, (૫) ખાવુંઝ હોવું, (૬) નમાજો પછી તુરત જ વુંઝક કરસું.

(૨૧) કેટલાક બહિલ એવું હજરે છે કે પહાડ પર ચઢી જાય છે અને ત્યાં ઉકાસ્ફીને

કુલોદ્વારા હુલાવતા રહે છે. તેનાથી બચો અને તેમની પ્રત્યે પણ ખરાબ જાહેર ન કરો, આ સમય પીજાઓના એમ જોવાનો નથી. પોતાના એમો પર લગ્ન રૂફન-આફંદ અને કાંકલુદિ કરવાનો સમય છે.

વકુરીના આદાય

(૨૨) હવે જેચો કે અહીંચા છે, અને તેચો કે તંબુઓમાં છે જૌ સ્વાંગ સાચા દિવાથી પોતાના કુપાળું મુહેરખાત રળબ પ્રત્યે ધ્યાનિત થઈ જાય અને કિયામતના મેદાનમાં આ'માલ (કૃત્યો)ના હિસાબ માટે તેની સસ્કષ હાજરીની કલ્પના કરો, અહું જ ખુશુઅ તથા ખુમૂઅ (અકાયતા) સાથે ધૂજતા-કાંપતા, ડરતા, આશાવાહી થઈ આંખો બંધ કરેલ, શર્દીન ઝુંફાવેલ, હુઅના હાથ આડાશ પ્રત્યે માથાથી ઉંચા ફેલાવે, તફખીર તથા તહલીલ તથા તરણીહ તથા લખ્ણીહ તથા હરદો જિંક તથા હુઅ તથા તૈખા તથા ધર્સિતગઝારમાં કુણી જાય, પ્રયત્ન કરે કે એક દીપું આંસુઓનું ટપકે કે ધીનભાત (સ્વીકરણું) તથા સાચાદત (સદ્ગાંધ)ની દલીલ છે, નહીં તો રડવા જેવું ચોકું બનાવો કે સારાઓની સુરત પણ સારી. હુઅ તથા જિંક દરમિયાન લખ્ણીકની વારંવાર તકરાર (રદણું) કરો. આજના દિવસે હુઅઓ અહું જ મનકૂલ (નક્કલ થચેલી) છે અને હુઅઓ જામેઅ (કે ને આગળ આવી ગઈ છે) કાઢી છે, કેટલીક વખત તેને કહી લો અને જૌથી બહેતર એ કે સધળો સમય હુરદ, જિંક તથા કુર્ચાનની તિલાવતમાં શુઅરી દો કે, હંદીસ શરીરીના વાયદા પ્રમાણે હુઅવાળાઓ કરતાં અધ્યિક મેળવશો. નથીઓ કરીએ

સાંજદ્વાહો અલયહે વસણીમનું હામદ્ર (પાલવ) પકડો, ગૌસે આઝમ રહીયદ્વાહો અનહોથી વસિદો પકડો. પોતાના ચુનાહ અને તેની કંહડારી ચાદ કરીને જેતના વૃક્ષની જેમ ધુનો અને યકીન જણો કે તેની સારથી તેની જ પાસે પનાહ છે. તેનાથી નાસીને ક્યાંય જઈ શકતા નથી, તેના દરના નિવ્યાય ક્યાંય કેકાણું નથી, માટે તે શરીરો (શરીરાત કરનારાઓ)નું હામન પકડેલ તેના અગાધથી તેની જ પનાહ માંગો અને એ જ હાલતમાં રહો કે ક્યારેક તેના ગજબની યાદથી જીવ કાંપતો જાય છે અને ક્યારેક તેની આમ રહેમતની આશાથી સુરજાઓલું દિવ નિહાલ થઈજ્ઞાય છે. એવી જ રીતે રૂફન-આફંદમાં રહો ત્યાં સુધી કે સૂરજ કુણી જાય અને રાતનું. એક સોહામણું અંશ આવી જાય, તેનાથી પહેલા કુચ કરવું મના છે. કેટલાક ઉતાવળીઓ દિવસમાં ચાલી નિકળે છે, તેમનો સંગ્રામ કરો જાહી. સૂર્યાસ્ત સુધી થોલવાની જરૂરત ન હોત તો અસરને જોહરથી સેળવીને કેમ પદવાનો હુકમ થતો. અને શું ખરાદ કે રહેમતે ઈલાહી ક્યા સમયે તવજોહ (ધ્યાન) કરમાવે, જો તમારા નિકળી ગયા પછી રહેમત હતરી તો મન્માજ અન્નાહ કેવું નુકસાન છે અને જે સૂર્યાસ્તથી પહેલા અરકૃતાની હુદોમાંથી નિકળી ગયા તો પૂરો જુમ્બ (અપરાધ) છે. કેટલાક તવાઇ કરાવનારા (મુંઅદ્વીપ) અહીંચા એમ ડરાવે છે કે, રાતમા અતરો છે. આ વાત એ એક માણસો માટે ઠીક છે અને જયારે સધળો કાંકલો થોલશો તો ઈન્શાઅદ્વાહતાલા કાંઈ અંદ્રોણો નથી. આ સ્થગ પર પદવા માટે કેટલીક હુઅઓ લખવામાં આવે છે. અદ્વાહું અફખર

વિલ્લિંગિલ હંમુ પણ વખત, પછી કલમચે
તૈણીએ તે પછી આ હુઅા પઢે.

“અણ્ણાહુભુ ઇહિહેની બિલહુદા
વચ્ચેસીની વગ્ણીરલી ઝીંઆપેરતે
વદીલા”

(તરજુમો : અય અણ્ણાહ મને હિંદાયત
સાથે માર્ગદર્શન કર અને પાક કર અને પરહેજ-
ગારી સાથે શુનાહુથી સુરક્ષિત રાખ અને હુનિયા
તથા આપેરતમાં મારી મગફેરત કર) પછી
ત્રણુવાર આ હુઅા પઢે.

અણ્ણાહુભુઅલહો હજજન મહિદરન
વઅન્ધમ-મળકુર ન, અણ્ણાહુભુ લકો વ
ઇલોકા મા થી વ લકો રણ્યે તોરાસી.
અણ્ણાહુભુ ઇન્ની અડુઓએકા મિન
અઝાણીએકે વ વસ્તુસતિસસદરે વ
શોતાતિદાસરે અણ્ણાહુભુ ઇન્ની અસ્થાલોક
મિન ઔરે મા તળુએ એહિરીંહો વ
નગીઓએકા મિન શરો મા તળુએ
એહિરીંહો, અણ્ણાહુભુહેના બીલહુદા વ
ઔથના બિત્તાકુવા વગ્ણીર લના ઝીંઆ-
પેરતે વદીલા અણ્ણાહુભુ ઇન્ની અસ્થાલોક
રિઝકન તૈયેખન સુખારકન અણ્ણાહુભુ
ઇન્નકા અમર્તા બિદ્ધુઆએ વ કહેતા
આત્મા નક્સેકા બિલઈનખતે વ ઇન્નકા
લાતુખલેકુદ્ધમીઆદ વલા તન્કુસ અહુહેકા.
અણ્ણાહુભુ મા અહુખણ્ત મિન ગૈરિન
ઝીંહથીહો ઇલોના વ યસ્સીરહો લના વમા
કરેહતા મિન શર્દિન ઝીકર્દેહો ઇલોના વ
જનીણનાહો વલા તન્નેથ, મિનલઈલામ
અચાહ ઇંહદતૌના અણ્ણાહુભુ ઇન્નકા
તરાણી મઙ્ગાની વ તસ્મએ કલામી વ

તચકમો ભિરીંવ અદાનીયાતી વદા
યખુદો અદોકા શૈકિન મિન અભી
અનખખાએસુલુકીલુસુસ્તગીસુલુસ્તળ
સલ્વાજિદુ સુસ્થેદુ સુસ્તાતરિકા એ
અખોહિ અસ્થાલોક મસ્થાલતદમીસ્કીને
લખતહિન ઇલોકા ઇન્નેહાલ્લિમુઅનિખાજ
અલીદે વ અદોકા હુઅાઅદખાધીલુસુ-
દતરો હુઅાઅ મન અહેચાત લકો
રકુખતહો વઙ્ગાદત લકો અયનાહો વ
નહેલકો જસદોહુ વ રગમ અન્નેહુ
અણ્ણાહુભુ લાતજયદની પેહુઅાએકા
રણથી શકીયન વ કુનથી રહુફર્દીમન
યા જૈરહમસ્તકીન વ જૈરહસુસ્તતીન”.

(તરજુમો : અય અણ્ણાહ આને હજજે
મખરૂર કર અને શુનાહ બખ્શી હે, ઇલાહી
તારા માટે હમણ છે નેવી અમે ઇહીએ છીએ
અને તેનાથી એકતર જેને અમે ઇહીએ. અય
અણ્ણાહ મારી નમાજ તથા ઈંબાદત અને મારું
લવણું અને મરણું તારા માટે જ છે. અને
તારા જ તરફ મારું પ્રાયાગમન છે અને અય
પરવરહિગાર તુ જ મારો વારિસ છે, અય
અણ્ણાહ હું તારી પનાહ માંશુ છું, અગામે
કષ અને સીનાના વસ્તવસાએ અને કામની
વિધીનતાથી, ઇલાહી હું સવાલ કરું છું તે
ચીજની ઔરનો જેને હવા લાવે છે, અને તે
વસ્તુના શર્ત (ઉપદ્રવ)થી પનાહ માંશુ છું જેને
હવા લાવે છે. ઇલાહી હિંદાયત પ્રત્યે અમારું
માર્ગદર્શન કર અને તકવાથી અમને વિલૂબિત
કર અને આપેરત તથા હુનિયામાં અમને
બખ્શી હે, ઇલાહી હું પાડિજા તથા સુખારક
રિઝકનો તારાથી સવાલ કરું છું. ઇલાહી તેં

હુઅા કરવાનો હુકમ આપો અને કુણુલ કરવાની જવાબદારી તેં પોતે લીધી અને ષેશક તુ વાયદા વિકુદ્ધ કરતો નથી અને પોતાના નિયમને તોડતો નથી. ઈલાહી ને સારી વાતો તને પ્રિય છે તેમને અમારા માટે પ્રિય કરી હે અને અમારા માટે ઉપલબ્ધ કર અને જે ખરાખ વાતો તને ના પસંદ છે તેમને અમારા માટે નાપસંદ કરી હે અને અમને તેમનાથી બચાવ અને ઈસ્લામ પ્રતિ અમને હિદાયત કરી તો તેને અમારાથી જુદા ન કર. ઈલાહી તુ મારા મહાનને જુએ છે અને મારો કલામ સાંભળે છે અને મારા શુંગ તથા ખાંદને જાણે છે. મારા કામમાંથી કોઈ વસ્તુ તારાથી શુંગ નથી. હું નામુરાહ, મોહતાજ, ઇસ્થિયાદ કરનાર, પનાહ માંગનાર, ભયંકર ડરનાર, પોતાના શુનાડોનો સ્વીકાર કરી છું; મિસ્કીનની જેમ તારાથી સવાલ કરું છું અને શુનેહગાર તિરસ્કૃતની જેમ તારાથી આજિઝી કરું છું અને ડરનાર બ્યાંકુણની જેમ તારાથી હુઅા કરું છું; તેના જેમ હુઅા જેની ગર્દન તારા માટે જુકી ગઈ અને આંણો વહેતી અને શરીર હુણ્ણી અને નાક ધુળમાં મળી છે. અયપરવરદિગાર તું પોતાની હુઅાથી મને હુલ્લાંગી ન કર અને મારા પર બહુજ મહેરભાન થઈ ના, અય ઐહતર સવાલ કરવામાં આવેલ અને અયણેહતર આપનાર.

અને અયહુકીની રિવાયત જાખિર રહીયાણો અન્નેથી ઉપર સભ્રૂર થઈ ગઈ છે, તેમાં જે હુઅાઓ છે તેમને પણ પઢો. અર્થાત “લાઈલાહા ઈલાલાહુ વહદાહુ

લાશરોહલહુ લહલામુદુ વહલુલહલહુ વહુલા અલાકુલ્લે શૈર્દિન કદ્દીર.” ૧૦૦ વખત, કુલ્લોવલ્લાહ, ૧૦ વખત અલ્લા હુમ્મા સલ્લેઅલા સૈયેહેના સુહમુહિન કમા સલ્લયતા અલાસૌદહેના ઈલાહીમા વઅલા આદે સૌયેહેના ઈલાહીમા ઈન્નકા હમીદુમ મળુફુંંબ વઅલયના મઅહુમ.” સો વખત પઢો. ઈજનેઅલી થયબહ વિગેરે અમીરી મોભિનીન મૌલાઅલી કરેમદલાહુ તાલા વજહાંથી રાલીકેરસુલુલ્લાહ સલ્લાહાણો અલયહે વસલ્લામે ઝરમાંયું કે મારી અને અંભિયાણોની હુઅા અસ્ક્રાના દિવસે આછે—

લાઈલાહા ઈલાલાહો વહદાહુ લાશરોહિલાહુલમુદુદી વહલહુલહુમ્દો યોહયી વ યોમાતો વહુઅા અલા કુલ્લોરોઈન કદ્દીર. અલ્લાહુમજબઅલ ઝી સર્દી તુરંબુ ઝીભસરી તુરંબુફી કદ્દીનુરંન અલ્લાહુશરહ લી સહરીવ યસ્સીરજી અભરી વ અભિઝો ઐકા મિન વસવેસીસસહરે વતશતીતિ અદમરે વઅઅભિલક્ષણરે. અલ્લાહુમજબ ઈન્નીઅજાણેકામિન શર્રો માયલેને ઝીલ્લેસે વશર્રો માયલેને ઝીનનારે મા તહેણો ઐહિરીંહા વશર્રો લવાહુકીદહરે.

તરલુમો : અય અલલાહુ મારા ઝીનો જોદી હે અને મારું કામ જાસાન કર અને હું તારી પનાહ માંશું છું જીતાના વસવાણો અને કામની વિચિન્નતા અને અજાણે કથ્યથી. અયઅલલાહ હું તારી પનાહ માંશું છું તેની ખુરાધ્યથી જેરાતમાં દાખલા થાય છે

અને તેની ઝુરાઈથી કે હિવસમાં હાખલ થાય છે અને તેની ઝુરાઈથી કેને હવા ઉદાધી લાવે છે અને દહેરની અરક્તતની ઝુરાઈથી

આ સ્વયેં પઢવાની ડેટલીએ હુઅચો કિતાઓમાં મજબૂર છે પરંતુ આટલીમાં જ કિદ્ધાયત છે અને હુરુદ શરીર તથા તિકાવતે કુર્ચિન સૌ હુઅચો કરતાં લાલકારક છે.

(૨૩) આ હિવસે યાદ રાખવા જેવો એક અદ્ભુત એ છે કે અદ્ભુત તાત્ત્વાના સાચા વાયદાએ પર લારાસો કરીને યકીન કરે કે આજે હું શુનાડીથી એવો પાક થઈ ગયો જેવો જે હિવસે માંના પેટમાંથી પૈંડા થયો હતો. હવે પ્રયત્ન કરો કે જવિષ્યમાં શુનાહુન થાય અને જે ડાધ અદ્ભુત તાત્ત્વાએ ડેવળ પોતાની રહેમતથી આ મારા લલાઠી થી ઘણો છે તે ફરી ન લાગે.

(૨૪) વકુફના મફર્હેણ

અહીંયા આ વાતો મફર્હેણ છે (૧) સૂર્યાસ્તથી પહેલા વકુફ છોડીને રવાનગી જ્યારે કે સૂર્યાસ્ત સુધી અરક્તતની હદેથી બહાર ન થઈ જય. નહિતો હરામ છે. (૨) અસર તથા ઓહરની નમાજ મેળવવા પછી વકુફ માટે જવામાં વિલંબ (૩) તે સમયથી સૂર્યાસ્ત સુધી ખાવા-પીવા અથવા (૪) ઝુદા પ્રત્યેના ધ્યાન સિવાય કોઈ કામમાં મથગૂલ થબું. (૫) કોઈ સંસારિક વાત કરબું. (૬) મગરિય અથવા ઈશા અરક્તતમાં પઢબું.

ચેતનાં : મેન્ડિશમાં છત્રી ઓફવા અથવા કોઈ પ્રકારે છાંયડો ઈચ્છવાથી શક્ય હોય ત્યાં સુધી બચો, હા જે લોકો મજબૂર છે તે મજબૂર છે.

જરૂરી ન મીઠા : જરૂરી ચેતનાં : જરૂરો સખત જરૂરી : ખરાબ દાખિ હોશા હરામ છે ન કે એહામમાં, નકે મેન્ડિશ અથવા મસ્તિઝુલ હરામમાં, નકેકાંખા મોઅઝ-માંની સામે, નકે તવાર બયતુલ હામમાં. આ તમારી પરિક્ષાનો પ્રસંગ છે એરતોને હુકમ આપવામાં આવ્યો છે. કે અહીંયા મેહું છુપાવો નહીં અને તમને હુકમ આપવામાં આવ્યો છે કે તેમના પ્રત્યે દાખિ ન કરો, યકીન બણો કે આ મોટા જૈરતવાળા ખાદશાહુની બ દીચો કનીઓ છે અને અત્યારે તમે અને તેઓ ખાસ દરખારમાં હાજર છો વગર એળએ શેરનું બન્યું તેની ખગલમાં હોય તે સમયે કોણ તેની પ્રત્યે નજર નાખે શકે છે, તો અદ્ભુત વાહિદ કહુફારની દાસીએક જે તેના ખાસ દરખારમાં હાજર છે તેમના પર કુદ્દિં ડેટલા પ્રમાણુમાં સખત થશે. વિલલાહિલ મભલુલ આલા, હા, હા, હેંશિયાર ઈમાન અચાવેલ હૃદ્ય તથા દાખિ સંલાગેલ, હરમ તે સ્થળ છે જ્યા શુનાહના ઈરાદા પર પકડ અને એક શુનાહુન લાખ શુનાહની બરાબર કરે છે. ઈલાહી ઔરની તૌફીક આપ આમીન.

વકુફના મસાઈલ :-

મસાઈલ-(૧) વકુફનો સમય નવમી જિલહિજલહના સૂર્ય દળવાથી દસમીના તુલુએકજર સુધી છે, તે સમય સિવાય કોઈ ખીન સમયે વકુફ કર્યું તો હજા ન મળી પરંતુ એક સૂરતમાં તે એક જિલહિજલહનો હિવાલ દેખાયો. નહીં અથવા જિલહિજલહના ત્રીસ હિવસ પૂરા કરીને જિલહિજલહનો મહીનો શરૂ કર્યો અને તે હિવસે આજે નવમી છે, પણીથી સાખિત થયું કે એગણુ-

ત્રીસનો ચાંદ થયો તો તે હિસાએ દસમી થશો અને વઢું દસમી તારાએ થયો પરંતુ જરૂરતન આ જઈજ માનવામાં આવશે અને જો ધોકો થયો કે આડળી ને નવમી સમલુને વઢું કર્યું પછી ખબર પડી તો આ વઢું સહીહ ન થયો. (આલમગીરી વિગેર)

મરણલા-(૨) જે ગવાહીએ રાતના સમયે ગવાહી આપી કે નવમી તારાણ આજે હતી અને આ દસમીરાત છે તો જે તેરાતમાં સ્ત્રી લોકો અથવા અક્સર લોકોની સાથે ઈમામ વઢું કરી શકે છે તો વઢું લાજિમ છે. વઢું ન કરે તો હજા હૈત થઈ (ઝરી) જરો અને જે એટલો સમય બાકી ન હોય કે અક્સર લોકોની સાથે ઈમામ વઢું કરે, જે કે ખૂદ ઈમામ અને જે થોડા લોકો ઉતાવગ કરીને જાય તો સતતથી અગાઉ ત્યાં પહોંચી જરો પરંતુ જે લોકો પગપણા છે અને જેમની સાથે બાલ-બચ્ચાં છે અને જેમનો પાસે સરસનાન વધારે છે તેમને વઢું મળશે નહી તો આ શહાદત (સાક્ષી) અનુસાર અમલ ન કરે બલકે બીજ દિનસે અગાલ પછી સધળા હાજુઓની સાથે વઢું કરે. (મનાસિક)

મરણલા-(૩) જે લોકોએ જિલ્લાદિનજ હના ચાંદની ગવાહી આપી અને તેમની ગવાહી કબૂલ ન થઈ તે લોકો જે ઈમામથી એક દિવસ પહેલા વઢું કરશે તો તેમની હજા થશો નહી બલકે તેમના માટે જરૂરી છે કે એજ દિવસે વઢું કરે જે દિવસે ઈમામ વઢું કરે જે કે તેમના હિસાથી હું દશમી તારીખ છે. (મનાસિક)

મરણલા-(૪) થોડીકવાર થોરાવાથી પણ વઢું થઈ જાય છે, જેવે તેને ખબર હોય કે આ અરક્ષાત છે અથવા ખબર ન હોય, બાબુશ્રુ હોય કે બેબુશ્રુ, જનાભતવાળોના હોય કે હૈઝ તથા નિદ્રાસવાળી ઓરત, નિદ્રાધિન હોય કે જાગૃત, હોશમાં હોય કે એહેશી તથા પાગલપણુંમાં, ત્યાં સુધી કે અરક્ષાતમ થી થઈને પસાર થઈ ગયો. તેને હજા મળશે અર્થાત હું તેની હજાજરાસિદ્ધ થશે નહી જ્યારેકે તે સધળા એહુરામથી હોય. એહેશીમાં એહુરામની સુરત એ છે કે પહેલા હોશમા હતો અને તે સમયે જ એહુરામ બાંધિલિદ્ધો હતો અને જે એહુરામ બાંધરાંથી પહેલાં બેહેશ થઈ ગયો અને તેના સાથીઓ પોકી કોઈએ અથવા કોઈધીનાંથી તેના તરફથી એહુરામ બાંધી હોયા જેકે આ એહુરામ બાંધવાવાળાએ ખૂબ પોતાની તરફથી પણ એહુરામ બાંધ્યો. હોય કે તેનો એહુરામ આના એહુરામની તેરફ નથી તો આ સરરૂપમાં પણ તે એહુરામવાળો થઈ ગયો. ધીજનો એહુરામ બાંધવાનો એ અર્થ નથી કે તેના કપડાં ઉતારી હુંગી બાંધી હે બલકે એ કે તેના તરફથી નિયત કરે અને લખણોક કહે. (આલમગીરી, જવહરી)

મરણલા-(૫) જેનો હજા હૈત (તરીકી) થઈ ગયો અર્થાત તેને વઢું ન મળ્યું તો હું હજાના બાકીના કાર્યો સાક્ષિત (૨૬) થઈ ગયા અને તેનું એહુરામ ઉમરા પ્રત્યે પરિવર્તિત થઈ ગયું માટે ઉમરો કરીને એહુરામ છાડીનાએ અને ધીજ વર્ષે હજાની કંઝ કરે. (આલમગીરી, હુર્રુસુખતાર)

મસ્ટઅલા-(૬) સૂર્યાસ્ત પહેલા ભીડના દરથી અરદ્ધાતની હુદ્દોથી બહાર થઈ ગયો। તેના પર દમ આપવું વાનિબ છે. પછી જે સૂરજ દુષ્યવાથી પહેલા પાછો આવી ગયો, અને થોબી રહ્યો, ત્યાં સુધી કે સૂરજ દુષ્યી ગયો તો દમ માફ થઈ ગયો અને જે દુષ્યવા પછી પાછો આવ્યો તો દમ રહ ન થયો, અને જે સવારી પર હતો અને જાનવર તેને લઈને નાચી ગયું તો પણ દમ વાનિબ છે એવી જ રીતે જે તેનું જાંટ નાચી ગયું અને તે તેની પાછળ ચાલો નીકળ્યો. (તો પણ દમ વાનિબ છે). (મનાસિક)

મસ્ટઅલા (૭) એહારામવાળાએ ઈશાની નમાજ પઢી નથી અને ડેવળ એટલો સમય બાકી છે કે, ચાર રક્ખત પઢે, પરંતુ પઢે છે તો વઢુકે અરદ્ધ જતો રહેશે, તો નમાજ છાડી હો અને અરદ્ધાત ચાલ્યો જાય (જથું હરણ) અને એહાતર એ છે કે, ચાલતામાં પઠો કે પાછળથી પુનરાવર્તન કરો. (મનાસિક)

મુજદલિદાની રવાનગી

અને તેનું વક્રુદ્ધ :

અદ્વાહ અઝાજવજદ્વાહ ઇરમાવે છે :
ફર્દિજ અફેનુમ મિન અરદ્ધાતિન
ફર્મકેડુલાહ ઠન્દુમશઅરિલહરામે ફર્જ
કેડ્રાહો કમા હદાકુમ વર્ધિતકુન્તુમ મિન
કુફ્લેહિ લમિનદાલ્ખીન

અર્થઃ જ્યારે અરદ્ધાતથી તમે પાછા આવો તો મશઅરે હરામ (મુજદલિદા)ની નિકટ અદ્વાહનો જિક કરો. અને તેને યાહ કરો જેવું તેણે તમને બતાવ્યું અને એશક

તેનાથી પહેલા તમે ગુમરાહો પૈકી હતા.) સહીહ સુસ્લિમ શરીરમાં હજરત બાબિર રહીયદ્વાહો અન્હોથી રિવાયત છે કે હજગતુલવિદાયમાં હજરત નણી સહૈદ્વાહો અલયહે વસદ્વલમ અરદ્ધાતથી મુજદલિદામાં તથારીક લાવ્યા, અહીં મગરિબ તથા ઈશાની નમાજ પઢી, પછી સુઈ રહ્યા ત્યાં સુધી કે ઇજરને સમય થયો, જ્યારે સવાર (ઇજરની નમાજનો સમય) થઈ તો તે સમયે અજાન તથા ઈકામતની સાથે ઇજરની નમાજ પઢી, પછી કસ્વા (ઉંટણી) પર સવાર થઈને ‘મશઅરે હરામ’માં આવ્યા અને કિંલા તરફ મોઢું કરીને હુદ્દા તથા તકણીર તથા તહીલી તથા તૌહીલમાં મદ્ધગૂલ રહ્યા અને વઢ્ઢે કર્યું, ત્યાં સુધી કે સારી રીતે અજવાણું થઈ ગયું અને સૂર્યોદિયથી પહેલાં અહીંથી રવાના થયા. અયહકી મોહમ્મદ બિન મણરમહુથી રાવી કે રસુલુલ્લાહ સહૈદ્વાહો અલયહે વસદ્વલમે ઘૂલ્યો પઢ્યો અને ઇરમાવ્યું કે, જહિલયત વાળા ક્રોકો (ઈસ્લામ પૂર્વે) અરદ્ધાતથી તે સમયે રવાના થતા હતા જ્યારે સૂર્ય મુખની સામે હતો, અને મુજદલિદાથી સૂર્યોદિય પછી રવાના થતા જ્યારે સરજ મુખની સામે હતો અને અમે અરદ્ધાતથી ન થઈશું જ્યાં સુધી સૂરજ દુષ્યી ન જાય અને મુજદલિદાથી સૂર્ય ઉદ્ઘાટી પહેલા રવાના થઈશું અમારી તરીકો (પ્રથા) બૂત પરસ્તો અને મુશરિકોના તરીકાની વિરુદ્ધ છે.

(૧) જ્યારે સૂર્યાસ્તનું થકીન થઈ જાય તથા મુજદલિદા માટે ચાલી નીકળે અને

ઈમામની સાથે જવું અઝલ છે પરંતુ તે વિલંબ કરે તો તેની પ્રતીક્ષા ન કરે.

(૨) રસ્તામાં જિડી, હરે, હુંચા, લણ્ણોક તથા રૂધન-આંકદ કાંકલુદિમાં વ્યસ્ત રહેણી તે સમયની કેટલીક હુંચાઓ આ છે.

“અદલાહુમ ઈલૈકા અદેહતો વડ્હી રહમતેકા રગળતો વમિન સખતેકા રહણતો વમિન અઝાણેકા અથેકા ફાસુકબન નોસેણી, વ અઅઝીમ અજરી વતકણબનતૌણ વ, વઅરહમ તદરોઈ, વસ્તાજિબ, હોઆઇ વ અઅતેની રોનાદી અદલાહુમ લા તજ અંગ હાજા આખેરા આહુના મિન હાજુદમોકિદીશરો ફીદાઝીમે, વરાઝુકનદાઓઈ ઈલૈકે મર્રતિન કસીરતિન બેલુંકેકદામીમ.

તરજુએં : અયઅહ્વાહ હું તારી તરદે પાછેં કચેરી અને તારી રેહમતમાં રગભત-કરી અને તારી નારાજી ઉર્યે અને તારા અજાખથી એંક કચેરી, તુ મારી ઈણાદત કબુદ્ધ અને મારો અજીમકર અને મારી તીખા કબૂલકર અને મ.રી આજિઝી પર રહેમકર અને મારી હુંચા કબુદ્ધ કર અને મને મારો સવાલ અતાડર. અયઅહ્વાહ આ શરીર બુઝુર્ગ જગ્યામાં મારી આ હાજરી અંતિમ હાજરી ન કર અને તુ પોતાની મહેરખાનીથી અહીંયા અનેક વખત આવવું નસીબકર)

(૩) રસ્તામાં જ્યાં ગુંજાઈશ જુએં અને પોતાની અથવા બીજાની તકલીફની સંભાવના ન હોય ત્યાં એટલીવાર તેવું હર જડપથી ચાલો, પયહલ હોકે સવાર,

(૪) જ્યારે મુજદલિકા દેખાય, શક્તિ હોય તો પયહલ (પગપાળા) થઈ જવું બહેતર છે. અને સનાન કરીને દાખલ થબું અઝલ છે. મુજદલિકામાં દાખલ થતા સમયે આ હુંચા પઢોઃ

“અદલાહુમ હાજા જરૂન અસથ-લોક અસથલોકા અન તરફુકની નવામેઅદખોરે કુલ્લોહુ, અદલાહુમ રઘભદમરારિદહરામે વ રઘભુરુંકને વહમકામે વરણુદખલદીન હરામે વરણુદમરલુદીન હામે અસથલોક એનૂરે વજણેકદરોમ અન તંકેરલી ઓનુથી વ તરહમની વ તજમાચ અલદહુદા અમરી વ તજબલ તકલા આદી વાનુખરી વહણાખેરત મથાથી વહભલી રહાકા અન્ના ફીદહુન્યા વહ બા-ખેરતે યામાં એયદેહિદ્ધેર કુલ્લોહુ અઅતનીદ્ધોર કુલ્લોહુ વસ્તોફ અમાશર્દે કુલ્લું, અહ્વાહુમ હર્દિમ લઙ્ખમી વ અઝરી વાયાહમી વશાખરો વસાઈર જવારેહુ અદનતનરે યા અરહમ હિમીન

તરજુએં : અય અદલાહ આ જગ્યા (મુજદલિકા) છે. હું તારાથી તમામ જીરના મજમૂઆ નોસવાલ કરું છું. અયઅહ્વાહ મશઅરે હરામના રઘભ અને દુકન તથા મકામનારઘભ અને ઈજાતવાળા શહેર અને ઈજાતવાળી મસ્કદના રઘભ, હું તારાથી તારી કુપાળુ વજેહ કરીમના વસીલાથી સવાલ કરું છું કે તુ મારા ગુનાહ બાળશીહે અને મારા પર રહેમ કર અને હિદાયત પર મારા કામને એકત્ર કરી હે અને તકવાને મારું

લાખું અને લાંડાર કર અને આધિરત મારું ડેડાણું કર અને ફુનિયા તથા આધિરતમાં હું મારાથી રાજુ રહે. અથ તે જાત જેના હાથમાં તમામ લલાઈ છે, મને દરેક પ્રકારની ઔર અતાડર અને દરેક પ્રકારની ખુરાઈથી બચાવ. અથ અદ્વાહ મારા મસ અને હાડકાં અને ચરણી અને વળ અને સંધળાં અવધોને જહનનમ પર હાંમ કરી દે. અથ સંધળા મહેરભાનોથી અધિક મહેરભાન.

(૫) ત્યા પહેંચીને શક્ય હોય ત્યાં સુધી જખાંથે કઅહની પાસે રસ્તાથો હડીને ઉત્તરે નહીં તો જયાં જગ્યા મળો.

(૬) સુજદલિક્ષામાં મગરિબ તથા ઈશાની નમાજ: સંભવત ત્ય પહેંચતા પહેંચતા શક્ક (સંધ્યા) દુધી જશો. મગરિબનો સમય નાકળી જશો, ઉટ છોડવા, સામાન ઉતારવાથી પહેલા. (મુની) ઈમામની સાથે મગરિબ તથા ઈશા એઠો અને જે મગરિબનો સમય બાકી પણ રહે તો પણ અત્યારે મગરિબ કરગિય ન પઢો, ન અરકૃતમાં પઢો ન રસ્તામાં કે તે હિવસે અહીંથાં મગરિબની નમાજ, મગરિબના સમયમાં પઢવું ચુનોહ છે અને જે પઢી લેશો તો ઈશાના સમયે કુરીથી પઢવી પડશો. તાત્પર્ય કે અહીંથાં પહેંચીને મગરિબની નમાજ ઈશાના સમયમાં અદાની નિયતથી નકેકજાની નિયતથી, શક્ય હોય ત્યાં સુધી (ઇમામ સુન્ની હોય તો) ઈમામની સાથે પઢો. મગરિબની સલામ દેરવતાં જ તુરત જ ઈશાની જમાયત થશો. ઈશાના કુર્જ પઢીલો તે પછી મગરિબ તથા ઈશાની સુન્નતો અને વિત્ર પઢો અને જે

ઇમામની સાથે જમાયત ન મળી શકે તો પોતાની જમાયત કરી લો અને એ પણ ન થઈ શકે તે એકલા પઢો.

મસ્તાકા (૧): આ મગરિબ ઈશાના સમયમાં પઢવું તેના જ માટે ખાસ છે જે સુજદલિક્ષા આવે અને જે અરકૃતમાં જ રાતે રહી ગયો અથવા સુજદલિક્ષા સિવાય બીજા રસ્તાથી પાછો હોય; તો તેણે મગરિબની નમાજ પોતાના સમયમાં પઢવી જરૂરી છે. (કુર્દુલ સુહતાર)

મસ્તાકા (૨): જે સુજદલિક્ષા આવનારે મગરિબની નમાજ રસ્તામાં પડી અથવા સુજ દલિક્ષા પહેંચાંયી ને ઈશાને સમય આવતાથી પહેલા પઢો લોધી તો તેને એ હુકમ છે કે પુનરાવર્તન કરે, પરંતુ પુનરાવર્તન ન કર્યું અને કુર્રનો સમય થઈ ગયો તો તે નમાજ હવે બહીહ થઈ ગઈ. (કુર્રેસુખતાર)

મસ્તાકા (૩): જે સુજદલિક્ષામાં મગરિબથી પહેલા ઈશા પડી તો મગરિબ પઢીને ઈશાનું પુનરાવર્તન કરે અને જે તુલૂએ કુર્રસુધી પુનરાવર્તન ન કર્યું તો હવેસડીહ થઈ ગઈ, બલે તે શખ્સ સાહેબ તરતીમ હોય કે નહીં. (કુર્રેસુખતાર, તકતાવી)

મસ્તાકા (૪): જે માર્ગમાં એટલીવાર થઈ ગઈ કે તુલૂએકજરની શંકા છે તો હવે રસ્તામાં જ બંને નમાજો પઢીલે. સુજદલિક્ષા પહેંચવાનો ઈન્તાર ન કરે. (કુર્રેસુખતાર)

મસ્તાકા (૫): અરકૃતમાં ઓહર તથા અસર માટે એક અજાન અને એ ઈકામતો છે અને સુજદલિક્ષામાં મગરિબ તથા ઈશા

માટે એક અજાત અને એક ઈકામત છે.
(હરેસુખતાર)

મરસલા (૬) : બંને નમાજોના દરમિયાનમાં સુનતથા નિર્દેલો નપઢે. મગરિબની સુનનતો પણ ઈશાની નમાજ પછી પડે. જે દરમિયાનમાં સુનનતો પછી લીધી અથવા બીજું કોઈ કામ કર્યું તો એક ઈકામત. બીજું કહેવામાં આવે અર્થતી ઈશા માટે. (શદ્દુલમુહના)

મરસલા (૭) : તુલુએ કેઝર પછી સુઅ દાલિકામાં આવ્યો તો સુનત તર્ક થઈ પરંતુ હમ વિગેરે તેના પર વાજિબ નથી.

(આલમગીરી)

(૭) નમાજો પછી આકીની રાતજિક તથા લઘ્યેક તથા હુરેદ તથા હુઅ તથા રેનમાં શુઅરો કે આ ધણી જ અંગુલ જગ્યા છે અને ધણી જ અંગુલ રાત છે. કેટલાક આલીમોએ આ રાતને શામેકફરથી પણ અંગુલ કણ્ણું છે. જિંદગી છે તો સુઈ રહેના માટે તો બીજું કેટલીએ રાતો મળેશે અને અહીંથાં આ રાત ખુદા જાણે ઈરીથી હોને મળે, અને ન થઈ શકે તો તહારત (પાકી) લુશ્ય ગુમલુ (સાથે સુઈ રહેણું કે વ્યથાં વાતોથી સુઈ રહેવું અડેતર છે અને એટલા વહેલા ઉઠી જાન કે સવાર ચ્યામકવાથી પહેલા જરૂરતો અને તહારતથી ફારેગ થઈ જાન. આજે સવારની નમાજ બહુજ અંખારામા પદવામાં આવશે. પ્રયત્ન કરો કે જમાઅતે ઈમામ બદકે પહેલો તકબીર છુટી ન જાય કે ઈશા તથા સવારની નમાજ જમાઅતથી પદનાર પણ પૂરી શખ મેદારી (રાત્રો જેગરણ)નો સવાખ પામે છે.

(૮) હવે દરખારે આજમની બીજુલુણાજરી ને. સમય આગ્યો. હા, હા, કૃપાના દરવાજા ઉધાડવામાં આવ્યા છે કાલે અરદે તમાં હુકુકે દલાહ મારે થયા હતા અહીંથાં હુકુકુલાયેખાદ (લોકેના હઙ્કો) મારે ઇરમાવવાનો વાયદો છે. મશાઅદ્દલદરાખમાં અર્થતી ખાસ પહાડી ગર અને ન મળે તો તેનો તળેશીમાં અને તે પણ ન મળે તો વાદીએ સુહુસ્કર સિવાય કે તેમાં વુકૂર (શાબુનુ) જઈજ નથો જ્યાં શુંના ઈશ પાના વુકૂર કરો અને તે સંધળી વાતો કે જે વુકુરે અરદે તમાં મજરૂર થઈ છે તેનું ધ્યાન રાખો. અર્થતી લઘ્યેકની અધેકતા કરો અને જિક, હુઅ, દર્દમાં મશગૂલ રહો. અહીંથાં માટે કેટલોક હુઅએ આ છે.

અદલાહુમગુરી, દી અતીવાતી વજહુની વધસરાહી દી અજરી વના જનત અભદ્રમો એન્ધિ મિનના અદલાહુમગુરી દી લુદ વ હજવા વખતાથ વ અમની વકુલો આર્જિના ઈન્દ્રી અદલાહુમ્મમ ઈન્ના અંગો એકા મિલદુકરે વલુંદે વલુંજાએ વલકસ્યે અંગોણો એકા મનલંદ કરે વલુંદે વલું જાએ વલકસ્યે વ અંગોણો એકા મિનલંદમે વલુંઝને વ અંગોણેમે। (મનલંદને વલુંઝ સેચ લધુને વ ગદમાત રંના વ અસુદ્ધનાકા અની તકદેયનીદમગ્રમ વ અન નાચું અની મજાસેમદાયેખાદે વ અન તુર્દેથ અનીદમાસુમા વલોરમાય વ અસંધા મુદુંદુકે જંદ્ધા હુંમ અચ્યતે નાંસા તક રાહા એકદેહા અન્તા જોડન મન એકાહા અનત વલોરયાહા વ મૌજાહા અદલાહુમ્મમ ઈન્ના અંગોએકા મિન ગદિય નદેન વ મિન ગદિય નદ્દુદ્ધ્યે વ મિન ધરારન લાગેમિન વ મિન શીતાતદમસીહીદીજળાલે, અન્નાહુમજ બદની મનદરજીના ઈજા અહસનું ધર્તતફરાર વ

ધર્જા અસાડી અસાગ્રહેર અદ્વાહુમજાઘડના મિન એમાદાસસ લેહીનાંગુર્િલ સુદજ્જબી નદવકદીદમુનાદલભીન સુનકદલભીન, અદ્વાહુમ ધની અસાચ્ચોકા હી શાઝિનામ એ અન તઘમય લી જવામેચા કુદલેદુ વ અન તુસ્દેહ લી શાના કુદલહુ ર અન તસ્રેદ અની સુસુઅા કુદ્દીહુ ઇર્ધનહુ લા યકુદ્દો આલેકા જોરેકા વલા પળુદો યોહુ ધર્દલા અના અદલા હુમ ધની અદીજો યોકા મિન શર્દે મંનદ્યમી અલા બતમહુ વ મિન શર્દે મંનદ્યમી રિજુલેને વ મંનદ્યમી અલા અન્યાય, અદલાહુમજાઘડની અગશાકા કયાનની અરાકા અયફન હુતા અદકાક વ અસાદોની એ તકવાકા વલા તશેની એ અસ્સીયતેકા વ પિર લી મિન કદાયેકા વ બારિક લી હી કદરેકા હુતા લાયો હુણ્ણો તયાલુલા મા બજારતદવારિસો મિની વન્સુરના અના મન જલમની વ અરેના હીછે સારી વ અક્રો યોજાલિન એની.

તશ્જુમો :- અયઅદ્વાહ મારી ખતા અને અહુલ અને જિયાદતી વ્યર્થ બાખતો કુ કે તુ મારા કરતાં વધારે જાણે છે, સૌ બજશીદે, અયઅદ્વાહ મારા સધળા શુનાહ માઝ કરી હે, કોશીયથી નેને મેં કુર્દી અથવા કોશીશ વગર અને ભૂલથી કર્યા અથવા ઈરાદાથી અને આ સધળું મેં કર્યું, અયઅદ્વાહતારી પનાહ માંગું છું મોહતાળ અને કુદુ અને આજિઝી તથા સુસ્તીથી અને તરી પનાહગમ તથા વિષાદથી અને તારી પનાહ બુઝાદી તથા કંજુઝી અને દીનની કઠિનતા અને મર્દોના ગવાથી. સવાલ કરું છું કે મારાથી તાવાન અહા કરી હે અને બોકેના હુંકો મારાથી માઝ કર અને શકુંચો તથા ગરીયો અને હકદારોને રાજુ કરી હે.

અયઅદ્વાહ મારા નક્સને તકદો (સંયમ) આપ અને તેને પાક કર, તુ બેહતર પાક કરતાર છે, તુ તેનો વલી તથા મૌલા છે, અયઅદ્વાહ તારી પનાહ દીનના ગવા અને હરેમનના ગવાથી અને તે વિનાશથી જે મલામત (ધૃણા)માં નાખનાર છે અને મસીહ દજીલના કિલાથી અયઅદ્વાહ મને તે લોકો પૈકો કરે કરીને ખૂશ થાય છે અને બુરાઈ કરીને ઇસ્તિગફાર કરે છે. અયઅદ્વાહ અમને તારા નેક બંદાચ્ચો પૈકી બનાવ કે જેમણી પેશાવીએ અને હાથપગ ચમકે છે, જે મહિયુલ પ્રતિનિધિએ પૈકી છે. અયઅદ્વાહ આ સુજાદલિક્ષામાં મારા માટે દરેક જૈર (લાઈ) એકજ કરી હે અને મારી દરેક હાવતને ટીક કરી હે અને દરેક બુરાઈને મારાથી ફેરવી હે હે તારા સિવાય કોઈ કરી શકતું નથી અને તારા સિવાય કોઈ આપી શકતું નથી, અયઅદ્વાહ તારી પનાહ તેના શર્દે (ઉપદ્રવ)થી જે પેટ પર (લોંઘ ધસડીયું) ચાલે છે. (દા. ત. સાપ) અને એ પગો અને ચાર પગો પર ચાલનારાયોના શર (બુરાઈ)થી અયઅદ્વાહ તુ મને એવો કરી હે કે હુમેશાં તારાથી હરતો રહું, જાણું હું તને નિહાળું, ત્યાં સુધી કે તારાથી મળું અને તકવા સાથે મને લાગ્યવાન કર અને શુનાહ કરીને હંબાળી ન બતું અને પોતાની કઝા (મૃત્યુ) મારા માટે બાહેતર કર અને જે તે સુકદર (નિશ્ચિત) કર્યું છે તેમાં બરકાન આપ, ત્યાં સુધી કે જે તે વિલંબિત કર્યું છે તેની ઉતાવળને પસંદ ન કરું અને જે જલ્દી કરી દીધું તેના વિલંબને ટીક ન સમજું

અને મારી તવંગરી મારા નહિસમાં કર અને કાન આંખથી મને લાલાં વિતકર અનેતેમને મારા વારિસ બનાવ અને જે મારા પર કુદમ કરે તેમના પર મને વિજયી કર અને તેમાં મારો બદદો હેખાડી હે અને તેનાથી મારી આંખ ઠંડીકર).

મસાલા (૮) : વુક્કે મુજદલિકાનો સમય તુલુંચો કન્જરથી અજવાળું થવા સુધી છે. આ સમય દરમિયાન વુક્કે ન કર્યું તો ઝોટ થઈ ગયું અને જે તે સમયમાં અહીંચા થઈને પસાર થઈ ગયો તો વુક્કે થઈ ગયું અને અરકાતના વુક્કેમાં જે વાતો હતી તે અહીંચા પણ છે. (આતમગીરી)

મસાલા (૯) : તુલુંચેકન્જર (વહેલી પરોઠ)થી પહેલા જે અહીંચાથી ચાલ્યો ગયો તેના પર ફુમ વાજિબા છે, પરંતુ જ્યારે થીમાર હોય અથવા ઓરત અથવા કમન્નેર કે લીલમાં કષ્ટની શંકા છે તે કારણે પહેલાં ચાલ્યો ગયો તો તેના પર કાંઈ નથી. (આતમગીરી)

મસાલા (૧૦) : નમાજથી પહેલા પરંતુ તુલુંચેકન્જર (પોંડ ફાટવા) પછી અહીંચાથી ચાલ્યો ગયો અથવા સૂર્યોદિય પણ ગયો તો જોકું કર્યું, પરંતુ તેના ઉપર ફુમ વિગેરે વાજિબ નથી. (આતમગીરી)

મિતાના આ'માલ અને હજનના ખાડીના કાર્યો

અદ્દાહુ અજઓ જલ્દી રેમાયે છે. ઇંજિએ અદ્દાહુમ મનાસેક કુમ ઇંજેરલાહુ કિંજિકરેકુમ આધ્યાઅફુમ અથ અશદો જિકરા.

કુમિનનાસે મંડુકુસો રખયના આતેના શીદુન્યા વ માલહુ શીદ્યાખેરતે મિન ખલાક વ મિનહુમ મંદ્યકુસી રખયના આતેના શીદુન્યા હુસનતંબ શીદ્યાખેરતે હસનતંબ કેના અજાભનાર, ડિલાયેકા લહુમ નસીબુમ્ભીમ્ભમા કસભૂ વધ્યાછે, સરીડીલહી સાધ, વ જકેરલાહુ શીયેરયામિમભમયહુદીતિન ઇમન તચ્યાજાલ હી યૌમૈને ઇન્ના ઈસમા અદૌછે વ મન નચ્યાખર ઇલા ઈસમા અદૌછે લેમાનતકા વતુલાહુ વઅલમુ અનનફુમ ઈદૌછે તોહશારના (કર્બાન શરીરે)

તરજુમો : પછી જ્યારે હજાનું કામ પુરું કરી લોધું તો અવકાહનો જિક કરે જેવું પોતાના આપ-દાહાનો જિક કરતા હતા બદ્કે તેનાથી વધારે અને કેટલાક માણુસો એમ કહે છે કે, અમારા રખય અમને હુનિયામાં આપ અને આખેરતમાં, તેના માટે કાંઈ હિસ્સો નથી અને કેટલાક કહે છે. કે અય રખય અમારા અમને હુનિયામાં લલાઈ આપ અને અમને ઢાખણા અજાખથી ણચાવ, આ લોડો તે છે કે તેમની કમાણીની તેમનો હિસ્સો છે અને અવકાહ જદ્દી હિસામ કરનાર છે અને અવકાહની ચાદ કરે ગણુન્ત્રીવાળા દિવસોમાં તો જે ઉતાવળ કરે એ દિવસમાં ચાલ્યો જય તેના પર કાંઈ શુનોદ નથી અને જે રહી જય તો તેના પર કાંઈ શુનોદ નથી પરહેલગાર માટે અને અવકાહથી ડરો અને જાણી લોકે તેમને તેના તરફ જ જવું છે.)

હીસ-(૧) : સહીહ સુસ્થિત્વમ શરીરકમાં જાણિર રહીયદાહુ અનહોથી રિવાયત છે કે રસ્કુલુલાહુ સલ્લદાહુ અલયહે વસ્તુત્વમ

મુજ દલિકથી રવાના થયા ત્યાં સુધી કે અતને મુહુરસરમાં પહોંચ્યા અને અહીંથા જાનવરોને તેજ કરી દીધા, પછી ત્યાંથી વરચેના માર્ગથી ચાહ્યા જે જમરએ કુથ્યા તરફ ગયો છે, જયારે તે જમરહ પાસે પહોંચ્યા તો તેના પર સાત કાંકરીઓ મારી દરેક કાંકરી પર તકખીર કહેતા અને અતન વાહીથી રમી કરી, પછી મિતહરમાં (કુર્માની સ્થળ) આવી ચેંસઠ (૧૩) ઊંટ પોતાના મુખારક હાથથી ઝુંહ કર્યા. પછી હજરત અલો રહીયદ્વાહોઅન્હોને આપી દિદ્યા, આડીના તેમણે ઝુંહ કર્યા અને હજૂરે પોતાનો કુર્માનામાં તેમને શરીરક કરી દિદ્યા પછી હુકમ આપ્યો કે દરેક ઊંટમાંથી એક એક હુકડો હાંડલોમાં નાંખી પકાવવામાં આવે. બંને સાડેઓએ આ માંસમાંથી આધું અને શોરણો (સુપ) પીધો. પછી રસૂલુદ્વાહ સદ્વલદ્વાહો અલયહે વસ્તુલભ સરવાર થઈને અયનુલભાહ તરફ રવાના થયા અને ઓહરની નમાજ મછ્કામાં પડી.

હૃદીસ-(૨) : તિરમિજી શરીરમાં હજરત જાણિર રહીયદ્વાહો અન્હોથી રિવાયત છે કે રસૂલુલભાહ સદ્વલદ્વાહો અલયહે વસ્તુલભ સુઅં લેઝથી શાન્તિ સાથે રવાના થયા અને લોકોને હુકમ ઝરમાય્યો કે સંતોષ સાથે ચાલે અને વાહીએ મુહુરસરહમાં સવારીને તેજ કરી દીધી અને લોકોને ઝરમાયું કે નાની નાની કાંકરીએથી રમી કરે અને એ ઝરમાયું કે, કદાચ આ વર્ષ પછી હવે હું તમને જોઈશ નહિં. (એટલે વારો નિષ્ઠાલ થઈ જશે).

હૃદીસ-(૩) : સહીડૈનમાં હજરત જાણિરથી રિવાયત છે કે રસૂલુલભાહ સદ્વલદ્વાહો અલયહે વસ્તુલભ મેમેનહર (દસમી તારીખ) માં ચાશતના સમયે રમો કરો અને તેના પછીના દિવસોમાં સ્થાયી ઠગના પછી.

હૃદીસ-(૪) : સહીડ યુખારી તથા મુદ્દિલમાં છે કે અલહુદ્વાહબિન મસઉદ રહીયદ્વાહો અન્હો જમરએ કુણ્ણા (મોટા શયતાન) પાસે પહોંચ્યા તો મજ્જા મોઅઝ-માને ડાણી બાળુએ રાખ્યું અને મિનાને જમણી બાળુએ અને સાત કાંકરીએ મારી દરેક કાંકરી પર તકખીર કરી. પછી ઝરમાયું કે આવી રીતેજ તેમણે રમી કરી જેમના પર સરએ બાકરહ નાજિબ થઈ.

હૃદીસ-(૫) : ઈમામ માલિક નાફેઅથી રાની કે અલહુદ્વાહ બિન ઉમર રહીયદ્વાહો અન્હોમા બંને પહેલા જમરાએ પાસ કાઢી સમય સુધી થોલતા, તકખીર તથા તરખીલ તથા હરદો હુંઘા કરતા અને વચ્ચા જમરએ ઉકણા પાસે થોલતા નથી.

હૃદીસ-(૬) : તિથાની ઈન્ને ઉમર રહીયદ્વાહો અન્હોમાથી રાની કે એક શર્ષે રસૂલુલભાહ સદ્વલદ્વાહો અલયહે વસ્તુલભને પૂછ્યું કે રમીજિમારમાં શું સવાર છે. આપે ઝરશાદ ઝરમાયો તુ પોતાના રખણન નિકટ તેનો સવાર તે સમયે પામણો કે તને તેની અધિક હાજરત હશે.

હૃદીસ-(૭) : ઈન્ને યુઔમા તથા હાકિમ ઈન્ને અભ્યાસ રહીયદ્વાહો અન્હોમાંથી રાની કે રસૂલુલભાહ સદ્વલદ્વાહો અલયહે વસ્તુલભ ઝરમાયું જયારે ઈથાહીમ

ખવાલુલ્લાહ અલયહિમુસ્લામ મનાસિકમાં આવ્યા, જમ્રાની ઉડાની પાસે શયનાન સામે આવ્યો. તેને સાત કાંકરીઓ મારી, ત્યાં સુધી કે જમીનમાં ધસી ગયો, પણ જમ્રાને સાનિયાની પાસે આવ્યો, કરી તેને સાત કાંકરીઓ મારી ત્યાં સુધી કે જમીનસાં ધસી ગયો, કરી ત્રીજ જમ્રાની પાસે આવ્યો. તો તેને સાત કાંકરીઓ મારી ત્યાં સુધી કે જમીનમાં ધસી ગયો, ઈઝને અમ્ભાસ રહીયલ્લાહ અન્હોમાં ક્રમાવે છે કે તમે શયતાનને રજમ કરો છે અને મિલકતે ઈથ્રાહી મતું અનુસરણ કરો. છો.

હૃદીસ-૮ : બજાર તેમનાથી રાત્રી કે રસૂલુલ્લાહ સલ્લાલ્લાહ અલય હે વસ્તુદમે ક્રમાંયું—જમરાઓની રમી કરવું તારા માટે કયામતના દિવસે નૂર થશે.

હૃદી ૧-૬ : તિથાની તથા હાકિમ અથુ સહીદ ખુદરી રહીયલ્લાહ અન્હોથી રાતી કહે છે અમોએ અર્જુ કરી યા રસૂલુલ્લાહ! આ જમરાઓ પર જે કાંકરીઓ ફરેઠ વષે મારવામાં આવે છે. અમારી ધારણા છે કે એછી થઈ જાય છે, આપે ક્રમાંયું કે-જે કખૂલ થાય છે તે ઉડાલી લેવામાં આવે છે. જે એવું ન થતું હોત તો તમે તેને પહડાડોની જેમ જેતા. (જે કખૂલ થતી નથી એજ કાંકરીઓ ત્યાં પડી રહે છે. અનુવાદકે.)

હૃદીસ-૧૦ થા ૧૨ : સહીદ મુસ્લિમમાં ઈમાસુલ હસીન રહીયલ્લાહ અન્હોથી મરવી કે રસૂલુલ્લાહ સહીદ્દાહ અલય હે વસ્તુદમે હજજતુલવિદામાં માથું સુંદરવા વાળાઓ માટે નણું વખત હુચા કરી અને કલરાવવા-

વાળાઓ માટે એક વખત, તેનાં અનુઝ્યપ અભૂહુરૈરહ તથા માલિકબિનરથીઅહુ રહીયલ્લાહ અન્હોમાથી મરવી છે.

હૃદીસ (૧૩-૧૪) : ઉમરહીયલ્લાહ અન્હોમાથી મરવી કે રસૂલુલ્લાહ સલ્લાલ્લાહ હો અલય હે વસ્તુદમે ક્રમાંયું કે વાળ સુંદરવામાં ફરેઠ વાળના અદલામાં એક નેદી છે અને એક શુનોહ નાય કરવામાં આવે છે.

હૃદીસ (૧૪) : એઓબાદહુબિન સામિત રહીયલ્લાહ અન્હોથી મરવી કે રસૂલુલ્લાહ સલ્લાલ્લાહ અલય હે વસ્તુદમે ક્રમાંયું માથું સુંદરવામાં જે વાળ જમીનપર પડેશે તે તારા માટે કિયામતના દિવસે નૂર થશે.

(૧) જ્યારે સૂરોદિયમાં એ રકાત પદવાને સમય બાકો રહો જાય ઈમામના સાથે મિત્રાની ચાંપો અને અહીંયાયો સાત ન.ની નાની કાંકરીઓ પાજૂરના ઠગીયા જેટાંથી પાક જગ્યાએથી વીળી લઈન નણું વખત ધોઈદો કોઈ પથ્થરને તોડી કાંકરીઓ ન જનાયો અને એ નણું થઈ શકે છે કે નણું દિવસ જમરાઓને મારવા માટે અહીંયાથી કાંકરીઓ લઈદો અથવા સધગી કોઈ વીળું જગ્યાએથી દો પરંતુ તે નાપાક જગ્યાનો ના હોય, ન મસ્જિદની ન જમરાના નિકટની.

(૨) રસ્તામાં કરી નિયમાનુસાર જિક્ક કરો, હુચા તથા હુરું તથા લાખૌકના રણણમાં મશગૂલ રહો અને ચાં હુચા પઢો.

“અલ્લાહુમ ઈલૈકા અફુનો વ મિત અગ્રાયેકા અશક્તાનો વધાલૈકા વધાલૈકા રજાયતો વ મિતકા રહુણતા ઇ અકઘલ વનોસેકી વઅજીમ અજરી વરહુમ તદરેરીએ વ અકુલ તૌખતી વસ્તાલ્લાય હોયાંકુ

તરણુમો : - અથ અદલાહુ હું તારી તરફ પાછો આવ્યો અને તારા અજાબથી ડર્યો અને તારી તરફ રણુઅ થયો અને તારાથી એદ કર્યો. હું મારી ઈભાઈત કણૂલ કર અને મારી અજર અધિકર અને મારી આનિઝી પર રહું કર અને મારી તૌખા કણૂલ કર અને મારી હુા સુસ્તળગર.

(૩) જ્યારે વાતીએ સુહુદસર (આમિના તથા સુઅદલિક્ષાની વરચે એક નાળુ છે. એનેની હ્ઠોમાંથી ખારિજ, સુગ્રદલિક્ષાથી મિના જતાં ડાખા હાથે કે પહાડ આવે છે તેની ચાટીથી શરૂ થઈને પડ્ય હાથ સુધી છે. અહીંથા અસ્કુષેદીત ચાલીને થોળ્યા અને તેમના પર અભાણીનો ગાજળ ઉત્થેં હતો માટે આ જગ્યાએથી ઉતાવળે પસાર થવું અને અભાણોઈલાહીથી પનાહ માંગવી જોઈએ) પહોંચો. પાંચસો પીસ્તાલીસ (૫૪૫) હાથ ખણું જડપથી ચાલીને નિકળી જવ, પરંતુ નતો જડપ જેનાથી કોઈને ઈજા થાય અને આ સમય દરમિયાન આ હુા પઢો.

૦ અદલાહુમ લા તકતુલના એ ગદણેકા વલા તેહલીકના એ અભાણેકા વ આરેના કણલ જાસેકા

તરણુમો : અથ અદ્વાહુ પોતાના ગંગથી અમને હુલાડ ન કર અને આનાથી પહેલા અમને આદ્ધિયત આપ.)

(૪) જ્યારે મિના નજરે પડે એજ હુા પડો કે મજાથી આવતાં મિનાને જોઈને પડી હતી.

જમરતુલભિકબાનીરભી

(૫) જ્યારે મિના પહોંચો સૌ કામોથી પહેલા જમરતુલભિકબા જવ, આ આગુણેથી

પાછદો જમરા છે અને મજા મોઅજમાંથી પહેલો. નાળાના મંધ્યમાં સલારી પર જમરાથી એઓજામાં એંડું પાંચ હાથ હડેલ એવી રોતે ઉલા રહો કે મિના જમણા હાથ પર અને કા'બા ડાખા હાથ પર અને જમરા તરફ મુખ છોય. સાત કંકરીએ જુદી જુદી ચપટીમાં લઈને જમણો હાથ સારી રોતે ઉપાડી કે અગલને રંગ હેબાય, દરેક પર-મિસ્ટ્રીઃદાહે.

અદલાહુ અકુખર રણમન લી રૈતાને રેદન જિર્દહુમાને, અદલાહુમજ અદલે, હુજજન અભરુરન વસયવમ મરુરત વજસ્મ મરુરા, કહીને શૈતાન પર કંકરીએ મારે.

તરણુમો : અદ્વાહના નામથી અદ્વાહ બહુ મોટો છે, શયતાનને બદ્દીલ કરવા માટે અદ્વાહની રાખ માટે, અયઅદ્વાહ અને હજને મળરૂર કર અને આભારી ચેણ્ટાકર અને શુનાહ બખશીદે.

(નોટ : મિના અને મજા નીવચ્ચે વળું સ્થળે સ્થંબણનેલા છે તેમનો જમરા કહે છે, પહેલો કે મિનાથી નિકટ છે જમરાએ ઉલા કહેવાય છે. અને વચ્ચેનો જરૂરે વુસ્તા અને છેવટનો કે કે મજા મોઅજમાથી નિકટ છે જમરતુલ ઉકળા કહેવાય છે.) કહીને અથવા કેવળ નિસ્તિમદ્વાદ અદલાહુ અકુખર કહીને મારો એહતર છે કે કાંકરીએ જમરા સુધી પહોંચે, નહીં તો ત્રણ હાથના અંતર સુધી પડે. તેનાથી વધારે અંતર પર પડી તો તે કંકરીએ ગણુતીમાં આવશે નહીં. પ્રથમ કંકરીથી લાઘુણૈક બંધ કરી હો, અદલાહુએ અકુખરના બદલે સુગુણલદ્વાદે અથવા દાઈલાહાઈલદ્વાદ ઉદ્ધું તો પળ વાંધો નથી.

(૬) રમીના મસ્થાદ્વા

જ્યારે સાત કાંકરીઓ પુરી થઈ જય પછી ત્યાં થાલો નહીં, તુરતાજિંહ તથા હુએ કરતા પાછા આવી જવ.

મસ્થાદ્વા (૧) : સાતથી એછી કાંકરીઓ જોઈજ નથી જે કેવળ વણું મારી અથવા બિચ્છુલ મારી નહીં તો હમ આપવો લાજિંમ થશે અને જો ચાર મારી તો બાકીની ફરેક કાંકરોના બફલે સહકે આપો.

(રદ્દુલસુહૃત્તાર)

મસ્થાદ્વા (૨) : કાંકરી મારવામાં એક પછી એક મરવું થરત નથી, પરંતુ વક્ષેપ (અટકી જવું પછી મારવું, પછી અટકી જવું એ) સુનના વિરુદ્ધ છે. (રદ્દુલસુહૃત્તાર)

મસ્થાદ્વા (૩) : સધળી કાંકરીઓ એક સાથે ફેંકે તો આંસાટે કાંકરીઓ એકની જ ગણુનામાં આવી. (રદ્દુલસુહૃત્તાર)

મસ્થાદ્વા (૪) : કાંકરીઓ જરૂરિના પ્રકારની હોય અને એવી વસ્તુની જેનાથી તથભું જરૂર છે. કંકર, પત્થર, મારી ત્યાં સુધી કે જે ધુળ ફેંકી તો પણ રમી થઈ ગઈ, પરંતુ એક કાંકરી ફેંકવાની ગણુનામાં આવી. મોટી, અંબર, સુરક વિગેરથો રમી જોઈજ નથી. એવી જ શીતે જવાહિર અને સોનાચાંદીથી પણ રમી થઈ શકતી નથી કે તે તો નિધાવર કરવું થયું, મારવું ન થયું. લીંડી (મેગાણી) થી પણ રમી જોઈજ નથી.

(ફરેસુખ્તાર, રદ્દુલસુહૃત્તાર)

મસ્થાદ્વા (૫) : જમરાની પાસેથી કાંકરીઓ લેવું મકરૂહ છે કે ત્યાં એજ કાંકરીઓ રહે છે કે મકખૂલ (સ્વીકૃત) થતી

નથી અને મરદ્ધદ (૨૬) થઈ જાય છે અને જે મકખૂલ થઈ જાય છે, ઉઠાવી લેવામાં આવે છે. (રદ્દુલસુહૃત્તાર)

મસ્થાદ્વા (૬) : જો અભર હોય કે કાંકરીઓ નાપાડ છે તો તેનાથી રમી કરવું મકરૂહ છે અને અભર ન હોય તો મકરૂહ નથી, પરંતુ ઘોંધ લેવું સુસ્તાહ છે.

(રદ્દુલસુહૃત્તાર)

મસ્થાદ્વા (૭) : આ રમીનો સમય આજના સમયથી અગીયારમનીના ઇજર (સવાર) સુધી છે. પરંતુ મસનૂરન એ છે કે સ્લોર્નિયથી જવાલ સુધી હોય અને જાલથી સ્લૂર્સ્ટાન્ડ સુધી સુઅંડ (ઉચ્ચતા) અને સ્લૂર્સ્ટાન્ડથી ઇજર સુધી મકરૂહ છે. એવી જ શીતે દસમીનો ઇજરથી સ્લોર્નિય સુધી મકરૂહ છે અને જે કોઈ ઉજરના ટારણે હોય, ફા.ત. ચરવાહાઓ (ગોવાળો) એ રાતમાં રમી કરી તો કરાહત નથી. (ફરેસુખ્તાર)

(૭) હજજની કુરખાના

હવે “રમી” થી ફારેગ થઈને કુરખાનીમાં મશળૂલ થાન, આ કુરખાની તે નથી જે બકર ઈંડ (ઇન્દેન્ફાન્ડ) માં થાય છે કે તે તો સુસાંક્રિય પર સ્વર્થા નથી, અને સુકીમ (સ્થાયો) માલદાર પર વાજિય છે, જેકે હજજમાં હોય બદકે આ હજજનો શુકાના છે. કારિન અને સુતમતોએ પર વાજિય, લાલે ફ્રીર (માલદારના હોય) હોય અને સુશરિંદ માટે સુસ્તાહ લાલે માલદાર હોય, જાનવરની ઉંમર તથા અવયવોમાં એજ શરતો છે કે ઈંદ્ની કુરખાનીમાં છે.

મસ્થાદ્વા-(૧) મોહતાજમહાજ (સર્વથા-

નિર્ધન) જેનો માતિકીમાં ન કુરખાનીના લાયક કેઈ જાનવર હોય, ન તેની પાસે એટલું રોકડ અથવા સામાન કે તેને વેચોને જાનવર લઈ શકે, તે ને ડિરાન અથવા તમતોઅની નિયત કરશે તો તેના પર કુરખાનીના બદલે હસરોઝા વાજિમ થશે. ત્રણ તો હજજના મહીનાઓમાં અથવા પહેંચી શાખાદથી નવમી જિલહિજાહ સુધી એહરામ ખાંધયા પણી. આની વચ્ચે જાયારે ઈચ્છે રાખી લે એક સાથે અથવા અલગ અવગ અને બેહતર એ છે કે જિલહિજાહના ચાંદ ૭-૮-૯ તારીખોએ રાખે અને બાકીના સાત તેરમી જિલહિજાહ પણી જાયારે ઈચ્છે રાખે અને બેહતર એ છે કે, વેર પહેંચીને હોય.

(૮) જુંહ રતાં આમડતું હોય તો જુંહ જુંહ કરે કે સુન્નત છે નહીં તો જુંહ કરવાના સમયે પોતે હાજર રહે.

(૯) જાનવરને કિલ્વા રખ સુવડાવી અને પોતે પણ કિલ્વા તરફ સુખ કરીને આ પઢો.

ઇની વજજહુનો વજહેયા ઇતર સભમા-વાતે વહયર્દી હુનીએંબમા અના (મનદમુદ્રે-કીન ધૂન રૂલાતી વ નોસાડી વ મહુયાય વમમાતા લિલ્લાહુ-અધીદાલમીન લાશારકા લષું વ એમાલકા ઊર્માદો વ અના મનદમુદ્રેભેભીન)

તરજુમો :— મેં પોતાની જાતને તેની તરફ ધ્યાનિત કરી જેણે આકાશો અને ધરતીને પૈઠા કર્યા, હું બાતિલથી હુક્ક પ્રત્યે પ્રવૃત્ત થયો અને હું સુશરિકો પૈકી નથી. બેશક મરી નમાજ તથા કુરખાની

અને માર્દં જુંહું તથા મરવું અવ્યાહ માટે છે જે સમસ્ત જગતનો રઘુ છે. તેનો કોઈ શરીરક (લાગીદાર) નથી અને મને તેનો જ હુકમ થયો અને હું મુસલમાનો પૈડો છું.)

તે પણી “મિસ્ટિમિલ્લા હે અહ્માહો અકુમર” કહેતાં બદુજ તેજ (ધારદાર) છરીથી બહુ જાપથી જુંહ કરો હો કે ગર્દનની ચારે નસો કપાઈ જાય, વધારે હાથ ન ફેરવો કે વગર કારણુની તકદીએ કે.

(૧૦) બેહતર એ છે કે જુંહ કરવાના સમયે જાનવરના બને હાથ એક પગ ખાંધાલો, જુંહ કર્યા પણી છેડી નાખો.

(૧૧) કુરખાની માટે ઊંટ હોય તો તેને જાલો, રાખીને છાતીમાં ગળાન છેઢા પર તકધીર કહીને, લ લો, મારો કે સુતત એમજ છે. તેને “નકર” કહે છે, અને તેનું જુંહ કરવું મકરહ, પરંતુ હલાલ, જુંહથા પણ થઈ જશો. જો જુંહ કરે તો ગર્દન પર એક જ સ્થળો તેને પણ જુંહ કરે જ હેલોમાં જે મશહૂર છેકે, ઊંટ ત્રણ જરૂ-એ જુંહ થાય છે. બોંદં નાથા સુન્નત નિર્દ્રદ્ર છે અને મદતનું કષ્ટ તથા મકરહ છે.

(૧૨) જે જાનવર જુંહ કરવામાં આવે જ્યાં સુધી ઠંડું ન પડી જાય તેનું ચામડું ન જિતારો, ન અવયવો કાપો કે ઈંજા છે.

(૧૩) આ કુરખાની કરીને પોતાની અને સધળા સુસલમાનોની હજજ તથા કુરખાની કુણૂલ થવાની હુઅા માગો.

(૧૪) હજક તથા તકસીર : કુરખાની પણી કિલ્વા રખ એચીને પુરુષ હજક કરે અર્થર્ત સધળું માથું મુંડાવે કે અર્દજલ છે, અથવા.

વાળ કટરાવે કે એની ઇખસત છે. એસરતોનું વાળ સુંડાવવું હશામ છે. એક લટ બરાબર વાળ કટરાવી લે સુદ્ધરિદ જે કુરખાની કરે તો તેના માટે સુસ્તહબ એ છે કે કુરખાની પછી હલક (માથું સુંડન) કરે અને જો હલક પછી કુરખાની કરી તો પણ વાધો નથી અને તમતોએ તથા કિરાનવાળા પર કુરખાની પછી હલક કરવું વાનિબ છે. અર્થાત જે કુરખાનીથી પહેલા માથું સુંડાવશે તો દમ વાનિણ થશે.

મસાલા-(૧) : વાળકટરાવો (છંટાવે) તો માથામાં કેટલાં વાળ છે તે પૈકી ચાથા ભાગના કટરાવવા જરૂરી છે. માટે એક પોરાથી વધારે કટરાવો કે વાળ નાના મોટા હોય છે શક્ય છે કે ચાથા ભાગના વાળોમાં સૌ એક એક પોરા ન કરાય.

મસાલા-(૨) : માથું સુંડાવવા અથવા વાળ કટરાવવાનો સમય નડુરના દિવસો છે, અર્થાત-૧૦-૧૧-૧૨ ચાંદના તારાખ અને અફઝલ પહેલો દિવસ અર્થાત દસમો જિલ હિંજાહ છે. (આલમગીરી)

મસાલા-(૩) : જન્મારે એહેરામથી બદાર થવાના સમય આવી ગયો તો હુદે એહેરામવાળા પોતાનું અથવા બીજાનું માથું સુંડી શકે છે, જે કે તે બીજે પણ એહેરામવાળો હોય. (મિનાસિક).

મસાલા-(૪) : જેના માથા પર વાળ ન હોય તેણે અસ્તરો ફેરવડાવવો વાનિબ છે અને જે વાળ છે પરંતુ માથામાં ફેદ્દાઓ છે જેના કારણે સુંડાવી શકતો નથી. અને વાળ એટલા મોટા પણ નથી કે કટરાવે

તો આઉઝરના કારણે તેનાથી સુંડાવવું અને કટરાવવું સાકોત (જવાબદારી ઉત્તરી ગઈ) થઈ ગયું તેને પણ સુંડાવવાવાળાઓએ અને કટરાવવાવાળાઓની જેમ સૌ વસુદેશો હુલાલ થઈ ગઈ પરંતુ બેહતર એ છેકે નડુરના દિવસો પૂરા થવા સુધી નિયમાનુસાર રહે. (આલમગીરી).

મસાલા-(૫) : જે ત્યાંથી કોઈ ગામ વિગેરે ચાલ્યો, એવા સ્થળે ચાલ્યો ગયો કે, ન હજામ મળે છે ન અસ્તરો કે કેંચી પાસે છે કે સુંડાવી લે અથવા કટરાવતો આ કોઈ ઉઝર નથી. સુંડાવવું અથવા કટરાવવું જરૂરી છે. (આલમગીરી) અને એ પણ જરૂરી છે હરમથા બાંન સુંડાવવું અથવા કટરાવવું ન થાય, બલકે હરમના (હુદોની) અંદર થાય કે તેના માટે આ જગ્યા ખાસ છે, હરમથી બહાર કરશે તો દમ વાનિભ આપશે.

(મનાસિક)

મસાલા (૬) : આ પ્રસંગે માથું સુંડાવવા પછી મૂછે કટરાવવું, હુદી નીચેના વાળ સાંચ કરવું સુસ્તહબ છે અને દાઢીના વાળ ન લે અને લ્ંઘા તો દમ વિગેરે વાનિણ નથી. (આલમગીરી)

મસાલા (૭) : જે વાળ ન સુંડાવ્યાં ન કટરાવ્યાં તો કોઈ વસ્તુ જે એહેરામમાં હશામ હતી, હલાલ ન થઈ. જે કે તવાં પગુ કરી લીધે હોય તો પણ (આલમગીરી)

મસાલા (૮) : જેખારમીતારીખ સુધી હુલક તથા કસર ન કયું તો દમ વાનિભ આવશે કે તેના માટે આ સમય સુકર્રર (નાંદી) છે. (રંદુલ સુહતાર)

(૧૫) હુલક હોય કે તકસીર (વાળોનું કટરાવવું) જમણી બાળુએથી શરૂ કરો (અર્થાત સુંડાવવાવાળાની જમણીભાળુ) એજ હુફિસથી સાખિત છે અને ઈમામેય જમે પણ એવું જ કુઝું માટે ડેટલીક કિતાયોમાં ને હળવમની જમણીભાળુથી શરૂ કરવાનું બતાવ્યું છે સહીહ નથી) અને તે સમયે અદલાહો અકબર અદલાહો આકબર લાઈલાહો દિલ્હીલાહો વલસાહો અકબર અદલાહો અકબર વદિલ્હાહિલાહું કહેતા નવ અને દ્વારેણ થવા પછી પણ કહો અને હુલક અથવા તકસીર સમયે આ હુઓ પછો અને સૌ સુસલમાનેની બજશીશાની હુઓ કરો.

અદહુમ્હો લિલાહિ અલા માહદાના વ અ-અમ અસૈના વ કહું અનના નોસોઇના, અદલ હુમ્મું હું તાસેયતી ષેયદેકા ઇજ અલદી બેકુલ્સે શાયરતિન નૂરંયૌમદીયા-મતે રમ્હો અ-ની ષેહાસૌયેબલન વરદાલી ષેહેમા દરજતન શીજજનતીદાલાસેયતે અદલાહુમ્મ બાર્ક લો કી નઈસી વ તક જખલ (મનની) અદજાહુમ્મઝીરલી લિલસુહ લેકીન વલસુકુસરીન યા નાસેઅલમ રેરતે અ મીન.

તરજુમો : હુંદ છે અદલાહુ માટે તેના પર કે તેણે અમને હિંદાયત કરી અને ઈનામ કુઝું અને અમારી ઈભાદતો પૂરી કરાવી દીધી. અય અદલાહુ ! આ મારી ચીરી તારા હાથમાં છે, મારા માટે દરેકુ વાળના અદલામાં કિયામતના દિવસે નૂર કર અને તેના કારણે મારો શુનોહ નષ્ટ કરી હે અને જન્નતમાં હરને ખુલંદ કર, ઈલાહી મારા માટે મારા નક્સમાં બરકત, કર અને

મારાથી કખૂલ કર, અય અદલાહુ ! મને અને માથું સુંડાવવાગાંયો અને વાળ કટરાવવા વાળાંને બજશી હો. અય મોટી મગફેરતવાળા, આમીન.)

મસ્તખા (૧) ને સુંડાવવા અથવા કટરાવવા સિવાય ડોઈ ભીજા પ્રકારે વાળ હૂર કરો. દાત ચુના-હડતાલ વિગેરથી તો પણ બાદી છે. (હરે મુખતાર)

(૧૬) વાળ દૃષ્ટન કરી હો અને હુમેશા અદનથી ને વસ્તુ વાળ, નખ, ચામડી જુહા થાય તેને દૃષ્ટન કરી હો.

(૧૭) આહીંચા હુલક અથવા તકસીરથી પહેલા નખ ન કટરાવો ન ખત (ઢાઠો) અનાવો. નહી તો દમબાંજિમ આપશો.

(૧૮) હવે સ્વી (પતની) થી સોહખત કરવા, શહુવતથી તેને હાથ લગાવવા, ચુંબન કરવા, શર્મગાહ જોવા સિવાય ને કાંઈ એહુ-રામ માટે હુરામકુર્દું હતું તે સધળું હુલાલ થઈ ગયું.

તવાઇ ઈર્ઝ :

(૧૯) અદ્દજત એ છે કે આજે દસમી તારીખે જ દ્રાર તવાઇ માટે જેને તવાઇ-જિયારત તથા તવાઇ ઈંકાજા કહે છે, મઙ્ગુર નિયમાનુસાર પૈદલ બાલુઝુ તથા સતરે ચોારત સહિત તવાઇ કરો પરંતુ આ તવાઇમાં ઈજતેખાઅ (ચાહરને જમણી ખગલની નીચેથી લટકાવી રાખવું, એવી રીતે કે જમણો, અલો ઉથાડો રહે તે) નથી.

મસ્તખા-(૧) આ તવાઇ હજનો ભીજે રૂકેન છે તેના સાત દેરા (ચક્કર) કરવામાં

આવશે જેમાં ચાર ઝેરા ઝરજ છે કે તેમના વગર તવાદે થશે જ નહીં અને ન હજ થશે, અને પૂરા સાત ઝેરા કરવું વાળિબ, છે. તો જે ચાર ઝેરા પણી પત્નીથી સંબોગ કર્યો તો હજન થઈ ગઈ પરંતુ દમ વાળિબ થશે. કેમ કે વાળિબ તરક થશું.

(આવભગીરિ)

મસ્તમાલા ૨ : આ તવાદેને સહીહ થવા માટે એ શરત છે કે પહેલા જેહરામ ખાંધ્યો. હોય અને વુકું કરી લીધો હોય અને પોતે કરે. અને જે ડાઈ બીજાએ તેને ખલા પર ઉડાવીને તવાદે કર્યો તો તેનો તવાદે થયો નહીં. પરંતુ જ્યારે કે એ મજબુર વિનશ હોય કે, ચોતે તવાદે કરી શકતો ના હોય, દા.ત. એ હોશ છે, તો તવાદે થઈ જશે. (જૈહરા-રહદુલ-સુહૃત્તાર),

મસ્તમાલા-(૩) : એહોશ માણુસને પીડ ઉપર ઉડાવીને યા કોઈ અન્ય વસ્તુ પર તવાદે કરાંયો. અને તેમાં પોતાના તવાદેની પણ નિયત કરી લીધી તો અન્નેનાં તવાદે થઈ ગયા, અદેને અન્નેના એ પ્રકારના તવાદેશ હોય.

મસ્તમાલા-(૪) : આ તવાદેનો સમય દસમીની તુલુઅ (સવારથી) છે, તેના પહેલા થઈ શકતો નથી. (જૈહરા).

શુસ્તમાલા-(૫) : આમાં બદકે જર્વથા દરેક તવાદેમાં નિયત શરત છે. જે નિયતના હોય તો તવાદે થશે નહીં. દા.ત. દુશમન અથવા ઝાડીખાનાર પ્રાણીઓ નાસીને, ઝેરા કર્યો, તો તવાદે થયો નહીં. અભિવાદ વકુંહે અર્દ્ધ, કે તે નિયત વગર પણ થઈ જાય છે.

પરંતુ એ નિયત શરત નથી કે, આ તવાદે જિયારત છે. (જૈહરા).

મસ્તમાલા-(૬) : ઈંદ્ર અદ્ધા (દુર્ભાનીનો ઈંદ્ર)ની નમાજ ત્યાં પઠવામાં આવશે નહીં. (રહદુલ સુહૃત્તાર).

(૨૦) કાર્ણિન અને સુક્રિદ તવાદે કુદ્રમમાં અને તમતોઓ હજ કરનાર હજના એહરા. મયધી ડોઈ નિદ્રલતવાદેમાં હજના રમત અને સર્દ બને યા ફૂકત સઈ કરી લીધી હોય તો એ તવાદેમાં રમત-સર્દ કાંઈ કરે નહીં. અને જે તેમાં રમત અને સઈ કાંઈ કર્યું ના હોય અથવા રમત કર્યું હોય અથવા જે તવાદેમાં કર્યો હતા તે ઉમરાનો હતો દા.ત; કાર્ણિન અને સુતમતોઓ પ્રથમ તવાદે અથવા તે તવાદે તહીરત (ખુશુ શુસ્તા) વગર કર્યો હતો અથવા શંખાલ મહિનાથી પહેલાના તવાદેમાં કર્યો હતા, તો આ પાંચેય હાલતોમાં રમત અને સર્દ બને આ ઈર્જતવાદેમાં કરે.

(૨૧) અશકત અને સ્વીઽયો જે લોહના કારણે દશમિયો ના જાય, તો તેના પછી અગિયારમિયો અદ્રાવ છે. અને આ તે દિવસે એ મહાન નહોં છે. કેમ કે મતાદે (તવાદેસણ) ખાતી મળે છે. ગણુનીના વીસ ત્રીસ માણુસો હોય છે (આ ગણુની પહેલા જમાનાની હણો, આજે તો હજારદેશની સાંખ્યામાં તવાદે કરનારાઓ દરેક સમયે હોય છે. અસુવાદકો) સ્વીઽયોને પણ ઈતમિનાની સાથે દરેક ઝેરામાં “સ્ફોર્ઝો અસ્વદ” તુંબુંબન મળે છે.

(૨૨) ને અગિયારમીએ ના જય તો, બારમીએ કરી લે, તે પછી કારણું વગર વિલંબ કરવો શુંનોહ છે. જુમના (દંડમાં એક કુરખાની કરવી પડ્યો. હા. દા. ત. ખીને હૈઝ (માસિક) આવી ગયું અથવા નિક્ષાસ આવ્યું, તો તેના ખતમ-ખંધ થવા પર તવાદ્દ કરે. પરંતુ હૈઝ અને નિક્ષાસથી એવા સમયે પાક થઈ કે નહાઈ-થોઈને બારમી તારીએ સ્થાયિત્વ પહેલાં ચાર ફેરા કસી શકે છે તો કરવું વાનિય છે. નહિ કરશે તો શુંનેહગાર થશે. એવી જાતિ ને એન્દ્રાદી સમય તેને મળ્યો હતો. કે તવાદ્દ કરી લેની અને તવાદ્દ કર્યું નહિ, હવે હૈઝયા નિક્ષાસ (પ્રસૂતિ પછીનું બોહી) આવી ગયું તો શુંનેહગાર થઈ (રદ્દુલ-સુહૃતાર).

(૨૩) અહુર હાલ તવાદ્દ કર્યો પછી એ રકાત નમાજ દસ્તુર સુજાય પઢો. ત્યાર પછી સ્વીઓ (પત્નીઓ) હુલાલ થઈ જશે. અને હજાર પુરે થઈ ગયો; કે તેને બીજે રૂકન, આ તવાદ્દ હતો.

મસ્ટાદા : (૭) ને એ તવાદ્દ ના કર્યો તો સ્વીઓ હુલાલ થશે નહિ. ભલેને તેના પર વર્ષો પસાર થઈ જય. (આવમગીરી) (તવાદ્દ જિયારત કર્યો પછી જ પોતાની પત્નીઓથી સોહબત કરી શકો. ને એ તવાદ્દ ના કર્યો હોય તો એવા હાજ માટે પોતાની પત્ની ત્યાં સુધી હુલાલ થશે નહિ જ્યાં સુધી એ તવાદ્દનો રૂકન અદ્દ કરેનહિ.

—અનુવાદકો)

મસ્ટાદા : (૮) લુણુંગાર અથવા જના-ખતમાં તવાદ્દ કર્યો નહિ એહારામથી બહાર

થઈ ગયો, ત્યાં સુધી કે તેના પછો (પત્નીથી) સંસોગ કરવાથી હજાર દ્વારાં થશે નહિ. અને જે ઉંડો તવાદ્દ કર્યો એટલે કે કા'બાની ડાણી બાજુથી તો ઔરતો હુલાલ થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી મજામાં છે તે તવાદ્દનું પુનરાવર્તન કરે અને જે નાપાક કંપું પહેરીને તવાદ્દ કર્યો તો મકરદ્દ થયું અને નમાજ અવરોધક માત્રા પ્રમાણે સતર ઉધાડું રહ્યું તો થઈ જશે; પરંતુ દમ આપવું લાજિમ છે. (આવમગીરી-નૌહરા)

(૨૪) દસમી, અગિયારમી, બારમીની રાત્રિઓ મિનામાંજ પસાર કરવી સુલત છે. ના સુંજ દિવક્રમાં, ના મકડામાં, ના રસ્તામાં માટેને શાખાસ દસમી અથવા અગિયારમીએ તવાદ્દ માટે ગયો તો પરત આવીને રાત્રિ મિનામાં જ જ્યતિત કરે.

મસ્ટાદા (૯) : જે પોતે મિનામાં રહ્યો અને માલસામાન વિગેરે મજાશરોઝ મોકલી હીધો અથવા માલસામાન મજામાં જ છાડીને અરક્ષાતે ગયો તો ને નષ્ટ થઈ જવાને ભય ના હોય તો કરાહુત છે. નહેતર નહિ.

(દર્દેસુખતાર)

(૨૫) “અગિયારમી તારીખ” નમાજે એહાર પછી ઈમામનો ઝુલ્યો સાંભળીને પછી રમી માટે ચ.લો. આ હિવસોમાં રમી, જમરાએ જીલાથી શરૂ કરો. જે મસજુદે એકથી નજીડ છે. તેના રમી માટે મજાના માર્જની તરફથી આવીને ચારાઈ પર ચારો કે આ જગ્યા જમરાએજીકણા કરતા જાંચાણું પર છે. અહિં કિઅલા તરફ મેહુ કરીને સાત કાંકડીઓ મજફુર તરીકાથી મારાને જમરાથી

કાંઈ આગળ વધી જણો અને કિણલા તરફ મોંડું કરીને હુઆમાં આવી રીતે હાથ ઉડાવો કે હુથેલોએ કિણલાની તરફ રહે. હિલની હાજરી સાથે મન લગાવીને હસ્ત, દર્દદયરીએ અને ઈસ્ટગદ્વારમાં કમથી કમ વીસ આયતો પદ્ધબાના પ્રમાણમાં પ્રવૃત્તમય રહે. નહિલર પોણો સુપારો અથવા સુરએ બકરાની મિકદાર માત્રા સુધી.

(૨૬) પછી “જમ્રાચો તુસ્તા” પર જહને એવું જ કરો

(૨૭) પછી જમ્રાચો ઉક્ખા પર પરંતુ અહીં રમી કરીને થેલો નહિ તરત જ પાછા કરી જવ. પાછા ઝરતાની સાથે જ હુઅા કરો.

(૨૮) બિલકુલ એવી જ રીતે ભારમી તારી જ જવાલ પછી ત્રણે જમ્રાચોની રમી કરો. કેચવાક લોડો બપોરથી પહેલાં, આને રમી કરીને મજ્જા સુઅઅભમાની તરફ ચાલી નીકળે છે, આ અમારા મૂળ મજહબ વિડુદ છે અને એક અહીંક રિવાયત છે. તમે એના પર અમલ કરો. નહિ.

(૨૯) ભારમીની રમી (શેનાનોને કાંકરીએ મારવાની વિધિ) કરીને સૂર્યાસ્તથી પહેલા ઈખીયાર છે કે, મજાસુઅઅભમાએ રવાના થઈ જવ. પરંતુ સૂર્યાસ્ત પછી ચાહ્યા જવું તે એખવાળું છે, માટે એક હિવસ વધારે થોખવું, અને તેરમીએ દસ્તુર પ્રમાણે બધોર ઢળી ગયા પછી રમી કરીને મજ્જા જવાતું થશે, અને એજ અફુલ છે. પરંતુ સામાન્ય લોડો ભારમીએ ચાહ્યા નાય છે. તે કારણે એક શાન્તિ-હિવસ વધારે

નિવાસ કરવામાં નાની જમાયતુ (થોડા લોડો)ને થોડી દિક્કત-તકલીફ પડે છે. અને જે તેરમીની સવાર થઈ ગઈ તો હુએ રમી કર્યી વિગર જવું જાહેર નથી. જે ચાહ્યો જશે તો “હમ” આપરો વાજિણ થશે. દસ્તીની રમીનો સમય ઉપર મજહુર થયો. અગિયારમી ભારમીનો સમય સૂર્ય દળયા પછીથી સવાર સુધી છે. પરંતુ રાત્રિમાં એટલે કે સૂરજ આથની ગયા પછી મકરૂહ છે અને તેરમીની રમીનો સમય સવારથી માંડી સૂર્યાસ્ત સુધી છે. પરંતુ સવારથી સૂર્ય દળવા સુધી મકરૂહ વખત છે. સૂરજ હુઅવા પછી મકરૂહ છે અને તેરમીની રમીનો સમય સવારથી સૂરજ હુઅવા સુધી છે. પરંતુ સવારથી સૂરજ દળવા સુધી મકરૂહ સમય છે. તેના પછી સૂર્યાસ્ત સુધી મસનૂન છે માટે જે પહેલી ત્રણુ તારીખો ૧૦-૧૧-૧૨થી રમી હિવસમાં ન કરી હોય તો રાતમાં કરી લે પછા જે ઉજર વગર છે તો કરાહત છે, નહી તો કાંઈ નથી અને જે રાતમાં પણ ન કરી તો કાજા થઈ ગઈ હુએ ખીલ હિવસે તેની કાજા આપે અને તેના માથે કફકારો વાજિખ થયો. અને તેની કરી નો પણ સમય તેરમીના સૂર્યોસ્ત સુધી છે. જે તેરમીએ સૂરજ દૂધા ગયો અને રમી ન કરી તો હુએ રમી થઈ શકતી નથી કંને હમ વાજિખ થયો. (રદુલમુહુતાર)

મસ્તાદા (૧) : જે બિલકુલરમી ન કરી તો પણ એક જ હમ વાજિખ થશે. (મનાસિક)

મસ્તાદા (૨) : કાંકરીએ ચારે હિવસો માટે લીધી હતી અર્થાત સિસ્ટેર (૭૦) અને

ખારમી નીરમી કરીને મહો જવા છંચે છે તો જે ખીજને જરૂરત હોય તો તેને આપી હો, નહીં તો કોઈ પાક જગ્યાએ નાખી હો વધેલ કાંકડીએં જમરાએં પર ઈંડિયું મકરૂહ છે, અનેદેન કરવાની પણ જરૂરત નથી. (મનાસિક)

મસ્તાકા (૩) : રમી પયદલ પણ જઈજ છે અને સવાર થઈને પણ પરંતુ અદ્દજલ એ છે કે પહેલા અને ખીજ જમરાએં પર પયદલ રમી કરે અને ગ્રીલની સવારી પર (ફરેં સુખતાર વિગેરે)

મસ્તાકા (૪) : જે કાંકડી કોઈ શરૂસની પીડા અથવા કોઈ ખીજ વસ્તુ પર પડી અને ચોટેલી રહી ગઈ તો તેના બદ્દાની ખીજ મારે અને જે પડી ગઈ અને ત્યાં પડી જ્યાં તેની જગ્યા એ અથડિ જમરાથી વણું હાથના અંતરની અંદર, તો જઈજ થઈ ગઈ. (આદમગીરી)

મસ્તાકા (૫) : જે કાંકડી કોઈ શરૂસ પર પડી અને તેના પરથી જમરાને વાંચી તો જે અભર હોય કે તેને હડાવનાથી જમરા પર પહોંચી તો તેના અફલે ખીજ કાંકડી મારે અને અભર ન હોય તો પણ જાવધાનીએ છે કે ખીજ મારે, એમજ જે શાંકા હોય કે કાંકડી પોતાની જગ્યા પર પહોંચી કે નહીં તો પુનરાવર્તન કરે (મનાસિક)

મસ્તાકા (૬) : તરતીભની વિરુદ્ધ રમી કરી તો ખણેતરથો છે કે પુનરાવર્તન કરે અને જે પહેલા જમરાની રમી ન કરી એને ખીજ ગ્રીલ ગ્રીલની કરી તો પહેલા પણ મારીને કરી ખીજ અને તીસરા પર મારી

દેવું ખણેતર છે, અને જે ગણુ-ગણુ કાંકડીએં મારી છે તો પહેલા પર ચાર ખીજ મારે અને ખીજ-ગીજ પર સાત સાત અને જે ચાર-ચાર મારી છે તો દરેક પર ગણુ-ગણુ ખીજ મારે અને સારું એ છે કે કૃશીથી રમી કરે અને જે એમ ડિયું કે એક એક કાંકડી ગણુ પર મારી આવ્યો પછી એક એક એમજ સાત વખતમાં સાત સાત કાંકડીએં પૂરી કરી તો પહેલા જમરાની રમી થઈ ગઈ અને ખીજ પર ગણુ ખીજ મારે અને ગ્રીલ પર છ તો રમી પૂરી થઈ ગઈ. (આદમગીરી)

મસ્તાકા (૭) : જે શરૂસ ખીમાર હોય કે જમરા સુધી સવારી પર પણ જઈ શકતો ન હોય તે ખીજને હુકમ આપી હો કે તેની તરફથી રમી કરે અર્થાત જ્યાદે કે ખુફ રમી ન કરી હોય અને જે એમ ડિયું કે એક કાંકડી પોતાની તરફથી મારી પછી એક ખીમારની તરફથી એમજ સાતવાર ડિયું તો મકરૂહ છે, અને ખીમારના હુકમ વગર રમી કરી હીધા તો જઈજ થઈ નહીં. અને જે ખીમારમાં એટલી શક્તિ નથી કે રમી કરે તો ખણેતર એ છે કે, તેનો સાર્થી તેના હાથ પર કાંકડી મૂકી રમી કરાવે, એમજ એહેંશ અથવા પાગલ અથવા ના સમજ તરફથી તેના સાથવાળા રમી કરા હો અને ખણેતર એ છે કે તેમના હાથ પર કાંકડી મૂકને રમી કરાવે (મનાસિક)

મસ્તાકા (૮) : ગણીને એકવીસ કાંકડીએં લઈ ગયો અને રમી કરવા ગઈ જુયે છે કે ચાર વધી છે અને એ યાહ નથી

કે કયા જમરા પર એઠી નાણી તો પહેલા પર આ ચાર કાંકરીઓ મારો અને બંને પાછકાંદો પર સાત સાત અને જે ગણ વધી છે તો દરેક પર એક એક અને જે એક યાહ હેઠળ તો પણ દરેક જમરા પર એક એક મારે (ફેટહુલકડીર)

(૩૦) રમીથી પહેલા હલક (માથું સુંડાવવું) જાઈજ નથી.

(૩૧) અગ્નિયારમી-ભારમીની રમી એ પહેલા (બપોર)થી પહેલા મૂળભૂત રીતે સહીહ નથી.

(૩૨) રમીમાંભાર ચીઝો અકડુહ છે રમીમાં આ વસ્તુઓ મકડુહ છે.
 (૧) હલમીની રમી સૂર્યાંત્રિક પછી કરવું
 (૨) તેરમીની રમી બપોર થી પહેલાં કરવું
 (૩) રમીમાં મોટો પત્થર મારવું (૪) મોટો પત્થરને તેડીને કાંકરીઓ ગનાવવું (૫) મસ્તિજદની કાંકરીઓ મારવું (૬) જમરાના નીચે જે કાંકરીઓ પડી છે તે ઉપાડીને મારવું કે આ મરહુદ કાંકરીઓ છે, જે કષ્યુલ શાય છે તે ઉઠાવી લેવામાં આવે છે. કથામત ના દિવસે નેકીઓના પદ્ધામાં મૂકવામાં આશે. નહી તો જમરાઓની આસપાસ પહાડો થઈ જતા, (૭) નાપાડ કાંકરીઓ મારવું (૮) સાત કરતાં વધારે મારવું (૯) રમી માટે જે દિશા મજાર થઈ તેના વિરદ્ધ કરવું (૧૦) જમરાથી પાંચ હાથના અંતરે ઉલા રહેવું (તેનાથી) વધારેનો વાંધો નથી (૧૧) જમરાઓમાં તરતીબ (કમ)ની વિરદ્ધ કરવું (૧૨) મારવાના બદલે કાંકરી જમરા પાસે નાણી હેવું.

(૩૩) મહકા મોઅઝમા માટે રવાનગી

છેદા દિવસે અર્થાત બારમી કે તેરમીએ જ્યારે ભિનાથો દુઃખસ્ત પદ્ધને મહકા મોઅઝમા ચાલો વાંદીએ મહસુખમાંકે જનતુલ જનતાની નિકટ છે, સવારી પરથી જિતરી જાત અથરા વગર જિતરે થોડીક વર થોળીને હુચા કરે. અને અંજલ એ છે કે ઈશા સુધી નમાજો આહીંયાં પઢા, એક ઉંઘ દઈને મહકામોઅઝમામાં ફાખત થાં.

નોટ : જનતુલ જનતા (ઉચ્ચયજ્ઞનત) કે જે મહકાઓઅઝમાનું કથરસ્તાન છે તેની પાસે એક પહાડ છે અને બીજો પહાડ તે પહાંની સામે મહકા જતાં જમણા હાથ પર નાંણાના પેટથી જુહો છે. આ બને વચ્ચેનું નાળું વાંદીએ મહસુખ છે. જનતુલ જનતા મહસુખમાં ફાખત નથી.

(૩૪) ઉમરા

હુચે તેરમી પછી જ્યાં સુધી મહકામાં રોકાવ પોતાના અને પોતાનાપીર, ઉસ્તાદ, માંભાપ, સુસૂસન હુઝૂરપુરનૂર સૈયદેશાલમ સહ્લવલા હો. તથાલા અલયહેવસહ્લવમ અને આપના અસહ્યાં તથા એહુદે બયત તથા હુઝૂર ગૌધેયાજમ રહીયલ્લાહો. અન્હુમની તરફથી જેટલા થઈ શકે તેટલા ઉમરા કરતા રહેણો. તનઈમકે જે મહકા મોઅઝમાથી દક્ષિણામાં અર્થાત મહીના તથાયાહ તરફ ગણ માઈલના અંતરે છે, જાવ, ત્યાંથી ઉમરાનો એહુરામ જેવી રીતે ઉપર બયાન થયો છે બાંધીને આવો અને તવાઇ તથા સઈ નિયમાનુસાર કરાને હુલક અથવા તકરીર કરી લો, ઉમરા થઈ ગયો. જેણે

હુલક કરાવી લીધું અને એજ દિવસે થીને ઉમરો કચ્છે તે માથા પર અસ્તરો હેઠાં લેવડાવે, કાઢી છે એવી જ રીતે તે શાખસ જેના માથા પર કુદરતીનાળ ન હોય (તે પણ અસ્તરો હેઠવી લેવડાવે).

(૩૫) મંજુ મોઅઝમામાં એથામાં એછું એક ખર્મે કર્યાનથી મહરમ ન રહે.

(૩૬) જનતુલ મઅલા હાજર થઈને ઉમ્મુકમેભિનીન હાજરત ખીજતુલ કુદ્રાં તથા ભીજાદીન થાયેલાએનો જિયારત કરે.

(૩૭) સુતખર્રોક સ્કળોની જિયારત :

(૧) હુલુરે અકદસ સલ્વલ્વાહો અદ્યા વસલ્વલમના વિલાદતનું મકાન (જનમસ્થળ) (૨) હાજરત ખીજતુલકુદ્રા રહીયલ્વાહો અનહાતું મકાન (૩) હાજરતઅલી રહીયલ્વાહો તાદાલાની વિલાદતનું મકાન (જનમસ્થળ) જખલે સોર તથા જખલેહિરા મસ્તિજહુવજિનન તથા મસ્તિજહે જખલે અણીકુણીસ વિગેરે પ્રવેશ સ્થળોનો પણ જિયારતથી સન્માનિત થાન.

(૩૮) હાજરત અણુલ સુતલિભના (મજારની) જિયારત કરે. અને અણુતાદ્વિ બની કંદ્ર પર ન જાવ. એવી જ રીતે જિદ્દુહમાં જે લોકોએ હાજરત ઉમ્મોનાઅભી હુવા રહીયલ્વાહો અનહાતો. મજાર કેટલાએ સોહાથેનો બનાવી રાખ્યો છે, ત્યાં પણ ન જાવ કે એ અસર છે. [આની કાઈ સાબિતી નથી]

(૩૯) કા'ખા મોઅઝમાનો પ્રવેશ

કામામોઅઝમાનો પ્રવેશ સદ્ગુલાય છે, જે જાઈ રીતે પ્રાણ થાય. મહરમમાં

આમ પ્રવેશ થાય છે પરંતુ સખત કશમણ રહે છે, કમજોરનું તો કામજ નથી, ન એરતોને એવી બીજમાં હિંમત કરવાની ઈજાત. મજારુત પુરુષ જે પેતે કષ્ટથી બચ્ચી પણ ગયો તો બાનાઓને ધક્કા મારા ઈજા પહોંચાડશે અને એ જઈજ નથી. ન એવી રીતનો હાજરામાં કાઈ આનંદ મળે અને પ્રવેશ વગર લેનદેન પ્રાપ્ત નથી અને તેના પર લેવું પણ હરામ, આપવું પણ હરામ, હરામદ્વારા એક મુસ્તાહબ મજયું પણ તો તે પણ હરામ થઈ ગયું આ ઉપરદ્વારા મુક્તિ ન મળે, તો હતીમની હાજરા ગનીમત સમલે, કે તે પણ કા'ખાના જ જમીન છે અને જે કદાચ શક્ય હોય કે કા'ખાના આહિમોથી નક્કી થઈ જય કે પ્રવેશના બદ્લામાં કાઈ આપીશું નહીં, તે પછી અથવા પહેલા લબે હજરો રૂપીયા આપી હો તો સ પૂર્ણ બદ્ભર્થી આહિરતથા બાતિનની રિચાયતથી આચોનીચે કરેલ, ગર્દન જુડાવેલ, શુનાહો પર શરમાતા રણયુક્તિજરૂરા જલલથી કાંપતા મિસમાલ્વાહ કહીને પ્રથમ સીપો (જમણી) પગ અગળ કરો દાનલ થાવ અને સામેની દીવાલ સુધી એટલા આગળ વધ્યો કે ત્યા હાથતું અંતર રહે. ત્યાં એરકાત નિર્દેશ મકર્દહયમય સિવાય પઢો કે નમાએ કરીમ સલ્વલ્વાહો અદ્યા હે વસલ્વલમે તે સ્થળો નમાજ પઢી છે, પછી દીવાલ પર ગાલ અને મૂખ સુકીને હુમ્દ તથા હુર્દ તથા હુઅમાં કાશાશ કરે. એવી જ રીતે આચોની રાખા ચારે ખૂણુંઓ પર જાવ અને હુગા કરો અને થાંકલાએથી ચાંડો અને પછી આ હોલત મળવા અને હજજ તથા જિયા-

રતની કષુદ્રીયત સ્વીની) માટે સ્વીકારની હુચા કરે। અને એવી જ રીતે આપે। નીચા રાખી પાછા આવો। ઉપર અથવા આમતેમ હરગિજ ન જુચો। અને મોટા ઇજલની આશા કરે। કે તે ઈંમાંથી છે— ‘વસુન દાખલાણું કાન આમનન’ કે આ ધરમાં દાખલ થયો તે અમાનમાં છે. ‘બલહરુંજિલલાહે’

(૪૧) હુમૈત શરીરેનના તાર્ડેકાત

વધેલી ભત્તી વિગેરે ને અહીંયા અથવા મહીન, તૈયેબાહમાં આહિમે। આપે છે હરગિજ નલો, બલકે પોતાના પાસેથી ભત્તી ત્યાં રોશન કરાને બાકીની ઉઠાવીલો.

મસ્ટઅલા (૧) : ગિલાદે કાબા ને એક વષ્ણ પછી બદલવામાં આવે છે અને ને ઉત્તારવામાં આવેલ કુકરાઓને વહેંચી દેવામાં આવે છે તેને તે કુકરાઓ (નિર્ધિના) થી ખરીદી શકો છો. અને ને ગિલાદે ચઢેલો છે તેમાથી લેલું લઈજ નથી બલકે ને કોઈ કુકરા જુદો થઈને પડી જાય તો તેને પણ ન લો અને લો તો કોઈ ક્ષીરને આપીદો.

મસ્ટઅલા : (૨) કા'બા મોઅઝમામાં ને ખુશ્યુ નાગેલો હોય તેને પણ લેલું જેઈજ નથી અને લિધો તો પાછો આપી હો અને હંચા હોય તો પોતાની પાસેથી ખૂશ્યુ લઈજ નીંને રગડી લાવો.

(૪૨) જયારે રખસતનો ઈરાહો થાય તવાદે વિહાઅ રમલ તથા સઈ તથા ઈજતે-બાબા વગર અજાવી લાવો કે બહુરવાળાઓ પર વાજિબ છે. હા, રખસતના સમયે ઔરત હૈજ અથવા નિકાસથી હોય તો તેના પર તવાદે વિહાઅ નથા. નેણું કેવળ ઉમરો કર્યો

છે તેના પર આ તવાદે વાજિબ નથી. તવાદે પછી નિયમાનુસાર ઐરકાત નમાજ સુકામે ઈશ્રાહીમાં પઢો.

મસ્ટઅલા (૧) : સિક્ર (પ્રવાસ) ને ઈર હો હતો રખસતનો તવાદે કરી લિધો કોઈ બરણોસર થોલી ગયા, જેઠકામત (રહેના) ની નિયત ન કરી તો એજ તવાદે કાઢો છે પરંતુ સુસ્તહબ એ છે કે ફરીથી તવાદે કરે કે પાછલું (અંતિમ, કામ તવાદે રહે, (આલમગીરી વિગેરે)

મસ્ટઅલા (૨) : મછારવાળા અને મીકાતની અંદર રહેવાળા પર રખસતનો તવાદે વાજિબ નથી (આલમગીરી)

મસ્ટઅલા (૩) : બહુરવાળાએ મછામાં અથવા મછાની આસપાસ મીકાતની અંદર કોઈ સ્થળે રહેવાનો ઈરાહો કર્યો અર્થાત એ કે હવે અહીં જ રહેશે તો ને ખારમી તારીખ સુધી એ નિયત કરી લિધી તો હવે તેના પર આ તવાદે વાજિબ નથી અને તેના પછી નિયત કરી તો વાજિબ થઈ ગયો અને પ્રથમ સૂરતમાં ને પોતાના ઈરાહાને તોડી નાખ્યો અને ત્યાંથી રખસત થયો તો તે સમયે પણ વાજિબ થશે નહીં (આલમગીરી)

મસ્ટઅલા (૪) : વિદાયના તવાદેમાં નઈસે-તવાદેની નિયત જરૂર છે. વાજિબ તથા રખસતેનિયતમાં હોવાની જરૂરત નથી ત્યાં સુધી કે ને નિકલનાનિયતથી કર્યો વાજિબ અદ્દ થઈ ગયું. (રદ્દુલ સુહતાર)

મસ્ટઅલા (૫) : હૈઅનાગી ઔરત મછા-મોઅઝમાથી જવાથી પહેલા પાક થઈ ગઈ

તો તેનો પર આ તવાદું વાજિબ છે અને જો જવાના (ગયા) પછી પાક થઈ તો તેને એ જરૂરી નથી કે પાછી આવે અને પાછી આપીનો તવાદું વાજિબ થઈ ગયો, જ્યારે કે મીકાતથી અહાર થઈ ન હતી અને જો જવાથી પહેલા હેઠળ અતિમ થઈ ગયું પરંતુ ન શુસલ કર્યું હતું ન નમાજનો એક અમય શુજયો હતો તો તેના ઉપર પણ પાછા આવવું વાજિબ નથી.

(આલમગીરી)

મસ્ટાદા (૬) : જો “ઝખસતના તવાદું” વગર ચાલ્યો ગયો તો જ્યાં સુધી મીકાતથી અહાર ન થયો, પાછા આવે અને મીકાતથી અહાર થયા પછી યાદ આવવું તો પાછા આવવું જરૂરી નથી અને “હમું” આપી હો અને જો પછો કરે તો ઉમરાનો એહરામ બાંધીને પાછા કરે અને ઉમરાથી ફારેગ થઈ ઝખસતનો તવાદું અજાતી લાવે અને એ સુરતમાં “હમું” વાજિબ થશે નહીં.

(આલમગીરી, રદ્ડુલમુહુતાર)

મસ્ટાદા (૭) : તવાદું ઝખસતના વચ્ચે દેરા છોડી દીધા તો હરેક દેરાના અદ્દે સંદર્ભે આપે.

(આલમગીરી)

(૮૩) ઝખસતના તવાદું પછી અમઝમ પર આપી એવી જ રીતે પાછી પીચે, શરીર પર નાણે.

(૮૪) પછી કાંખાના દરવાજાની સાથે ઉલો રહીને આસ્તાનએ પાકને બોસો આપે અને હજાજ તથા જિયારતના કણુલ્લીયત (સ્વીકાર) માટે અને વારંવાર હાજરાની હુઅ માંગે અને એજ જામેઅહુઅ પછે અથવા એ પઢે.

અસ્સાધનો ષેખાણેકા યસ્યાદેલાકા મિન ઇલેકા વ મઅરસ્ટેકા વ યજ્ઞું રહેમતકા.

તરજુમો : તારા દરવાજા પર સાઈન તારા ઇઝલ તથા એહુસાનનો સવાલ કરે છે અને તારો રહેમતનો ઉમેદવાર છે.

(૮૫) પછી સુલતાંજિમ પર આવીને ગિલાઇકાણા પકડીને એવી જ રીતે ચાંદો, જિક, હુર્દ તથા હુઅની અધિકતા કરો તે સમયે આ હુઅ પડો.

અદ્દુલ્લાહિદિનજી હુફાના લેખાઝા વભાકાના કુના લે નહૃતદ્વારા લોલા અન હુફાનદસાહુ અદનાહુદમ ઇકમા હૈતના સેહાઝા ઇતકામજલહુ મનના વજા તજય હુફાઝા આભિરદય્યાહુ મિન ષેનેદ્દ્દુરામે વરલુકનીદયૌહા ઇલેછે હતા તર્દી બે રહેમ તેકા યા અહુમર્રાહમીન વલહુદ્દો લિલલાહુ રમાણાદયાલમીન. વસદલલાહો તમાલા અદ્દાસૌયહના સુહુમદિનયામીહ પ સહેલ્લિ અજમણી.

તરજુમો : હુમદ છે અદ્વાહ માટે જેણે અમને હિદાયત કરો. અદ્વાહ અમને હિદાયત ન કરતો તો અમે હિદાયત ન પામતા, ઈંગ્રાહી જેવી રીતે અમને તે આની હિદાયત કરી છે તુ કન્યુલ દરમાણ અને બયતુલહુરામાં આ અમારી અભારી હાજરી ન કર અને તેની તરદ્દ કરી પાછા ઇલું અમને નથીમ કર કે જેવી તુ પોતાની રહેમતના કારણે રાઝી થઈ જ, ચાય સવાળ મહેરમાનો કરતાં અધિક મહેરમાન અને હુમદ છે અદ્વાહ માટે જે રણથ છે. સમસ્ત જહાંનો અને અદ્વાહ હુર્દ મોદલે અમારા જરદાર મોહમ્મદ અને તેમની આલ તથા અસ્સાખાખ સૌ પર.

(૪૬) પછી હજરે અસ્વદને માસો આપે અને જે આંસુ ધરાવો છો, પાડો (અર્થાત રડો) અને આ પઢો : -

યા આમીનલક્ષાહે ઝી અદેહિ ઈન્ની
ઉશહેરોકા વક્ફા બિલક્ષાહે શાહીદા ઈન્ની
અશહેરો અલ લાઈકાહો ઈલ્લલક્ષાહે વ
અશહેરો આતન સુહમભન રસ્તુલુલક્ષાહે વ
આતા એચેદે એકા હાજેહિ અશાહાહતા
દે તરફદા લી ઐહા ઈન્દ્રલક્ષાહે તાચાલા ઝી
યૌમીલકીયામતે ચૌમ લેઝુલિયાંદર
અલ્લાહુમભની ઉશહેરોકો અલાઅલિકા
વ ઉશહેરુદમલાધિક અલ્લેરામ વસલક્ષાહે
આદા સૌચેહના સુહમભન વ્યાલેહિ
વસહણેહિ અજમદિન.

તરજુમો : અય જમીન અલાહ ના
ચેમનમાં તને ગવાહ કરું છું અને
અલાહની ગવાહી કાશી છે કે હું તેની
ગવાહી આપું છું કે અલાહ સિવાય કોઈ
મઅભૂત નથી અને મોહમ્મદ સલ્લાલાહો
અલયહે વસલમ અલાહના રસ્તુલ છે અને
તારી પાસે આ શહાહત (સાક્ષી)ની અમાનત
સુકુ છું કે અલાહની નજીહિક કિયામતના
દિવસે કે જે દિવસે બહુ ગલરાટ હોશે, તું
મારી શહાહત આપશો, અય અલાહ હું
તને અને તારા ઇરિરતાઓને તેના ઉપર
ગવાહ કરું છું, અલાહ હુદદ મોકલે
અમારા સરદાર મોહમ્મદ સલ્લાલાહો
અલયહે વસલમ અને તેમની આલ તથા
સૌ અસહાય પર.

(૪૭) પછી પાછા પગે ડાખા પ્રતિ
ખ. શ. ૧૩

મૂખ કરીને અથવા સીધા ચાલમાં ફરી ફરીને
કા'ખાને હસરત (અલિલાખા)થી લેતા તેની
જુદાઈ પર રડતા અથવા રડવા જેલું મેંદું
કરીને મદિજાહે કરીમના દરવાજાથી ડાખા
પગ પહેલા આગળ વધારીને નિકળો અને
મજૂર હુએ પઢો અને તેના માટે ખડેતર
બાખૂલ હજવરહ છે.

(૪૮) હેઠ તથા નિકાસવાળી ઔરત
મદિજાહના દરવાજા પર ઉલ્લી રહીને હસરતની
દરિથી જુદે અને હુએ કરતી પાછી ફરે.

(૪૯) પછી શહિત અનુસાર મજૂદાના
કુકરાએ (ગરીણા) પર તસ્વીદ (પુષ્ટિ)
કરીને મહીના તચ્યબાના સરડારે આ'ગમ
પ્રયે ધ્યાનિત થાય.

કિરાનનું ખચાન

અલાહ અભજવ જરૂર ફરમાવે છે.
“એ આતીમ્ભૂલહજજ વહૃપ્રતા લિલ્લાહે”

અર્થ : (અને અલાહ માટે હજજ
તથા ઉમરાને પુરા કરો.) અભૂલહજ તથા
નિસાઈ તથા ઈજનેમાળ સુખણી બિન
મઅભાદ તગલથી રાવી કરે છે શેં હજજ
તથા ઉમરાનો એક સાથે એહરામ બાંધ્યો,
અમીરુલ મોમેનીન ઉમરક્કારું રહીયલાહો
અન્હોએ ફરમાયું તે પોતાના નણી
મોહમ્મદ સલ્લાલાહો અલયહે વસલમની
પેરવી કરી, સહીહ બુખારી તથા સહીહ

મુસ્લિમમાં અનસ રવીયદ્વાળો અન્હોથી રિયાયત છે તેઓ હોણે છે, માં રસૂલુલ્લાહ સદ્ગુરુદ્વાળો અલયણે વસ્તુદ્વારને સાંભળ્યા હજજ તથા ઉમરા બંનેને લણૌકમાં જિક ઇરમાવે છે. ઈમામ અહુમદે અધ્યુ તલ્લા અન્સારી રવીયદ્વાળો અન્હોથી રિયાયત કરી કે રસૂલુલ્લાહ સદ્ગુરુદ્વાળો અલયણે વસ્તુમે હજજ તથા ઉમરાને કેગા કર્યો.

મસ્ટાદા (૧) : કિરાનનો એ અર્થ છે કે હજજ તથા ઉમરા બંનેનો એહુરામ એક સાથે બાંધે અથવા પહેલા ઉમરાનો એહુરામ બાંધ્યો હતો અને હજજ તવાફના ચાર ઝેરા કર્યો ન હતા કે હજજને શામેલ કરી લીધી અથવા પહેલા હજજને એહુરામ બાંધ્યો હતો. તેની સાથે ઉમરા પણ શામેલ કરી લીધો. લક્ષે ‘તવાઝે કુદ્દમ’ થી પહેલા ઉમરા શામેલ કર્યો અથવા પછીથી તવાઝે કુદ્દમથી પહેલા અસામત છેકે તે સુન્નતની વિરુદ્ધ છે. પરંતુ દમ વાણું નથી અને તવાઝે કુદ્દમ પછી શામેલ કર્યું તો વાણું છે કે ઉમરા તોડી નાખે અને દમ આપે અને ઉમરાની કાજા કરે અને ઉમરા ન તોડ્યો તો પણ દમ આપવું વાણું છે. (હરે સુખ્તાર, રદ્દુલ સુહૃત્તાર)

મસ્ટાદા (૨) : કિરાન માટે શરત એ છે કે ઉમરાના તવાફનો અધિકાંશ ભાગ પુરુષે અરક્ષુણી પહેલા હોય માટે જેણે તવાફના ચાર ઝેરાઓથી પહેલા પુરુષે કર્યું તેતું કિરાન ભાતલ થઈ ગયું. (ફિતહુલકાફીર)

મસ્ટાદા (૩) : સૌથી અર્જુલ કિરાન

છે, પછી તમતોાચ, પછી ઝરાહ, (રદ્દુલ સુહૃત્તાર વિગેર.) કિરાનના એહુરામનો તરીકો એહુરામના બયાનમાં આવી ગયો છે.

મસ્ટાદા (૪) : કિરાનનો એહુરામ મીકાતથી પહેલાં પણ થઈ શકે છે અને શાંવાલથી પહેલા પણ, પરંતુ તેના અર્જુલ (કાર્ય) હજજના મહીનાઓમાં કરવામાં આવે. શાંવાલથી પહેલા અર્જુલ કરી શકતા નથી. (હરે સુખ્તાર)

મસ્ટાદા : (૫) કિરાનમાં વાણું છે કે પહેલાં તવાફના સાત ઝેરા કરે. અને એમાં પહેલા ત્રણ ઝેરાઓમાં રમલ સુન્નત છે પછી સર્જ કરે, હવે કિરાનનો એક અંશ અથીત ઉમરા પૂર્ણ થઈ ગયો. પરંતુ હજજ હુલક ઝરાવી શકતો નથી, અને કર્યું પણ તો એહુરામથી નિકળે નહીં અને તેના દંડમાં એ દમ લાગિમ છે. ઉમરા પૂર્ણ કર્યો પછી તવાઝે કુદ્દમ કરે અને ઈચ્છે તો અથવા સર્જ પણ કરી લે નહીં તો તવાઝે ઈચ્છા પછી સર્જ કરે. જે અથવા સર્જ કરે તો તવાઝે કુદ્દમના પહેલા ત્રણ ઝેરાઓમાં પણ રમલ કરે અને બંને તવાફોમાં ઈજાતેબાબ પણ કરે. (હરે સુખ્તાર વિગેર).

મસ્ટાદા (૬) : એક સાથે એ તવાઝ કર્યો પછી એ સર્જ પણ કરી તો પણ નાઈજ છે પરંતુ સુન્નત વિરુદ્ધ છે અને દમ લાગિમ નથી જલે પહેલા તવાઝ ઉમરાની નિયતથી અને બીજે કુદ્દમની નિયતથી હોય અથવા બંને પૈકી કાઈમાં નિશ્ચિક ન કર્યું અથવા તેના સિવાય કાઈ બીજી

પ્રધારની નિયત કરી, વસ્તુત પહેલો તવાઝ ઉમરાનો થશે અને બીજો કુદ્રમનો (હરેં સુખતાર, મનાસિક)

મસ્ટાદા (૭) : પ્રથમ તવાઝમાં જે હજજના તવાઝની નિયત કરી તો પણ ઉમરાનો જ સવાખ છે. (જવહરહ) ઉમરાથી ફૂરેગ થઈને નિયમાનુસાર સુહરિમ રહે અને સંઘળા કાચો બલલવી લાયે. દસમી તારીખે હુલા પછી કરી તવાઝ એકાદા પછી જેવી રીતે હજજ કરવાવાળા માટે વસ્તુઓ હુલાલ થાય છે આના માટે પણ હુલાલ થશે.

મસ્ટાદા (૮) : કારિન પર દસ મીનીરમી પછી કુરખાની વાળું છે અને આ કુરખાની ડોઈ દંડમાં નથી. બદકે તેનો શુદ્ધિયા (આલાર) છે કે અદ્દાહ અજ્જવ જદ્દલે તેને એ ઈબાહતોની તૌશીક બખશી. કારિન માટે અઝેલ એ છે કે ચાતાની સાથે કુરખાનીનું જનવર લઈ નાય.

(આલમગીરી, હરેં સુખતાર વિગેર)

મસ્ટાદા (૯) : આ કુરખાની માટે એ જરૂરી છે કે હુરમમાં થાય, હુરમની બહાર થઈ શકતી નથી. અને સુનનત એ છે કે મિનામાં થાય અને તેનો સમય દસમી જિલ હિજજહની ઝરા તુલૂઅ થવાથી બારમીના સૂર્યાસ્ત સુધી છે પરંતુ એ જરૂરી છે કે રમી પછી થાય. રમીથી પહેલા કરશે તો દમ લાભિમ આવશે. અને જે બારમી સુધી કુરખાની ન કરી તે રદ થશે નથી બદકે જ્યાં સુધી જીવંત છે કુરખાની તેના માથે

બાકી છે. (મનાસિક)

મસ્ટાદા (૧૦) : જે કુરખાની પર શક્તિમાન હતા અને હણુ કુરખાની કરી ન હતી કે ઈન્ટેકાલ થઈ ગયો તો તેની વસિયત કરી જવું વાનિખ છે અને જે વસિયત ન કરી પરંતુ વારસોએ ખૂદ કરી દીધી તો પણ સહીહ છે. (મનાસિક)

મસ્ટાદા (૧૧) : કારિનને જે કુરખાની કરવાનું પ્રાપ્ત થાય નથી કે તેની પાસે જરૂરત કરતા વધુ માલ નથી, ન એટલો સામાન છે કે તેને વેચીને જનવર ખરીદે તો દસ રોજા રાખે, તેમાં ત્રણ તો ત્યાં અર્થાત પહેલી શન્વાતથી જિલહિજજહની નવમી સુધી એહરામ બાંધવા પછી રાખે, જ્યે સાત, આડ, નવ રાખે અથવા તેના પહેલા, અને એહતર એ છે કે નવમીથી પહેલા પુરા કરી હે અને એ પણ ઈખ્ત્યાર છે કે વિલિન રીતે રાખે. ત્રણું એકપછી એક રાખવું જરૂરી નથી અને સાત રોજા હજજનો સમય પસાર થઈ ગયા પછી અર્થાત તેરમી પછી રાખે. તેરમીએ અથવા તેના પહેલા થઈ શકતા નથી. આ સાત રોજાએમાં અધિકાર છે કે ત્યાં જ રાખે અથવા ઘેર પાછા આવીને અને ઉત્તમ એ છે કે ઘેર પાછા આવીને રાખે. અને આ દસે રોજાએમાં રાતથી નિયત કરવું જરૂરી છે. (આલમગીરી, હરેં સુખતાર, રદ્દુલસુહતાર)

મસ્ટાદા (૧૨) : જે પહેલાના ત્રણ રોજા નવમી સુધી રાખ્યા નથી તો હવે

રોજા ડાઢી નથી બંકે હમ વાજિબ થશે,
હમ આપીને એહરામથી બહાર થઈ જાય
અને જે હમ આપવા શક્તિમાન નથી તો
માથું સુંડાવી અથવા વાળ કલરાવી
એહરામથી અલગ થઈ જાય. અને એહમ
વાજિબ છે. (હરેસુખતાર)

આપે. (હરેસુખતાર)

તમતોઅનું ખ્યાન

અદ્વાહ અજવ જદ્વલ ફરમાવે છે :-

એ મન તમતોઅ બિદ્વિઅતે હલિલહજને
કેમસ્તયસરા ભિનલહદ્યે એ ભલ લમ
થજિદ એ સિયામે સલાસતા ગૈયાભિન
ક્રીલહજને વ સણાતિન છા રજાતુમ
તિલકા ગાશરતુન ડાભિલતુન આલિકા
લેમન લમ યકુન આહુલોહ હાહેરિદ્ભસ્ત્ર-
હિલહરામે, વતતક્રીણાહ વાદસ્તૂ અન્નદ્વાહ
શાદીદુલ્લેંકાય.

તરજુમો :- જેણુ ઉમરહથી હજા
પ્રત્યે “તમતોઅ” કરો તેના પર કુરબાની
છે, જેવી પણ પ્રાત થાય. પછી જેને
કુરબાનીની શક્તિ ન હોય તો ત્રણ રોજા
હજાજના દિવસોમાં રાયે અને સાત રોજા
હજાથી પાછા આપ્યા પછી. આદસ પૂરા
છે, આદસ તેના માટે છે જે મકાનો રહે-
વાવાળોના ન હોય અને અદ્વાહથી ડરો અને
નાણી લો કે અદ્વાહનો અજાબ સખત છે.
તમતોઅ તેને કહે છે કે હજાજના મહીના-
માં ઉમરો કરે પછી એ જ વર્ષે હજાજનો
એહરામ બાંધે અથવા પૂરો ઉમરો ન કરો
કેવળ ચાર ચક્કર કર્યો પછી હજાજનો
એહરામ બાંધો.

મસ્તાદા (૧) : તમતોઅ માટે એ

મસ્તાદા (૧૩) : શક્તિમાન ન હોવાના
ગરણે રોજા રાખી લીધા પછી હલકથી
પહેલા દસમીએ જનવર મળી ગયું તો
હુયે તે રોજા ડાઢી નથી માટે કુરબાની કરે
અને હલક પછી જનવર પર શક્તિ થઈ
તો તે રોજા ડાઢી છે. બલે કુરબાનીના
દિવસોમાં શક્તિ જોવામાં આવી અથવા
પાછળથી, એવીજ રીતે જે કુરબાનીના
દિવસોમાં માથું ન સુંડાંયું તો જે જે
હલકથી પહેલા જનવર પર શક્તિમાન થાય
તે રોજા ડાઢી નથી, (હરેસુખતાર,
રદ્દુલમુહતાર)

મસ્તાદા (૧૪) : ડારિને ઉમરાના
તવાઝના ત્રણ ઝેરા કરવા પછી વુદ્ધે અરકા
કયું તો તે તવાઝ જતો રહ્યો અને ચાર
ઝેરા પછી વુદ્ધે કયું તો આતલ ન થયું
જે કે તવાઝે કુદુમ અથવા નિઝલની નિયત-
થી કર્યો, માટે યૌસુનનહરમાં તવાઝે
જિયારતથી પહેલા લેની પૂર્ણતા કરે અને
પ્રથમ સૂરતમાં કેમકે તેણે ઉમરો તોડી
નાણો માટે એક દમ વાળુણ થયો. અને તે
કુરબાનીના શુંક માટે વાળુણ હતી, રહ
થઈ ગઈ અને હુયે ડારિન ન રહ્યો અને
તશરીફના દિવસો પછી આ ઉમરાની કંજા

શરત નથી કે મીકાતથી એહરામ બાંધે, તેનાથી પહેલા પણ બાંધી શકે છે બઢે ને મીકાત પછી એહરામ બાંધ્યા તો પણ તમતોઅ છે. જે કે વગર એહરામે મીકાતથી પસાર થવું શુનોહ છે અને દમ લાજિમ છે. અથવા હરી મીકાતે પાછો જાય, એવીજ રીતે તમતોઅ માટે એ શરત નથી કે ઉમરાનો એહરામ હજજના મહીનામાં બાંધવામાં આવે બઢે શાંવાલથી પહેલા પણ એહરામ બાંધી શકે છે. અલખત એ જરૂરી છે કે ઉમરાના સધળા કાચો અથવા અકસર તવાઝ હજજના મહીનામાં થાય હા.ત. ત્રણું ચક્કર તવાઝના રમજાનમાં કર્યા પછી શાંવાલમાં બાકીના ચાર ચક્કર કરી લિધા, પછી એજ વર્ષે હજજ કરી લિધી તો તે પણ તમતોઅ છે અને જે રમજાનમાં ચાર ચક્કર કરી લિધા હતા અને શાંવાલમાં ત્રણું બાકીના કર્યા તો તે તમતોઅ નથી અને એ પણ શરત નથી કે જે વર્ષે એહરામ બાંધ્યો એજ વર્ષે તમતોઅ કરી કે, હા.ત. રમજાનમાં એહરામ બાંધ્યો અને એહરામ પર કાયમ રહ્યો, ખીન વર્ષે ઉમરો. કરી હજજ કરી તો તમતોઅ થઈ ગયો. (આતમગીરી, રદ્દુલસુહતાર) તમતોઅની દસ શરતો છે.

તમતોઅની શરતો : (૧) હજજના મહીનામાં પુરો તવાઝ કરવો અથવા અકસર છિસ્સો અર્થાત ચાર ઈરા કરવું (૨) ઉમરાનો એહરામ હજજના એહરામથી પ્રથમ હોવું (૩) હજજના એહરામથી પહેલા ઉમરાનો

પુરો તવાઝ અથવા અકસર છિસ્સો કરી લિધો હોય (૪) ઉમરો ઇસિદ ન કરો હોય (૫) હજજ ઇસિદ ન કરી હોય (૬) અહમામ સહીહ ન કર્યો હોય અહમામ સહીહનો એ અર્થ છે કે ઉમરા પછી એહરામ છાડીને પોતાના વતન પાછો જાય અને વતનથી સુરાદ તે સ્થળ છે જ્યાં તે રહે છે. જન્મનું સ્થળ જેકે ખીન સ્થળે હોય, માટે જે ઉમરો કરવા પછી વતન ગયા પછી પાછો આવી હજજ કરી તો તમતોઅ નથી અને જે ઉમરો કરવાથી પહેલા ગયો અથવા ઉમરો કરી હોલેક કર્યા વગર અર્થાત એહરામમાં જ વતન ગયો, પછી પાછા આવીને એજ વર્ષે હજજ કરી તો તમતોઅ છે. એવી જ રીતે જે ઉમરો કરીને એહરામ જોતી દિધો પછી હજજનો એહરામ બાંધીને વતન ગયો તો તે પણ અહમામ સહીહ નથી માટે જે પાછા આવીને હજજ કરશે. તો તમતોઅ થશે. (૭) હજજ તથા ઉમરો બંને એક જ વર્ષમાં હોય (૮) મઙ્ગ મોઅઝમામાં હમેશા માટે રહેવાનો ઈરાહો ન હોય માટે જે ઉમરો કર્યા પછી પાડો ઈરાહો કરી લિધો કે અહીંચા જ રહેશે તો તમતોઅ નથી અને જે એ એક મહીના રહેવાનો ઈરાહો હોય તો તમતોઅ છે. (૯) મઙ્ગ મોઅઝમામાં હજજનો મહીનો આવી જાય તો એહરામ વગરના ન હોવું એવું હોય કે એહરામ છે પરંતુ ચાર ચક્કર તવાઝના આ મહીનાથી પહેલા કરી લિધા છે, હા જે મીકાતથી ખાડાર પાછો જાય પછી ઉમરાનો એહરામ

બાંધીને આવે તો તમતોઅ થઈ શકે છે.
 (૧૦) મીકાતથી બહારનો રહેવાવણો હોય,
 મક્કાનો રહેવાવણો તમતોઅ કરી શકતો
 નથી. (૨૬હુલમુહતાર)

મસ્યાદા (૨) : તમતોઅની એ સૂરતો
 (૨૪૩૫) છે. એક એ કે ચોતાની સાથે
 કુરખાનીનું જનવર લાગ્યો, બીજુ એ કે ન
 લાગ્યો. જે શાખસ જનવર ન લાગ્યો. તે
 મીકાતથી ઉમરાતું અહેરામ બાંધે, મક્કા
 મોઅઝમામાં આવીને તવાદ તથા સર્જ કરે.
 અને માથું સુંડાવે. હવે ઉમરાથી ફારેગ
 થઈ ગયો. અને તવાદ શરૂ કરતાં જ
 અથોત સંગે અસ્વદનો ઓસો આપતી
 વખતે લગ્નોક ખતમ કરી હે. હવે મક્કામાં
 અહેરામ વગર રહે. આઠમી જિલહિજલ
 એ મસ્જિદ હરામ શરીરથી હજજનો
 અહેરામ બાંધે અને હજજના સઘળાં
 ડાચો બજલી લાવે પરંતુ તેના માટે
 તવાદ કુદ્દમ નથી અને તવાદ જિયારતમાં
 અથવા હજજનો અહેરામ બાંધ્યા પછી કોઈ
 નક્કી તવાદમાં રમલ કરે અને તેના પછી
 સર્જ કરે અને જે હજજનો અહેરામ બાંધ્યા
 પછીતવાદે કુદ્દમ કરી લીધો છે. (જે કે તેના
 માટે આ તવાદ મસનૂન નહુતો) અને તેના
 પછી સર્જ કરી લીધો છે તો હવે તવાદ
 જિયારતમાં રમલ નથી. લદે તેણે તવાદ
 કુદ્દમમાં રમલ કચું હોય કે નહીં અને
 તવાદ જિયારત પછી હવે સર્જ પણ નથી.
 ઉમરાથી ફારેગ થઈને હલક પણ જરૂરી નથી.
 તેને એ પણ અખત્યાર છે કે માથું ન

સુંડાવે. નિયમાનુસાર મહરમ રહે. એવી જ
 રીતે મક્કા મોઅઝમામાં જ રહેવું તેના
 માટે જરૂરી નથી. લદે ત્યાં રહે અથવા
 વતન સિવાય બીજે પરંતુ જ્યાં રહે, ત્યાં
 વાળા જ્યાંથી એહેરામ બાંધે છે તે પણ
 ત્યાંથી જ એહેરામ બાંધે. જે મક્કા સુકર્મમા-
 માં છે તો અહીંથા વાળાએની જેમ એહેરામ
 બાંધે અને જે હરમથી બહાર અને મીકાતની
 અંદર છે તો હરમમાં એહેરામ બાંધે અને
 મીકાતથી પણ બહાર થઈ ગયો. તો મીકાતથી
 બીજુ બાંધે, આ તે સૂરતમાં છે. જ્યારે કે કોઈ
 ગરજથી હરમ અથવા મીકાતથી બહાર જવું
 હોય અને જે એહેરામ બાંધવા માટે હરમ-
 થી બહાર ગયો. તો તેના પર દમ વાજિથ
 છે પરંતુ જ્યારે કે વકુલથી પહેલા મક્કામાં
 આવી ગયા. તો દમ સાંકિત થઈ ગયો. અને
 મક્કા મોઅઝમામાં રહ્યો તો હરમમાં એહેરામ
 બાંધે અને બહેતર એ છે કે મક્કા મોઅઝમ-
 માં હોય અને તેનાથી બહેતર એ કે
 મસ્જિદે હરમમાં હોય અને સૌથી બહેતર
 એ કે હુતીમ શરીરકુમાં હોય.

એવી જ રીતે આઠમી તારીખે એહેરામ
 બાંધવું જરૂરી નથી. નવમીએ પણ થઈ
 શકે છે અને આઠમી પહેલા પણ બદકે એ
 અદ્દજલ છે કે તમતોઅ કરનાર પર વાજિથ
 છે કે દસમી તારીખે શુક્રાનામાં કુરખાની કરે.
 તે પછી માથું સુંડાવે. જે કુરખાનીની
 શક્તિ ન હોય તો એવી જ રીતે રાઓ
 રાખે જે કુરખાનીવાળા માટે છે. (જવહર,
 આલમગીરી, હર્રે સુખતાર)

મરણદા (૩) : ને ચોતાની સાથે જનવર લઈ જય તો એહામ બાંધીને લઈ ચાલે અને એંચીને લઈ જવા કરતાં હાંડવું અફઝલ છે. હા, ને પાછળથી હાંડવાથી ચાલતું નથી તો આગળથી એંચે અને તેના ગળામાં હાર નાખી હે કે લોકો સમજે કે તે હરમમાં કુરબાની માટે જય છે અને હાર નાખવું જૂલ નાખવા કરતાં બહેતર છે. અને એ પણ થઈ શકે છે કે તે જનવરના ડોહાનમાં જમણી અથવા ડાણી ખાળું નાનકડું છિર કરી હે કે માંસ સુધી ન પહેંચે. હવે મફક મોઅંગમાં પહેંચીને ઉમરો કરે. અને ઉમરાથી ઝારેગ થઈને પણ મહરમ (એહારામવાળો) રહે, નયાં સુધી કુરબાની ન.કરી લે. તેણે માથું સુંડાષવું લઈજ નથી નયાં સુધી કુરબાની ન કરી લે. નહીં તો દમ લાભિમ આવશે. પછી તે તમામ અફઝાલ (કાંચો) કરે ને તેના માટે બતાવવામાં આવ્યો છે કે જનવર ન લાવ્યો હતો. અને દસમી તારીખે રમી કરીને માથું સુંડાવે. હવે બંને એહારામથી એક સાથે ઝારેગ થઈ ગયો. (હરે સુખતાર)

મરણદા (૪) : ને શાખ જનવર લાવ્યો અને ન લાવ્યો. બંનેમાં તક્ષાવત એ છે કે ને જનવર ન લાવ્યો. અને ઉમરા પછી એહારામ ખોલી નાખ્યો, હવે હજાજનો એહારામ બાંધ્યો. અને કોઈ જનાયત (ભૂલ-ચુક) ઘટિત થઈ તો જુરમાનો (૬૩) સુદ્રિદ્ધિની જેમ છે અને એહારામ બાકી હતો તો જુરમાનો છારિન જેવો છે. અને

જનવર લાવ્યો છે તો હર હાલતમાં છારિન જેવો છે. (રહુલમુહતાર)

મરણદા (૫) : મીકાતની અંદરવાળા-ઓ માટે કિરાન તથા તમતો નથી, ને કરે તો દમ આચે. (હરે સુખતાર)

મરણદા (૬) : ને શાખ જનવર લાવ્યો છે તેને રોઆ રાખવું કાઢી ન ધશે, લદે નાદાર હોય. (હરે સુખતાર)

મરણદા (૭) : જનવર લઈ ગયા નથી અને ઉમરો કરીને ઘેર ચાલ્યો આવ્યો તો આ અદ્મામ સહીહ છે તેને “તમતોઅ” જતો રહ્યો, હવે હજાજ કરશે તો સુદ્રિદ્ધ છે. અને જનવર લઈ ગયા છે. અને ઉમરો કરીને ઘેર પાછો આવ્યો પછી મહરમ રહ્યો. અને હજાજ માટે ગયો તો આ આદમામ સહીહ નથી માટે તેનો તમતોઅ બાકી છે એવી જ રીતે ને ઘેર ન આવ્યો. ઉમરો કરીને કોઈ ધીન સ્થળે ચાલ્યો ગયો તો તમતોઅ ગયો નહીં. (હરે સુખતાર વગેરે)

મરણદા (૮) : તમતોઅ કરનારે હજાજ અથવા ઉમરો ઝાસિદ કરી દીધેા તો તો તેની કા કરે અને જુરમાનામાં દમ સાથે તમતોઅની કુરબાની તેના સાથે નથી કે તમતોઅ રહ્યો જ નથી. (હરે સુખતાર)

મરણદા (૯) : તમતોઅ વાળા માટે એ જરૂરી નથી કે હજાજ તથા ઉમરો બંને એકજ માણુસ તરફથી હોય બલ્કે એ થઈ શકે કે એક ચોતાની તરફથી હોય અને બીજે કોઈ ધીન તરફથી અથવા એક શપસે

તેને હુકમ આપ્યો અને ખીલાએ ઉમરાનો અને બંનેએ તમતોઅની ઈજાત આપી દિધી તો કરી શકે છે પરંતુ કુરબાની ખુદ તેના માથે છે અને જો નાદાર છે તો રોઝા રાખો. (મનાસિક)

મસ્ટાલા (૧૦) : હજાજના મહીનામાં ઉમરા કર્યો પરંતુ તેને ફાસિક કરી દિધો. પછી ઘેર માણે આવી ગયો. પછી આવીને ઉમરાની ડાંડા કરી અને એજ વર્ષે હજાજ કરી તો આ તમતોઅ થઈ ગયો. અને જો મજ્જામાં જ રહી ગયો અથવા મજ્જાથી ચાલ્યો. ગયો. પરંતુ મીકાતની અંદર રહ્યો અથવા મીકાતથી પણ બહાર થઈ ગયો. પરંતુ ઘેર ન ગયો. અને આવીને ઉમરાની ડાંડા કરી અને એજ વર્ષે હજાજ પણ કરી તો આ સધળી હાલતોમાં તમતોઅ ન થયો. (જવહરફ)

જીમ્ (ગુનાહ) અને તેમના કિંડિનાનું વયાન :

અદ્દાહ અભિજ જદ્દા કૃમાવે છે :

યા ઐચ્છાકુદ્દીના આમનૂં લા તકો-
લુસ્સોયદ્દ વ અન્તુમ હોરોસુન.....

અર્થ્ : “હે ઈમાનવાળાઓ, એહરામની હાલતમાં શિકાર કરો નહીં અને જે તમારા પૈકી ઈરાદાપૂર્વક જનવરને કંતલ કર્શે તો બદલો આપે તે જનવરના જેવો જે કંતલ થયું, તમારામાંના એ આહિદ જે

હુકમ કરે તે બદલો કુરબાની થશે. કે કા'બાએ જાય અથવા કિંડિનાનું આણું અથવા તેના બરાબર રોઝા કે જેથી પોતાના કરતુતનો ત્યાં બદલો આપો. અદ્દાહ તેને માઝ કરી દિધો. જે અગાઉથી થઈ ગયું અને જે કુરીથી કર્શે તો અદ્દાહ તેનાથી બદલો લેશો અને અદ્દાહ ગાલિબ બદલો લેનાર છે. દરિયાનો શિકાર અને તેનું આણું તમારા માટે હુલાલ ઠેરવવામાં આયું, તમારા અને સુસાઇરોના વર્ત્વા માટે અને ખૂફ્ફીનો શિકાર તમારા પર હરામ છે, જાયાં સુધી તમે એહરામવાળા હો અને અદ્દાહથી ડરો જેના પ્રત્યે તમે ઉડાવવામાં આવશો.” અને કૃમાવે છે :

ફેમન કાના મિન્કુમ મરીદનાઓ બેહિ અયન.....

અર્થ્ : જે તમારા પૈકી ખીમાર હોય અથવા તેના માથામાં તકલીફ હોય (અને માણું સુડાવી લે) તો કિંડિયો આપે રોઝા અથવા સંદકા અથવા કુરબાની, સંહીંન વિગેરમાં કાયબિન અજરહ રહીયદ્વાહો. અનહોમાથી મર્દવી છે નથીએ કરીમ સંદક્ષાહો. અલયહે વસ્તુભ તેમની પાસે તશરીફ લાયા અને તેઓ એહરામવાળા હતા અને હાંડકીના નીચે આગ સાગાવી રહ્યા હતા. અને જીમ્ તેમના ચહેરા પર પડી રહી હતી, આપે ઈરશાદ કૃમાયો શું આ જ તુંએ તમને તકલીફ આપી રહ્યા છે, તેમણે અજો કરી હા, આપે કૃમાયું—માણું સુંડાવી નાયો. અને ત્રણ સાચ આવાતું (લોજન)

૭ મિસ્કીનોને આપી હો, અથવા ત્રણ રોજા રાખો અથવા કુરખાની કરો.

ચેતવણી : મહરમ (એહારામવાળો) જે ઉજર વગર ઈરાદાપૂર્વક જીમ્બ (હજજની પ્રતિબંધિત બાબતો) કરે તો કિશોરા પણ વાજિબ છે અને ચુનેહગાર પણ થચો, માટે આ હાલતમાં તો એ વાજિબ કે કેવળ કિશોરાથી પાક થશે નહીં, જ્યાં સુધી તૌખા ન કરે અને જે અનાણુતામાં અથવા ઉજર (શર્ક્રિકારણ) થી છે તો કિશોરા કાઢી છે. જીમ્બમાં કિશોરા હર હાલતમાં લાજિમ છે. ઈરાદાથી થાય કે ભૂલ ચુક્કથી, તેનું જીમ્બ હોવું જાણુતો હોય અથવા ખખર ન હોય, ઘૂસીથી હોય કે મજબૂરીથી, નિંદ્રામાં થાય કે જાગૃતાવસ્થામાં, નશા અથવા એહોશીમાં થાય કે હોશમાં, તેણે ચાતે સ્વચ્છ હુદ્દું હોય કે બીજાએ તેના હુડમથી હુદું.

ચેતવણી : આ બધાનમાં જ્યાં દમ કહીશું તેનાથી ભાવાર્થ એક બાકરી અથવા ઘેરું હશે. અને “બહના” ઉંટ અથવા ગાય આ સૌ જાનવર એજ શરતોના હોય ને કુરખાનીમાં છે અને “સદ્ગા”થી ભાવાર્થ અંગેઝ રૂપીયાથી એકસો પંચાતેર (૧૭૫) રૂપીયા આઠ આના લાર ઘડું કે તેના સો રૂપીયાના શેરથી ચોણું એ શેર આઠ આના લાર ઉપર થયા. હાલના વજન પ્રમાણે ૨ કિલો ૪૫ થામ અથવા તેના ખમણું જવ અથવા ખનુર અથવા તેમની કીંમત.

મસ્યાદા (૧) : જ્યાં દમનો હુડમ છે તે જીમ્બ જે બિમારી અથવા સખત ગરમી ખ. શ. ૧૪

અથવા તિબ્ર શર્દી અથવા જખમ અથવા હૈલ્દા અથવા જુઓની સખત ઈજના કારણે હશે તો તેને ગેરાખત્યારી જીમ્બ કહે છે. તેમાં અખત્યાર હશે કે દમના બદલે છ મિસ્કીનોને એક એક સદકો આપી હે. અથવા જંને ટાઈમ પેટ જરીને ખવડાવે અથવા ત્રણ રોજા રાખી લે. જે છ સદકા એક મિસ્કીનને આપી હીધા અથવા ત્રણ અથવા સાત મિસ્કીના પર વહેંચી હે તો કિશોરા અદા થશે નહીં. બદકે શરત એ છે કે છ મિસ્કીનોને આપે અને અદ્ભુત એ છે કે, હરમના મિસ્કીન હાય. અને જે તેમાં સદકાનો હુડમ છે અને મજબુરીએ ક્રોટો તો અખત્યાર હશે કે સદકાના બદલે એક રોજા રાખી લે. કિશોરા એટલા માટે છે કે ભૂલચૂંકથી અથવા નિંદ્રામાં અથવા મજબુરીથી જીમ્બ થાય તો કિશોરાથી પાક થઈ જય, ન એટલા માટે કે જાણી જોઈને ઉજર વગર જીમ્બ કરો અને કહો કે કિશોરા આપી દઈશું. આપવો તો ત્યારે પણ પડશે પરંતુ ઈરાદાપૂર્વક અદ્ભુતાદુના હુડમની વિરોધતા સપ્તતર છે.

મસ્યાદા (૨) : જ્યાં એક દમ અથવા સદકો છે ત્યાં કારિન પર એ છે.

(આરમતુલ કુતુખ)

મસ્યાદા (૩) : કિશોરાની કુરખાની અથવા કારિન તાં સુતમતેઅના શુકોનાની ગેરે હરમમાં થઈ શકતી નથી, ગેરે હરમમાં કરી તો અદા થઈ નહીં. હા, જીમ્બ ગેર અખત્યારીમાં જે તેનું માંસ છ મિસ્કીનો પર તસદ્દુક હુદું અને દરેક મિસ્કીનને

એક સદકાની કીમતનું પહોંચ્યું તો અદ્ય દર્દ ગયું. (આલમગીરી)

મસ્ટાલા (૪) : શુકાનાની કુરબાની-માંથી આપ (ચોતે) આવ, ગની (માલદાર) ને ખવડાવો, મિસ્કીનને આપે અને કંકણારાની કુરબાની ડેવળ મોહતાજેનો હડ છે.

મસ્ટાલા (૫) : જે કંકણારાના રોજા રાખ્યા તો તેમાં શરત એ છે કે રાતથી અથોત સુણહ સાહિક્યી પહેલા નિયત કરી કે અને એ પણ નિયત કરે કે ઇલાણ્યા કંકણારાનો રોજો છે. સર્વથા રોજાની નિયત અથવા નિર્દિશ અથવા કોઈ બીજી નિયત કરી તો કંકણારો અદ્ય થયો નહીં. અને એક પછી એક હેલું અથવા હરમાં અથવા અહેરામમાં રાખતું જરૂરી નથી. (મનાસિક)

હવે અહેકામ સાંભળો

ખુશ્ય અને તેલ લગાવવું

મસ્ટાલા (૧) : ખુશ્ય જે એટલી વધુ લગાવી જેને જેઈને લોકો બહુ બતાવે, જેકે અવયવના થોડા લાગ પર અથવા કોઈ માટા અવયવ જેલું કે માયું, મૂળ, સાથળ, ગીંદળીને સંપૂર્ણત ચોપડી હીધી. જેકે ખુશ્ય થાડી છે તો આ બંને હાલતોમાં દમ છે, અને જે થાડીક ખુશ્ય અવયવના થોડાક લાગમાં લગાવી તો સહોં છે. (આલમગીરી)

મસ્ટાલા (૨) : વસ્ત અથવા પથારી પર ખુશ્ય ચોપડી તો ખુદ ખુશ્યની માત્રા જેવામાં આવશે, અધિક છે તો દમ અને એઠાં છે તો સદકો આપવો પડશે. (આલમગીરી)

મસ્ટાલા (૩) : ખુશ્ય સુંધી, ઇણ હાય કે કુલ, જેલું કે લીધુ, નારંગી, શુલાબ, ચમેલી, બેલા, જુહી વિગેરના કુલ તો કાઈ કંકણારો નથી. જેકે સુહરિમે ખુશ્ય સુંધું મહેદ છે. (રદ્દુલ સુહતાર)

મસ્ટાલા (૪) : એહરામ પહેલા શરીર પર ખુશ્ય લગાવી હતી હવે એહરામ પછી ઈલાઈને બીજી અવયવોને લાગી તો કંકણારો નથી. (રદ્દુલ સુહતાર)

મસ્ટાલા (૫) : સુહરિમે બીજાના શરીર પર ખુશ્ય લગાવી પરંતુ એવી રીતે કે તેના હાથ વિગેર કોઈ અવયવમાં ખુશ્ય ન લાગી અથવા તેને સીવેલું કપડું પહેરાયું તો કાઈ કંકણારો નથી પરંતુ જયારે કે સુહરિમે ખુશ્ય લગાવી અથવા સીવેલું કપડું પહેરાયું તો શુનેહગાર થયો. અને જેને લગાવી અથવા પહેરાયું તેના પર કંકણારો વાજિબ થયો. (રદ્દુલસુહતાર)

મસ્ટાલા (૬) : થાડીક ખુશ્ય શરીરના વિવિધ ભાગોમાં લગાવી, જે એકત્ર કરવાથી પરા મોટા અવયવની માત્રાએ પહોંચી જાય તો દમ છે, નહિ તો સદકો અને અધિક ખુશ્ય વિવિધ જગ્યાએ લગાવી તો હુર હાલતમાં દમ છે. (રદ્દુલ સુહતાર)

મસ્ટાલા (૭) : એક જરસા (બેઠક)માં કેટલાએ અવયવો પર ખુશ્ય લગાવે બઢું સધગા શરીર પર પણ લગાવે તો એક જી જુમ્બ છે અને એક કંકણારો વાજિબ અને કેટલાએ જરસાઓમાં લગાવે તો દરેક વખતના માટે અસગ અસગ કંકણારો છે. જ્ઞાતે પ્રથમવાર કંકણારો આપીને બીજી વખત લગાવી અથવા હન્જ ડોઈનો કંકણારો આપ્યો ન હોય.

(હરે સુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્ટાકા (૮) : કાંઈ વસ્તુમાં ખુશ્ય લાગેલી હતી તેનો સ્પર્શ કર્યો, જે તેનાથી ખુશ્ય છુટીને મારા કામિલ અવયવ નેટલી શરીર પર લાગી તો દમ આપે અને એઠી હોય તો સહડો આપે અને કાંઈ પણ લાગી નથી તો કાંઈ પણ આપે નહીં. હા. ત. સંગે અસ્વદ પર ખુશ્ય ચોપહવામાં આવે છે, જે એહારામની હાલતમાં જોસો લેતા સમેયે અધિકતમ લાગી તો દમ આપે અને થીડીક લાગી તો સહડો આપે.

(આલમગીરી)

મસ્ટાકા (૯) : ખુશ્યદાર સુરમે એક અથવા એ વખત લગાવ્યો તો સહડો આપે, તેનાથી અધિકમાં દમ છે અને જે સુરમામાં ખુશ્ય ન હોય તેના ઉપયોગમાં પછીતાછ નથી. જ્યારે કે જરૂરતથી હોય અને વગર જરૂરતે મહૃદ્દ છે.

(આલમગીરી)

મસ્ટાકા (૧૦) : જે શુદ્ધ ખુશ્ય જેવું કે સુરક્ષા, જરૂરાન, લવિંગ, ઈલાયચી, દારચીની એટલી ખાદી કે સુખના અકસર ભાગમાં લાગી ગઈ તો દમ છે, નહીં તો સહડો છે. (રદ્દુલ સુહતાર)

મસ્ટાકા (૧૧) : ખાણામાં પાડતી વખતે ખુશ્ય પડી અથવા ઝના થઈ ગઈ તો કાંઈ નથી. નહિ તો ખુશ્યના અંશ અધિક હોય તો તો શુદ્ધ ખુશ્યના હુકમમાં છે અને ખાણું અધિક હોય તો કંકણારો કાંઈ નથી, પરંતુ ખુશ્ય આવતી હોય તો મહૃદ્દ છે. (આલમગીરી, હરેસુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્ટાકા (૧૨) : પીવાની વસ્તુમાં

ખુશ્ય મેળવી, જે ખુશ્ય ગાતિબ છે અથવા નાના વખત અથવા વધારે પીધું તો દમ છે, નહિ તો સહડો.

(રદ્દુલ સુહતાર વિગેર)

મસ્ટાકા (૧૩) : તમાડુ અને પાન ખાવાવાળા એ વાતનો જ્યાલ રાજો કે એહારામમાં ખુશ્યદાર તમાડુ ન ખાય કે પતીઓમાં આમે કાચી ખુશ્ય મેળવવામાં આવે છે અને ડિવામમાં પણ બહુધા પકવવાં પછી સુરક્ષ વિગેર મળવે છે.

મસ્ટાકા (૧૪) : અમીરા તમાડુ ને પીવું બહેતર છે કે, તેમાં ખુશ્ય હોય છે. પરંતુ પીધી તો કંકણારો નથી.

મસ્ટાકા (૧૫) : જે એવા સ્થળો ગયો જ્યાં ખુશ્ય સળગી રહી છે અને તેના કપડાં પણ વસી ગયા તો કાંઈ નથી, અને સળગાવીને તેણે ચોતે છુણી દીધી તો ચોછામાં સહડો અને અધિકમાં દમ આપવો પડશે અને ધુણીદાર ન થયા તો કાંઈ નહીં, અને જે એહારામથી પહેલા ધુણી દીધી હતી અને એહારામમાં પહેલો તો મહૃદ્દ છે, પરંતુ કંકણારો નથી. (આલમગીરી, નિસ્કા)

મસ્ટાકા (૧૬) : માથા પર મહેંદ્રીનો પાતળો બિજાબ કર્યો કે વાળ છુપાય નહીં, તો એક દમ છે અને ધાડી થોપી કે વાળ ઢાંકાઈ ગયા અને ચાર પહેલા પસાર થઈ ગયા તો પુરુષ પર એદમ છે અને ચાર પહેલાથી ચોછામાં એક દમ છે અને એક સહડો છે અને ઔરત પર દરેક હાલતમાં એક દમ છે. ચાથાઈ માથું ઢાંકાવામાં પણ એજ હુકમ છે અને ચાથાઈથી ચોછામાં સહડો છે, અને માથા પર વસમહ (નીલના પતાં

જેનાથી જિનાણ તૈયાર કરવામાં આવે છે) પાતળું પાતળું લગાવ્યું તો કાંઈ નથી અને જે ઘાડી હોય તો પુરુષે ક્રક્કારો આપવો પડશે. (જવહરહ આલમગીરી)

મસ્ટાકા (૧૭) : દાઢીમાં મહેણી લગાવી તો પણ દમ વાજિબ છે, આખી હુણેણી અથવા તળવામાં લગાવી તો દમ આપે, પુરુષ હોય કે સ્ત્રી, અને ચારે હાથે પગોમાં એકાજ એઠકમાં લગાવી તો પણ એકાજ દમ છે. નહિ તો દરેક એઠક પર એક દમ અને હાથ પગના કોઈ લાગમાં લગાવી તો સહકો આપે. (જવહરી, રદ્દુલ સુહૃત્તાર વિગેર)

મસ્ટાકા (૧૮) : ખતમી (ઝૈરનાકુલ) થી માથું અથવા દાઢી ધોઈ તો દમ છે. (આલમગીરી)

મસ્ટાકા (૧૯) : અતર બેચનારની હુકાન પર ખુરણું સુંધવા માટે એઠો તો કરાહુત છે. નહી તો, વાંધો નથી. (આલમગીરી)

મસ્ટાકા (૨૦) : ચાદર અથવા તેહુંદ (ખુંગી)ના કિનારામાં સુર્ક, અંબર, આફ્રાન બાંધું અને અધિક છે અને ચાર પહોંચ પસાર થઈ ગયા તો દમ છે અને ઓછું છે તો સહકો છે. (રદ્દુલ સુહૃત્તાર)

મસ્ટાકા (૨૧) : ખુરણુનો ઉપયોગ કરવામાં ઈરાદા પૂર્વીક હોય કે વગર ઈરાદે હોલું, ચાદ કરીને કે ભૂલથી હોલું, મજણુરન અથવા ખુશીથી હોલું, પુરુષ-સ્ત્રી બંને માટે જૌનો એક જરણો હુકમ છે.

(આલમગીરી)

મસ્ટાકા (૨૨) : ખુરણું લગાવવું જ્યારે જુમ્ (અપરાધ) ડયું ત્યારે શરીર અથવા વસ્ત્રથી દુર કરવું વાજિબ છે અને ક્રક્કારો આપ્યા પણી નાટ ન ડયું તો પછી દમ વિગેર વાજિબ થશે. (આલમગીરી)

મસ્ટાકા (૨૩) : ખુરણું લગાવવાથી દરેક હાલતમાં ક્રક્કારો વાજિબ છે જેણે તકાળ નાટ કરી નાખી હોય અને જે કાઈ જેર મહરમ મસળે તો તેનાથી ધોવડાવે અને જે કેવળ પાણી વહાવવાથી ધોવાઈ જાય તો એમજ કરે. (તુસુક)

મસ્ટાકા (૨૪) : ચમેદીનું તેલ વિગેર ખુરણુદાર તેલ લગાવવાનો એજ હુકમ છે જે ખુરણુનો ઉપયોગ કરવામાં હુતો.

(આલમગીરી)

મસ્ટાકા (૨૫) : તિલ અને જયતુનતું તેલ ખુરણુના હુકમમાં છે જેણે તેચોમાં ખુરણું ન હોય. અલખત તેમના ખાવા અને નાડમાં ચદાવવા અને જખમ પર લગાવવા અને ડાનમાં ટપમાવવાથી સહકો વાજિબ નથી. (રદ્દુલસુહૃત્તાર)

મસ્ટાકા (૨૬) : મુર્ક, અંબર, જાફ્રાન વિગેર જે સ્વચ્છ ખુરણું છે, તેમના ઉપયોગથી સર્વથા ક્રક્કારો લાજિબ છે, લદે દ્વારામાં ઉપયોગ કર્યો હોય, આ તે સ્વરૂપમાં છે કે જ્યારે તેમને શુદ્ધ ઉપયોગ કરે અને જે થીજુ વસ્તુ જે ખુરણુદાર ન હોય તેની સાથે મેળવી ઉપયોગ કર્યો તો ગાલિબનો એતખાર છે અને થીજુ વસ્તુમાં મેળવી પકાવી લીધું હોય તો કાંઈ નહીં. (દરેક સુખતાર)

મસ્તકા (૨૭) : અખમનો ઈલાજ એવી દવાથી કરો કેમાં ખુશ્ય છે. પછી ધીજે જખમ થયો, તેનો ઈલાજ પહેલાની સાચે કર્યો તો જ્યાં સુધી પહેલો સારો ન થયો. તે ધીજાના ઝારણે કદ્રિયારો નથી અને પ્રથમના સારા થવા પછી પણ ધીજામાં તે ખુશ્યહાર દવા લગાવી તો એ કદ્રિયાર વાજિબ છે. (આલમગીરી)

મસ્તકા (૨૮) : કુસુમ અથવા ઝારનાનું રંગેલ કૃપડું ચાર પહેલાર પહેલ્યું તો દમ આપે, અને તેનાથી ઓછું પહેલ્યું છે તો સહકો આપે. લકે તે તત્કાળ ઉતારી નાખ્યું હોય. (મનાસિક, આલમગીરી)

(૨) સીવેલાં વસ્તો પહેરવા

મસ્તકા (૧) : મુહરિમે સીવેલું કૃપડું મુરા ચાર પહેલાર પહેલ્યું તો દમ વાજિબ છે અને તેનાથી ઓછું પહેલ્યું તો સહકો છે. લકે શાડીવાર પહેલ્યું હોય અને લગાતાર કેટલાએ દિવસો સુધી પહેરી રાખ્યું તો પણ એકજ દમ વાજિબ છે. જ્યારે કે આ લગાતાર પહેરવું એક જાતનું હોય, અર્થાત ઉજરથી અથવા વગર ઉજરે. અને જે દા. ત. એક દિવસ ઉજર વગર પહેલ્યું હતું. ધીજ દિવસે ઉજરથી અથવા તેનાથી ઉદ્દું તો એ કદ્રિયાર વાજિબ થશે.

(આલમગીરી વિગેર)

મસ્તકા (૨) : જે દિવસમાં પહેલ્યું રાતમાં ગરમીના ઝારણે ઉતારી નાખ્યું, અથવા રાતમાં શરહીના ઝારણે પહેલ્યું. દિવસમાં ઉતારી નાખ્યું. રોકાઈ જવા (બાજ

આવવા)ની નિયતથી ન ઉતાર્યું તો એક કદ્રિયારો છે અને તૌમાની નિયતથી ઉતાર્યું તો હરેક વખતે કદ્રિયારો વાજિબ થશે. એવી જ રીતે કોઈ એક દિવસ અમીસ પહેલ્યું હતું અને ઉતારી નાખ્યું પછી પાયલમે પહેલ્યો. તેને પણ ઉતારીને ટોપી પહેરી તો આ સધળું એક જ પહેરવું છે અને જે એક દિવસ એક પહેલ્યું, ધીજ દિવસે ધીજું તો એ કદ્રિયાર વાજિબ છે.

(આલમગીરી, હરે મુખ્તાર)

મસ્તકા (૩) : ધીમારીના ઝારણે પહેલ્યું તો જ્યાં સુધી ધીમારી રહેશે એક જ જીમ (હતાળનો અપરાધ) છે અને ધીમારી વાસ્તવમાં જતી રહી અને ન ઉતાર્યું તો આ ધીજે જીમ અખત્યારી (સ્વેચ્છાચે) છે. અને જે તે ધીમારી ખરેખર જતી રહી, પરંતુ ધીજી ધીમારી તત્કાળ શરીર થઈ ગઈ અને તેમાં પણ કૃપડું પહેરવાની જરૂરત છે તો પણ આ ધીજે જીમ ગેરઅખત્યારી છે.

(હરે મુખ્તાર, રદ્દુલમુહ્તાર)

મસ્તકા (૪) : એકાંતરીયે તાવ આવે છે અને જે દિવસે તાવ આવે કૃપડાં પહેરી લીધા ધીજ દિવસે ઉતારી નાખ્યા. ત્રીજ દિવસે કરી પહેરી લીધા તો જ્યાં સુધી આ તાવ આવે એક જ જીમ છે.

(મનાસિક)

મસ્તકા (૫) : જે સીવેલું કૃપડું પહેલ્યું અને તેનો કદ્રિયારો અદા કરી હીધો. પરંતુ કૃપડું ઉતાર્યું નહીં, ધીજ દિવસે પણ પહેરેલું જ રાખ્યું તો હવે ધીજે કદ્રિયાર વાજિબ છે. એવી જ રીતે જે

એહામ બાંધતી વખતે સીવેલું ક્રપડું ન હિતાયું તો આ જુમ્બ છે.

(આલમગીરી, હુરે સુતાર)

મસ્ટકાચા (૬) : બીમારી વિગેરના કારણે જે માથાથી પગો સુધી સઘળા ક્રપડાં પહેરવાની જરૂરત પડી તો એક જ જુમ્બ ગેરઅભ્યારી છે અને ઉત્તર વગર સૌ ક્રપડાં પહેયાં તો એક જુમ્બ અભ્યારી છે અથોત થર પહેર પહેયાં તો બંને સુરતોમાં દમ છે અને તેનાથી ઓછામાં સહડો છે અને જે જરૂરત એક વસ્તુની હૃતી તેણે એ પહેયાં તો જે એ જરૂરત હેઠળ બીજું પણ પહેયું તો એક કદ્દારો છે અને શુનેહગાર થયો. હા. ત. એક ખમીસની જરૂરક હૃતી, એ પહેરી લીધા અથવા ટોપીની જરૂરત હૃતી કે અમામેં પણ બાંધી લીધા અને જે બીજું ક્રપડું તે જગ્યાની સિવાય બીજું જગ્યાએ પહેયું. હા. ત. જરૂરત કેવળ અમામાની છે તેણે ખમીસ પણ પહેરી લીધું તો એ જુમ્બ છે. અમામાના ગેરઅભ્યારી અને ખમીસનો અભ્યારી, ખુલાસો એ કે જરૂરત હેઠળમાં અધિકતા કરી તો એક જુમ્બ છે જરૂરત હેઠળ સિવાય બીજું જગ્યાએ પણ પહેયું તો એ કદ્દારા છે.

(આલમગીરી વિગેર)

મસ્ટકાચા (૭) : વગર જરૂરતે સઘળા વસ્તો એક આથે પહેરી લીધા તો એક જુમ્બ છે. એ જુમ્બ તે સમયે છે કે એક જરૂરત સાથે હોય અને બીજું જરૂરત વગર.

(મનાસિક)

મસ્ટકાચા (૮) : ફરમનના કારણે ક્રપડાં

પહેયો, હથિયાર બાંધ્યા અને તે નાચી ગયો. તેણે ક્રપડાં, હથિયાર હિતારી નાખ્યા તે ફરીથી આવી ગયો, તેણે ફરીથી પહેયો તો એક જુમ્બ છે. એવી જ રીતે દિવસે ફરમનથી લડવું પડે છે, તે દિવસમાં હથિયાર બાંધી લે છે, રાતમાં હિતારી નાખે છે તો આ દરરોજ બાંધવું એક જુમ્બ છે, જ્યાં સુધી ઉત્તર બાકી છે. (આલમગીરી)

મસ્ટકાચા (૯) : સુહરિમે બીજા સુહરિમનો સીવેલું અથવા ઝુંખુંદાર ક્રપડું પહેરાયું તો આ પહેરાવનાર પર કાઈ કદ્દારો નથી. (આલમગીરી)

મસ્ટકાચા (૧૦) : પુરુષ અથવા સ્ત્રીએ સુખની ટોટલી સમય અથવા ચોથા લાગનું છુપાવી અથવા પુરુષે સમય અથવા ચોથા લાગનું માથું છુપાયું તો ચાર પહેર અથવા વધારે લગાતાર છુપાવવામાં દમ છે અને ઓછામાં સહડો છે અને ચોથા લાગથી ઓછાને ચાર પહેર સુધી છુપાયું તો સહડો છે અને ચાર પરોથી ઓછામાં કદ્દારો નથી, પરંતુ શુનોહ છે.

(આલમગીરી વિગેર)

મસ્ટકાચા (૧૧) : સુહરિમે માથા પર ક્રપડાંની ચોટલી સુડી તો કદ્દારા છે અને અનાજની ચોટલી અથવા પાટીયું અથવા પરાથ વિગેરે કાઈ વાસણું સુડી લીધું તો કાઈ નથી અને જે માથા પર માટી ચોપી લીધી તો કદ્દારા છે. (આલમગીરી, મનાસિક)

મસ્ટકાચા (૧૨) : સીવેલું ક્રપડું પહેરવામાં શરત નથી કે એરાદા પૂર્વીક પહેરે બદ્દે ભૂલથી હોય કે નાદાનીમાં, દરેક

હાલતમાં એજ હુકમ છે, એવી જ રીતે માથું અને સુખ છુપાવવામાં, ત્યાં સુધી કે સુહરિમે ઉંઘમાં પણ માથું અથવા સુખ છુપાવી લીધું તો કદ્દારો વાજિબ છે (આલમગીરી)

મસ્યાદા (૧૩) : જાન અને શરીર છુપાવવામાં વાંધો નથી એવી જ રીતે નાડ પર ખાલી હાથ સુકવામાં વાંધો નથી, અને જે હાથમાં કૃપડું છે અને કૃપડાં સાથે નાડ પર હાથ સુકયો તો કદ્દારો નથી પરંતુ મકરૂહ તથા ચુનોહ છે.

(હરે સુપતાર, રદ્દુલસુહતાર)

મસ્યાદા (૧૪) : પહેરવાનો અર્થ એ છે કે તે કૃપડું એવી રીતે પહેરે જેવું આદત (ટેવ) પ્રમાણે પહેરવામાં આવે છે. નહીં તો જે ખરીસતું તેહથાં બાંધો લીધું અથવા પાયળમાને તેહથાંધની જેમ લગેઠ્યો, પગ પાંથચામાં ન નાંખ્યા તો ઝાઈ નથી, એવી જ રીતે અંગરખું ફેલાવી બંને ખળાઓ પર સુકી લીધું, બાંહચોમાં હાથ ન નાંખે તો કદ્દારો નથી પરંતુ મકરૂહ છે, અને ખરી પર સીવેલા કૃપડાં નાણી લીધા તો ઝાઈ નથી.

(હરે સુપતાર, રદ્દુલસુહતાર, આલમગીરી)

મસ્યાદા (૧૫) : જુતા ન હોય તો મોનાઓને ત્યાંથી ઝાપીને પહેરે જ્યાં અરથી જુતાની ઢોરી હોય છે અને વગર ઝાપે પહેરી લીધા તો પુરા ચાર પહોર પહેરવામાં દમ છે અને તેનાથી એછા સમયમાં સદકો છે અને જુતા (ખુટ) હાજર હોય તો મોના ઝાપીને પહેરવું જાઈજ નથી કે માલને નષ્ટ કરવું છે. તે છતાં પણ જે એવું કર્યું તો

કદ્દારો નથી. (મનાસિક) અહીં એ પણ જાણી શકાયું કે અહેરામમાં અચૈત્ય ખુટ પહેરવું જાઈજ નથી કે તે સાંધાને છુપાવે છે. પહેરશે તો કદ્દારો લાજિમ થશે.

(૩) વાળ હુર કરવા

મસ્યાદા (૧) : માથા અથવા દાઢીના ચાથા ભાગના વાળ અથવા અધિક ઝાઈ પ્રકારે હુર હોયો તો દમ છે અને ઓછામાં સદકો છે અને જે ટાલીઓ છે અથવા દાઢીમાં ઓછા વાળ છે તો જે ચાથાઈ નીમાત્રામાં છે તો કુલમાં દમ છે. નહીં તો સદકો છે. કેટલીક જગ્યાએથી થાડા થાડા વાળ લીધા તો સૌની માત્રા જે ચાથાઈને પહોંચે છે તો દમ છે, નહીં તો સદકો છે.

(આલમગીરી, રદ્દુલસુહતાર)

મસ્યાદા (૨) : પુરી ગરદન અથવા પુરી એક બગલના વાળ હુર કરવામાં દમ છે અને ઓછામાં સદકો છે. લકે અધ્યા અથવા અધિક હોય. એજ હુકમ કુઠી નીચેના વાળ માટે પણ છે, બંને બગલો પુરી સુંડાવે તો પણ એકજ દમ છે.

(હરે સુપતાર, રદ્દુલસુહતાર)

મસ્યાદા (૩) : સમય માથું કેટલીક એકોમાં સુંડાયું તો એકજ દમ વાજિબ છે પરંતુ ન્યારે કે પ્રથમ થાડોક ભાગ સુંડાવી તેનો કદ્દારો અદ્દ કરી હીધો પણી થીએ એકોમાં સુંડાયું તો હુકે નવો કદ્દારો આપવો પરશે. એવી જ રીતે બંને બગલો એ એકોમાં સુંડાવી તો એકજ કદ્દારો છે. (હરે સુપતાર, રદ્દુલસુહતાર)

મરસાલા (૪) : માથું સુંડાંયું અને દમ આપી હીથે પણી એજ એઠકમાં દાઢી સુંડાવી તો હવે બીજે દમ આપે.

(આલમગીરી)

મરસાલા (૫) : માથું, દાઢી અને બગલો અને સમય શરીરના વાળ એકજ એઠકમાં સુંડાંયા તો એકજ કંકારો છે જે એક એક અવયવના એક એક (અલગ અલગ) એઠકમાં સુંડાંયા તો તેટલા જ કંકારો છે.

(આલમગીરી)

મરસાલા (૬) : માથું, દાઢી, ગર્દન, બગલ, હુંટીની નીચેના સિવાયના બાકીના અવયવોના વાળ સુંડાંયવામાં કેવળ સદકો છે. (રદ્દહુલમુહુતાર)

મરસાલા (૭) : સુંધ જે કે આખી સુંડાવે અથવા કટરાવે સદકો છે.

(રદ્દહુલમુહુતાર)

મરસાલા (૮) : રોટી પકાવવામાં કેટલાક વાળ સણગી ગયા તો સદકો છે, વુંઝ કરવા અથવા ખંજવાણવા અથવા ડાંસકો કરવામાં વાળ ખરે તેના પર પણ પુરો સદકો છે અને કેટલાકોએ (ઉદ્માચે) હણું કે એ ત્રણું વાળ સુધી દરેક વાળ માટે એક સુઠી અનાજ અથવા એક હુકડો રોટી અથવા એક ખારેક આપે,

(આલમગીરી, રદ્દહુલમુહુતાર)

મરસાલા (૯) : પોતાની મેળે હાથ લગાંયા સિવાય વાળ ખરી જન્ય અથવા બીમારીના લીધે સંઘળાં વાળ ખરી જન્ય તો કાંઈ નથી. (નસ્ક)

મરસાલા (૧૦) : એક સુહરિમે બીળ

સુહરિમનું માથું સુંડયું તેના પર પણ સદકો છે. લલે તેણે તેને હુકમ આપ્યો હોય કે નહીં, ખુશીથી સુંડાંયું હોય કે મજાયુરીથી અને ગેર સુહરિમનું સુંડયું તો થાડીક જૈરાત કરી હે. (આલમગીરી)

મરસાલા (૧૧) : ગેર સુહરિમે સુહરિમનું માથું સુંડયું. તેના હુકમથી અથવા વગર હુકમે તો સુહરિમ પર કંકારો છે અને સુંડવાવાળા પર સદકો છે અને તે સુંડવાવાળાથી ચાતાના કંકારાનો બદલો લઈ શકતો નથી અને જે સુહરિમે ગેર સુહરિમની મૂછો લીધી અથવા નખ કાપ્યા તો મિસ્કાનોને કાંઈ અવડાવી હે.

(આલમગીરી)

મરસાલા (૧૨) : સુંડવું, કટરવું, ઉષેડવું અથવા કોઈ વરતુથી વાળ ઉડાવવું સૌનો એક જ હુકમ છે.

(રદ્દહુલ સુહતાર વિગેર).

મરસાલા (૧૩) : ઔરત પુરા અથવા ચોથાઈ ભાગના માથાના વાળ એક પોરા બરાબર કટરે તો દમ આપે અને ઓછામાં સદકો આપે. (મનાસિક)

મરસાલા (૧૪) : વાળ સુંડાવીને પછના લીધા તો દમ છે. નહીં તો સદકો છે. (હુરે સુખતાર) (પછના એટલે શીંગી અથવા કોઈ સાધન મારકૃત ખરાબ લેણી એંચણું.)

મરસાલા (૧૫) : આંખમાં વાળ ઉગે તો તેમને ઉષેડવામાં સદકો નથી.

(મનાસિક)

(૪) નખ કતરવા

મસ્યાદા (૧) : એક હાથ, એક પગના પાંચે નખ કતર્યા અથવા વિસે નખો એક સાથે કતર્યા તો એક દમ છે અને જો કાઈ હાથ અથવા પગના પુરા પાંચે નખો ને કતર્યા તો દરેક નખ પર એક સદકો છે ત્યાં સુધી કે જો ચારે હાથ-પગોના ચાર ચાર કતર્યા તો સોણ સદકા આપે, પરંતુ એ કે સદકાની કોઈ મત એક દમની બરાબર થઈ જાય તો થાડું કે એછું કરે અથવા દમ આપે અને જો એક હાથ અથવા પગના પાંચે એક એઠકમાં અને બીજાના પાંચે બીજુ એઠકમાં કતર્યા તો એ દમ લાભિમ છે અને ચારે હાથો-પગોના નખ ચાર એઠકોમાં કતર્યા તો ચાર દમ છે. (આલમગીરી)

મસ્યાદા (૨) : કાઈ નખ તુટી ગયો કે વધવા ચોણ્ય ના રહ્યો, તેથી આડીનો નખ તેણું કાપી નાખ્યો તો કાંઈ નથી.

(આલમગીરી)

મસ્યાદા (૩) : એકજ એઠકમાં એક હાથના પાંચે નખ કાર્યા અને ચોથાઈ માથું સુંડાંદું અને અવયવ પર ખુશ્ય લગાવી તો દરેક પર એક એક દમ અર્થાત ત્રણ દમ વાળિય છે. (આલમગીરી)

મસ્યાદા (૪) : સુહરિમે બીજાના નખ કાર્યા તો એજ હુકમ છે જે બીજાના વાળ સુંડવાનો છે. (મનાસિક)

મસ્યાદા (૫) : ચાપુ અથવા નીલ-કટરથી કાપવું અને દાંતથી કાપવું સૌનો એક હુકમ છે.

ઘ. શ. ૧૫

(૫) ઓસ્સો-ચુંખન

(આલિંગન) વિગેરે

મસ્યાદા (૧) : સુખાશરતે ક્રાંકેશા (બન્નેના શુપતાંગો વચ્ચે ક્રપદું વિગેરે ના હોય તે) અને શહુવત સાથે ઓસાખાથી (ચુંખન) અને શરીરને સ્પર્શ કરવામાં દમ છે. જલે વીર્યસ્ખલન ન થાય અને જો શહુવત વગર હોય તો તેમાં કાંઈ નથી. આ ઝેલો (કૃથો) ઔરત સાથે હોય કે પુરુષ સાથે, બન્નેનો એકજ હુકમ છે.

(દરેક સુખતાર, રદ્દુલ સુહૃતાર)

મસ્યાદા (૨) : પુરુષના આ (ઉપરોક્ત) કાર્યથી ઔરતને લિઙ્ગજત આવે તો તે પણ દમ આપે. (જવહરહ)

મસ્યાદા (૩) : થોનિ પર દાખિપાત કરવાથી કાંઈ નથી, જલેને વીર્ય સ્ખલન થઈ જાય. જેકે વારંવાર દાખિપાત કરી હોય અથવા એમજ વિચારો જમાવવાથી.

(આલમગીરી, રદ્દુલ સુહૃતાર)

મસ્યાદા (૪) : હસ્તમૈશુનથી વીર્ય સ્ખલન થઈ જાય તો દમ છે, નહી તો મહૃહ છે અને સ્વર્ણદોષથી કાંઈ નથી.

(આલમગીરી)

(૬) સંલોગ-સમાગમ :

મસ્યાદા (૧) : વફુકે અરકાથી પહેલા સંલોગ કર્યો તો હુનજ ઇસિદ થઈ ગઈ. તેને હજની જેમ પુરી કરીને દમ આપે અને બીજા વધે જ તેની કંજ કરી લે.

ઔરત પણ અહેરામે હજમાં હતી તો તેના ઉપર પણ એજ લાજિમ છે અને જે આ જ્વામાં ફરીથી પડી જવાનો ડર હોય તો ચોણ્ય છે કે કઝાના અહેરામથી ખતમ સુધી બને એવી રીતે નુદી રહે કે એક જીનને જીવે નહીં. (આલમગીરી)

મસ્ટાલા (૨) : વુકુર પછી સંભોગ કરવાથી હજમ તો જરો નહીં, પરંતુ જે હલક તથા તવાફુથી પહેલાં હોય તો “બહનહુ” આપે અને હલકના પછી થયું હોય તો દમ આપે, અને અહેરતર હજુ પણ બદનહુ આપવું છે અને બન્નેની પછી હોય તો ડાંઈ નથી, તવાફુથી સુરાદ અડસર છે અર્થાત ચાર ઝેરા. (આલમગીરી)

મસ્ટાલા (૩) : ઈરાદાપૂર્વક સંભોગ હોય કે ભુલથી અથવા નિંદ્રાવસ્થામાં અથવા બળજબરીથી હોય સૌનો એકજ હુકમ છે.
(આલમગીરી)

મસ્ટાલા (૪) : વુકુરથી પહેલાં ઔરતથી એવા બાળકે વતી (સંભોગ) કરી જેના મિસલ (જેવો) સંભોગ કરે છે અથવા પાગલે વતી કરી તો હજમ ફાસિદ થઈ જરો. એવીજ સુરૂપે સુરતહાત (નાભાલિગ શહુબત શાળી) છોડીથી વતી કરી અથવા પાગલ સાથે વતી કરી તો હજમ ફાસિદ થઈ ગઈ. બાળક અને પાગલ પર ન દમ વાજિબ છે ન કાંઠ.

(હરે સુખતાર, રદ્દુલસુહતાર)

મસ્ટાલા (૫) : વુકુર અરક્ષાથી પહેલાં કેટલીક વખત સંભોગ હોયો, જે એકજ એકમાં છે તો એક દમ વાજિબ છે અને

એ વિવિધ એકડેમાં છે તો એ દમ અને જે ધીજુ વખત અહેરામ તોડવાના વિચારથી સંભોગ હોયો તો દરેક હાલતમાં એકજ દમ વાજિબ છે. લદે એકજ એકમાં હોય કે અનેકમાં. (આલમગીરી)

મસ્ટાલા (૬) : વુકુર અરક્ષા પછી, માથું સુંડાવવાની પહેલા કેટલીક વખત સંભોગ હોયો, જે એક એકમાં છે તો એક બદનહુ છે અને એ એકડેમાં તો એક બદનહુ અને એક દમ આપવો પડશે. અને જે ધીજુ વખત અહેરામ તોડવાની ઈરાદાથી સંભોગ હોયો તો આ વખતે ડાંઈ નથી.

(આલમગીરી, રદ્દુલ સુહતાર)

મસ્ટાલા (૭) : જનવર અથવા મડદા અથવા બહુ નાની છોડીથી સંભોગ હોયો તો હજમ ફાસિદ થશે નહીં. વીર્ય સ્પર્ષન થાય કે નહીં, પરંતુ વીર્ય સ્પર્ષન થયું તો દમ લાજિમ છે. (રદ્દુલ સુહતાર)

મસ્ટાલા (૮) : ઔરતે જનવરથી વતી ઝરાવી અથવા ડાંઈ આદમી અથવા જનવરનું ડ્રાયાલું અવયવ (લીંગ) ચોનીમાં સુકી લીધું તો હજમ ફાસિદ થઈ ગઈ.

(હરે સુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્ટાલા (૯) : ઉમરામાં ચાર (ઝેરા)થી પહેલાં સંભોગ હોયો, ઉમરો જતો રહ્યો, દમ આપે અને ઉમરાની કાંઠ કરે. અને ચાર ઝેરાઓ પછી હોયો તો દમ આપે, ઉમરો સહીએ થઈ જરો. (હરે સુખતાર)

મસ્ટાલા (૧૦) : ઉમરો કરનારે કેટલીક વખત વિવિધ એકડેમાં સંભોગ હોયો તો દરેક વેળા દમ વાજિબ અને તવાફ તથા

સઈ પછી હુલકથી પહેલા કથો તો પણ દમ વાજિય છે અને હુલક પછી તો કાંઈ નથી. (આલમગીરી)

મસ્તાદા (૧૧) : હજાને કિરાનવાળાએ ઉમરાના તવાઝથી પહેલા સંલોગ કથો તો હજાન તથા ઉમરો બંને ફસિદ થશે, પરંતુ બંનેના સધળા અફુઆલ (કથો) બનબી લાવે અને એ દમ આપે અને આવતા વર્ષે હજાન તથા ઉમરો કરે અને જે ઉમરાનો તવાઝ કરી લીધો છે અને બુરેએ અરકાથી પહેલા સંલોગ કથો તો ઉમરો ફસિદ થયો નહીં, હજાન ફસિદ થઈ ગઈ. એ દમ આપે અને આવતા વર્ષે હજાનની કાંડે. અને જે બુરુદ્દ પછી કથો તો ન હજાન ફસિદ થશે ન ઉમરો. એક બદનહ અને એક દમ આપે અને તે ઉપરાંત કિરાનની કુરાબાની આપે. (મનાસિક)

મસ્તાદા (૧૨) : સંલોગથી એહરામ જતે નથી, તે નિયમતુસાર સુહરિમ (એહરામ-વાળા) છે, બીજી વસ્તુઓ સુહરિમ માટે નાનાઈજ છે, તે હન્દુ પણ નાનાઈજ છે. અને એજ સધળા એહડામ છે.

(૨૬હુલ સુહતાર)

મસ્તાદા (૧૩) : હજાન ફસિદ થયા પછી બીજી હજાનનો એહરામ એજ વર્ષે આંધો તો બીજે નથી બઢું એજ છે જેને તેણે ફસિદ કરી દીધો. આ તરકીબથી આવતા વર્ષની કાંઠથી બચી શકતો નથી.

(૨૬હુલ સુહતાર)

(૭) તવાઝમાં ભૂલો

મસ્તાદા (૧) : તવાઝ કંઈ કુલ

અથવા અકસર અર્થાત ચાર હેરા જનાયત અથવા હૈજ તથા નિદ્રાસમાં કથો તો “બદનહ” છે અને એ બુજુ કથો તો દમ છે અને પ્રથમ રિથતિમાં તહૃરત સાથે પુનરાવર્તન વાજિય છે. જે મજાથી ચાલ્યો ગયો હોય તો પણો આલીને પુનરાવર્તન કરે, લાલેને મીકાતથી પણ આગળ વધી ગયો હોય પરંતુ બારમી તારીખ સુધી જે સંપૂર્ણ રીતે પુનરાવર્તન કરી લીધું તો જુરમાનો (૮૩) સાકિત થઈ ગયો. અને બારમી પછી કંદું તો દમ લાલિમ થશે, બદનહ સાકિત (૮૬) માટે જે તવાઝ કંઈ બારમી પછી કથો છે તો બદનહ સાકિત થશે નહીં કે બારમી તો પસાર થઈ ગઈ અને જે તવાઝ કંઈ બુજુ વગર કથો હતો તો એચાદહ (પુનરાવર્તન) સુસ્તહણ છે. પછી પુનરાવર્તનથી દમ સાકિત થઈ ગયો. અગરચે બારમી પછી કથો હોય.

(જવહરહ, આલમગીરી)

મસ્તાદા (૨) : ચાર કેરાથી એછા તહૃરત વગર તવાઝ કથો તો દરેક કેરાના બદલે એક સદકો છે અને જનાયતમાં કથો તો દમ છે. પછી જે બારમી સુધી પુનરાવર્તન કરી લીધું તો દમ સાકિત થશે અને બારમી પછી પુનરાવર્તન કંદું તો દરેક કેરાના બદલે એક સદકો આપે. (આલમગીરી)

મસ્તાદા (૩) : કુરુ તવાઝ કુલ અથવા અકસર ઉજર વગર ચાલીને ન કથો બદલે સવારી પર અથવા જોગામાં અથવા ઘસડાઈને અથવા સતર વગર કથો. દા.ત. ઔરતનું ચોથાઈ કંડુ અથવા ચોથાઈ ભાગના માથાના વાળ ઉધાડા હતા અથવા

ઉદ્દો તવાક્ર ક્યો અથવા હૃતીમની એં દરથી તવાક્રમાં પસાર થયો અથવા બારમી પણી ક્યો તો આ સધળી હાલતોમાં દમ આપે અને સહીંહ પ્રકારે પુનરાવર્તન ડરી લિધું તો દમ સાહિત અને પુનરાવર્તન ક્યો વગર ચાલ્યો આવ્યો તો બદ્દરી અથવા તેની કીં મત મોઝી આપે કે હરમમાં જુખ ડરી હેવામાં આવે. પાછા આવવાની જરૂરત નથી.

(આલમગીરી, ૨૬હુલસુહતાર)

મસ્ટાદા (૪) : જનાભતની હાલતમાં તવાક્ર ડરીને ઘેર ચાલ્યો ગયો તો કુરીથી નવો એહુરામ બાંધીને પાછો આવે અને પાછો ન આવ્યો બદ્દકે બદનહ મોઝી દીધા તો પણ કાઢી છે. પરંતુ પાછા આવવું અફાલ છે અને વજુ વગર તવાક્ર ક્યો હતો તો પાછા આવવું પણ જાઈજ છે અને બહેતર એ છે કે ત્યાંથી જ બદ્દરી અથવા તેની કીં મત મોઝી આપે.

(આલમગીરી)

મસ્ટાદા (૫) : ઇરજ તવાક્રના ચાર ડેરા ડરીને ચાલ્યો ગયો અર્થાત ત્રણું અથવા એ અથવા એક ડેરા બાકી છે તો દમ વાજિબ છે. ને ચાતે ન આવ્યો અને દમ મોઝી દીધો તો કાઢી છે. (આલમગીરી)

મસ્ટાદા (૬) : ઇરજ સિવાય કોઈ ખીને તવાક્ર કુલ અથવા અકસર જનાભતની હાલતમાં ક્યો તો દમ આપે અને વુજુ વગર ક્યો તો સદકે આપે અને ત્રણું ડેરા અથવા તેનાથી એાછા જનાભતની હાલતમાં ક્યો તો દરેક ડેરાના બદલામાં એક સદકે આપે પણ ને મજ્જા મોઅજમામાં જ છે તો સધળી સુરતોમાં (એઆદા) પુનરાવર્તન

ડરી લે કદ્દારો રહ થઈ જશે. (આલમગીરી)

મસ્ટાદા (૭) : ઇખસત (વિદાય)નો તવાક્ર કુલ અથવા અકસર તક્ર ક્યો તો દમ લાજિમ છે, અને ચાર ડેરાઓથી એછો છોડ્યો તો દરેક ડેરાના બદલામાં એક સદકે છે અને તવાક્રકુલમ તક્ર ક્યો તો કદ્દારો નથી, પરંતુ બુર ક્યું અને ઉમરાના તવાક્રનો એક ડેરો પણ તક્ર કરશે તો દમ લાજિમ થશે અને બિલકુલ ન ક્યો અથવા અકસર (અધિકાંશ) તક્ર ક્યો તો કદ્દારો નથી બદ્દકે તેનું અહા કરવું લાજિમ છે.

(મનાસિક)

મસ્ટાદા (૮) : ડારિને તવાક્ર કુલમ તથા તવાક્ર ઉમરહ બંને બુજુ વગર કર્યા તો દસમી તારીખથી પહેલા ઉમરહના તવાક્રનું પુનરાવર્તન કરે. અને લે પુનરાવર્તન ના ક્યું, ત્યાં સુધી કે દસમી તારીખની હુલ્કુએ ઇજર (સુષ્ઠા સાદિક) થઈ ગઈ તો દમ વાજિબ થશે અને ઇરજ તવાક્રમાં રમત તથા સર્દ કરે. (મનાસિક)

મસ્ટાદા (૯) : નાપાં ક્રપદાંચોમાં તવાક્ર મંજૂહ છે. પરંતુ કદ્દારો નથી.
(આલમગીરી વિગેર)

મસ્ટાદા (૧૦) : ઇરજ તવાક્ર જનાભતની હાલતમાં ક્યો હતો અને બારમી તારીખ સુધી તેનું પુનરાવર્તન પણ ન ક્યું, હવે તેરમી તારીખે તવાક્ર ઇખસત તહીરત સાથે ક્યો તો આ તવાક્ર ઇરજના કાયમ સુકામ (સ્થાને) થઈ જશે અને ઇખસતના તવાક્રને છોડવા અને ઇરજ તવાક્રમાં વિલાંબ ઇરવાના કારણે તેના પર એ દમ લાજિમ

થશે અને જે બારમી તારીખે રૂખસતનો તવાઇ ક્યો છે તો આ તવાઇ ઇરજના કાયમ સુકામ થશે અને કેમકે રૂખસતનો તવાઇ ન ક્યો માટે એક દમ લાંજિમ છે અને જે રૂખસતનો તવાઇ બીજુ વાર કરી લીધો તો આ દમ પણ રદ ગઈ ગયો. અને જે ઇરજ તવાઇ વુજુ વગર ક્યો હતો અને આ તવાઇ બાબુજુ ક્યો તો એક દમ છે અને જે ઇરજ તવાઇ વુજુ વગર ક્યો હતો અને રૂખસતનો તવાઇ જનાભતની હાલતમાં કર્યો તો એ દમ છે. (આલમગીરી)

મસ્ટાદા (૧) : ઇરજ તવાઇના ત્રણ દેરા ક્યો અને રૂખસતનો તવાઇ પૂરો કર્યો તો આમાંના ચાર દેરા તેનામાં ગણ્ણાઈ જશે. અને એ દમ લાંજિમ આવશે. એક ઇરજ તવાઇમાં વિલંખ કરવાના કારણે અને ખીને રૂખસતના તવાઇના ચાર દેરા છોડી ઢેવાના કારણે. અને જે દરેકના ત્રણ ત્રણ દેરા ક્યો તો કુલ ઇરજમાં ગણ્ણના થશે અને એ દમ વાંઝિય થશે. (આલમગીરી) આ મસ્ટાદામાં કુદ્દાએ કસીરહ (અધિક પ્રશાખાઓ) છે. લંબાણુના ડરથી ઉદ્દેખ કર્યો નથી.

(૮) સર્ધિમાં ભૂલો

મસ્ટાદા (૧) : સર્ધિના ચાર દેરા અથવા વધારે ઉંચર વગર છોડી છીધા અથવા સવારી પર ક્યો તો દમ આપે, અને હજા થઈ ગઈ. અને ચારથી ચોછામાં દરેક દેરાના બદલામાં સહકો છે. અને પુનરાવર્તન કરી લીધું તો દમ તથા સહકો સાડિત. અને ઉંચરના કારણે એવું થયું તો માફ છે. એજ દરેક વાંઝિયનો હુકમ છે કે, સહીં

ઉંચરથી તર્ક કરી શકે છે.

(આલમગીરી, દુર્દુસુખતાર)

મસ્ટાદા (૨) : તવાઇથી પહેલા સર્ધ કરી અને પુનરાવર્તન ન કર્યું તો દમ આપે. (દુર્દુસુખતાર)

મસ્ટાદા (૩) : જનાભતની હાલતમાં અથવા એવુજુ તવાઇ કરીને સર્ધ કરી તો સર્ધના પુનરાવર્તનની હાજર નથી.

(દુર્દુસુખતાર)

મસ્ટાદા (૪) : સર્ધમાં એહારામ અથવા હજાનો સમય શરત નથી. જે ન કરી હોય તો નયારે ઈંછે કરી લે, અદ્ય જશે. (જવહરહ)

(૯) વુક્કે અરદ્ધામાં ભૂલો

મસ્ટાદા (૧) : જે શર્ષ સુયોગની પહેલા મેદાને અરક્ષાતથી ચાલ્યો ગયો તો તે દમ આપે. પછી જે શર્ષ (સુયોગની) પહેલા પાછો આંદો તો દમ સાડિત થઈ ગયો. અને શુરૂણ પછી પાછો આંદો તો દમ રદ થયો નહીં. અને અરક્ષાતથી ચાલ્યા આવવું લદે આપમેળે હોય કે અખત્યાર વગર, હા, ત, ઉંટ પર સવાર હતો. તે તેને લઈને લાગી ગયું. બંને હાલતમાં દમ છે. (આલમગીરી, જવહરહ)

(૧૦) સુઅદલિઝામાં વુક્કે

મસ્ટાદા (૧) : દસમી તારીખની સવારે સુઅદલિઝામાં ઉંચર વગર વુક્કે ન કર્યું તો દમ આપે. હા, એમનેર અથવા ઔરત લીઇના ડરથી વુક્કે તર્ક કરે તો

જુરમાના (૬૩) નથી. (જવહરહ)

(૧૧) રમીની ભૂતો.

મસ્યાદા (૧) : કોઈ પણ દિવસે રમી કરી નહીં અથવા એક દિવસ કરી, બિંદુલ અથવા અક્ષર તક કરી દીધી. હ. ત. દસમી તારીખે ત્રણ કાંઈરીએ સુધી મારી અથવા અગ્યારમી તારીખ વિગેરએ દસ કાંઈરીએ સુધી અથવા કોઈ દિવસની બિંદુલ અથવા અક્ષર રમી બીજા દિવસે કરી તો આ સધળી હાલતોમાં દમ છે અને જે કોઈ દિવસની અધો કરતાં એધી છોડી હા. ત. દસમીએ ચાર કાંઈરીએ મારી, ત્રણ છોડી દીધી અથવા બીજા દિવસોની અગ્નીયાર મારી, દસ છોડી દીધી અથવા બીજા દિવસે રમી કરી તો દરેક કાંઈરી પર એક સદકો આપે અને જે સદકાએની કીમત દમની બરાબર થઈ જય તો થોડું ઓછું કરી હે. (અલગારી હરે સુખતાર, ૨૬૬૫૮ સુહૃત્તાર)

(૧૨) કુરખાની અને હલકમાં ભૂતો :

મસ્યાદા (૧) : હરમમાં હલક ન કર્યું, હરમની હુદ્દોથી બહાર કર્યું અથવા બારમી તારીખ પછી કર્યું અથવા રમીથી પહેલા કર્યું અથવા કારિન તથા મુતમતેઅએ કુરખાનીથી પહેલા કર્યું અથવા તે બંનેએ રમીથી પહેલા કુરખાની કરી તો આ સધળી હાલતોમાં દમ છે. (હરે સુખતાર વિગેર)

મસ્યાદા (૨) : ઉમરાનો હલક પણ હરમ (નીહદ)માં જ થવું જરૂરી છે, આનો

હલક પણ હરમ (નીહદ)થી બહાર થયો. તો દમ છે પરંતુ તેમાં સમયની શરત નથી. (હરે સુખતાર)

મસ્યાદા (૩) : હજજ કરવાવાળાએ બારમી તારીખ પછી હરમથી બહાર માથું સુંડાયું તો જે દમ છે, એક હરમથી બહાર હલક કરવાતું થિયું બારમી તારીખ પછી થવાથી. (૨૬૬૫૮ સુહૃત્તાર)

(૧૩) શિકાર કરવું :

મસ્યાદા (૧) : ખૂંઝીનું જંગલી જનવર શિકાર કરવું અથવા તેની પ્રત્યે શિકાર કરવા માટે ઈશારો કરવું અથવા બીજુ કોઈ રીતે બતાવવું આ સધળાં કામ હંતમ છે અને સૌમાં કદ્રફારો વાજિણ છે. લદે તેના આવામાં વિવશ હોય અર્થાત ભૂષે મરી રહ્યો હોય અને કદ્રફારો તેની કીમત છે અર્થાત જે ન્યાયી ત્યાંના હિસાબે જે કીમત બતાવી હે તે આપવી પડશે અને જે ત્યાં તેની કોઈ કીમત ન હોય તો ત્યાંથી નિકટના સ્થળે જે કીમત હોય તે આપે. અને જે એકજ આદિસે બતાવી દીધું તો પણ કાઢી છે. (હરે સુખતાર વિગેર)

મસ્યાદા (૨) : પાણીના જનવરનો શિકાર કરવો જર્દર છે. પાણીના જનવરથી ભાવાર્થ તે જનવર છે જે પાણીમા પેદા થયું હોય, લદે ખુશીમા પણ કયારેક રહેતું હોય અને ખુશીનું જનવર એ છે જેની પૈદાર્થ ખુશીની હોય, લદે પાણીમાં રહેતું હોય. (મનાસિક)

મસ્યાદા (૩) : શિકારની કીમતમાં

અખત્યાર છે કે તેનાથી ઘેડું-ખડકી વિગેર જે ખરીદી શકતો હોય તો ખરીદીને હરમમાં જુણ્ણ કરીને નિર્ધારનો (ગરીબો)ને વહેંચી હે અથવા તેનું અનાજ ખરીદી મિસ્કીનને પર સદકો કરી હે. એટલો કે દરેક મિસ્કીનને હિતાના સદકા જેટલું પહોંચે. અને એ પણ થઈ શકે છે કે તે કીમતના અનાજમાં જેટલા સદકા થઈ શકાના હોય દરેક સદકાના બદલામાં એક રોજો રાખે અને જે થોડું અનાજ બચી જય જે પૂરો સદકો નથી તો અખત્યાર છે કે તે કોઈ મિસ્કીનને આપી હે અથવા તેના બદલામાં એક રોજો રાખે. અને જે પુરી કીંમત એક સદકાના લાયક પણ નથી તો પણ અખત્યાર છે કે એટલાનું અનાજ ખરીદીને એક મિસ્કીનને આપી હે અથવા તેના બદલે એક રોજો રાખે.

(હરે સુખતાર, આલમગીરી વિગેર)

મસ્યાદા (૪) : જે કષ્કારાનું જનવર હરમની બહાર જુણ્ણ કચું તો કષ્કારો અદ્દો નથી અને જે તેમાંથી ચાતે પણ આઈ લીધું તો એટલાનું તાવાન આપે અને જે આ કષ્કારાના માંસને એક મિસ્કીન પર સદકો કરો તો પણ જર્જર છે. એવીજ રીતે તાવાનની કીમત પણ એક મિસ્કીનને આપી શકે છે અને જે જનવરને બહાર જુણ્ણ કચું અને તેનું માંસ દરેક મિસ્કીનને એક એક સદકાની કીંમતનું આપું અને તે સધળું માંસ એટલી કીંમતનું છે જેટલી કીંમતનું અનાજ ખરીદામાં આવતું, તો અદ્દ થઈ ગયું. (આલમગીરી, ૨૮હુલમુહતાર)

મસ્યાદા (૫) : કષ્કારાનું જનવર

ચોરાઈ જું અથવા જીવંત જનવર જ સદકો કરી હીધું તો અપુરતું છે અને જે જુણ્ણ કરી હીધું અને માંસ ચોરાઈ ગયું તો અદ્દ થઈ ગયો. (૨૮હુલમુહતાર)

મસ્યાદા (૬) : કીંમતનું અનાજ સદકો ડરવાની હાલતમાં દરેક મિસ્કીનને સદકાની માત્રામાં આપવું જરૂરી છે. ઓછું વતુ આપશે તો અદ્દ થશે નહીં. ઓછું ઓછું આપું તો કુલ નિકલ સદકો છે અને વધુ-વધુ આપું તો એક સદકાથી જેટલું વધારે આપું નિકલ છે. આ તે સ્વરૂપમાં છે કે એકજ દિવસમાં આપું હોય અને જે કેટલાએ દિવસોમાં આપું અને દરરોજ પૂછું સદકો તો આમ એક મિસ્કીનને કેટલાએ સદકા આપી શકે છે અને એ પણ થઈ શકે છે કે દરેક મિસ્કીનને એક એક સદકાની કીંમત આપી હે.

(હરે સુખતાર, ૨૮હુલમુહતાર)

મસ્યાદા (૭) : સુહરિમે જંગલના જનવરને જુણ્ણ કચું તો હલાલ થયું નથીં બદકે સુરદાર છે. તો જુણ્ણ કચો પણી તેને આઈ પણ લીધું તો જે જે કષ્કારો આપ્યા પણી ખાદું તો હવે કુરીશી ખાવાનો કષ્કારો આપે અને જે કષ્કારો આપ્યો ન હતો તો એકજ કષ્કારો કાઢી છે. (૪૪હુરહ)

મસ્યાદા (૮) : તે શિકારની જેટલી કીંમત નકડી થઈ તેનું જનવર ખરીદી જુણ્ણ કચું અને કીંમતમાંથી ચોડીએ રકમ બચી ગઈ તો બાકીની રકમનું અનાજ ખરીદી સદકો કરે અથવા દરેક સદકાના બદલે એક રોજો રાખે અથવા થોડાએ રોજા રાખે થોડાએ સદકો આપે સધળું જર્જર છે.

એવીજ રીતે જોકે કીંમત એ જનવરોના અરીંવાનો લાયક છે તો જલે એ જનવર જુખું કરે અથવા એક જુખું કરે અને એકના બદલાનો સર્દકો આપે અથવા રોજા રાખે, દરેક પ્રકારે અખત્યાર છે. (આલમગીરી)

મસ્તાદા (૮) : એહુરામવાળાએ હુરમના જનવરનો શિકાર કર્યો તો તેનો પણ એજ હુકમ છે, હરમના કારણે એવડો કદ્દકરારો વાજિબ થશે નહીં. અને જે એહુરામ વગર હુરમના શિકાર કર્યો તો તેનો પણ એજ કદ્દકરારો છે જે સુહુરિમ માટે છે, પરંતુ આમાં રોજો કાશી નથી. (આલમગીરી)

મસ્તાદા (૯) : જંગલના જનવરથી સુરાફ (ભાવાથી) એ છે જે જે ખુશીમાં પૈંડા થાય છે જલે પાણીમાં રહેતું હોય. માટે સુરગાઢી અને જંગલી ઘતકનો શિકાર કરવાનો પણ એજ હુકમ છે અને પાણીનું જનવર એ છે જેની ઉત્પત્તી પાણીમાં થાય છે. જોકે કયારેક કયારેક ખુશીમાં રહેતું હોય, ઘરેલું જનવર દા.ત. ગાય, લોંસ, બકરીને જંગલમાં રહેવાના કારણે માનવીથી કરે તો જંગલી નથી અને જંગલી જનવરને કોઈએ પાળી લીધું તો હજુ પણ જંગલનું જ જનવર ગણુવામાં આવશે, જે પાળેલી હુરણુનો શિકાર કર્યો તો તેનો પણ એજ હુકમ છે, જંગલનું જનવર જે કોઈની માલિકીમાં થઈ જારી નથી જાય, દા.ત. પડી લાંયા અથવા પદ્ધતિનાર પાસેથી ખરીદી લીધું તો તેનો શિકાર કરવાનો પણ એજ હુકમ છે.

(આલમગીરી, જવહરહ, ૨૬હુલમુહતાર)

મસ્તાદા (૧૧) : હુરામ અને હુલાલ જનવરો બંનેના શિકારનો એક હુકમ છે,

પરંતુ હુરામ જનવરના કઠલ કરવામાં કદ્દકરારો એક બકરી કરતાં વધારે નથી. જોકે જનવરની કીંમત એક બકરીથી બહુ વધારે હોય, દા.ત. હાથીનો કઠલ કર્યો તો કેવળ એક બકરી કદ્દકરામાં વાજિબ છે.

(હરે સુખતાર, ૨૬હુલ મુહતાર)

મસ્તાદા (૧૨) : શીખવેલું જનવર કઠલ કશું તો કદ્દકરામાં એજ કીંમત વાજિબ છે જે વગર શીખવેલની છે, અથભત જે તે કોઈની માલિકીનું છે તો કદ્દકરા ઉપરાંત તેના માલિકને શીખવેલની કીંમત આપે. (હરે સુખતાર)

મસ્તાદા (૧૩) : કદ્દકરા લાભિમ આવવા માટે ઈરાદા પૂર્વે કઠલ કરવું શરત નથી, ભૂલચૂઝીથી કઠલ થશું તો પણ કદ્દકરારો છે. (હરે સુખતાર વિગેર)

મસ્તાદા (૧૪) : જનવરને જખમી કરી હીધું પરંતુ મયું નથી અથવા તેના વળી અથવા પાંખો એંચી અથવા કોઈ અવયવ કાપી નાખ્યો તેના કારણે જે કાંઈ તે જનવરમાં કરી થઈ તે કદ્દકરારો છે અને જે જખમના કારણે મરી ગયું તો પૂરી કીંમત વાજિબ છે. (આરમાદુલ કરતુથ)

મસ્તાદા (૧૫) : જખમ ખાઈને જનવર લાગી ગયું અને ખખર છે કે મરી ગયું અથવા ખખર નથી કે મરી ગયું કે જીવાંત છે તો કીંમત વાજિબ છે અને જે ખખર છે કે મરી ગયું પરંતુ આ જખમના કારણે નહીં બદ્દે કોઈ ધીલ કારણીથી તો જખમની જરૂ (બદ્દો) આપે અને બિલકુલ સાડું થઈ ગયું તો પણ કદ્દકરારો ૨૬ થશે નહીં. (હરે સુખતાર)

મસ્ટઅલા (૧૬) : જનવરને જખમી કર્યું, પછી તેને કંતલ કરી નાખ્યું તો જખમ તથા કંતલ બનેનો કદ્દકારો આપે.

(આલમગીરી)

મસ્ટઅલા (૧૭) : જનવર જાળમાં ફેસેલું હતું અથવા કાઈ લક્ષ જનવરે તેને પકડ્યું હતું. તેણે છોડાવવા હઈછ્યું તો જો મરી પણ જાય તો પણ કાઈ નથી.

(હરે સુહૃત્તાર)

મસ્ટઅલા (૧૮) : પક્ષીની પાંચો વિંધી નાંએ. એટલે કે ઉડી ન શકે અથવા ચોપગાના હાથ-પગ કાપી નાંએ કે નાસી ન શકે તો પુરા જનવરની કીંમત વાજિબ છે. અને ઈંડુ તોડયું અથવા ભુન્યું તો તેની કીંમત આપે પરંતુ જાયારે કે ગંધ હોય (બગરલું હોય) તો કાઈ વાજિબ નથી. લલે તેનું ઝાતરું કીંમતી હોય. જેવું કે શાહમૃગતું ઈંડુ કે લોડો તેને ખરીદીને પ્રદર્શનની રીતે રાખે છે. લલે ગંધ હોય, ઈંડુ તોડયું તેમાંથી મરેલું બચ્યું નીકળ્યું તો બચ્યાની કીંમત આપે. અને જંગલના જનવરનું હુધ હોણ્યું તો હુધની અને વાળ કંતારી તો વાળાની કીંમત આપે.

(હરે સુહૃત્તાર વિગેર)

મસ્ટઅલા (૧૯) : પક્ષીની પાંચો ઓંચી નાંખી અથવા ચોપગાનાં હાથપગ કાપી નાંખ્યા. પછી કદ્દકારો આપવાથી પહેલા તેને કંતલ કરી નાખ્યું તો એકજ કદ્દકારો છે. અને કદ્દકારો અદા કર્યો પછી કંતલ કર્યું તો એ કદ્દકારા આપે, એક જખમ વિગેરનો, ખીંઠે કંતલનો અને જો જખમી કર્યું પછી

તે જનવર જખમના કારણે મરી ગયું તો એકજ કદ્દકારો છે. લલે મરવાથી પહેલા આપેથી હોય કે પછીથી.

(મનાસિક, આલમગીરી)

મસ્ટઅલા (૨૦) : જંગલના જનવરનું ઈંડુ ભુન્યું (શેકચું) અથવા હુધ હોણ્યું અને કદ્દકારો અદા કરી દીધો તો હવે તેનું આવું હરામ નથી અને વેચવું પણ જાઈજ, પરંતુ મકરણ છે અને જનવરનો કદ્દકારો આપેથી અને આદું તો કરીથી કદ્દકારો આપે અને ખીંઠ સુહરિમે ખાઈ દીધું તો તેના પર કદ્દકારો નથી. જોકે આવું હરામ હતું કે તે સુરદાર છે.

(જવહરહ, રદ્દુલ સુહૃત્તાર)

મસ્ટઅલા (૨૧) : જંગલના જનવરનું ઈંડુ ઉપાડી લાંચો અને મરધીની નીચે સુકી દીધું. જો ગંધ થઈ ગયું તો તેની કીંમત આપે અને તેમાંથી બચ્યું નિકળ્યું અને મોકું થઈને ઉડી ગયું તો કાઈ નથી. અને જો ઈંડા ઉપરથી જનવરને ઉડાવી દીધું અને ઈંડુ ગંધ થઈ ગયું તો કદ્દકારો વાજિબ છે. (મનાસિક)

મસ્ટઅલા (૨૨) : હરણીને મારી તેના ચેટમાં બચ્યું હતું તે મરેલું પડ્યું તો તે બચ્યાની કીંમતનો કદ્દકારો આપે અને હરણી પાછળથી મરી ગઈ તો તેની કીંમત પણ આપે અને જો ન મરી તો તેના કારણે જેટલું તેમાં તુકસાન આવ્યું તે કદ્દકારામાં આપે અને જો બચ્યું પડ્યું નથી, પરંતુ હરણી મરી ગઈ તો ગર્ભની હાલતમાં તેની જે કીંમત હતી તે આપે. (જવહરહ)

મસ્યાદા (૨૩) : ચીલ, વર્ણ, વિષુ, સર્પ, ઉંદર, મોટો ઉંદર, છષુંદર, કરડી આતું કુતર્દ, મખતર્દ, મચથર્દ, ચીચઠ, કચવો, કેકડા, પતંગીચો, કરડનારંકિઠી, માંખ ગર્ડાડી, અને સધળાં કીડા મકોડા, બિજજુ (ગોરખર) લોમડી, ગીદળ ન્યારે આ જનવર હુમલો કરે અથવા જે લક્ષ્ય પશુઓ એવા હોય જેમની આદત અક્સર હુમલો કરવાની હોય છે, જેવા કે શેર, ચીતો, તેંદવા આ સૌને મારવામાં કાંઈ નથી. એવી જ રીતે પાણીના સધળા જનવરના કલતમાં ક્રદ્ધારો નથી. (આલમગીરી, હર્રે સુખતાર, રદ્દુલ સુહૃત્તાર વિરોધે).

મસ્યાદા (૨૪) : હરણુ (નર) અને બકરીથી અન્યું પૈદા થયું તો તેના કલતમાં કાંઈ નથી. હરણી (નારી) અને બકરાથી છે તો ક્રદ્ધારો વાજિબ છે.

(હર્રે સુખતાર, રદ્દુલસુહૃત્તાર)

મસ્યાદા (૨૫) : ગેર સુહરિમે શિકાર કર્યો તો સુહરિમ તેને ખાઈ શકે છે જેકે તેણે તેના જ માટે કર્યો હોય ન્યારે કે આ સુહરિમે ન તેને બતાવ્યો ન હુકમ કર્યો ન કાઈ પ્રકારે તે ડામમાં સહાયતા કરી હોય અને એ શરત પણ છે કે હરમથી બહાર તેને ચુણું કર્યું હોય. (હર્રે સુખતાર)

મસ્યાદા (૨૬) : બતાવનાર, ઈશારો કરન ર પર ક્રદ્ધારો તે સમયે લાજિમ છે કે (૧) નને બતાવ્યું તે તેની વાતને જુઠી ન સમજે અને (૨) તેના બતાવ્યા સિવાય તે જાણુંતો પણ ન હોય અને (૩) તેના બતાવવા પર તુરત જ તેણે મારી પણ નાખ્યું હોય અને (૪) તે જનવર ત્યાંથી

નાસી ન ગયું અને (૫) આ બતાવનાર જનવરના માર્યા ગયા સુધી એહામમાં હોય. જે આ પાંચ શર્તોમાં એક ન પામવામાં આવે તો ક્રદ્ધારો નથી, પરંતુ હર હાલતમાં શુનોહ છે.

(હર્રે સુખતાર, રદ્દુલરહે)

મસ્યાદા (૨૭) : એક સુહરિમે કોઈને શિકારનું હેકાણું બતાવ્યું પરંતુ તે તેને ન સાચું સમજાયો ન જુહું, પછી બીજાએ અખર આપી, હવે તેણે તપાસ કરી અને જનવરને માચું તો બંને બતાવનારાઓ પર ક્રદ્ધારો છે અને જે પ્રથમવાળાને જુહો સમજાયો તો કેવળ બીજા પર ક્રદ્ધારો છે.

(રદ્દુલસુહૃત્તાર)

મસ્યાદા (૨૮) : સુહરિમે શિકારનો હુકમ આપ્યો તો ક્રદ્ધારો હર હાલતમાં લાજિમ છે. જાણે જનવર જુદ મારનારની જાણુડારીમાં છે. (રદ્દુલસુહૃત્તાર)

મસ્યાદા (૨૯) : એક સુહરિમે બીજા સુહરિમને શિકાર કરવાનો હુકમ આપ્યો અને બીજાએ જુદ શિકાર ન કર્યો બલકે તેણે બીજા સુહરિમને હુકમ આપ્યો હવે બીજાએ શિકાર કર્યો તો પહેલા પર ક્રદ્ધારો નથી અને બીજા અને બીજા પર લાજિમ છે અને જે પહેલાએ બીજાને કાઢ્યું કે તું ક્રદ્ધારોને શિકારનો હુકમ આપ અને તેણે હુકમ આપ્યો તો તેણું પર જીરમાનો (૬૩) લાજિમ છે. (મનાસિક)

મસ્યાદા (૩૦) : ગેરસુહરિમે સુહરિમ (એહામવાળા)ને શિકાર બતાવ્યો અથવા હુકમ કર્યો તો શુનેહગાર થયો, તૌખા કરે. તે ગેર સુહરિમ પર ક્રદ્ધારો નથી. (મનાસિક)

મસ્ટઅલા (૩૧) : સુહરિમે જેને બતાવ્યું તે સુહરિમ હોય કે નહોય હર હાલતમાં બતાવનાર પર કદ્દારો લાજિમ છે.

(રદ્દખલસુહતાર)

મસ્ટઅલા (૩૨) : કેટલાય શાખસોએ લેગા મળીને શિકાર કર્યો તો સૌ પર પુરૈપુરો કદ્દારો છે. (આલમગીરી)

મસ્ટઅલા (૩૩) : લીડ પણ ઘુસ્કીનું જાનવર છે. તેને મારે તો કદ્દારો આપે અને એક ખનુર કાઢી છે. (જવહરહ)

મસ્ટઅલા (૩૪) : સુહરિમે જંગલનું જાનવર ખરીદયું અથવા વેચ્યું તો સોડો આતલ છે. પછી ખરીદનાર તથા વેચનાર બંને સુહરિમ છે અને જાનવર હુકમ થયું તો બંને પર કદ્દારો છે. આ હુકમ તે સમયે છે કે એહુરામની હાલતમાં પકડયું અને એહુરામમાં જ વેચ્યું અને જે પકડવા સમયે સુહરિમ ન હતો અને વેચવાના સમયે છે તો વેચાણું રહે છે અને જે પકડવા સમયે સુહરિમ હતો અને વેચવાના સમયે નથી તો વેચાણું જાઈએ છે. (જવહરહ)

મસ્ટઅલા (૩૫) : ગેર સુહરિમે ગેર સુહરિમને જંગલનું જાનવર વેચ્યું અને ખરીદનારે હન્જુ કહણે લીધે. નહતો કે બંને માંથી એકે એહુરામ બાંધી લીધું તો હેવે તે વેચાણું આતિલ થઈ ગયું. (જવહરહ)

મસ્ટઅલા (૩૬) : એહુરામ બાંધું અને તેના હાથમાં જંગલનું જાનવર છે તો હુક્ક છે કે છાડી હે અને જે ન છાડ્યું, ત્યાં સુધી કે મરી ગયું તો જમાન આપે પરંતુ છાડી હેલાથી તેની માલિકીમાંથી

નિકળતું નથી. જ્યારે કે એહુરામથી પહેલા પકડયું હતું અને એ પણ શરત છે કે, હરમની બહાર પકડયું હોય.

જે તેને કાઈએ પકડી લીધું તો માલિક તેનાથી લઈ શકે છે. જ્યારે એહુરામથી નિકળી ગયો હોય અને જે કાઈ ધીનાએ તેના હાથમાંથી છાડાવી લીધું તો આ તાવાન આપે, અને જે જાનવર તેના ઘેર છે તો કાંઈ વાંધી નથી, અથવા પાસે છે પરંતુ પીંજરામાં છે તો જ્યાં સુધી હરમથી બહાર છે છાડ્યું જરૂરી નથી. માટે જે મરી ગયું તો કદ્દારો લાજિમ નથી.

(જવહરહ, આલમગીરી)

મસ્ટઅલા (૩૭) : સુહરિમે જાનવર પકડયું તો તેની મિઠાત ન થયું. હુકમ છે છે કે છાડી હે, લલે પીંજરામાં હોય કે ઘેર અને તેને કાઈ પકડી લે તો એહુરામ પછી તેનાથી લઈ શકતો નથી અને જે કાઈ ધીનાએ છાડી સુધું તો તેનાથી તાવાન લઈ શકતો નથી અને ધીન સુહરિમે મારી નાખ્યું તો બંને પર કદ્દારો છે પરંતુ પકડનારે જે કદ્દારો આપ્યો છે તે મારવાવાળાથી વસુલ કરી શકે છે.

(જવહરહ, આલમગીરી)

મસ્ટઅલા (૩૮) : સુહરિમે જંગલનું જાનવર પકડયું તો તેના પર લાજિમ છે કે, જંગલમાં અથવા એવી જગ્યાએ છાડી હે જ્યાં તે પનાહ લઈ શકે, જે શહેરમાં લાવીને છાડ્યું જ્યાં તેના પકડાવાની શાંકા છે તો જુરમાનાથી સુકત થશે નહીં.

(મનાસિક)

મસ્ટઅલા (૩૯) : કાઈએ એવા સ્થળે

શિકાર જેથો કે મારવા માટે તીર-કમાન, ગદોલ, બંદુક વિગેરની જરૂરત છે અને સુહરિયિ આ વસ્તુઓ તેને આપી તો તેના પર પૂરો ક્રિક્કારો લાજિમ અને શિકાર જુણું કરવો છે, તેના પાસે જુણું કરવાની વસ્તુ નથી. સુહરિયિ છુરી આપી તો ક્રિક્કારો છે. અને જે તેની પાસે જુણું કરવાની વસ્તુ છે અને સુહરિયિ છુરી આપી તો ક્રિક્કારો નથી, પરંતુ હરાહત છે. (આલમળીરી)

મસ્ટયદા (૪૦) : સુહરિયિ જનવર પર ચાતાનો કુતરો અથવા શીખવેલ બાજ છોડયો, તેણું શિકારને મારી નાખ્યું તો ક્રિક્કારો વાજિય છે અને જે એહારામના કારણે શરર્થ હુકમ પાલન માટે બાજ છોડયો, તેણું જનવરને મારી નાખ્યું અથવા સુકવવા માટે બળ પાથરી. તેમાં જનવર કુસીને મરી ગણ્યું અથવા કુવો જોઈયો હતો તેમાં પડીને મણ્યું તો આ સુરતોમાં ક્રિક્કારો નથી.

(આલમળીરી)

(૧૪) હરમના જનવરોને ઈજા આપવું :

મસ્ટયદા (૧) : હરમના જનવરનો શિકાર ડેર્બું અથવા તેને કોઈ પ્રકારે ઈજા પહોંચાડવું સૌને (માટે) હરામ છે. સુહરિયિ અને ગેરસુહરિયિ બંને આ હુકમમાં સરખા છે. ગેરસુહરિયિ હરમના જંગલનું જનવર જુણું ડર્યું તો તેની કીંમતના બદલામાં રાજો રાખી શકો નથી અને સુહરિયિ છે તો રાજો પણ રાખી શકે છે. (હરે સુખતાર વિગેર)

મસ્ટયદા (૨) : સુહરિયિ જે હરમનું

જનવર માણું તો એકજ ક્રિક્કારો વાજિય થશે, એ નહીં. અને જે તે જનવર કોઈની માલિકીનું હતું તો માલિકને તેની કીંમત પણ આપે, પછી જે શીખવેલ જનવર હોય હા. ત. તોતી, તો માલિકને તેની કીંમત આપે જે શીખવેલાની છે અને ક્રિક્કારામાં વગર શીખવેલાની કીંમત આપે.

(મનાસિધ)

મસ્ટયદા (૩) : જે શાખ હરમમાં દાખલ થયો અને તેની પાસે કોઈ જંગલી જનવર હોય, લદે પીંજરામાં હોય તો હુકમ છે કે તેને છોડી હે પછી જે તે શિકારી જનવર બાજ, શકરી, બહરી વિગેર છે અને તેણું આ શરર્થ હુકમના પાલન માટે તેને છોડી સુકદ્યું. તેણું શિકાર કર્યો તો તેનામાથે તાવાન નથી અને શિકાર પર છોડદ્યું તો તાવાન છે. (હરે સુખતાર વિગેર)

મસ્ટયદા (૪) : એક શાખ ખીનાનું જંગલી જનવર અપહરણ કરીને (ધીનની લઈને) હરમમાં લાવ્યો તો વાજિય છે કે, છોડી હે અને માલિકને કીંમત આપે. અને છોડદ્યું નહીં બદકે માલિકને પાછું આપ્યું તો તાવાન આપે. અપહરણ પછી એહારામ બાંધ્યું તો પણ એ હુકમ છે.

(રદ્દહુલમુહતાર વિગેર)

મસ્ટયદા (૫) : એ ગેરસુહરિયિ હરમના જનવરને એક ઇટકામાં મારી નાખ્યું તો બંને અધી-અધી કીંમત આપે, એવીજ રીતે જે ડેટલાયે લોકોએ માણું તો જો પર તે કીંમત વહેંચાઈ જશે અને જે તેમનામાં કોઈ સુહરિયિ પણ છે તો તેના ભાગમાં આવતી કીંમત ઉપરાંત પુરી કીંમત

પણ કિક્કારામાં આપે અને એક પડેલા ઇટકો લગાવ્યો પછી ભીજાએ તો ફરેફના ઇટકાથી તેની ઝીંમતમાં ને કમી થઈ તે આપે, પછી બાકીની ઝીંમત બંને પર વહેંચાઈ જશે, આ બાકીનું અધું-અધું બંને આપે. (આલમગીરી, મનાસિક)

મસ્યલા (૬) : એક શખ્સે હરમનું જનવર પડકયું અને ભીજાએ મારી નાખ્યું તો બંને પૂરેપૂરી ઝીંમત આપે અને પડકનારને અખ્યાર છે કે ભીજાથી તાવાન વસૂલાત હરી દે. (આલમગીરી)

મસ્યલા (૭) : કેટલાક સુહરિમ શખ્સો મજ્જાના ડેઈ મજ્જાનમાં થાયા, તે મજ્જાનમાં કષ્યુતર રહેતા હતા, સૌચે એક શખ્સને કષ્યું, દરવાને બંધ કરી દે. તેણું દરવાને બંધ કરી હોયો અને સૌ મિના આદ્યા ગયા. પાછા આદ્યા તો કષ્યુતર તૃથાથી ભરેલ પદ્યા હતા. તો સૌ પૂરેપૂરી કિક્કારી આપે. (આલમગીરી)

મસ્યલા (૮) : જનવરનો કેટલોક ભાગ હરમાં હોય અને કેટલોક બહાર તો જે ઉભું હોય અને સઘળાં પગ હરમાં હોય અથવા એક જ પગ તો તે હરમનું જનવર છે. તેને મારવું હરામ છે. લદે માથું હરમની બહાર છે. અને જે ડેવળ માથું હરમાં છે અને સઘળાં જ પગો બહાર તો ડેવલ પર દંડ લાજિમ નથી અને જે આડું પડેલ સુઈ રહ્યું છે અને ડેઈ ભાગ પણ હરમાં છે તો તેને મારવું હરામ છે.

(રદ્દુલ સુહતાર)

મસ્યલા (૯) : જનવર હરમથી બહાર

હતું. તેણું તીર છોડયું, તે જનવર લાખ્યું અને તીર તેને એ સમયે વાખ્યું કે હરમમાં પહોંચી ગયું હતું તો જુરમાનો લાજિમ છે અને જે તીર વાગ્યા પછી નાસીને હરમમાં ગયું અને ત્યાં જ મરી ગયું તો જુરમાનો નથી. પરંતુ તેને આવું હલાલ નથી. (રદ્દુલ સુહતાર)

મસ્યલા (૧૦) : જનવર હરમમાં નથી. પરંતુ શિકાર ઇરનાર હરમમાં છે અને હરમમાંથી તીર છોડયું તો જુરમાનો વાળું છે. (આલમગીરી)

મસ્યલા (૧૧) : જનવર અને શિકારી બંને હરમથી બહાર છે, પરંતુ હરમમાંથી પસાર થયું તો તેમાં પણ કેટલાક ઉદ્માતાવાન વાળું કહે છે, હરે સુખતારમાં એમ જ લાખ્યું છે, પરંતુ “બહદરરાઈક” વિલાસમાં તસરીહ છે કે, તેમાં તાવાન નથી. અને અહલામા શામીએ હરમાંયું : ઉદ્માચોના કથનથી એ જ સાબિત છે. કુતરો અથવા બાજ છોડયો અને હરમમાંથી પસાર થયો તેનો પણ એ જ હુકમ છે.

મસ્યલા (૧૨) : જનવર હરમથી બહાર હતું તેના પર શિકારી કુતરો છોડયો. કુતરાએ હરમમાં આવીને જનવરને પડકયું તો તેના પર તાવાન નથી. પરંતુ શિકાર આવામાં આવે નહીં. (આલમગીરી)

મસ્યલા (૧૩) : ધોડા વિગેરે ડોઈ જનવર પર સવાર થઈને જઈ રહ્યો હતો. અથવા તેને હાંડતો અથવા એંચતો લઈ જઈ રહ્યો હતો, તેના હાથ-પગથી ડોઈ જનવર હખાઈને મરી ગયું અથવા તેણું ડોઈ જનવરને દાંતથી કરી આધું અને

તે મરી ગયું તો તાવાન આપે.

(આલમગીરી)

મસ્યાદા (૧૪) : વરુ પર કુતરો છાડ્યો, તેણે જઈને શિકાર પડક્યો અથવા વરુ પડકવા માટે જાળ પાથરી તેમાં શિકાર ફ્રસાઈ ગયો તો બંને હુલાલોમાં તાવાન નથી. (આલમગીરી)

મસ્યાદા (૧૫) : જનવરને લગાડયું અને તે કુવામાં પડી ગયું અથવા લપસીને પડયું અને મરી ગયું અથવા ડોઈ વસ્તુની ઢોંકર વાગી અને તે મરી ગયું તો તાવાન આપે. (આલમગીરી)

મસ્યાદા (૧૬) : હરમનું જનવર પડકી લાંઘો અને તેને હરમની બહાર છાડી છીધું. હવે ડોઈએ તેને મારી નાખ્યું તો પડકાનાર પર કંકણારો લાભિમ છે, અને જે ડોઈએ ન પણ માયું તો જ્યાં સુધી અમન સાથે હરમની જમીનમાં પહોંચી જવું તેની અખર ન હોય, કંકણારથી મુક્ત થશે નહીં. (નષ્ટ)

મસ્યાદા (૧૭) : જનવર હરમથી બહાર હતું અને તેનું બહુ જ નાતું અચ્યું હરમની અંદર હતું, જેરમુહરિમે તે જનવરને માયું તો તેનો કંકણારો નથી, પરંતુ અચ્યું ભૂખથી મરી જશે તો અચ્યાનો કંકણારો આપવો પડશે. (મનાસિક)

મસ્યાદા (૧૮) : હરણીને હરમમાંથી છાડી તેણે અચ્યાનો જન્મ આપ્યો પછી તે મરી ગઈ અને અચ્યાં પણ, તો સૌનું તાવાન આપે અને જે તાવાન આપ્યા પછી અચ્યાંનો જન્મ આપ્યો તો અચ્યાંઓનો તાવાન લાભિમ નથી. (હરે મુખતાર વિગેરે)

મસ્યાદા (૧૯) : પક્ષી વૃક્ષ પર બેઠેલું છે અને તે વૃક્ષ હરમની હદ બહાર છે, પરંતુ જે ડાળી પર બેઠેલું છે તે હરમમાં છેતો તેને મારવું હરામ છે. (હરે મુખતાર વિગેરે)

(૧૫) હરમના વૃક્ષ વિગેરે કાપવું :

મસ્યાદા (૧) : હરમના વૃક્ષોના ચાર પ્રકાર છે. (૧) ડોઈએ તેને વાંયું અને તે એલું વૃક્ષ છે જેને કોડા વાંયા કરે છે. (૨) વાંયું છે પરંતુ તે પ્રકારનું નથી જેને કોડા વાંયા કરે છે. (૩) ડોઈએ તેને રાંયું નથી પરંતુ તે પ્રકાર ચૈકી છે જેને કોડા રાંયા કરે છે. (૪) રાંયું નથી, ન તે પ્રકાર ચૈકી છે જેને કોડા રાંયે છે.

પહેલા ત્રણું પ્રકારોના કાપવા વિગેરેમાં કાંઈ નથી અથીત તેના પર જીરમાનો નથી. તે જે ડોઈની માલિકીનું છે તો માલિક તાવાન કેશો. ચોથા પ્રકારમાં જીરમાનો આપવો પડશે. અને જે ડોઈની માલિકી છે તો માલિક તાવાન પણ કેશો અને જીરમાનો એજ સમયે છે કે તર (લીલું) હોય, અને હુટેલું કે ઉભેદલું ન હોય. જીરમાનો એ છે કે તેની ડીંમતતું અનાજ લઈને મિસ્કીનાને સહકો કરી હે, દરેક મિસ્કીનને એક સહકો અને જે ડીંમતતું અનાજ પુરા સહડાથી ઓછું છે તો એકજ મિસ્કીનને આપે અને તેના માટે હરમના મિસ્કીનો હોલું જરૂરી નથી. અને એ પણ થઈ શકે છે કે ડીંમત જ સહકો કરી હે અને એ પણ થઈ શકે છે કે, તે ડીંમતતું જનવર

જરીદી હરમમાં જુાળું કરી હે. રોડો રાખવું જાહી નથી. (આલમગીરી, હરે સુખતાર વિગેર)

મસ્યાદા (૨) : વૃક્ષ ઉખેડયું અને તેની ઝીંમત પણ આપી દીધી તો પણ તેનાથી કાઈ પ્રકારનો લાલ ઉડાવવું જર્ખિજ નથી અને જે બેચી નાખ્યું તો વેચાણ થઈ જશે, પરંતુ તેની ઝીંમત સદકો કરી હે.

(આલમગીરી)

મસ્યાદા (૩) : જે વૃક્ષ સુકાઈ ગયું તેને ઉખેડી શકાય છે અને તેનાથી લાલ પણ ઉડાવી શકે છે. (આલમગીરી)

મસ્યાદા (૪) : વૃક્ષ ઉખેડયું અને તાવાન પણ આદી ઝીંધું ઝરી તેને ત્યાં જ રોપી દીધું અને તે જામી ગયું પછી ઝરી તેને ઉખેડયું તો હવે તાવાન નથી.

(આલમગીરી)

મસ્યાદા (૫) : વૃક્ષના પાંડા તોડયા, જે તેનાથી વૃક્ષને તુકસાન ન પહોંચયું તો કાઈ નથી. એવી જ રીતે જે વૃક્ષ ફેલાય છે તેને પણ કાપવામાં તાવાન નથી. જ્યારે માલિકથી પરવાનગી લઈ દીધી હોય અથવા તેને ઝીંમત આપી હે. (હરે સુખતાર)

મસ્યાદા (૬) : ફેટલાક શાખ્સો લેગા મળીને વૃક્ષ ઝાંચું તો એકજ તાવાન છે, જે સૌના પર વહેંચાઈ જશે, જ્યે સૌ સુહરિમ હોય કે ગેરસુહરિમ અથવા ફેટલાક સુહરિમ, ફેટલાક ગેરસુહરિમ. (આલમગીરી)

મસ્યાદા (૭) : હરમના પીલુ અથવા કાઈ વૃક્ષતું મિસ્વાક બનાવવું જર્ખિજ નથી.

(આલમગીરી)

મસ્યાદા (૮) : જે વૃક્ષની જડ (મૂળ)

હરમથી બહાર છે અને ઢાળીએ હરમમાં છે, તે હરમતું વૃક્ષ નથી અને થડીયાને કેટલોક ભાગ હરમમાં છે અને કેટલોક બહાર છે તો તે હરમતું છે.

(હરે સુખતાર વિગેર)

મસ્યાદા (૯) : પોતાના અથવા જાનવરના ચાલવામાં અથવા તંણુ ઉલો કરવામાં કેટલાક વૃક્ષો જતા રહ્યા તે કાઈ નથી.

(હરે સુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્યાદા (૧૦) : જરૂરતના ઝારણે એ વાત પર ફેટચો છે કે ત્યાંનું ઘાસ જાનવરોને ચાલવવું જર્ખિજ છે. કાપવા, કિઅડવા માટે એજ હુકમ છે જે વૃક્ષનો છે. સિવાય ઈજભિર અને સુકા ઘાસના કે તેમનાથી દરેક પ્રકારે લાલ લેવું જર્ખિજ છે. જેતીને તોડવા ઉખેડવામાં કાઈ વાંદ્યા નથી.

(હરે સુખતાર, રદ્દુલસુહતાર)

(૧૧) જી મારવું :

મસ્યાદા (૧) : પોતાની જી પોતાના જાદન અથવા કાપાંએમાં મારી અથવા ઝાંકી દીધી તો એકમાં રાઠીને હુકડો આપે અને જે એ અથવા ત્રણ હોય તો એક સુઠી અનાજ આપે અને તેનાથી વધારેમાં સદકો આપે. (હરે સુખતાર)

મસ્યાદા (૨) : જીએ મારવા માટે માલું અથવા કાપડું ધોયું અથવા તડકામાં નાખ્યું તો પણ એજ કદ્દારો છે, જે મારવામાં હતો. (હરે સુખતાર)

મસ્યાદા (૩) : ભીજાએ તેના કહેવાથી અથવા ઈજશારો કરવાથી તેની જી મારી તો

પણ તેના પર ક્રક્રારો છે. લદે બીજે એહામભાં ન હોય. (હરેં સુખતાર)

મસ્થદાા (૪) : જીવિન વિગેરે પર પડી ગયેલ જી અથવા બીજના શરીર અથવા વસ્તોની મારવામાં તેનો પર કેંદ્ર ટંડનથી, જેકે તે બીજે પણ એહામભાં હોય.

(બહર)

મસ્થદાા (૫) : વસ્તે પદળી ગયું હતું તેને સુધ્વવા માટે તડકામાં સુધ્વયું, તેનાથી જુઓ મરી ગઈ, પરંતુ એ હતું ન હતો તો કાંઈ વાધો નથી. (મનાસિક)

મસ્થદાા (૬) : હુંમની મારી અથવા કાંકરીઓ લાવવામાં વાધો નથી.

(આલમગીરી)

(૧૭) એહામ વગર

મીકાતથી પસાર થવું :

મસ્થદાા (૧) : મીકાતની બહારથી ને શાખસ આંદો અને એહામ વગર મઝ્ઝા મોઅજમા ગયો. તો લદે હજાનો ઈરાહોના હોય અને ઉમરાનો પણ ઈરાહોના હોય પરંતુ હજા અથવા ઉમરો વાનિબ થઈ ગયો. પછી જે મીકાતે પાછો ન ગયો, અણીંયા જ એ એહામ બાંધી હીધો. તો દમ વાનિબ છે. અને મીકાતે પાછો જર્દને એહામ બાંધીને આંદો. તો દમ સાકિત થઈ જશો. એવીજ રીતે જે એહામ બાંધીને આંદો. અને લણ્ણોડ કઢી હીદું છે તો દમ સાકિત થઈ જશો. અને હીદું નથી તો સાકિત નથી. (આલમગીરી)

અથવા નિકલ અથવા મિનનતનો ઉમરો અથવા હજા ને તેના પર બાકી હતો, તેનો એહામ બાધો અને એજ વર્ષે અદા કચો તો પણ જવાખદારીમાંથી સુકૃત થઈ ગયો. અને જે તે વર્ષે અદા ન કચો તો તેનાથી સુકૃત થયો નહીં, જે મઝ્ઝા મોઅજમામાં જવાથી વાનિબ થયો હતો.

(આલમગીરી, હરેં સુખતાર, રદ્દુલ સુહેતાર)

મસ્થદાા (૨) : કેટલીક વાર એહામ વગર મઝ્ઝા મોઅજમા ગયો. પાછાંકી વેળા મીકાતે પાછો આવીને હજા અથવા ઉમરાનો એહામ બાંધીને અદા કચો તો કેવળ આ વેળા ને હજા અથવા ઉમરો વાનિબ થયો હતો. તેનાથી સુકૃત થયો, પહેલાં-વાળાંઓથી નહીં. (આલમગીરી)

મસ્થદાા (૩) : હજા અથવા ઉમરાનો ઈરાહો છે અને એહામ વગર મીકાતથી આગળ વઠ્યો. તો જે એ આશંકા છે કે મીકાતે પાછો જશો તો હજા છુટી જશો તો પાછો ન કરે ત્યાંથી જ એહામ બાંધી લે અને દમ આપે અને જે એ આશંકા ન હોય તો પાછો આવે, પછી જે મીકાત પર એહામ વગર આંદો. તો દમ સાકિત થઈ જશો. એવીજ રીતે જે એહામ બાંધીને આંદો. અને લણ્ણોડ કઢી હીદું છે તો દમ સાકિત થઈ જશો. અને હીદું નથી તો સાકિત નથી. (આલમગીરી)

મસ્થદાા (૪) : મીકાતથી એહામ વગર ગયો. પછી ઉમરાનો એહામ બાંધો. અને ઉમરાને ફાંકિદ કરી હીધો, પછી મીકાતથી એહામ બાંધીને ઉમરાની કંાડ કરી તો મીકાતથી એહામ વગર પસાર

થવાનો દમ સાડિત થઈ ગયો.

(હરે સુજીતાર)

મસ્યાદા (૫) : તમતોવાળાએ હરમની બહારથી હજજનો એહરામ બાંધ્યો. તો તેને હુકમ છે કે, નયાં સુધી વફૂરઅરક્ષા ન કરો અને હજજ દ્રોત થવાની શાંકા નહાય તો હરમાં પાછો આવે. જે પાછો ન આવ્યો તો દમ વાજિબ છે અને પાછો આવ્યો અને લંઘોક કઢી લીધું છે તો દમ સાડિત છે, નહીં તો સાડિત નથી અને બહાર જઈને એહરામ બાંધ્યો. ન હતો અને પાછો આવ્યો અને અહીંયાંથી એહરામ બાંધ્યો. તો કાઈ નથી, મજ્જામાં જેણે નિવાસ કરી લીધો છે તેનો પણ એજ હુકમ છે અને જે મજ્જાવાળો કાઈ કામથી હરમની બહાર ગયો હતો અને ત્યાંથી જ હજજનો એહરામ બાંધીને વફૂર કરી લીધું કાઈ નથી, અને જે ઉમરાનો એહરામ હરમાં બાંધ્યો. તો દમ લાજિમ આવ્યો.

(આલમગીરી, રદ્દહુલસુહતાર)

મસ્યાદા (૬) : નાભાલિગ એહરામ વગર મીકાતથી પસાર થયો. પછી ભાલિગ થઈ ગયો. અને ત્યાંથી જ એહરામ બાંધી લીધું તો દમ લાજિમ નથી અને શુલામ જે એહરામ વગર પસાર થયો. પછી તેના ભાલિકે એહરામની પરવાનગી આપી દીધી અને તેણું એહરામ બાંધી લીધો. તો દમ લાજિમ છે, જથાડે આજાદ થાય અહા કરે.

(આલમગીરી)

મસ્યાદા (૭) : મીકાતથી એહરામ વગર પસાર થયો. પછી ઉમરાનો એહરામ

૪. શ. ૧૭

બાંધ્યો, તે પછી હજજનો અથવા કિરાન કર્યો તો દમ લાજિમ છે અને જે પ્રથમ હજજનો એહરામ બાંધ્યો. પછી હરમાં ઉમરાનો તો એ દમ આગે. (આલમગીરી)

(૧૮) એહરામ હોવા છતાં ખીને એહરામ બાંધવો

મસ્યાદા (૧) : જે શર્જસ મીકાતની હુદની અંદર રહે છે. તેણું હજજના મહીના-ઓમાં ઉમરાનો તવાદુ એક ઝેરા પણ કરી લીધો. તેના પછી હજજનો એહરામ બાંધ્યો. તો તેને તોડી નાખે અને દમ વાજિબ છે. આ વર્ષે ઉમરો કરી લે, આવતા વર્ષે હજજ અને જે ઉમરો તોડીને હજજ કરો તો ઉમરો સાડિત થઈ ગયો. અને દમ આપે અને બંને કરી લીધા તો થઈ ગયા, પરંતુ શુનેહગાર થયો અને દમ વાજિબ.

(હરે સુજીતાર)

મસ્યાદા (૨) : હજજનો એહરામ બાંધ્યો. પછી અરક્ષાના દિવસે અથવા રાતે ખીન હજજનો એહરામ બાંધ્યો. તો તેને તોડી નાખે અને દમ આપે અને હજજ તથા ઉમરો તેના પર વાજિબ અને જે દસ્મી તારીખે ખીન હજજનો એહરામ બાંધ્યો. અને હલડ (માથું સુંકન) કરી લીધો. તો નિયમાનુસાર એહરામમાં રહે અને ખીનને આવતા વર્ષે પૂરો કરે અને દમ વાજિબ નથી અને હલડ કરો નથી તો દમ વાજિબ.

(રદ્દહુલસુહતાર)

મસ્યાદા (૩) : ઉમરાના સંઘણા કાર્યો

કરી લીધી હતા કેવળ હલક ખાડી હતો કે ખીંચ ઉમરાનો એહુરામ બાંધ્યો તો દમ વાજિબ છે અને શુનેહગાર થયો.

(હરે સુખતાર)

મસ્ટાલા (૪) : બહારના રહેવાવાળાનો પ્રથમ હજજનો એહુરામ બાંધ્યો અને તવાઇ કુહુમથી અગાઉ ઉમરાનો એહુરામ બાંધી લીધી તો ડારિન થઈ ગયો પરંતુ એસાઅત (ખુરૂ) થઈ અને શુંગાનાની કુરબાની કરે અને ઉમરાના બહુધા તવાઇ અર્થાત ચાર ફેરાથી પહેલા વકુલ કરી લીધી તો ઉમરો બાતલ થઈ ગયો.

(હરે સુખતાર, રદ્દુલ સુહૃતાર)

મસ્ટાલા (૫) : તવાઇ કુહુમનો એક ફેરા પણ કરી લીધી તો ઉમરાનો એહુરામ બાંધવું જરૂર નથી. તે છતાં જે બાંધી લીધી તો એહુતર એજ છે કે, ઉમરો તોડી નાંયે અને ડાંડા કરે અને દમ આપે. અને જે તોડ્યો નહીં અને બંને કરી લીધી તો દમ આપે. (હરે સુખતાર)

મસ્ટાલા (૬) : દસમીથી તેરમી તારીખ સુધી હજજ કરનારે ઉમરાનો એહુરામ બાંધવું મના છે. જે બાંધી લીધી તો તોડી નાંયે અને તેની ડાંડા કરે અને દમ આપે અને કરી લીધી તો થઈ ગયો, પરંતુ દમ વાજિબ છે. (હરે સુખતાર)

મુહુરતનું પ્રયાન

અંશાઢ અજ વ જલ્દી ફરજાવે છે :

“ફરજન ઓહસિર તુસ ફેમસ્ટાયસર ભિનલહુદ્યે વલા તહલેકું રોડિસકુમ હતા યધલોગલહુદ્યો ભહિલલાહું.”

(અર્થ) : જે હજજ તથા ઉમરાથી તમને રોકી ફેવામાં આવે તો જે કુરબાની પ્રાપ્ત થાય કરે અને ચોતાના માથાં સુંડાવે નહિ જ્યાં સુધી કુરબાની ચોતાના સ્થળે (હરમ)માં ન પહોંચી બાય.)

અને અદ્વાહ પાક ફરજાવે છે :

“દનનિલ્કારીના કરેદ વ અસુદ્દુન અન સથીલિલ્વાહે વદમસજેદિલ્કરામિલ્કારી જાયદનાહે લિનનાસે સવાચોનિ) આકિકુ ઝીહે વદબાચો વમંય ચોરેહો ઝીહે બે દિલ્હાહિન લેજુદમીન નોચિકહે મિન અજાયિન ચાલીસ. ” (કુર્યાન મળું)

(અર્થ) : છેશાડ તેઓ જેમણે કુરે કયું અને રોકે છે અદ્વાહની રાહ અને મસ્તિજી હરામથી, જેને અમોચે સૌ લોડો માટે સુકર્રે કયું. તેમાં ત્યાંના રહેવાવાળાનો અને બહારવાળા જરાઓ હુક ધરાવે છે અને જેઓ તેમાં નાહુક (અનુચિત) અત્યાચારનો હરાહો કરે અમે તેને દર્દનાક અજાય ચાલીશું.)

સહીહ યુખારી શરીરમાં અનુલૂષાહિન ઉમર રહીયદીહો અનહોમાંથી રિવાયત છે કે, અમે રસુલુલૂષાહુ સલુલુલાહો અલયહે વસ્તુંમની સાથે ચાલ્યા, કુરૈશના ડાંકિરો ડા'બા સુધી જવામાં નિરોધક થયા, નખીએ કરીમ સલ્વલ્વાહો અલયહે વસ્તુંમે કુરબાનીએ કરી અને માથું સુંડાંયું અને સહાયાઓએ વાળ ડાંતરાંયા, તથા યુખારી શરીરમાં મિસ્તર બિન મઘરમહ રહીયદીહો અનહોથી રિવાયત છે કે, રસુલુલુષાહુ સલ્વલ્વાહો અલયહે વસ્તુંમે હલકાંધી પહેલા કુરબાની

કરી અને સહાખાઓને પણ તેનો હુકમ અત્યારે તો પૈદલ ચાલી શકે છે પરંતુ મજબૂર થઈ જશે, તેણે એહારામ ઉપરી દેવું જર્દાર છે. (રદ્દુલ સુહતાર)

અષુદ્દાઉદ્દ, તિરમિઝી, નિસાઈ, ઈને-માંન તથા દારોમી હજાળજબિન અમૃ અન્સારી રહીયદલાહો અન્હોથી રિવાયત કરે છે કે રસુલુલ્લાહ સદ્દલદલાહો અલયહે વસ્તુભે દ્વરમાંથું કે જેતું હાડકુ તુટી જાય અથવા લાંગડો થઈ જાય તો એહારામ ચોલી શકે છે અને આવતા વર્ષો તેણે હજાળ કરવી પડશે અને અષુદ્દાઉદ્દની એક રિવાયત માં છે અથવા બીમાર થઈ જાય.

મસ્તાદા (૧) : જેણે હજાળ અથવા ઉમરાનો એહારામ બાંધ્યો પરંતુ કોઈ કારણોસર પૂછું કરી શક્યો નહીં તેને “મુહસર” કહે છે. જે કારણોસર હજાળ અથવા ઉમરાન કરી શકે તે આ છે :-

(૧) હુશમન (૨) લક્ષ જનવર (૩) બીમારી કે પ્રવાસ કરવા અને સવાર થવામાં તેના વધી જવાતું શુમાન ગાલિબ છે. (૪) હાથ પગ તુટી જવા (૫) ડેંડ (૬) ઔરતનો મહરમ અથવા પતિ કે જેની સાથે જર્દ રહી હતી તેનું અવસાન થઈ જવું (૭) ઈદત (૮) અચી અથવા સવારીનું નાટ થઈ જવું (૯) પતિ નિકલ હજાળમાં સ્ત્રી (પત્ની)ને અને માલિક કોંડી-શુલામને મના કરી હે.

મસ્તાદા (૧) : વાટખ્યો ચારાઈ ગઈ અથવા સવારીનું જનવર મુત્યુ પાર્યું તો જે પૈદલ નથી ચાલી શકતો તો સુહસર છે, નહીં તો સુહસર નથી. (આલમગીરી)

મસ્તાદા (૩) : મજફુર હાલતમાં

અત્યારે તો પૈદલ ચાલી શકે છે પરંતુ મજબૂર થઈ જશે, તેણે એહારામ ઉપરી દેવું જર્દાર છે. (રદ્દુલ સુહતાર)

મસ્તાદા (૪) : સ્ત્રીનો પતિ અથવા મહરમ મરી ગયો અને ત્યાંથી મજ્જા માઝાજમા પ્રવાસનું અંતર અથીત વણું દિવસના રસ્તાથી ઓછું છે તો સુહસર નથી અને ત્રણ દિવસ અથવા તેનાથી અધિકનો રસ્તો છે તો થાક્વાની જગ્યા છે તો સુહસર છે, નહીં તો સુહસર નથી.

(આલમગીરી, રદ્દુલ સુહતાર)

મસ્તાદા (૫) : ઔરતે પતિ અથવા મહરમ વગર એહારામ બાંધ્યો, તો તે પણ સુહસર છે કે તેને તેમના વગર પ્રવાસ હરામ છે. (આલમગીરી)

મસ્તાદા (૬) : સ્ત્રીએ નિકલ હજાળનો એહારામ પતિની રણ દીધા વગર બાંધ્યો તો પતિ મના કરી શકે છે. માટે જે મના કરી હે તો સુહસર છે, જાણે તેની સાથે મહરમ પણ હોય અને દ્વરજ હજાળને મના કરી શકતો નથી. અલયતા જે સમયથી બહુ પહેલા એહારામ બાંધ્યો તો પતિ ઉત્તરાવી શકે છે. (રદ્દુલ સુહતાર)

મસ્તાદા (૭) : માલિકે શુલામને પરવાનગી આપી દીધી તે છતાં મના કરવું મજફુર છે, અને કોંડીને માલિકે પરવાનગી આપી દીધી તો તેના પતિને રોકવાનો હુક્ક પ્રાપ્ત નથી. (રદ્દુલ સુહતાર)

મસ્તાદા (૮) : ઔરતે એહારામ બાંધ્યું તે પછી પતિએ તદ્વારા આપી દીધી

તો સુહુસર છે. લકે મેહુરમ પણ સાથે હોય.
(૨૬૬૫ સુહુસર)

મસ્તઅદા (૮) : સુહુસરને એ ઈજાત છે કે હુરમમાં કુરબાની મોઝલી હે, જ્યારે કુરબાની થઈ જશે તેનો એહુરામ ખુલી જશે અથવા ઈજાત મોઝલી હે ત્યાં જનવર ખરીદીને જુંહુ કરી દેવામાં આવે, તેના વગર એહુરામ ખુલી શકુંતો નથી નયાં સુધી મઙ્ગા મોઅજમા પહેંચીને તવાદું તથા સર્જ તથા હલા ના કરી લે, રાજો રાખવાથી અથવા સદકો આપવાથી છામ ચાલશે નહીં. કુરબાનીની શક્તિ ન હોય, એહુરામ જાંધતા સમયે જો શરત કાગાવી છે કે, કોઈ કારણો સર ત્યાં સુધી ન પહેંચી શકુંતો એહુરામ ખોલી નાખીશ, તો પણ એજ હુકમ છે, તે શરતની કોઈ અસર નથી.

(આલમગીરી, હરે સુહુસર, ૨૬૬૫ સુહુસર)

મસ્તઅદા (૯૦) : એ જરૂરી કાર્ય છે કે, જેના હાથે કુરબાની મોઝલે તેનાથી નક્કી કરી લે કે ઇલાણું દિવસે, ઇલાણું સમયે કુરબાની જુંહુ થાય અને તે સમય પસાર થઈ ગયા પછી એહુરામથી બહાર થશે, પછી જો એજ સમયે કુરબાની થઈ જે નક્કી થયો હતો અથવા તેનાથી પહેલા તો એહતર અને જો પછીથી થઈ અને તેને હવે ખરુર પડી તો જુંહુથી પહેલા કેમકે એહુરામથી બહાર થયો માટે દમ આપે. સુહુસરનો એહુરામથી બહાર આવવા માટે હલક (માથું સુંડાવવું) શરત નથી, પરંતુ એહતર છે. (આલમગીરી વિગેર)

મસ્તઅદા (૧૧) : સુહુસર જો સુફરિદ હોય અથવા ઈવળ હજજ અથવા ઈવળ હોય અથવા મોઝલવું કાઢી છે અને એક ઉમરો કરવો પડશે અને જો

ઉમરાનો એહુરામ બાંધ્યો છે તો એક કુરબાની મોઝલે અને એ મોઝલી તો પહેલી કુરબાનીના જુંહુદી જ એહુરામ ખુલી ગયો અને કારિન હોય તો એ મોઝલે, એકથી કામ ચાલશે નહીં. (હરે સુહુસર)

મસ્તઅદા (૧૨) : આ કુરબાની માટે હુરમ શરત છે. હુરમની હુદુ બહાર થઈ શકતી નથી. દસમી, અગ્નીયારમી, બારમી તારીખોની શરત નથી. પહેલા અને પાછળથી પણ થઈ શકે છે. (હરે સુહુસર)

મસ્તઅદા (૧૩) : કારિને ચેતાના ખ્યાલથી એ કુરબાનીઓના પૈસા મોઝલ્યા અને ત્યાં પૈસાની એકજ મળી અને જુંહુ કરી નાખી તો આ નાકારી છે.

(રહે સુહુસર)

મસ્તઅદા (૧૪) : કારિને એ કુરબાનીઓ મોઝલી અને એ નક્કી ન કર્યું કે, આ હજાની છે અને આ ઉમરાની, તો પણ કાઈ વાંધ્યો નથી પરંતુ એહતર એ છે કે નિયુક્ત હજી હે કે આ હજાની કુરબાની છે અને આ ઉમરાની કુરબાની છે. (આલમગીરી)

મસ્તઅદા (૧૫) : કારિને ઉમરાનો તવાદું કર્યો અને વક્રુદ્ધે અરક્ષાથી પહેલા સુહુસર થયો તો એક કુરબાની મોઝલે અને હજાના બદલે એક હજજ અને એક ઉમરો કરે, બીજે ઉમરો તેના માથે નથી.

(આલમગીરી)

મસ્તઅદા (૧૬) : જો એહુરામમાં હજજ અથવા ઉમરો કોઈની નિયત હતી નહીં, તો એક જનવર મોઝલવું કાઢી છે અને એક ઉમરો કરવો પડશે અને જો નિયત

હતી પરંતુ એ યાદ નથી કે શેની નિયત હતી તો એક જનવર મોડલી આપે અને એક હજાર અને એક ઉમરો કરે અને જે એ હજારનો એહુરામ બાંધ્યો તો એ દમ આપીને એહુરામ જોવે અને એ ઉમરાનો એહુરામ બાંધ્યો અને અહો કરવા માટે મક્કા મોઅજજમા પ્રતિ ચાલ્યો, પરંતુ જઈ શક્યો નહીં, તો એક દમ આપે અને ચાલ્યો ન હતો કે, સુહસર થઈ ગયો તો એ દમ આપે અને તેણે એ ઉમરા કરવા પડશે. (આલમગીરી)

મસ્ટાલા (૧૭) : ઔરતે નિક્ષેપ હજારનો એહુરામ બાંધ્યો હતો. જેકે પતિની પરવાનગીથી, પછી પતિએ એહુરામ જોલાવી નાંખ્યાંયો તો તેનો એહુરામ ખુલવા માટે કુરખાનીનું ઝુખ્ખ થઈ જવું જરૂરી નથી બદકે દરેક તે કામ જે એહુરામમાં મના હતું તે કરવાથી એહુરામથી બહાર થઈ ગઈ પરંતુ તે છતાં કુરખાની અથવા તેની કોંભત મોડલવું જરૂરી છે. અને જે હજારનો એહુરામ હતો તો એક હજાર અને એક ઉમરો કરા કરવો પડશે. અને જે પતિ અથવા મહુરમના મરી જવાથી “મુહસીરહ” થઈ અથવા કુરજ હજારનો એહુરામ હતો અને મહુરમ વગર જઈ રહી હતી, પતિએ મના કરી દીધું તે તેમાં કુરખાની ઝુખ્ખ થયા વગર એહુરામથી બહાર થઈ શકતી નથી. (મનાસિક)

મસ્ટાલા : (૧૮) સુહસરે કુરખાની મોડલી નથી એમજ ઘેર ચાલ્યો આંધ્યો અને એહુરામ બાંધેલ રહી ગયો તો પણ જઈજ છે. (હર્દે સુખતાર)

મસ્ટાલા (૧૯) : તે નિરોધક જેના કારણે રોડાવું પડયું હતું તે જતો રહ્યો અને સમય એટલો છે કે હજાર અને કુરખાની બંને પામી લેશો તો જવું કરજ છે, હવે જે ગયો અને હજાર પામી લીધી તો ઠીક નહીં તો ઉમરો કરીને એહુરામથી નિકળી જાય અને કુરખાનીનું જનવર જે મોડયું હતું મળી ગયું તો જેવી ઈચ્છા હોય તેમ કરે. (હર્દે સુખતાર વિગેર)

મસ્ટાલા (૨૦) : નિરોધક જતો રહ્યો અને એજ વર્ષે હજાર કરી તો કાજાની નિયત ન કરે અને હવે સુક્રરદ પર ઉમરો પણ વાનિબ નથી. (આલમગીરી)

મસ્ટાલા (૨૧) : વઢ્હે અરક્ષહ પછી એહુસાર થઈ શકતો નથી અને જે મક્કામાં જ છે પરંતુ તવાદ અને વઢ્હે અરક્ષહ બંને પર શક્તિમાન ન હોય તો સુહસર છે અને બંનેમાંથી એક પર શક્તિમાન છે તો સુહસર નથી. (આલમગીરી વિગેર)

મસ્ટાલા (૨૨) : સુહસરે કુરખાની મોડલી જાયારે એહુરામથી નીકળી ગયો, હવે તેની કરા કરવા ઈચ્છે છે તો જે કેવળ હજારનો એહુરામ હતો તો એક હજાર અને એક ઉમરો કરે અને કિરાન હતો તો એક હજાર, એ ઉમરા અને એ અખ્યાતયાર છે કે કાજામાં કિરાન કરે પછી એક ઉમરો અથવા નણે અલગ અલગ કરે અને જે એહુરામ ઉમરાનો હતો તો કેવળ એક ઉમરહ કરવો પડશે. (આલમગીરી વિગેર)

હજાર ઈત થવાનું ખયાન :
અખુદાઉદી, તિરમિશી, નિસ્ખાઈ, ઈન્ને-

માળ તથા દારોમી અખુલ રહેમાન રહીયદાહો અન્હોથી રિવાયત કરે છે કે, મેં રસુલુલાહ સલ્લાહુલાહો અલયહે વસ્લેલમને ઝરમાવતા સાંલળા કે હજા અરહેલા છે, જેણે સુજ દલિદ્દની રાતે તુલુએ ઝરથી પહેલા વડુકે અરકુહ પામી લીધો તેણે હજા પામી લીધો. દારકુતનીએ ઈધને ઉમર તથા ઈધને અખબાસ રહીયદાહો અન્હુમાંથી રિવાયત કરી કે રસુલુલાહ સલ્લાહુલાહો અલયહે વસ્લેલમે ઝરમાંયું જેનો બુકુહે અરકુહ રાત સુધીમાં હોત થઈ ગયો. તેની હજા હોત થઈ ગઈ, તો હવે તેણે ઉમરો કરીને અહેરામ આલી નાખવો જોઈએ અને આવતા વર્ષે હજા કરે.

મસ્ટાકા (૧) : જેની હજા હોત થઈ ગઈ અર્થાત તેને બુકુહે અરકુહ ન જાયો. તો તવાદ તથા સર્જ કરીને માથું સુંડાવી અથવા વાળ કટરાવી અહેરામથી નિકળી જાય અને આવતા વર્ષે હજા કરે અને તેના પર દમ વાજિઅ નથી. (જવહુરહ)

મસ્ટાકા (૨) : ડારિનની હજા હોત થઈ ગઈ તો ઉમરા માટે સર્જ તથા તવાદ કરે પછી એક બીજે તવાદ તથા સર્જ કરીને હુલક કરે અને કિરાનનો દમ જતો. રહ્યો અને પાછલો તવાદ જેને કરીને એહુરામથી બહાર થશે તેને શરૂ કરતાં જ લાખ્યૌક બંધ કરી હો અને આવતા વર્ષે હજાની કણ કરે, ઉમરહની કણ નથી કેમકે ઉમરહ કરી લીધો. (મનાસિક આલમગીરી)

મસ્ટાકા (૩) : તમતોઅ વાગો કુરબાનીનું જનવર લાંધ્યો હતો. અને તમતોઅ આતિલ થઈ ગયો. તો જનવરનું

જેવી ઈચ્છા હોય તેમ કરે. (આલમગીરી)

મસ્ટાકા (૪) : ઉમરો હોત થઈ શકતો નથી કે તેનો સમય છાંદળીભર છે અને જેની હજા હોત થઈ ગઈ ગઈ તેના પર તવાદ સર નથી. (આલમગીરી)

મસ્ટાકા (૫) : જેની હજા હોત થઈ તેણે તવાદ તથા સર્જ કરીને અહેરામ જોડ્યો નહીં અને એજ એહુરામથી આવતા વર્ષે હજા કરી તો તે હજા સહી થઈ નહીં. (મનાસિક)

હજાને બદલ્યાનું બયાન :

હદીસ (૧) : દારકુતની ઈધને અખબાસ રહીયદાહો અન્હોમાથી રાવી કે રસુલુલાહ સલ્લાહુલાહો અલયહે વસ્લેલમે ઝરમાંયું : - જે પોતાના માં-ખાપ તરક્ખથી હજા કરે અથવા તેમની તરક્ખથી તાવાન અહા કરે, કિયામતના દિવસે અખરારની સાથે ઉઠવબામાં આવશે.

હદીસ (૨) : અને જાખીર રહીયદાહો અન્હોથી રાવી કે હુલુરે ઝરમાંયું : - જે શખ્સ પોતાના માં-ખાપ તરક્ખથી હજા કરે તો તેમની હજા પૂરી કરી હેવામાં આવશે અને તેના માટે દસ હજાનો સવાખ છે.

હદીસ (૩) : અને જયદ બિન અરકુમ રહીયદાહો અન્હોથી રાવી કે રસુલુલાહ સલ્લાહુલાહો અલયહે વસ્લેલમે ઝરમાંયું : - જયદ કોઈ શખ્સ પોતાના માં-ખાપ તરક્ખથી હજા કરુશે તો મહુલ થશે અને તેમની ઝેણા ખુશ થશે અને તે અદલાહની નજીબી નેફાડાર (સદાચારી) લખવામાં આવશે.

હટ્ટીસ (૪) : અભૂ હિસ કોઈર અનસ રહીયદાહો અન્હોથી રાવી કે તેમણે રસુલુદ્વાહ સહલુદ્વાહો અલયહે વસુદ્વામને પૂછ્યું કે, અમે ચોતાના મૃતકો (મરહુમો) તરફથી સદકો અને હજન કરીએ છીએ અને તેમના માટે હુઅા કરીએ છીએ તો શું તેમને પહોંચે છે. આપે કુરમાંયું : એશાડ તેમને પહોંચે છે અને એશાડ તેઓ તેનાથી ખુશ થાય છે, જેવી રીતે તમારા પાસે ધાળીમાં કાઈ વસુ લેટ મુહુબામાં આવે તો તેમે ખુશ થાવ છો.

હટ્ટીસ (૫) : સહીહૈનમાં ઈજને અહુભાસ રહીયદાહો અન્હોમાથી મરવી છે કે, એક ઔરતે અરજ કરી યા રસુલુદ્વાહ મારા બાપ પર હજન કુરજ છે અને તેઓ બહુ જ વુદ્ધ છે કે સવારી પર એસી શકતા નથી. શું હું તેમના તરફથી હજન કરે. આપે કુરમાંયું : -હો.

હટ્ટીસ (૬) : અભૂ દાઉદ, તિરમીઝી તથા નસાઈ અણી રજાન અડીલી રહીયદાહો અન્હોથી રાવી કે, તેઓ નથીએ કરીમ સહલુદ્વાહો અલયહે વસુદ્વામની ખિદમતમાં હાજર થયા અને અરજ કરી યા રસુલુદ્વાહ મારા બાપ બહુ વુદ્ધ છે, હજન તથા ઉમરો કરી શકતા નથી અને સવારી પર એસી શકતા નથી, આપે કુરમાંયું — પોતાના બાપ તરફથી હજન તથા ઉમરો કરે.

મસ્નાદા (૧) : ઈભાદતો વણુ પ્રકારની છે. (૧) બદની (૨) માલીઅન (૩) સુરક્ષભ, બદની ઈભાદતમાં નયાખહ (નાયાખપણુ) થઈ શકતા નથી અથીત

એકની તરફથી ભીજે અદા કરી શકતો નથી જેવી રીતે નમાઝ, રોઆ. માલીમાં નયાખત હુર હાલતમાં જરી થઈ શકે છે, જેવી રીતે જક્કાત તથા સદકો, સુરક્ષભમાં આજિજ (વિવદ્ધ) હોય તો ભીજે તેની તરફથી કરી શકે છે નહીં તો કરી શકતો નથી, જેવી રીતે હજન, રહ્યું સવાખ પહોંચાડવું કે જે કાઈ ઈભાદત કરી તેનો સવાખ કુલાણુને પહોંચે. તેમાં કાઈ ઈભાદતની વિશેષતા નથી. દરેક ઈભાદતનો સવાખ ભીજાને પહોંચડી શકાય છે. નમાઝ, રોઆ, જક્કાત, સદકો, હજન, તિવાવતે કુઅન, જિક, જિયારતે કુખુર, કુરજ, નિક્ષે સૌનો શુષ્વતા અથવા મડદાને પહોંચાડી શકે છે અને એવું ન સમજવું જેઈએ કે, કુરજનો સવાખ પહોંચાડી હીધે તો ચોતાની પાસે શું રહી ગયું, કે સવાખ પહોંચાડવાથી ચોતાની પાસેથી કાઈ ગયું નહીં, માટે કુરજનો સવાખ પહોંચાડવાથી કરી તે કુરજ પાછે ન કરેશે કે, તે તો અદા કરી હીધે, તેના માથેથી સાક્ષિત (ઉત્તરી) થઈ ગયો. નહીં તો સવાખ કરી વસુનો પહોંચાડ છે.

(કરે સુખતાર, રદ્દુલસુહતાર, આલમગીરી)

ઉપરોક્ત ઈભારતથી સારી રીતે સમનાઈ ગયું કે પ્રચલિત હૃતેહો જાઈજ છે કે તે ઈસાલે સવાખ છે. અને ઈસાલે સવાખ જાઈજ છે, અદકે મહસુદ (સ્તુત્ય) છે. અલખત કાઈ બહલા પર ઈસાલે સવાખ કરવું દા.ત. કેટલાક લોકો કાઈજ જાઈજને કુઅન મળુદનો સવાખ પહોંચાડે છે. આ નાનાઈજ છે કે પહેલાં જે પદી હીધું હોય તેનો અદલો હીધે તો તે વેપાર થયો. અને આ વેપાર

સર્વથા બાતિલ તथા હુરામ છે અને જે હું જે કાંઈ પદ્ધો તેનો સવાબ પહોંચાડશે તો આ ઈજારો થયો અને તાચાત (આજી પાલન) પર ઈજારો બાતિલ છે. સિવાય તે ત્રણું બસ્તુઓનો કે જેનું બયાન આગળ આવશે. (રદ્દુલભુહતાર)

હજને બદલની શરતો :

મસ્તાદા (૧) : હજને બદલ માટે ફેટલીક શરતો છે :

(૧) જે હજને બદલ કરાવતો હોય તેના પર હજન ક્રજ હોય અર્થાત જે ક્રજ ન હતો અને હજને બદલ કરાવ્યો તો ક્રજ અહા થયો નહીં માટે જે પછીથી તેના પર ક્રજ થયો તો આ ક્રજ તેના માટે કાઢી થશે નહીં, બદકે જે વિવશ હોય તો ક્રી હજન કરાવે અને શક્તિમાન હોય તો પાતે કરો.

(૨) જેના તરફથી હજન કરવામાં આવે તે આજિજ (વિવશ) હોય અર્થાત પોતે હજન કરી શકતો ન હોય. જે જેના ચોંચ હોય કે પોતે હજન કરી શકે છે તો તેના તરફથી હજન થઈ શકતી નથી. જેકે પછીથી વિવશ થઈ ગયો. માટે તે સમયે જે વિવશ ન હતો પછીથી થઈ ગયો તો હું ક્રીથી હજન કરાવે.

(૩) હજનના સમયથી મૃત્યુ સુધી ઉત્તર બરાબર બાકી રહે. જે દરમિયાનમાં તેના ચોંચ થઈ ગયો. કે પોતે હજન કરે તો પહેલાં જે હજન કરી લાગે છે તે અપુરતો છે, હાને તે કાઈ એવો ઉત્તર હતો જેના

જવાની આશા જ ન હતી અને ઓચિંંતો જતો રહ્યો તો તે પહેલો હજન જે તેના તરફથી કરવામાં આવ્યો કાઢી છે, દા.ત. તે આંધળો છે અને હજન કરાવ્યા પછી દેખતો થઈ ગયો તો હું ક્રીથી હજન કરાવવાની જરૂરત રહી નહીં.

(૪) જેના તરફથી હજન કરવામાં આવે તેણું હુકમ આપ્યો હોય. તેના હુકમ વગર હજન થઈ શકતો નથી. હા વારસદારે સુરિસ (પૂર્વજ) તરફથી હજન કરી તો તેમાં હુકમની જરૂરત નથી.

(૫) જેના તરફથી હજન કરવામાં આવે તેના માલમાંથી ખરચ થાય, માટે જે નિયુક્ત કરનારે પોતાનો માલ (પૈસે) ખર્ચ કર્યો તો હજને બદલ થયો નહીં, અર્થાત જ્યારે કે બદ્ધિસ તરીકે એલ્યું ક્ર્યું હોય અને જે તમામ અથવા અધિકાંશ પોતાનો માલ ખરચ કર્યો અને જે કાંઈ તેણું છે એટલું છે કે તેમાંથી ખરચ વસુલ કરી લેશે તો હજન થઈ ગઈ અને જે એટલો નથી કે, જે કાંઈ પોતાનું ખરચ ક્ર્યું છે વસુલ કરી લેતો જે અધિક લાગ તેના છે જેણું હુકમ આપ્યો છે તો હજન થઈ ગઈ નહીં તો થશે નહીં.

મસ્તાદા (૨) : પોતાનો અને તેનો માલ બેળસેળ કરી નાખ્યો અને ફેટલો તેણું આપ્યો હતો એટલો અથવા તેમાંથી અધિક લાગની બરાબર ખરચ કર્યો તો હજને બદલ થઈ ગયો. અને આ મેળવવાના કરણે તેના પર તાવાન લાગિમ થશે નહીં. બદકે પોતાના સાથીઓના માલ જાણે પણ મેળવી શકે છે. (આલમગીરી, રદ્દુલભુહતાર)

મસ્તઅલા (૩) : કોઈએ વસ્તીયત કરી હતી કે મારા માલથી હજજ કરાવી હેવામાં આવે અને વારસદારે પોતાના માલથી તખરોઅન (નેકી પ્રાપ્ત કરવા માટે) કરાવી તો હજજને બદલ ન થયો. અને જે પોતાના માલથી હજજ કર્યો એવી રીતે કે જે ખરચ થશે તરડા (મરનારે છોડેલ માલ) માંથી લઈ લેશો તો હજજ થઈ ગઈ અને લેવાનો ઈરાહો ન હોય તો હજજ થઈ નહીં. અને અજનથીએ (ભીજાએ) હજજને બદલ પોતાના માલથી કરાવી તો હજજ થઈ નહીં, જે કે તે ખુદ તેને હજજને બદલ કરવા માટે છુદી ગયો. હોય અને જે એવી રીતે વસ્તીયત કરી કે મારાં તરફથી હજજને બદલ કરાવી હેવામાં આવે અને એમ ન કણ્ણું કે મારા માલથી અને વારસે પોતાના માલથી હજજ કરાવી દીધી, જેકે પાછા લેવાનો ઈરાહો પણ ન હોય તો હજજ થઈ ગઈ.

(રદ્દુલસુહૃત્તાર)

મસ્તઅલા : (૪) મૈયિત તરફથી હજજ કરવા માટે માલ આપ્યો. અને તે ડાઢી હતો. પરંતુ તેણે પોતાનો માલ પણ થાડોક ખરચ કર્યો છે તો જે ખરચ થયો વસુલ કરી લે અને જે ના ડાઢી (અપુરતો) હતો. પરંતુ અધિકાંશ મૈયિતના માલથી ખરચ થયો તો મૈયિત તરફથી હજજ થઈ ગઈ, નહીં તો થઈ નહીં.

મસ્તઅલા (૫) : મૈયિતે વસ્તીયત કરી હતી કે, મારા તરફથી ઝ્લાણ્ણો શખ્સ હજજ કરે અને તે મરી ગયો અથવા તેણે ઈન્કાર કરી દીધો. હવે જીલ પાસે હજજ

કરાવી લેવામાં આવી તો જાઈજ છે.
(રદ્દુલસુહૃત્તાર)

(૭) સવારી પર હજજ માટે જાય. પયદલ (પગપાળા) હજજ કર્યો તો થયો નહીં. માટે સવારીમાં જે કાંઈ ખર્ચ થયો આપવો પડશે, હા જે ખરચમાં કર્મી પડી તો પયદલ પણ હજજ થઈ જશે. સવારીથી સુરાદ એ છે કે, બહુધા માર્ગ સવારી પર પસ્તર કર્યો હોય.

(૮) તેના વતનથી હજજ માટે જાય.

(૯) મીડાતથી હજજનો અહેરામ બાંધી. જે તેણે તેનો હુકમ કર્યો હોય.

(૧૦) તેની નિયતથી હજજ કરે અને અફ્જલ એ છે કે લુલથી પણ “લાઘ્યોક અનન્કુલાં” છુદી લે અને જે તેનું નામ કુદી ગયો છે તો એ નિયત કરી લે કે જેણે જને મોકદ્યો છે તેના તરફથી હજજ કર્દું છું. અને આ ઉપરાંત ખીલુ પણ શરતો છે જે અનુસંધી વણ્ણિંન થશે. આ શરતો જે વણ્ણિંત થઈ કરજ હજજમાં છે. નિકલ હજજ હોય તો તે પૈકી કોઈ શરત નથી. (રદ્દુલ સુહૃત્તાર)

મસ્તઅલા (૬) : અહેરામ બાંધતા સમયે એ નિયત ન હતી કે ડાના તરફથી હજજ કર્દું છું તે જ્યાં સુધી હજજની કિયાએ શરૂ ન કરી હોય અખત્યાર છે કે નિયત કરી લે. (રદ્દુલ સુહૃત્તાર)

મસ્તઅલા (૭) : જેને હજજ કરવા માટે મોકલે તેને એમ ન કહે કે મે' તને પોતાની તરફથી હજજ કરવા માટે મજૂરે

બનાવ્યો અથવા નોકર રાખ્યો. કેમ કે ઈલાઈટ પર ઈલારો કેવો, બદકે એમ કહે કે મેં ચોતાની તરફથી તને હજજ માટે હુકમ આપ્યો. અને જે ઈલારાનો શાખદ ઈલો તો પણ હજજ થઈ જશે પરંતુ મહેનતાણું કાંઈ મારશે નહીં કેવળ ખરચાઓ મળશે. (રદ્દુલ સુહુતાર)

મસ્તાકા (૮) : હજને બદલની સઘળી શરતો જ્યારે જેવામાં આવે તો જેની તરફથી નિયુક્ત ઈલો તેની ફરજ અદા થઈ અને આ હજજ કરનાર પણ સવાલ પામશે, પરંતુ આ હજજથી તેની હજજ અદા થશે નહીં. (હરેં સુહુતાર, રદ્દુલ સુહુતાર)

મસ્તાકા (૯) : બહેતર એ છે કે હજને બદલ માટે એવો શાખસ મોડલવામાં આવે જેણું ચાતે હજજ ફરજ અદા કરી લીધી હોય અને જે એવાને મોડલયો. જેણું ચાતે હજજ કરી નથી, તો પણ હજને બદલ થઈ જશે. (આલમગીરી)

અને જે ખુદ તેના પર હજજ ફરજ હોય અને અદા ન કરી હોય તો તેને મોડલવું મહેરણે તહીરીમી છે. (મનાસિક)

મસ્તાકા (૧૦) : અદ્દજલ એજ છે કે એવા શાખસને મોડલો જે હજજના તરીકા અને તેના કાર્યોથી જાણકાર હોય. અને બહેતર એ છે કે આજાદ પુરુષ જે (શુલામ ના હોય તે) હોય અને જે આજાદ સ્વી (જે લોંગી ના હોય તે) અથવા શુલામ અથવા બાંધી (દાસી) અથવા સુરાહિક અર્થાત બાલિગ થવાની નિકટના બાળકથી હજજ કરાવી તો પણ હજજ અદા થઈ જશે. (હરેં સુહુતાર વિગેર)

મસ્તાકા (૧૧) : મજતુન (પાગલ) અથવા કાદ્રિ (દા.ત. વહાખીયે જમાના વિગેર)ને મોડલયો. તો હજજ અદા ન થઈ કેમ કે તે તેના પાત્ર નથી. (હરેં સુહુતાર)

મસ્તાકા (૧૨) : એ શાખસોએ એક જ માણસને હજને બદલ માટે મોડલયો. તેણું એક હજજમાં બંને તરફથી “લાખ્યોકે” કહ્યું તો બંનેમાંથી કોઈના તરફથી હજજ ન થઈ બદકે તે હજજ કરનારની હજજ થઈ. અને બંનેને તાવાન આપે અને હુદે જે ઈચ્છે કે બંનેમાંથી એક માટે કરી હેતુ તો પણ કરી શકતો નથી અને જે એકની તરફથી “લાખ્યોકે” કહ્યું પરંતુ નક્કી ન કર્યું કે કોના તરફથી તો જે એમજ અસપણ રાખ્યું તો પણ કોઈની હજજ થઈ નહીં અને જે પાછળથી અર્થાત હજજની કીયાઓ અદા કરવાથી પહેલા નિયુક્ત કરી દીધું તો જેના માટે નિયુક્ત કર્યું તેની હજજ થઈ ગઈ અને જે અહેરામ બાંધતી વખતે કાંઈ કહ્યું નહીં કે કોની તરફથી છે, ન નિશ્ચિત ન અનિશ્ચિત તો પણ એજ બંને સુરતો છે. (આલમગીરી)

મસ્તાકા (૧૩) : માં-ખાપ બંને તરફથી હજજ કરી તો તેને અખ્યાર છે કે, તે હજજને ખાપ માટે અથવા માં માટે કરી હેતુ અને તેનો હજજ ફરજ અદા થશે અર્થાત જ્યારે કે આ બંનેએ તેને હુકમ ન કર્યો અને જે હજજનો હુકમ આપ્યો હોય તો તેમાં પણ એજ અહેરામ છે જે ઉપર મજકુર થયાં, અને જે વગર હુકે ચોતાની મેળે એ શાખસો તરફથી નિર્દિશ હજજનો અહેરામ બાંધ્યો તો અખ્યાર છે

જેના માટે કુચ્છે કરી હે, પરંતુ તેનાથી તેની ફરજ અહા થયો નહીં, જ્યારે કે તે અજનથી (અપરિચિત) છે. એવીજ રીતે સવાખ પહોંચાડવાનો પણ અખત્યાર છે અહેંકે સગાખ તો બંનેને પહોંચાડી શકે છે.

(આલમગીરી, રદ્દુલમુહુતાર)

મસ્તાકા (૧૪) હજન ફરજ થઈ ગયા પછી કોઈ શર્ષસ ગાંડો થઈ ગયો તો તેની તરફથી હજને બદલ કરાવી શકાય છે.

(રદ્દુલમુહુતાર)

મસ્તાકા (૧૫) : કોઈએ કેવળ હજન અથવા ઉમરહ માટે કદું હતું પરંતુ તેણું બંનેનો અહેરામ બાંધ્યો. લદે બંને તેના તરફથી કર્યો અથવા એક તેની તરફથી ધીલે ચોતાની તરફથી અથવા કોઈ ધીલ તરફથી, દરેક હાલતમાં તેનો હજન અહા થયો નહીં. તાવાન આપવો પડશે.

(આલમગીરી)

મસ્તાકા (૧૬) : કોઈએ હજન માટે કદું હતું તેણું ઉમરહનો અહેરામ બાંધ્યો, પછી મક્કા મોઅજમાથી હજનો, તો પણ તેની વિરુદ્ધતા થઈ માટે તાવાન આપે,

(આલમગીરી, રદ્દુલ સુહૃતાર)

મસ્તાકા (૧૭) : કોઈએ હજન માટે કદું હતું. તેણું હજન કર્યો પછી ઉમરો કર્યો અથવા ઉમરહ માટે કદું હતું, તેણું ઉમરો કરી હજન કરી, તો તેમાં વિરુદ્ધતા થઈ નહીં. તેનો હજન અથવા ઉમરો અહા થઈ ગયો, પરંતુ ચોતાના હજન અથવા ઉમરહ માટે જે ખર્ચ કદું ખુદ તેના માથે છે. મોઅલનાર પર નથી અને જે ઉદ્દુ કદું

અર્થાત જે તેણું કદું તેને બાદમાં કદું તો વિરુદ્ધતા થઈ ગઈ. તેનો હજન અથવા ઉમરહ અહા થયો નહીં. તાવાન આપે.

(આલમગીરી, રદ્દુલ સુહૃતાર)

મસ્તાકા (૧૮) : એક શર્ષસે તેને હજન માટે કદું. ધીલએ ઉમરહ માટે કદું, પરંતુ તે બંનેએ લેગા કરવાનો હુકમ આપ્યો ન હતો. તેણું બંનેને લેગા કરી દીધા તો બંનેનો માલ પાછો આપે. અને જે એમ કરી દીધું હતું કે લેગા કરી લેને તો જઈજ થઈ ગયું. (આલમગીરી)

મસ્તાકા (૧૯) : અક્રિલ ચૈ છે કે, જેને હજને બદલ માટે મોઅલવામાં આવે તે હજન કરીને પાછો આવે અને આવવા-જવાનો ખર્ચ મોઅલનાર પર છે. અને જે ત્યાં જ રહી ગયો તો પણ જઈજ છે.

(આલમગીરી)

મસ્તાકા (૨૦) : હજન પછી કાઝલાના ઈન્ટેજારમાં જેટલા દિવસ થોલેનું પડે તે દિવસોનો ખર્ચ મોઅલનારના માથે છે અને તેનાથી વધારે રોકાનું હોય તો ખુદ તેના માથે છે, પરંતુ જ્યારે ત્યાંથી નિકળ્યો તો પાછા કરવાનો ખર્ચ મોઅલનારના માથે છે અને જે મક્કા મોઅજમામાં બિલકુલ (સર્વથા) રહેવાનો ઈરાહો કરી દીધો તો હુદે પાછા આવવાનો ખર્ચ પણ મોઅલનારના માથે નથી. (આલમગીરી)

મસ્તાકા (૨૧) : જેને હજન માટે મોઅલયો તે ચોતાના કોઈ કામમાં મશગુલ થઈ ગયો અને હજન ઝોત થઈ ગઈ તો તાવાન લાભિમ છે, પછી જે ધીલ વધે તેણું પોતાના માલથી હજન કરી દીધો તો

કાશી થઈ ગયું અને જે 'વડુકે અરક્ષા'થી પહેલા પત્ની સાથે સંલોગ કર્યો તો પણ એજ હુકમ છે અને તેણે પોતાના માલથી આવતા વિષે હજાર તથા ઉમરહ ડરવે પછે અને જે વડુક પછી સંલોગ કર્યો તો હજાર થઈ ગઈ, અને તેના પર પોતાના માલથી દમ આપવું લાજિમ છે અને જે ગેરઅભયારી આકૃતમાં અસ્ત થઈ ગયો તો જે કાઈ પહેલાં અર્ચ થઈ ગયું છે તેનો તાવાન નથી, પરંતુ પાછા આવવામાં હવે પોતાનો માલ અરચ કરે.

(ડુરે સુપ્તાર, આલમગીરી)

મસ્તાદા (૨૨) : નિકટનો માગ્ય છોડીને ફરના રસ્તાથી ગયો કે અરચ વધારે થયો. જે તે રસ્તેથી હાળ્યો જાય છે તો તેનો તેને અભયાર છે. (આલમગીરી)

મસ્તાદા (૨૩) : એભારી અથવા હુસ્મનના ઝારણે હજાર કરી શક્યો નહીં અથવા કોઈ ધીલ પ્રકારે સુહસ્તિર થયો તો તેના ઝારણે જે દમ લાજિમ થયો તે તેના માથે છે કે જેની તરફથી ગયો. અને બાકીના દરેક પ્રકારના દમ તેના માથે છે. દા.ત. સીવેલું ક્રેપ્ડું પહેલ્યું અથવા ઝુશ્યું લગાવી અથવા અહેરામ વગર મીકાતથી આગળ વધ્યો અથવા શિકાર કર્યો અથવા મીકલનારની ઈંજાતથી કિરાન તથા તમન્તુઅ કર્યો.

(ડુરે સુપ્તાર)

મસ્તાદા (૨૪) : જેના પર હજાર ફરજ યા ઝાર અથવા મન્નતની હજાર. તેના માથે ફોય અને સુત્યુનો સમય નિકટ આવી ગયો, તો વાજિબ છે કે વસ્તીયત કરી જાય.

(મનાસિક)

મસ્તાદા (૨૫) : જેના પર હજાર ફરજ છે અને તેણે ન અહા કરી ન વસ્તીયત કરી તો બિલઈજ માચ (સર્વીનુમતે) ગુનેહગાર છે. જે વારસદારો તેના તરફથી હજારે બદલ કરાવવા ઈરછે તો કરાવી શકે છે. ઈન્નશાશ્વતાહ આશા છે કે, અહા થઈ જાય અને જે વસ્તીયત કરી ગયો તો ત્રીજા લાગના માલથી કરાવવામાં આવે જેણે તેણે વસ્તીયતમાં ત્રીજા લાગની કેદ ન લગાવી. દા.ત. એમ હુણીને સૃત્યુ પાર્યો કે મારા તરફથી હજારે બદલ કરાવવામાં આવે.

(આલમગીરી વિગેર)

મસ્તાદા (૨૬) : ત્રીજા લાગના માલની માત્રા એટલી છે કે, વતનથી હજારના અચ્યુત માટે કાશી છે તો વતનથી જ માણુસ મોકલવામાં આવે, નહીં તો મીકાતની બહાર જવાથી પણ તે ત્રીજા લાગથી મોકલી શકાય. એવીજ રીતે જે વસ્તીયતમાં કોઈ રકમ નિયુક્ત કરી દીધી ઢાય તો તે રકમમાં જે ત્યાંથી મોકલી શકાય છે તો મોકલવામાં આવે, નહીં તો જ્યાંથી થઈ શકે. અને જે તે ટૃત્યાંશ અથવા તે નિશ્ચિત રકમ મીકાત બહાર ક્યાંથી પણ કાશી નથી તો વસ્તીયત બાતલ છે. (આલમગીરી, ડુરે સુપ્તાર, રદ્દુલ સુહિતાર)

મસ્તાદા (૨૭) : કોઈ શર્ષસ હજાર માટે નીકળ્યો. અને રસ્તામાં અથવા મઝા મોઅજમામાં લુકુકે અરક્ષાથી પહેલાં તેનો ઈન્નેકાલ થઈ ગયો. તો જે એજ વિષે તેના પર હજાર ફરજ થઈ હતી તો વસ્તીયત વાજિબ નથી અને જે લુકુરે પણ ઈન્નેકાલ થયો તો હજાર થઈ ગયો, પછી જે તવાઈ

કુરાજ બાકી છે અને વસિયત કરી ગયો કે, તેની હજાજ પૂરી કરી હેવામાં આવે. તો તેની તરફથી “અહનહ”ની કુરખાની કરી હેવામાં આવે. (રદ્દુલ સુહૃત્તાર)

મસ્યાદા (૨૮) : રસ્તામાં ઈન્ટેકાલ થયો અને હજને બદલની વસિયત કરી ગયો તો જે કોઈ રકમ અથવા સ્થળ નિશ્ચિત કરી દીધું છે તો તેના કહેવા અનુસાર કરવામાં આવે. જેકે તેના માલનો તૃત્યાંસ એટલો હતો કે તેના વતનથી મોાડલી શકાતો હોય અને તેણું વતનથી મોાડલવાની વસિયત કરી અથવા તે રકમ એટલી બતાવી કે તેમાં વતનથી જરૂર શકાતું નથી તો શુનેહગાર થયો અને નિશ્ચિત ન કર્યું તો વતનથી મોાડલવામાં આવે.

(હર્દે સુખતાર, રદ્દુલ સુહૃત્તાર)

મસ્યાદા (૨૯) : વસીએ અર્થીત જેને કહેવામાં આવ્યું કે તું મારા તરફથી હજાજ અહા કરાવી હોય, જેર સ્થાનથી મોાડલ્યો અને તૃત્યાંશ એટલું હતું કે વતનથી મોાડલી શકાતો હતો તો આ હજાજ મૈયત તરફથી ન થઈ બદ્દે વસી તરફથી થઈ. માટે મૈયત તરફથી આ શાખા ઝરીથી પોતાના માલથી હજાજ કરાવે. પરંતુ જ્યારે કે તે સ્થળ જ્યાંથી મોાડલ્યો છે વતનથી નિકટ હોય કે ત્યાં જરૂર રાત થવાથી પહેલાં આવી શકતો હોય તો હજાજ થઈ જશે. (આલમગીરી, રદ્દુલ સુહૃત્તાર)

મસ્યાદા (૩૦) : માલ એટલા પ્રમાણમાં નથી કે વતનથી મોાડલવામાં આવે તો જ્યાંથી શક્ય હોય મોાડલે, પછી જે હજાજ પછી કાંઈ બચી રહ્યું જેનાથી અખર પડી

કે અહીંથાથી મોાડલી શકાતો હતો તો “વસી” પર તેનું તાવાન છે. માટે ઝરીથી હજાજ બદલ ત્યાંથી કરાવે, જ્યાંથી થઈ શકતું હતું, પરંતુ જ્યારે કે બહુ ઓછી માત્રા વધી, દા. ત. ભાથુ વિગેરે.

(આલમગીરી)

મસ્યાદા (૩૧) : જે તેના માટે વતન ન હોય તો જ્યાં ઈન્ટેકાલ થયો ત્યાંથી હજાજ માટે મોાડલવામાં આવે અને જે અનેક વતન હોય તો તેમનામાં જે સ્થળ મજા મોઅજમાંથી અધિક નિકટ હોય ત્યાંથી મોાડલવામાં આવે. (આલમગીરી)

મસ્યાદા (૩૨) : જે કહેવામાં આવ્યું કે તૃત્યાંશ માલથી એક હજાજ કરાવી હોય તો એક હજાજ કરાવી હે અને કેટલીક હજાનોની વસિયત કરી અને એકથી વધુ નથી થઈ શકતી તો એક હજાજ કરાવી હે તેના પછી જે વધી વારસદાર લઈ લે અને જે એ વસિયત કરી કે મારા માલના તૃત્યાંશથી હજાજ કરાવવામાં આવે અથવા કેટલાએ હજાજ કરાવવામાં આવે અને કેટલાએ થઈ શકે છે તો જેટલા થઈ શકે છે કરાવી લે. હું જે કાંઈ વધી રહ્યું કેનાથી વતનથી મોાડલી શકાતો નથી તો જ્યાંથી થઈ શકે કરાવી લે. અને કેટલાએ હજાજની સુરતમાં અખત્યાર છે કે સધાળા એકજ વર્ષમાં થાય અથવા કેટલાએ વર્ષોમાં અને બહેતર અન્બલ છે. એવીજ રીતે જે એમ વસિયત કરી કે મારા માલના તૃત્યાંશ ભાગમાંથી હરેક વર્ષે એક હજાજ કરાવવામાં આવે તો તેમાં પણ અખત્યાર છે કે સૌ એક સાથે થાય અથવા હરેક વર્ષે એક અને જે એમ

કણું કે મારા માલમાંથી હજને ઇપીયાથી હજન કરાવવામાં આવે તો તેમાં જેટલા હજન થઈ શકે કરાવી હેવામાં આવે.

(આલમગીરી, રદ્દુલમુહતાર)

મસ્તાલા (૩૩) : જે વસીને એમ કણું કે ડોઈને માલ આપીને મારા તરફથી હજન કરાવી હે જે તો વસી ચાતે તેની તરફથી હજને બદલ કરી શકતો નથી અને જે એમ કણું મારી તરફથી હજને બદલ કરાવી હેવામાં આવે તો વસી ચાતે પણ કરી શકે છે અને જે વસી વારિસ પણ છે અથવા વસીએ વારિસને માલ આપી દીધા કે તે વારિસ હજને બદલ કરે તો હવે બાકીના વારસદારો જે બાલિગ હોય અને તેમની ઈજાજતથી થાય તો હજને બદલ થઈ શકે છે, નહીં તો થઈ શકતી નથી.

(આલમગીરી)

મસ્તાલા (૩૪) : હજનની વસિયત કરી હતી, તેના ઈન્નેભાલ પછી હજનનો ખર્ચ ડાઢવા પછી વારસદારોએ માલ વહેંચી લિધો, પછી તે માલ જે હજન માટે ડાઢ્યો હતો નાટ થઈ ગયો તો હવે જે બાકી છે તેના તૃત્યાંશથી હજનનો ખરચ ડાઢે પછી નાટ થઈ જાય તો બાકીના તૃત્યાંશથી, ત્યાં સુધી કે માલ ખતમ થઈ જાય અને તે માલ વસીની પાસે નાટ થયો હોય અથવા તેની પાસેથી કે જેને હજન માટે મોાકલવા ઈચ્છા છે તો બનેનો એક હુકમ છે.

(મનાસિક)

મસ્તાલા (૩૫) : જેને હજન ડરવા માટે મોાકલ્યો, વક્રોક્કેઅરક્કાથી પહેલા તેનો ઈન્નેભાલ થઈ ગયો અથવા માલ ચોરાઈ

ગયો પછી જે માલ બાકી રહી ગયો તેના તૃત્યાંશથી ફરીથી વતનથી હજન કરવા માટે ડોઈને મોાકલવામાં આવે અને જે જેટલા માલથી વતનમાંથી મોાકલી શકતો નથી તો જ્યાંથી થઈ શકે મોાકલે. અને જે ખીલે શાખસ પણ મુલ્ય પામ્યો અથવા ફરીથી માલ ચોરાઈ ગયો તો હવે જે કાંઈ માલ છે તેના તૃત્યાંશથી મોાકલવામાં આવે અને એક પછી ખીલે એમજ ડરતા રહેલા ત્યાં સુધી કે માલનું તૃત્યાંશ તેના ચોર્ય ન રહે કે તેનાથી હજન થઈ શકે તો વસિયત બાતલ થઈ ગઈ અને જે વક્રોક્કેઅરક્કા પછી મુલ્ય પામ્યો તો વસિયત પૂરી થઈ ગઈ.

મસ્તાલા (૩૬) : જેને હજને બદલ માટે મોાકલ્યો હતો તે વક્રોક્કે કરીને તવાફ કર્યો વગર પાછો આંદ્યો તો જૈયિતની હજન થઈ ગઈ પરંતુ તેણે ઔરતની પાસે જવું હુલાલ નથી, તેને હુકમ છે કે ચોતાના ખર્ચ પાછો જાય અને જે ડાઢો બાકી છે. અદા કરે. (આલમગીરી વિગેરે)

મસ્તાલા (૩૭) : વસીએ ડોઈને આ વર્ષ માટે હજને બદલ માટે સુકર્રર કર્યો અને ખરચ પણ આપી દીધો પરંતુ તે આ વર્ષ ગયો નહીં, ખીલ વર્ષ જઈને હજન અદા કરી તો હજન થઈ ગઈ, તેના પર તાવાન નથી. (આલમગીરી)

મસ્તાલા (૩૮) : જેને હજન માટે મોાકલ્યો તે મહી મોઅજીભા જઈને ખીમાર થઈ ગયો અને સધળો માલ ખર્ચ થઈ ગયો તો વસીના માથે પાછો દરવા માટે ખર્ચ મોાકલવું લાજિમ નથી. (આલમગીરી)

મસ્તાલા (૩૯) : જેને હજન માટે

નિયુક્ત કરવામાં આવ્યો તે બીમાર થઈ ગયો તો તેને અખત્યાર નથી કે બીજને મોાડલી હો. હા, જે મોાડલનારે તેને અનુમતિ આપી દીધી હોય તો બીજને મોાડલી શકે છે, માટે મોાડલતી વખતે આ અનુમતિ આપી હેઠી જોઈએ. (આલમગીરી, હુરેં સુખતાર)

મસ્ટાદા (૪૦) : જે તેને એમ કઢી દીધું કે ખર્ચ અલાસ થઈ જય તો કરજ કષ્ટ લેને અને તેનું અહો કરવું મારા માથે છે તો જાઈજ છે. (આલમગીરી)

મસ્ટાદા (૪૧) : એહારામ પણી રસ્તામાં માલ ચોરાઈ ગયો, તેણે ચોતાની પાસેથી ખર્ચ કરી હજજ કરી અને પાછો આવ્યો તો કાંઈના હુકમ વગર મોાડલનાર પાસેથી વસુલ કરી શકો નથી. (આલમગીરી)

મસ્ટાદા (૪૨) : ભરનારે એ વસિયત કરી કે ફ્લાણ્ઝ શાખસ મારા તરફથી હજજ કરે અને તે શાખસ મરી ગયો તો કાઈ બીજને મોાડલી હો. પરંતુ જ્યારે કે નક્કી કરી દીધું હોય કે એજ કરે બીજે નહીં તો મજબૂરી છે. (આલમગીરી)

મસ્ટાદા (૪૩) : એક શખસે ચોતાના તરફથી હજજને ખફક માટે ખર્ચ આપીને કોઈને મોાડલ્યો, તે પછી તેને ઈન્ટેક્લાલ થઈ ગયો. અને હજજની વસિયત ન કરી તો વારસદાર તે શાખસ પાસેથી માલ પાછો કષ્ટ શકે છે. જ્યે એહારામ બાંધી દીધી હોય. (હરેં સુખતાર)

મસ્ટાદા (૪૪) : સુસારિદે હજજ (હજજ ખર્ચી)થી સુરાદ તે ચીજ છે જેની હજજના સફરમાં જરૂરત પડે છે. દા. ત.

ખાણું, પાણી, રસ્તામાં પહેરવાના કપડાં, એહારામના કપડાં, સવારીનું લાડું, મડાનતું લાડું, મશક, ખાવા-પીવાના વાસણું, બાળવા તથા માથામાં નાખવાનું તેવા કપડાં ધોવા માટે સાણું, પંહેરા હેનારાનો પગાર, હણમતનો ખર્ચી, સારાંશ કે જે ચીજેની જરૂરત પડે છે તેના મધ્યમખ્યા, નકુલુલ ખરથી થાય ન થડું કમી અને તેને એ અધિકાર નથી કે આ માલમાંથી ઐરાત કરે અથવા ફૂકીરાને ખાણું ખવડાવે અથવા ખાતીવેળા બીજાઓને પણ ખવડાવે, હા, જે મોાડલનારે આ કામોની ઈજાત આપી દીધી હોય તો કરી શકે છે. (લભાબ)

મસ્ટાદા (૪૫) : જેને હજજ માટે મોાડલ્યો છે, જે તે ચોતાનું કામ પોતાની મેળે કરતો હતો અને હવે આદિમથી કામ દીધું તો તેનો ખરચ તેના પોતાના માથે છે અને જે પોતે કરતો ન હતો તો મોાડલનારના માથે છે. (આલમગીરી)

મસ્ટાદા (૪૬) : હજજથી પાછા દ્વર્યા પણી જે કાઈ વધ્યું હોય પાછું આપી હો. તેને રાખી લેવું જાઈજ નથી. જ્યે તે કેટલીથે ચોડી ચીજ હોય. ત્યાં સુધી કે ભાયામાંથી જે કાઈ વધ્યું તે કપડાં અને વાસણ વિગેરે. સારાંશ કે સઘળો સામાન પાછો આપી હો બહે જે શરત કરી દીધી હોય કે જે વધણે તે પાછું આપીશ નહીં તો પણ આ શરત બાતલ છે. પરંતુ એ સુરતોમાંથી (૧) એ કે મોાડલનાર તેને વકીલ બનાવી હો કે વધે તેને ચોતાને તોહાબા (દાન) કરી હેલે અને કંપે કરી હેલે (૨) એ કે જે મરણું પથારીએ હોય

તો તેનો વસિયત કરી હે જે વધે તેની ચેં
તને વસિયત કરી અને જે એમ વસિયત
કરી કે વસીને કહી દીધું કે જે વધે તે તેના
માટે છે જે મોકલવામાં આવે અથવા જેને
ઈચ્છે આપી હે તો આ વસ્તુ ચંતુ ભાતલ
છે, વારસનો હક થઈ જશે અને પાછી
આપવી પડશે. (હુરે સુખતાર,

રદ્દુલ સુહુતાર)

મસ્તાદા (૪૭) : એવી વસિયત કરી
કે એક હુલર ઇલાણુંને આપવામાં આવે
અને એક હુલર મિસ્કીનોને અને એક
હુલરથી હજજ કરાવવામાં આવે અને
તરંગાનું તૃત્યાંશ કુલ એ હુલર છે તો એ
હુલરમાં સરખા ત્રણ ભાગ કરવામાં આવે
એક ભાગ તો તેને આપો કે જેના માટે
કંધું. અને હજજ તથા મિસ્કીનોના બંને
ભાગ મેળવીને જેટલાથી હજજ થઈ શકે
હજજ કરાવવામાં આવે અને જે કંઈ વધે
મિસ્કીનોને આપવામાં આવે. (આલમગીરી)

મસ્તાદા (૪૮) : જડાત તથા હજજ
થીલ કોઈને આપવાની વસિયત કરી તો
તૃત્યાંશના ત્રણ ભાગ કરે અને જડાત તથા
હજજમાં જેને તેણે પહેલાં કંધું તેને પહેલાં
કરો, તેનાથી જે વધે થીલમાં ખરચ કરો,
કરજ અને મન્નતની વસિયત કરી તો ફરજ
અચીમ છે અને નિર્દ્દિલ તથા નજરમાં નજર
પહેલા છે અને સૌ કરજ અથવા નિર્દ્દિલ
અથવા વાજિબ છે તો અચિમ તે છે જેને
તેણે પહેલાં કંધું. (રદ્દુલસુહુતાર)

હુદીનું ખયાન

અદ્વાર ફરમાવે છે (અર્થ) અને જે

અદ્વારની નિશાનીઓની તાચીમ કરે તો
તે દિલોની પરહેજગારી પૈકી છે, તમારા
માટે ચાપાચામાં એક સુકર્રર હુદ સુધી
ક્રાયહો છે. પછી તેમનું પહેંચયાનું છે તે
આજાહ ઘર સુધી અને દરેક ઉર્મત માટે
અમોચે એક કુરખાની સુકર્રર કરી કે,
અદ્વારનું નામ જિક કરે તે એજબાન
ચાપાચો પર જે તેણે તેમને આપ્યા, અને
ફરમાવે છે (અર્થ) અને કુરાનીના ડાંટ,
ગાય અમોચે તમારા માટે અદ્વારની
નિશાનીઓ પૈકી કર્યા તમારા માટે તેમનામાં
લકાઈ છે તો તેમના પર અદ્વારનું નામ
લો. એક પગ બાધેલ, ત્રણ પગોથી ઉલેલ,
પછી જ્યારે તેમના કરવટ પાસેશી પડી જય
તો તેમનામાંથી પોતે ખાંડું અને સંતોષ
કરવાવાળાઓ અને ભીખ માંગવાલાઓને
ખવડાવે, આવી રીતે અમોચે તેમને તમારા
કાણુમાં કરી દીધા કે તમે અહેસાન માનો,
અદ્વારને હરગિજ ન તેમનું માંસ પહેંચ્યે
છે ન તેમનું લોહી. હા, તેના સુધી તમારી
પરહેજગારી પણ છે. એવીજ રીતે
તેમને તમારા કાણુમાં કરી દીધા કે તમે
અદ્વારની મોટાઈ જાલો તેના પર કે તેણે
તેમને હિંદાયત આપી, અને ઝુશખબરી
પહેંચાડી હો નેકી કરવાવાળાઓને.

હુદીસ (૧) : સહીહેનમાં ઉચ્ચુલ
મોભિનીન હુલરત આઈશા સિદ્ધિઓ રહીયલ્લા
હો અનહુાથી રિવાયત છે. તેઓ કહે છે :
માં નથી સંદૂલ્લાહો અલયહે વસ્તુભીમની
કુરખાનીઓના હાર પોતાના હાથીએ બનાવ્યા.
પછી હુલુરે તેમના ગળાઓમાં નાંખ્યા અને
તેમના કોહાન (દેકા) ચીર્યા અને હુરમ
તરફ રવાના કરી.

હદ્દીસ (૨) : સહીહ સુર્વિમ શરીરમાં હજરત જાબિર રહીયલાહો અન્હોથી રિવાયત છે કે, રસૂલલાહ સદ્દલલાહો અલયહે વસદ્દલમે દસમી જિલહિજજહના દિવસે હજરત આઈશા સિહીકા રહીયલાહો અન્હો તરફથી એક ગાય જુખું કરી અને બીજી રિવાયતમાં છે કે, અઝવાજે મુતહષરાત (પુનિત પરિણામ) તરફથી હજમાં ગાય જુખું કરી.

હદ્દીસ (૩) : સહીહ સુર્વિમ શરીરમાં હજરત જાબિર રહીયલાહો અન્હોથી રિવાયત છે. કહે છે કે, મેં નથીએ કરીમ સદ્દલલાહો અલયહે વસદ્દલમને કરમાવતા સાંલાયા કે, જ્યારે તું મજબૂર થઈ જય તો હુદ્દીપર પરિચિતની સાથે સાથે સવાર થા, જ્યાં સુધી બીજી સવારી ન મળે.

હદ્દીસ (૪) : સહીહ સુર્વિમમાં હજરત ઈંને અખ્યાસ રહીયલાહો અન્હોમાથી મરવી છે કે, રસૂલલાહ સદ્દલલાહો અલયહે વસદ્દલમે સોળ ઉંટ એક શાખસની સાથે હુરમ માટે મોડાયા. તેમણે અર્દે કરી તેઓ પૈકી કોઈ થાકી જાય તો શું કરે. આચે કરમાંથું તેને નહર (જુખું) કરી હેઠે અને કોણીથી તેના પગ રંગી હેઠે અને પાસા પર તેનો છાચો કણગાવી હેઠે અને તેમાંથી તર્ફે અને તમારા સાથીએ પૈકી કોઈ ખાય નહીં.

હદ્દીસ (૫) : સહીહેનમાં હજરત અલી રહીયલાહો અન્હોથી મરવી છે- કહે છે મને રસૂલુલાહ સદ્દલલાહો અલયહે વસદ્દલમે પોતાના કુરખાનીના જાનવરો પર

નિયુક્ત કરો અને મને હુકમ આપો કે માંસ અને ચામડાં અને ગૂંઠ તસદ્દુદ (સદકો) કરી હો અને કસાઈને તેમાંથી કાંઈ આપો નહીં. કરમાંથું કે, અમે તેને અમારી પાસેથી આપીશું.

હદ્દીસ (૬) : અખ્યાસ અખ્યાસ બિન ઇત રહીયલાહો અન્હોથી રાવી કે પાંચ અથવા છ ઉંટ હુદ્દુરની પિદમતમાં કુરખાની માટે રણુ કરવામાં આવ્યા, તે સધણા હુદ્દુરની નિકટ થલા લાગ્યા કોનાથી શરૂઆત કરે (અર્થાત હરેકની એ ઈચ્છા હતી કે પ્રથમ મને જુખું કરે) અથવા એટલા માટે કે પ્રથમ જેને ઈચ્છે જુખું કરે પછી જ્યારે તેમની કરવટો જરૂરિનથી લાગ્યી ગઈ તો કરમાંથું : જેની ઈચ્છા હોય તેમાંથી કુદકો લઈ લે.

મસ્યલા (૧) : હુદ્દી તે જાનવરને કહે છે કે જે કુરખાની માટે હરમ તરફ લઈ જવામાં આવે, આ વણું પ્રાપ્તાના જાનવર છે (૧) બફરી, તેમાં ઘેકું અને હુંસો પણ પણ શામેલ છે. (૨) ગાય, લોંસ પણ તેમાં જ ગણ્યાય છે. (૩) ઉંટ, હુદ્દીનો અદના દરજને બફરી છે તો જે કોઈએ હરમ માટે કુરખાની મોડાલવાની મન્ત્ર માની અને નિશ્ચિત ન કર્યું તો બફરી કાઢી છે.

(કરે સુખ્તાર, વિગેર)

મસ્યલા (૨) : કુરખાનીની નિયતથી મોડાંથું અથવા લઈ ગયો તો તો સ્પષ્ટ છે કે, કુરખાની છે અને જે અદનહુના ગળામાં હાર નાખી હાંકયું તો પણ હુંગી છે. જે નિયત ન હોય, એટલા માટે કે

આવી રીતે કુરખાનીને જ લઈ લય છે.
(રદ્દુલસુહુતાર)

મસ્યાદા (૩) : કુરખાનીના જનવરમાં જે શરતો છે તે હુદ્દીના જનવરમાં પણ છે. દા.ત. ઉંટ પાંચ વર્ષાંતું, ગાય એ વર્ષાંની, બકરી એક વર્ષાંની, ૫૨ંતું હુંણા-ઘે ટો. છ મહીનાનો જો એક વર્ષાંવાળા જેવો હોય તો કુરખાની થઈ શકે છે. અને ઉંટ, ગાયમાં અહીંયા પણ સાત આદમીની શિરડક્ત (લાગીદારી) થઈ શકે છે.

(હુરે સુખતાર વિગેર)

મસ્યાદા : (૪) ઉંટ-ગાયના ગળામાં હાર નાખી હેવું મસનું છે અને બકરીના ગળામાં હાર નાખ્યો સુન્નત નથી ૫૨ંતું કેવળ શુકાના અર્થાત્ તમતો તથા કુઝાના અને નિક્ષલ અને અન્નતની કુરખાનીમાં સુન્નત છે. અહુસાર અને જુરમાનાના દમમાં ન નાખો. (આલમગીરી)

મસ્યાદા (૫) : હુદ્દી જો કિરાન અથવા તમતોઅની હોય તો તેમાંથી કાંઈ ખાઈ લેવું બહેતર છે. એવીજ રીતે જો નિક્ષલ હોય અને હુરમાં પહોંચ્યો ગયું હોય અને જો હુરમાં ન પહોંચ્યું તો ખુદ ખાઈ શકતો નથી. કુકીરાની હુક્ક છે અને આ ત્રણુના સિવાય ખાઈ શકતો નથી અને જેને ખુદ ખાઈ શકે છે, માલદારોને પણ ખવડાવી શકે છે, નહીં તો ખવડાવી શકતો નથી અને જેને ખાઈ શકતો નથી તેના ચામડા વિગેરથી પણ લાભ લઈ શકતા નથી. (હુરે સુખતાર)

મસ્યાદા (૬) : તમતોઅ તથા કિરાનની કુરખાની દસમી. તારીખથી પહેલા થઈ શકતી નથી અને દસમી પછી કરી તો થઈ

જો ૫૨ંતું દમ લાજિમ છે કે, વિકાંખ નાઈ નથી. અને આ એ સિવાયના માટે કાઈ દિવસ નિશ્ચિત નથી અને બહેતર દસમી છે. હુરમાં હોવું સૌમાં જરૂરી છે. મિનાની વિશિષ્ટતા નથી, હા, દસમીએ હોય તો મિનામાં હોવું સુન્નત છે અને દસમી પછી મઙ્ગમાં મિનનતના બદનહું હુરમાં જુંહ થવું શરત નથી જયારે કે મિનનતમાં હુરમની શરત ન લગાવી.

(હુરે સુખતાર, રદ્દુલસુહુતાર, આલમગીરી)

મસ્યાદા (૭) : હુદ્દીનું માંસ હુરમના મિસ્કીનેને આપવું બહેતર છે. તેની નક્કીલ અને જુલને જીરાત કરી હો અને કસાઈને તેના માંસમાંથી કાંઈ આપો નહીં, હા, જો તેને સહ્ય તરીકે આપો તો વાંધો નથી.

(હુરે સુખતાર વિગેર)

મસ્યાદા (૮) : હુદ્દીના જનવર ૫૨ વગર જરૂરતે સવાર થઈ શકતો નથી ન તેના પર સામાન લાદી શકે છે લદે નિક્ષલ હોય અને જરૂરત સમયે સવાર થયો અથવા સામાન લાદ્યો અને તેના કારણે તેમાં કાંઈ નુકસાન આવ્યું તો તેટલું મોહતાને ૫૨ તસ્કુડ કરે. (આલમગીરી)

મસ્યાદા (૯) : જો તે હુધવાળું જનવર છે તો હુધ હોણ નહીં અને આંચળ પર ઠંડુ પાણી છાંટી દેવામાં આવે કે હુધ ખાંધ થઈ જાય અને જો જુંહ કરવામાં વિકાંખ હોય અને ન હોઢવાથી નુકસાન થશે તો હોણને હુધ જીરાત કરી હો અને જો ખુદ ખાઈ લીધું અથવા માલદારોને આપી હીધું અથવા નષ્ટ કરી નાખ્યું તો તેટલું જ હુધ અથવા તેની કાંમત મિસ્કીનો

પર તસદ્દુક કરે.

(આલમગીરી, ૨૬૬૫લસુહતાર)

મસ્ટાલા (૧૦) : જે તે બચ્ચું જણે તો બચ્ચાને તસદ્દુક કરી હે અથવા તેને પણ તેની સાથે જુખા કરી હે અને જે બચ્ચાને વેચી નાંખ્યું અથવા હલાક કરી હીધું તો તેની કિંમત તસદ્દુક કરે અને તે કિંમતથી કુરખાનીનું જનવર અરીદી લીધું તો બહેતર છે. (આલમગીરી)

મસ્ટાલા (૧૧) : લુલથી તેણે ભીજના જનવરને જુખા કરી હીધું અને ભીજાને તેના જનવરને તો અનેની કુરખાનીએ થઈ ગઈ. (મનાસિક)

મસ્ટાલા (૧૨) : જે જનવરને હુરમાં લઈ જઈ રહ્યો હતો રસ્તામાં મરવા લાગ્યું તો તેને ત્યાં જ જુખા કરી નાખે અને કોણીથી તેનો હાર રંગી નાખે અને ઢોકા પર છાપ લગાવી હે કે જેથી તેને માલદાર કોડો ખાય નહીં, કશીરો જ ખાય. પછી જે તે નિક્ષલ હતું તો તેના બદલાતું ભીજું જનવર લઈ જવું વાજિબ છે અને જે તેનામાં કોઈ એવો એબ (ઝોડ) આવી ગયો કે કુરખાનીના ચોણ્ય ન રહ્યું તો તેનું જે છિંછે કરો અને તેના બદલામાં ભીજું જનવર લઈ જાય જાયારે કે વાજિબ હોય. (હરેં સુખતાર વિગેર)

મસ્ટાલા (૧૩) : જનવર હુરમાં પહોંચી ગયું અને ત્યાં મરવા લાગ્યું તો તેને જુખા કરીને મિસ્કોનેને તસદ્દુક કરી હે અને ચાતે ન ખાય, લદે નિક્ષલ હોય અને જે તેનામાં થોડું તુકસાન ચેદા થયું

છે કે હજુ કુરખાનીના ચોણ્ય છે તો કુરખાની કરે અને ચાતે પણ આઈ શકે છે.

(આલમગીરી)

મસ્ટાલા (૧૪) : જનવર ચોરાઈ ગયું તેના બદલે ભીજું ખરીદ્યું અને તેને હાર નાખીને ચાલ્યો. પછી તે ચોરાચોલું જનવર મળી ગયું તો બહેતર એજ છે કે બંનેની કુરખાની કરી હે અને જે પહેલાની કુરખાની કરી અને ભીજાને વેચી નાંખ્યું તો એમ પણ થઈ શકે છે અને જે પાછલાને જુખા કર્યું તો જે તેની કિંમત જેટલું જ હતું અથવા અધિકતું તો જાણી છે. અને એથી કિંમતનું હતું તો જેટલી કરી થઈ જાને કરી હે. (આલમગીરી)

હજાજની મન્નતનું બયાન

હજાજની મન્નત માની તો હજાજ કરવું વાજિબ થઈ ગયું. કંકારો આપવાથી સુકૃત થશે નહિં. લદે એમ કાણું કે અલ્લાહ માટે મારા પર હજાજ છે અથવા કોઈ કામ થવા પર હજાજની શરત કરી અને તે થઈ ગયું. (આલમગીરી)

મસ્ટાલા (૧) : અહેરામ બાંધવા અથવા ઝા'બા મોઅઝજમા અથવા મછા સુકર્રમા જવાની મન્નત માની તો હજાજ અથવા ઉમરા તેના પર વાજિબ છે અને એકતું નિશ્ચિત કરી કેવું તેના માથે છે.

(આલમગીરી)

મસ્ટાલા (૨) : પગપાળા હજાજ કરવાની મન્નત માની તો વાજિબ છે કે ઘેરથી કરજ તવાદ સુધી પગપાળા જ રહે.

અને પૂર્વો પ્રવાસ અથવા અધિકારીંશ સવારી પર હ્યો તો દમ આપે અને જે અક્ષર પયદલ રહ્યો અને થોડો સવારી પર તો એજ હિસાબથી બકરીની કીંમતનો જેટલો લાગ તેના સુધીભિલમાં આવે જૈરાત કરી હે. પયદલ ઉમરહણી મજૂત માની તો માથું સુંડાવના સુધી પયદલ રહે.

(હરે સુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્યલા (૩) : એક વર્ષમાં જેટલા હજનની મનત માની સંધળાં વાજિબ થઈ ગયાં. (આલમગીરી)

મસ્યલા (૪) : લોંડી (હાસી) ચુલામ, સુહરમ (અહેરામવાળા) ખરીદું જર્ઝ છે અને ખરીદનારને અખત્યાર છે કે અહેરામ તોડાવી નાપે લદે તેમણે ચેતાના પ્રથમના માલિકની ઈજાતથી અહેરામ બાધ્યો હોય અને અહેરામ તોડવા માટે ફેવળ એમ હઠી દેવું કાશી નથી કે અહેરામ તોડી નાખ્યો. બઢું કોઈ એવું કામ કરવું જરૂરી છે જે અહેરામમાં મનાચ હતું. હા.ત. દાંત, વાળ અથવા નખ કપાવવાનું અથવા ખૂશખૂ લગાવવાનું. તેની જરૂરત નથી કે હજનના અદ્યાત્મ (કૃત્ય) બલબી લાવી અહેરામ તોડે અને કુરેબાની મોદલવાનું પણ જરૂરી નથી પરંતુ આજાહી પણી કુરખાની, હજન તથા ઉમરેં વાજિબ છે, જે હજનનો અહેરામ હતો અને ઉમરેં જે ઉમરાહતું અહેરામ હતું. (હરે સુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્યલા (૫) : અદ્યાત્મ એ છે કે તે ખરીદેલ લોંડીનું અહેરામ સંભોગ સિવાયની કોઈ બીજી વસ્તુથી જોવાવી હે અને

સંભોગથી પણ અહેરામ ખુલી જશે પરંતુ જ્યારે કે તેને એ અખર ન હોય કે અહેરામથી છે અને સંભોગ કરી લીધો તો હજન ક્રાસિદ થઈ જશે.

(હરે સુખતાર, રદ્દુલ સુહતાર)

મસ્યલા (૬) : જે માલિક અહેરામ જોવાવી હીધા પણી તેણે બાંધ્યો, પણી જોવાવી હીધો, જે કેટલીક વખત આવી રીતે થયું પણી એજ વર્ષે અહેરામ બાંધીને હજન કરી લીધો તો કાશી થઈ ગયો અને જે આવતા વર્ષે હજન હ્યો તો દરેક વખત અહેરામ જોવાનો એક એક ઉમરે કરે. (આલમગીરી)

મસ્યલા (૭) : અહેરામની હાકતમાં નિકાહ થઈ શકે છે. કોઈ અહેરામવાળી ઔરતથી નિકાહ હ્યો તો જે નિકલનો અહેરામ છે તો જોવાવી શકે છે અને ક્રરજનો છે તો એ સુરતો છે, જે ઔરતનો મહેરમ સાથે છે તો જોવાવી શકતો નથી અને મહેરમ સાથમાં ન હોય તો ક્રરજનો અહેરામ પણ જોવાવી શકે છે અને જે તેનું મહેરમ હોવું અખર ન હોય અને જિમાચ (સંભોગ) હરી લીધો તો હજન ક્રાસિદ થઈ ગઈ. (આલમગીરી)

મસ્યલા (૮) : સુખારખાતું બનાવવાનું નિકલ હજનથી અદ્યાત્મ છે અને નિકલ હજન સદકાથી અદ્યાત્મ છે અર્થાત જ્યારે કે તેની અધિક હાજત ન હોય, નહીં તો હાજતના સમયે સદકો હજન કરતા અદ્યાત્મ છે. અહેરામા શામીએ અતિ શુદ્ધ હિંકાયત આ બધાનમાં નકલ કરી કે, એક સાહુબ હજન અશરજીએ લઈને હજન માટે જઈ

રદ્યા હતા. એક સૌયદાણી લશરીકું લાંયાં. અને પોતાની જરૂરત જહેર કરી. તેમણે સંઘળી અથરકુંઓ નજર કરી હીધી (સેટ આપી હીધી) અને પાછા આવ્યા. નયારે ત્યાંના લોડો હજજથી પાછા ક્રિયા તો ફરેક હાલુ તેમને કહેવા લાગ્યો, અદલાહુ તમારી હજજ કખુલ કરે. તેમને આશ્ર્ય થયું કે શું મામદો છે. હું તો હજજ કરવા ગયો નથી. આ લોડો આવું કેમ કહે છે. સ્વાનમાં હજજ સંદર્ભલાહો અલયહે વસદલમની પવિત્ર જિયારતથી લાલાંવિત થયા. આપે કરમાંયું : ‘શું તને લોડોની બાતોથી આશ્ર્ય થયો.’ તેમણે વિનંતી કરી : ‘હા, યા રસુલદલાહુ.’ આપે કરમાંયું કે, ‘તેં મારી અહૃતેથયત (સૌયદાણી સાહેબા)ની જિહમત કરી તેના બદલામાં અદલાહુ તારી સુરત (ચહેરા)નો એક ઇરિશ્ટો પૈદા કર્યો. જેણે તારા તરફથી હજજ કરી. અને જિયામત સુધી હજજ કરતો રહેશે.’

મસ્તાકા (૬) : હજજ સંઘળા શુનાહેના કર્દારો છે અથીત કરનેની તાણીર (વિલંબ)નો જે શુનોહ તેના માથે છે તે ઈન્શાઅદલાહુ નાટ થઈ જશે. પાછા આવી અહા કરવામાં કરી વાર કરી તો કરી આ નવો શુનોહ થયો. (હરે મુખ્યતાર)

મસ્તાકા (૧૦) : બુક્કે અરફદ બુરુચાના હિવસે થયો. તો બહુ સંવાદ છે કે, આ એ ઈન્દ્રાનો ઈન્દ્રતેમાચ (સંમેલન) છે અને તેને જ લોડો “હજજે આકથર” કહે છે.

અદલાહુનું મર્યાદિકના જિયારતા હરમેકો વ હરમે નથીયેકો વ હથીયેકો એ

જાહેરી ઈન્દ્રકા વ સંદર્ભલાહો ત્યાલા અહોષે વ અદા આદેર્દું વ અસહાયેહિ વધનેહિ વહિઅયેહિ અજમદન વલહમ્હો લિલલાહો રહ્યાદિયાદમીન.

ઇઝાઈલે મહીના તચ્યેભૂહ

હદીસ (૧) : સહીહ મુસ્લિમ તથા તિરમિઝીમાં અખ્યુ હુરૈર રહીયદલાહો અનહોથી રિવાયત છે કે રસુલુદલાહુ સંદર્ભલાહો અલયહે વસ્ત્વમે કરમાંયું કે મહીનાની તકલીફ તથા સખ્તાની પર મારી ઉમ્મતમાંથી જે કાઈ શાખસ સથ્ય કરે જિયામતના હિવસે હું તને શરીર (શક્તાચતુરનાર) થઈશ.

હદીસ (૨) તથા (૩) : મુસ્લિમમાં સઅહ રહીયદલાહો અનહોથી રિવાયત છે કે હુક્કુરે કરમાંયું - મહીના લોડો માટે બહેતર છે, જે તેઓ જણુતા, મહીનાને જે શાખસ વિમુખતાની રીતે છોડશે (ત્યાગશે) અદલાહુ તાદા તેના બદલામાં તેને લાવશે જે તેનાથી બહેતર હશે અને મહીનાની તકલીફ તથા કાટ પર જે અહગ રહેશે જિયામતના હિવસે હું તને શરીર અથવા શાહીદ થઈશ. અને એક રિવાયતમાં છે. જે શાખસ મહીનાવાળાચો સથે જુરાઈનો ઈરાદો કરશે અદલાહુ તેને આગમાં એવી રીતે પીગળાવશે જેલું સીસુ અથવા એવી રીતે જેવી રીતે નમક (મીહુ) પાણીમાં ઓગળી જાય છે. તેના જેલું જ બજજારે હજરત ઉમર રહીયદલાહો અનહોથી રિવાયત કર્યું છે.

હદીસ (૪) : સહીહેનમાં સુદ્રિયાન જિનઅણી અહીર રહીયદલાહો અનહોથી મરણી છે, કહે છે મેં રસુલુદલાહુ સંદર્ભલાહો

અલયહે વસદલમને ઝરમાવતા સાંલજ્યા કે ચમન ઝતેહ થશે, તે સમચે કેટલાક લોકો હોડતા આવશે અને પોતાના ઘરવાળાઓ અને તેમને જે તેમની તાણેહારીમાં છે, લઈ જશે, જેકે મહીના તેમના માટે બહેતર છે ને જાણુતા. અને ઈરાક ઝતેહ થશે, કેટલાક લોકો ઉતાવળ ડરતા આવશે અને પોતાના ઘરવાળાઓ અને ઝરમા બરદારોને લઈ જશે જેકે મહીના તેમના માટે બહેતર છે, ને તેઓ જાણુતા તો.

મસ્તાકા (૫) : તિભરાની ઈધીરમાં અણી અસહ સાચીની રહીયલાહો અન્હોથી રાવી, કહે છે કે અમે રસુલુલ્હાહો સદ્ગલદાહો અલયહે વસદ્ધુમની સાથે હબરત હમજહ રહીયલ્હાહો અન્હોની કખર પર હાજર હતા. (તેમના કદન માટે કેવળ એક ડામળી (ચાદર) હતી ન્યારે લોકો તેને એંચીને તેમનું સુખ ઢાંડતા તો કદમ ખુલી જતા અને કદમ પર નાખતા તો ચહેરો ઉધડી જતો, રસુલુલ્હાહો સદ્ગલદાહો અલયહે વસદ્ધુમે ઝરમાંયું આ ડામળીથી સુખ ઢાંડી હો. અને પગો પર આ ધાસ નાખી હો. પછી હજૂરે પવિત્ર મસ્તક ઉંચું કચું, સહાખાઓને રડતા નેયા. આપે ઝરમાંયું, લોકો પર એક જમાનો આવશે કે ઝળકૂપ હેશો પ્રતિ ચાદ્યા જશે. ત્યાં લોજન અને લિખાસ અને સવારી તેમને મળશે. પછી ત્યાંથી પોતાના ઘરવાળાઓને લખી મોદલશે કે અમારી પાસે ચાદ્યા આવો કે તમે હિન્દુજની સુકી ધરતીમાં પડયા છો. જેકે મહીના તેમના માટે બહેતર છે. ને તેઓ જાણુતા તો.

હૃદીસ (૬ થી ૮) : તિરમિશી, ઈજને

હુણાન તથા બયહુકી ઈજને ઉમર રહીયલ્હાહો અન્હોમાથી રિવાયત કરે છે કે રસુલુલ્હાહો સદ્ગલદાહો અલયહે વસદ્ધુમે ઝરમાંયું-જેનાથી થઈ શકે કે મહીનામાં જ મરે કે જે શાખસ મહીનામાં મરશે હું તેની શક્તાત કરીશ.

હૃદીસ (૯) : સહીહ સુસ્લિમ વિગેરમાં અણુ હુરૈરહ રહીયલ્હાહો અન્હોથી રિવાયત છે કે લોકો ન્યારે શરૂ શરૂ કુણ જેતા રસુલુલ્હાહો સદ્ગલદાહો અલયહે વસદ્ધમની ખિદમતમાં હાજર કરતા, હુજૂર તેને લઈને એમ કહેતા ઈલાહી તું અમારા માટે અમરા અન્જુરોમાં બરકત આપ અને અમારા મહીનામાં બરકત કર અને અમારા સાચ અને સુદ (એક પ્રકારના તોલમાપ)માં બરકત આપ. યા અદ્લાહો એશક ઈથાહીમ તારા બંદ્દ અને તારા ખલીસ અને તારા નષી છે અને એશક હું તારો બંદ્દ અને તારો નષી છું. તેમણે મહ્કા માટે તારાથી હુએ કરી અને હું મહીના માટે તારાથી હુએ કરું છું, તેના જેબું જ જેની હુએ મહ્કા માટે તેમણે કરી અને એટલી જ અને (અથીત મહીનાની બરકત મહ્કાથી બમહુદી થાય) પછી જે નાનું ધાળક આવતું તેને આદાખી તે અન્જુરો આપી હેતા.

હૃદીસ (૧૦ થી ૧૩) : સહીહ સુસ્લિમ-માં ઉમ્મુલમેમેનીન સિદ્ધીકા રહીયલાહો અન્હોથી રિવાયત છે કે રસુલુલ્હાહો સદ્ગલદાહો અલયહે વસદ્ધમે ઝરમાંયું-યા અદ્લાહો તું મહીનાને અમારું મહેખુખ (પિય) ખનાવી હો જેબું અમને મહ્કા મહેખુખ છે બંદ્દ તેનાથી અધિક અને તેની આણોહવાને અમારા માટે હુરસ્ત કરી હો

અને તેના સાચ તથા મુદ્ભમાં બરકૃત આપ અને અહીંયાની ઝુખાર (તાવ)ને પરિવર્તન કરીને જહુકહુમાં મોક્કી છે. (આ હુએ તે સમયે કરી હતી જ્યારે હિજરત કરીને મદીનામાં તશરીફ લાગ્યા અને અહીંયાની આખોહુવા સહુભાઓ કિરામને અતુકુળ ન થઈ કે અગાઉ અહીંયા વાદી બીમારીઓ અધિકતાથી થતી.) આ વિષય કે હુઝુરે મદીના તથેબહુ માટે હુએ કરી કે મજ્જાથી બમહી અહીંયા બરકૃતો થાય, મૌલાઅલી તથા અણુ સઈદ તથા અનસ રદીયદલાહો અન્હુમથી રિવાયત છે.

મદીનાવાળાઓ સાથે ઝુરાઈ કરવાનો અંગમ

હદીસ (૧૪) : સહીહ ઝુખારી તથા સુસ્તિમમાં સાચદ રદીયદલાહો અન્હોથી રિવાયત છે કે રસુલુદ્દલાહુ સલ્લદલાહુ અલયહે વસ્તુદમ ઝરમાવે છે - ને શાસ મદીનાવાળાઓ સાથે ઝુરેલ કર્શે એવો એગળી જ્ઞે જેવું મીહું પાણીમાં એગળી જય છે.

હદીસ (૧૫) : ઈને હણબાન ચોતાની સહીહમાં જાબિર રદીયદલાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસુલુદ્દલાહુ સલ્લદલાહુ અલયહે વસ્તુદમ ઝરમાન્યું - ને મદીનાવાળાઓને ડરાવશે અદ્દાહુ તેને ઝરમાં નાખશે.

હદીસ (૧૬-૧૭) : તિભરાની ઉભાડહ બિન સામિત રદીયદલાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસુલુદ્દલાહુ સલ્લદલાહુ અલયહે

વસ્તુદમ ઝરમાન્યું - યા અદ્દાહુ ને મદીનાવાળાઓ પર ઝુદ્દમ કરે અને તેમને ડરાવે તો તેને ખોઇ (લય)માં અસ્ત કર અને તેના પર અદ્દાહુ અને ઝરિશ્તાઓ અને સઘળા આદમીઓની લઘનત અને તેનું ન ઝરજ કષુલ કરવામાં આવે ન નિક્ષલ, તેના જેવું જ નિસાઈ તથા તિભરાનીએ સાઈબળિન ખદ્દાદ રદીયદલાહો અન્હોથી રિવાયત કર્યું.

હદીસ (૧૮) : તિભરાની ઝબીરમાં અપહુદદાહ બિન ઉમર રદીયદલાહો અન્હોથી રાવી કે રસુલુદ્દલાહ સલ્લદલાહુ અલયહે વસ્તુદમ ઝરમાન્યું : ને મદીનાવાળાઓને ઈજા આપશે અદ્દાહુ તેને ઈજા આપશે અને તેના પર અદ્દાહુ અને ઝરિશ્તાઓ અને તમામ આદમીઓની લઘનત અને તેના ન ઝરજ કષુલ કરવામાં આવે ન નિક્ષલ.

હદીસ (૧૯) : સહીહેનમાં અણુ હુરૈરહ રદીયદલાહો અન્હોથી રિવાયત છે કે રસુલુદ્દલાહ સલ્લદલાહુ અલયહે વસ્તુદમ ઝરમાન્યું : મને એક એવી વર્તી પ્રતિ (હિજરત)નો હુકમ થયો ને તમામ વર્તીઓને આઈ જશે (સૌ પર ગાલિબ આવશે) લોકો તેને યસરબ કહેણે છે. (હિજરતથી પહેલા લોકો યસરબ કહેતા હતા પરંતુ હવે આ નામથી ચોકારવું જઈજ નથી કે હદીસમાં તેની મનાઈ આવી, કેટલાક શાયરો ચોતાના અશારામાં મદીના તથયબહુને યસરબ લખે છે તેમને આનાથી વિરચિત લાખિમ છે અને એવા શાંતેર (પંક્તિ)ને પઢે તો તે શખદની જગ્યાએ

તચ્યાખહ પછે કે આ નામ હુંજુરે રાખ્યું છે બદકે સહીહ મુસ્લિમમાં છે કે, અદલાહ તથાલાએ મહીનાનું નામ તાખહ રાખ્યું છે.) અને તે મહીના છે, લોકોને એવી રીતે પાક તથા સાઝ કરશે એવું લડી લોખંડના મેલ (કાટ)ને કરે છે.

હંદીસ (૨૦) : સહીહ્યનમાં તેમનાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અલયહે વસદ્દલમે ફરમાયું - મહીનાના માગો પર ફરિશ્તા (ચેહરો આપે છે) તેમાં ન દંજાલ આવે ન તાજિન આવે.

હંદીસ (૨૧) : સહીહ્યનમાં અનસ રદીયદ્વાહો અન્હોથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અલયહે વસદ્દલમે ફરમાયું કે મહીના સિવાય કાઈ શહેર એવું નથી કે ત્યાં દંજાલ ન આવે, મહીના ને કાઈ રહ્યો એવો નથી જેના પર ફરિશ્તોએ કનાર બાંધી ચેહરો ન આપતા હોય, દંજાલ (મહીનાની નિકાટ) ખારી જમીનમાં આવીને ઉત્તરશે. તે સમયે મહીનામાં ત્રણ ધરતીઓ ધર્શન, જેનાથી દરેક કાદિર તથા સુનાઓ અહીંથાથી નિકળી દંજાલ પાસે ચાલ્યો જશે.

મહીના તચ્યેખહની હાજરી

અદલાહ અભજવ જદ્દલ ફરમાવે છે-
આર્થિક : જે લોકો પોતાના લુદો પર જુદ્દમ કરે અને તમારા હુંજુર (સમક્ષ) હાજર થઈને અદલાહથી મગફેરત તલખ કરે અને રસૂલ પણ તેમના માટે ઈસ્તિગ્ફાર કરે તો અદલાહને તૌબા ફાય્દા ફરનાર, રહુમ ફરનાર પામશે.

હંદીસ (૧) : હારુનની તથા બયહુકી વિગેર અહુદ્વાહ બિન ઉમર રદીયદ્વાહો અન્હોથાંથી રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અલયહે વસદ્દલમે ફરમાયું - જે મારી ઇથની જિયારત કરે તેના માટે મારી શક્તાત વાજિબ છે.

હંદીસ (૨) : તિથાની કણીરમાં તેમનાથી જ રાવી કે રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અલયહે વસદ્દલમે ફરમાયું : જે શખ્સ મારી જિયારત માટે આવે, સિવાય મારી જિયારતના થીએ કાઈ હાજર માટે ન આવ્યો તો મારા પર હજુ છે કે કિયામતના દિવસે તેનો શક્તીની બતું.

હંદીસ (૩) : હારુનની તથા તિથાની તેમનાથી જ રાવી કે રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અલયહે વસદ્દલમે ફરમાયું : જેણે હજુ કરી મારી વક્તાત પછી મારી ઇથની જિયારત કરી તો એવું છે જેણું મારી હૃયાતમાં જિયારતથી લાભાંબિત થયો.

હંદીસ (૪) : બયહુકીએ હાતિઅ રદીયદ્વાહો અન્હોથી રિવાયત કરી કે, રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અલયહે વસદ્દલમે ફરમાયું : જેણે મારી વક્તાત પછી મારી જિયારત કરી તો જણે તેણે મારી જિંદગીમાં જિયારત કરી અને જે હરમૈનમાં મરશે કિયાતમના દિવસે અમનવાળાએમાં ઉઠશે.

હંદીસ (૫) : બયહુકી હાતિઅ રદીયદ્વાહો અન્હોથી રાવી કે રસૂલુલ્લાહ સદ્દલદ્વાહો અવયહે વસદ્દલને મેં ફરમાવતા સાંલાખ્યા. જે શખ્સ મારી જિયારત કરશે કિયામતના દિવસે હું તેનો શક્તીની અથવા શાહીદ હોઈશ અને જે શખ્સ

હરમયનમાં મરશે અહ્લાહૃતઆદા તેને કિયામતના દિવસે અમનવાળાઓમાં ઉડાવશે

(૬) : ઈંગેનાથી ડામિલમાં તેમનાથી જ રાવી કે રસૂલુલ્લાહ સંલંઘાહો અલયણે વસ્તલમે ઇરમાનું : જેણે હજજ કરી અને મારી જિયારત ન કરી તેણે મારા પર જક્કા કરી.

(૭) જિયારતે અકદસ વાળિયના કર્માં છે. કેટલાક લોકો દોષ્ટ બનીને જલ જાતની વાતોથી ઉરાવે છે. માર્ગમાં ખતરા છે, ત્યાં બીમારી છે, ચા છે, તે છે. ખખરદાર કાઈની વાત સાંલળો નહી અને હરગિજ મહેદુભીને દાધ લઈને ન પડ્યો, જીવ એક દિવસ જરૂર જવાનો છે. યોનાથી શું બહેતર કે તેમની રાહમાં જીવ જય અને અનુભવ છે કે જે શાસ તેમતું દામન થાની લે છે તેને ચાતાના સાચામાં આરામથી લઈ જય છે, કોઈ ખટકો નથી રહેતો. કુમકો તો અપને સાચા મેં

આરામ હી સે લાચે
હીલે બહાને વાલોં કો

યે રાહ ડર કી હુય.

(૮) હાજેરીમાં ખાલિસ જિયારતે અકદસની નિયત કરો. ત્યાં સુધી કે ઈંગેનામ ઈંગે અદહામ ઇરમાવે છે કે- ચા વખતે મસ્તિજુદ શરીરીની નિયત પણ શરીર ન કરે.

(૯) જે ઇરજ હજજ છે તો હજજ કરીને મહીના તથેબહુ હાજર થાય. હા, જે મહીના તથેબહુ રસ્તામાં હોય તો જિયારતે વગર હજજ માટે જેવું સખત

મહેદુભી તથા કોર હુદ્દયતા છે અને આ હાજરીને હજજ સ્વીકરણ તથા હીની-હુન્યવી સદલાંય માટે જરૂરી તથા વસીલો ઠેરે અને નિકલ હજજ હોય તો અખત્યાર છે કે પહેલા હજજથી પાછ સાછ થઈને મહેદુભીના દરબારમાં હાજર થાય અથવા સરકારમાં પહેલા હાજરી આપીને હજજની મહેદુભીયત તથા નૂરાનિયત માટે વસીલો કરે, સારાંશકે ને પહેલા અખત્યાર કરે તેને અખત્યાર છે પરંતુ નિયત ઘોરદરદાર છે કે ઇન્નિમલ આ'માલો ઇન્નીયાતે વલેકુલ્દે અમરીમ મા નવા. (આ'માલોને મદાર નિયત પર છે અને દરેક માટે તે છે ને તેણે નિયત કરી.)

(૧૦) માર્ગલર હુદ્દના જિક શરીરીમાં કુંભી જય અને જેટલા પ્રમાણમાં મહીના નિકટ આવતું જય શ્રી-જીઃ અધિક થતો જય

(૧૧) જયારે હરમે મહીના આવે બહેતર એ છે કે પગપાળા થઈ જવ, રડતા, મસ્તક જુડાવી, આંખો નીચી કરેલ હુદ્દશરીરીની અધિકતા કરો અને શક્ય હોય તો નગન પગોએ ચાલો બદકે,

હરમકી જમીં એર કદમ રખક ચલના અરે સરકા મૌજા હુય એ જને વાલે.

જયારે કુંભએ અન્નર પર નજર પડે હુદ્દદોસલામની ખુલ કસરત (અધિકતા) કરો.

(૧૨) જયારે પવિત્ર શહેર સુધી પહેંચો જલાલ તથા જમાલ મહેદુભ સંલંઘાહો અલયણે વસ્તલમના તસ્વિર (ધ્યાન)માં લીન થઈ જવ અને શહેરના દરવાલમાં

દાખલ થતી વેળા પ્રથમ જમણો પગ સુડો અને આ પઢો.

બિસમીલ્હાહે માશાઅલ્હાહે લાકુલ્વતા ઇલ્હા બિલ્હાહે રૂણે અદ્ભિદની સુદાખલ સિદ્હકિલ્ય અપ્સીજની સુપરજ સિહકિન અલ્હાહુદેમકેતહુદી અણવાણા રહુમતેકા વરજુકની મિન જિયારતે રસૂલેકા સદ્ગુલ્હાહે આલા અલયહે વ સદ્ગુમ મા રઝકત અવલિયાએકા વ આહુક તાચાતેકા વન્કીઝદી મિનનારે વગ્દીરદી વરહુમની યા જૈશ મસ્તિલિન.

તરજુમો : અલ્હાહના નામથી શરૂ કરું છું કે અલ્હાહે ચાહું નેકીની તાકાત નથી પરંતુ અલ્હાહથી, અય રષબ ! સદ્ગુલ્હાઈ સાથે મને દાખલ કર અને સદ્ગુલ્હાઈ સાથે બહાર લઈ જ, ઈલાહી તુ ચોતાના રહુમતના દરવાજા મારા માટે જોવી હે અને ચોતાના રસૂલ સદ્ગુલ્હાહો અલયહે વસ્તુમની જિયારતથી. મને તે નસીબ કર કે ચોતાના ઔદિયા અને ફરમાં બરદાર બંદાઓ માટે તેં નસીબ કર્યું અને મને જહુનનમથી નન્જત આપ અને મને બળશી હે અને મારા પર રહુમકર, અય બહેતર સવાલ કરવામાં આવેલ.

(૭) મસ્તિદની હાજરીથી પહેલા તમામ જરૂરીઆતોથી કેનોં લગાવ દિલ લટકવાના કારણું રૂપ હાય, બહુજ જ જરૂરી કરેણ થાય, તેમના સિવાય કોઈ બેકાર વાતમાં ભશગુલ ન થાય તુરન્ત વુદ્ધ તથા મિસ્વાફ કરો અને શુસ્ત કરવું બહેતર છે, સાફેદ પાકીઓ ફ્પડાં પહેરો અને નવા હાય તો બહેતર છે,

સુરમો અને ખુશ્ય લગાવો અને સુદૃઢ અદ્ભુત છે.

(૮) હવે તરકાળ આસ્તાનચે અકદસ તરફ અતિશય ખુશ્ય અને ખુશ્ય (વિનયતા તથા આનિગ્રી)થી ધ્યાનિત થાવ, રહુવું ન આવે તો રહુવા જેવું માફું જનાવો અને દિલને રડવા માટે મજબૂર કરો અને પોતાના પાવણ હૃદયથી રસુલુલ્હાહ સદ્ગુલ્હાહો અલયહે વસ્તુમ પ્રત્યે વિનંતી કરો.

(૯) જ્યારે મસ્તિદના દરવાજ પર હાજર થાવ તો સલાતો સલામ ઝર્યો કરીને થોડું થોકો, જાણો સરકારથી હાજરીની ઈજાજત માંગતા હોવ, બિસ્મિલ્હાહ કહીને સ્વાધો (જમણો) પગ પહેલાં સુડોને સર્વાંગ અદખ થઈને દાખલ થાવ.

(૧૦) તે સમયે જેણું અદખ તથા તઅણીમ કરજ છે, દરેક સુસલમાનનું દિલ જાણો છે. આંખો, ડાન, જીબ, હાથ-પગ, દિલ સૌ ગૈર (પારકા)ના હ્યાલથી પાક કરો. પવિત્ર મસ્તિદના નક્શોનિગાર (વેલખુટા) ન હોયો.

(૧૧) જે કોઈ એવા શાખસ સામે જેનાથી સલામ કલામ જરૂરી હોય તો નયાં સુધી બને કંતરાઈ જવ, નહીં તો જરૂરત કરતાં અધિક આગળ ન વધો, તે છતાં દિલ સરકારની તરફ હોય.

(૧૨) હરગિજ હરગિજ પવિત્ર મસ્તિદમાં કોઈ શરૂદ જોરથી ના નિકળો.

(૧૩) યડીન જાણો કે હુંઝૂરે અકદસ સદ્ગુલ્હાહો અલયહે વસ્તુમ સાચી, વાસ્તવિક, હુનિયાવી શારીરીક હ્યાતથી એવા જ છુબંત છે જેવા વક્ષાત શરીક્ષથી પહેલા હતા,

તેમની અને સધારાં અંભિયા અલયહિ સુસસ્લામની મોત ડેવળ ખુદાના વાયદાની પુષ્ટિ માટે એક ક્ષણ માટે હતી, તેમનો ઈન્ટેક્લાલ ડેવળ અવામની નજરોથી છુપાઈ જવું છે, ઈમામ મોહમ્મદ ઈન્ને હાજર મક્કી મદખલમાં અને ઈમામ એહુમદ ક્રસ્તલાની મવાહિબ લહુનિયામાં અને દીનના ઈમામી ઝરમાવે છે :

તરજુમો : હુંજુરે અકદસ સલ્લાલલાહો અલયહે વસ્લામની હ્યાત તથા વક્ષતમાં તે વાતમાં ડેઈ તક્ષાવત નથી કે તેઓ ચોતાની ઉચ્ચમતને જેઈ રહ્યા છે અને તેમની હાલતો, તેમની નિયતો, તેમના ઈરાહાઓ તેમના હિક્લેના ખ્યાલેને ઓળખે છે અને આ સધળું હુંજુર પર એવું રોશન છે કે માં સર્વથા શુંતતા નથી. ઈમામ મોહિક્કિ ઈન્ને ઈલ્હામ નસ્કના શિષ્ય ઈમામ રહમતુલ્લાહ અને અદી કારી મક્કી તેની શરહ મસ્તક મશાકસ્તમાં ઝરમાવે છે :—

તરજુમો : એશા રસૂલલાહ સલ્લાલલાહો અલયહે વસ્લામ તારી હાજરી અને તારા ઉલા થવા અને તારા સલામ બદકે તારા તમામ કૃત્યો તથા અહેનાલ તથા ફૂચતથા મુકામથી જાણુકાર છે.

(૧૪) હવે જે નમાજની જમાઆત ઉલ્લિથી ગઈ હોય તો (સુન્ની ઈમામ હોય તો) શરીર થઈ જવ કે તેમાં તહીયતુલ્લ મસ્તિષ્ઠ પણ અદી થઈ જશો, નહીં તો જે શોએનો ગલાઓ મોહત્તુલ આપે અને કરાહુતનો સમય ન હોય તો એ રહમત તહીયતુલ્લ મસ્તિષ્ઠ તથા પવિત્ર દરખારની હાજરીના

શુકાનામાં ડેવળ કુલ યા અને કુલહોવદ્દલાહ્યી બહુ હદકી પરંતુ રસૂલુલ્લાહ સલ્લાલલાહો અલયહે વસ્લામની સુન્નતની રિચાયત સાથે નમાજ પઠવાની જગ્યા જ્યાં હવે મસ્તિષ્ઠ કરીમના મધ્યમાં મહેરાબ બની છે અને ત્યાં જગ્યા ન મળે તો જ્યાં સુધી બની શકે તેની નિકટ અદી કરો. પછી શુકના સિજાદામાં પડી હુએ કરો કે ઈલાહી તારા હુંથીએ સંક્રિયાહો અલયહે વસ્લામનો અદ્દય અને તેમનો તથા ચોતાની કણુલીયત નસીબ કર. આમીન.

(૧૫) હવે અદ્દના અતિરેકમાં હુમેલ, ગરદન જુકાવેલ, આંખો નીચી કરેલ, કાપતા-કુજાતા, શુનાહેના પશ્ચાતાપથી પરસેવો પરસેવો થતાં હુંજુર સલ્લાલલાહો અલયહે વસ્લામની ક્ષમા તથા કૃપાની ઉમ્મીદ રાખતા હુંજુરે વાલાની પાંયતી અથીત પશ્ચિમ તરફથી મવાજુહ શરીર (શિરાણુ)માં હાજર થઈને હુંજુરે અકદસ સંક્રિયાહો અલયહે વસ્લામના મજારે અન્વરમાં જ્યાં કિંલા ઇથે જદ્વા ઇરમાં છે, તે દિશાએથી હાજર થશો તો હુંજુરની નિગાહે એકશપનાહ તમારી તરફ હશે અને આ વાત તમારા માટે બંને જહાંનમાં કાઢી છે. વલહમુલિલ્લાહ.

(૧૬) હવે અદ્દ, હૈબત, ઔર્દુ તથા ઉમ્મીદની પરાકાણા સાથે ઇન્દિલની નીચે તે ચાંદીની ખીલીના સામે જે પવિત્ર હુંજુરાની ફક્ષણી દીવાલમાં ચહેરાએ અન્વરની સામે લાગેલ છે. ઓછામાં ઓછા ચાર હાથના અંતરેથી કિંલાને પીઠ અને મજારે અન્વર તરફ સુખ કરીને નમાજની જેમ હાથ ખાંધીને ઉલા રહો. હુંથાએ તથા

શરેહ હુથાય તથા ઈખ્તેયાર શરેહ સુપ્તિાર તથા ઇતાવા આલમગીરી વિગેર પ્રમાણિત કિટાઓમાં આ અદ્યનું સ્પષ્ટિકરણ કર્માંસું : “હુનુરની સમક્ષ એવી રીતે ઉલ્લા રહે જેમ નમાજમાં ઉલ્લા રહે છે.” આ ઈખારત આલમગીરી તથા ઈખ્તેયારની છે અને હુથાયમાં કર્માંસું : “હાથ બાંધીને જમણો હાથ ડાખા હાથ પર સુકીને ઉલ્લા રહે.”

(૧૭) અળરદાર જણી શરીરનો ઓસો આપયા હાથ લગાવવાથી બચા ડે, તે અદ્યની વિઝદ્ધ છે. બદકે ચાર હાથના અંતરથી અધિક નિકટ ન જવ. આ તેમની રહેમત શું એધી છે કે તમને ચોતાના હુનુર (સમક્ષ) આદાયા, ચોતાના પવિત્ર મવાજહમાં જગ્યા આપી. તેમની ઇપાળ દાઢિ લેકે હરેક જગ્યાએ તમારા પ્રતિ હૃતી, હુદે વિશેષતા અને આ નિકટતાના દરજનની સાથે છે.

(૧૮) અલહદોલિલદ્વાહ ! હુદે દિવની જેમ તમારું સુખ પણ આ પાડ જણી પ્રતિ થઈ ગયું જે અલાહ અખ્વાજદ્વાતના અભીજુથ શાન મહેભૂત સરદારદ્વાહો અલયહે વસ્તુલમની આરામગાહ છે, બહુ અદ્ય તથા વડાર સાથે બિનનસર તથા દર્દ લયો ચહેરે તથા શર્મનાહ દિલ તથા ચાડ-ચાક-જિગર, મદ્યમસ્વરથી, ન ખુલંદ તથા સખત (કે તેમના હુનુર અવાજ ખુલંદ કરવાથી આમાલ અધારત થઈ જય છે.) ન બહુ નરમ તથા નિર્મ (કે સુન્નતની વિઝદ્ધ છે જેકે તે તમારા હિલોના ખતરાએ સુદાંથી નાંધુભાર છે. જેખું કે હમણું ઈમામાના

વિવરણથી વણુંન થયું) સુજરો તથા તસ્વીમ બજાવી લાવો અને અર્જ કરો : —

અસસલામો આદયકા અચ્યુહનાણપીયું વ રહેમતુલ્લાહિ વ બરકાતુહુ. અસસલામું આદયકા યા રસૂલુલ્લાહિ. અસસલામું આદયકા, યા ખ્યરા અદિકલ્લાહિ, અસસલામું આદયકા યા શાફીઉલ્લાહિ મુજનેથીન. અસસલામું આદયકા વ અદા આદિકા વ અસહાયિકા વ ઉમ્મતિકા અજમદીન !!

તરજુમો : અય નણી આપ પર સલામ અને અદાહની રહેમત અને બરકતો, અય અદાહના રસૂલ આપ પર સલામ, અય અદાહની તમામ મખુફથી બહેતર આપ પર સલામ, અય ગુનેહગારોની શક્તાત્ત્વ કરવાળાણ આપ પર સલામ. અને આપની આલ તથા અસહાય પર અને આપની તમામ ઉમ્મત પર સલામ.

(૧૯) જયાં સુધી શક્ય હોય અને લુલ સાથ આપે અને મલાલ તથા આળસ ન હોય તો સલાતો સલામની કસરત (અધિકતા) કરો. હુનુરથી ચોતાના માં આપ, પીર, ઉસ્તાદ, ઔલાદ, સ્નેહીએ, મિત્રો અને સધ્ગાં સુસલમાનો માટે શક્તાત્ત્વ માંગો વારંવાર અર્જ કરો —

“અસઅલુકુશ શાફીઅતા આ રસૂલુલ્લાહ ”

(અર્થ) : (યા રસૂલુલ્લાહ હું હુનુરથી શક્તાત્ત્વ માંશું હું)

(૨૦) પણી જે કોઈએ અર્જ-સલામની વસ્તિયત કરી હોય તો બજાવી લાવો.

શરઅન તેનો હુકમ છે. અને આ ઇક્સીર અવીલ તે સુસલભાનોને કે ચા રિસાલા (કિતાબ)ને વાંચે વસીયત કરે છે કે જ્યારે તેમને બારગાળની હાજરી નસીબ થાય ઇક્સીર (લેખક તથા અનુવાદકોની જિંદગીમાં અથવા મૃત્યુ પછી ઓછામાં ઓછું નણ વખત મવાજુહ શરીરમાં જરૂર આ શરૂદો અર્જ કરીને શુનેહુંગારી પર અહેસાન કરે. અદ્વાહ તેમને બંને જહાનમાં જગાએ જૌર બપણો. -આમિન). (સાથે સાથે આ કિતાબના શુજરાતી અનુવાદકો માટે પણ અર્જ કરે.)
—અનુવાદકો

અસસ્લાતો વસસ્લામો અદૈકા યા રસૂલિબ્બાહે વ આજ્ઞા આદૈકા વશુરીધાતો ઝી કુદ્દે આનિય લહુઅતિન અહૃદ કુદ્દે ઝર્તિન અદ્વે અદ્વે ભર્તિન મિન અથીદેકા અમારદ્વારી વસુતારજેમીન યસસ્લેકુશશક્ષાયતા કેરક્ષય લહુ વલિ-દસુસ્લેમીન

તરજુમો : યા રસૂલિબ્બાહ હુન્દુર અને હુન્દુરની આદ અને સૌ સંખ્યાઓણો પર, દરેક પળ અને દરેક લહેજામાં દરેક દરેક ૨૯કણું ગણુંત્રી પર દસ દસ લાખ હુન્દો સલામ હુન્દુર નાહીંર શુલામ અમજૂં અદી (અને અનુવાદકો નાચીઝ : કમર્દીન પીરબાદા તથા ડાસુલાઈ પહેંચીયા) તરફથી તેઓ હુન્દુરથી શક્ષાયત માંગે છે, હુન્દુર તેમની અને તમામ સુસલભાનોની શક્ષાયત કરે.

(૨૧) પછી ચોતાના જમણા હાથ એટલે પૂર્વી તરફ એક હાથ જેટલું હંઠીને હુન્દુરત સિદ્દીકે અડભર રસીયદ્વાહે અન્દોના ચહેરાએ

અન્દરની સામે ઉલા રહીને અર્જ કરે.

અસસ્લામુ અદૈકા યા અદીઝીતોહ રસૂલિબ્બાહિ, અસસ્લામુ અદૈકા યા વર્જીર રસૂલિબ્બાહિ, અસસ્લામુ અદૈકા યા આહિયે રસૂલિબ્બાહિ ઝીલ ગારે વ રહેમતુલ્દાહિ વ બરકાતુહ.

તરજુમો : અય અદીઝી રસૂલિબ્બાહ આપ પર સલામ, અય રસૂલિબ્બાહના વજીર આપ પર સલામ, અય ગારે શોરમાં રસૂલિબ્બાહના રસીધ આપ પર સલામ, અને અદ્વાહની રહમત અને બરકતો.

(૨૨) પછી એટલું જ વહુ હંઠીને હુન્દુરત ઉમર ઝાડકે આજમ રસીયદ્વાહે અન્દોની ઝાડક ઉલા રહીને અર્જ કરે।

અસસ્લામો અદૈકા યા અમીરદ્વારે મોમિનીન, અસસ્લામો અદૈકા યા મુતનિમિલ અરભકુન, અસસ્લામો અદૈકા યા દિઝિઅલ દસ્તિલામ વલ મુસ્લેમીન વ રહેમતુલ્દાહે વ બરકાતુહ.

તરજુમો : અય અમીરદ્વારે મોમિનીન આપ પર સલામ, અય ચાદીસની સંખ્યા પુરી કરવાણા આપ પર સલામ, અય દસ્તિલામ તથા સુસલભાનોની દિઝિઅત આપ પર સલામ અને અદ્વાહની રહમત અને બરકતો.

(૨૩) પછી એક વેંત જેટલું પદ્ધિમ તરફ હોય અને હુન્દુરત સિદ્દીકે અડભર તથા ઝાડકે આજમની વચ્ચે ઉલા રહીને અર્જ કરો : —

અસસ્લામો અદૈકોમા યા અદીઝીતૌ

રસૂલિલ્હાહ, અસસ્તામો અદ્યાતોમા યા વળીરે રસૂલિલ્હાહે અસસ્તામો યા ઝણુંએ રસૂલિલ્હાહે વ બરકાતોહુ આસચલોડો મરશાઝાઅતા દનિ રસૂલિલ્હાહે સહલાહુણે ત્યાલા અદ્યાહે વ અદ્યાદોમા વ બારક વ સહલમા.

તરણુમો : અય રસુલુદ્વાહના પહેલુમાં આરામ કરવાવાળાઓ આપ બંને પર સલામ અને અદ્દાહની રહુમત અને બરકતો. આપ બંને હુઅરતોથી સવાલ કરું છું કે રસુલુદ્વાહ સહલાહુણે અલય હે વસ્તુભુના હુઅર અમારી સિક્ષારશ (અલામણ) કરને. અદ્દાહ ત્યાલા તેમના પર અને આપ બંને પર હુદ્દ તથા બરકત તથા સલામ નાજિક કરે.

(૨૪) આ સૌ હાજરીએ ઈન્દ્રાભત (ચીનુતિ)ના પ્રસંગ રૂપ છે. હુઅમાં કોશીશ કરો. જમેઅ હુઅા કરો. હુદ્દ પર સંતોષ બહેલર છે અને ઈચ્છો તો આ હુઅા પઢો:

“અદ્દાહુમ દન્નિ અશહેરોકા વ ઉશહેરો રસુલકા વ અદ્યા બરકરિન વ ઉમર વ ઉશહેરુદ્મલાચોકતનાઝેઝીના અદ્યા હાઝેહિ રોદતિકરીમતીદ્વાદેઝીન અદ્દોહા દન્નિ અશહેરો અન લાઈલાહ અન્ત વહુદકા લા શરીકા લકા ઝગ્ઝીરદી વમ્નુન અદ્યાય બિલ્લારી મનનત અદ્યા અચલિયાચોકા ઝઠિકરુદ્મજાનુદ્ગાદુર્રે રીદ્વીમ. રૂધાના આતેના ઝીદુન્યા હસનતંબ ઝીદ્વાખેરતે હસનતંબ કેના અગ્રા અજારે.

તરણુમો : અય અદ્દાહ હું તને તારા રસ્તુ અને અખુઅહ તથા ઉમરને અને તારા ઇરિંતાએને ને આ રોજા પર નાજિક તથા એટેકાઇમાં છે તે સૌને ગવાહ કરું છું કે હું ગવાહી આપું છું કે તારા સિવાય કોઈ મચ્યુહ (પુલય) નથી, તુ એકદેા છે. તારો કોઈ શરીર (ભાગીદાર) નથી અને મોહુમદ સહલાહુણે અલયહે વસ્તુમ તારા બંદા અને રસ્તુ છે, અય અદ્દાહ, હું પોતાના શુનાહ તથા અપરાધનો સ્વીકાર કરું છું, તુ મારી મગદેરત કર અને મારા પર તે અહેસાન કર જે તે પોતાના ઔલિયા પર ક્યોરી, એશાહ તુ અહેસાન કરનાર, બખશાનાર મહેરખાન છે.

(૨૫) પણી પવિત્ર મિશ્રભરની નિકટ હુઅા માંગો.

(૨૬) પણી જનતની ક્યારીમાં (અથીત ને જગ્યા મિશ્રભર તથા પવિત્ર હુજરાની વચ્ચે છે. (તેને હુદ્વામાં જનતની ક્યારી હાજી છે.) આવીને એ રકમત નિકૃત (મકરુદ સમય સિવાય) પરીને હુઅા કરો.

(૨૭) એવીજ રીતે મસ્તિજદ શરીરના દરેક થાંબલા પાસે નમાજ પઢો, હુઅા માંગો, કે બરકતના ઝારણું રૂપ છે. ખાસ કરીને કટલાકમાં ખાસ વિશિષ્ટતા છે.

(૨૮) જયાં સુધી મહીના તથેખણી હાજરી નસીબ થાય એક થાસ પણ એકાર ન જવા હો, જરૂરત સિવાય બહુધા સમય મસ્તિજદ શરીરમાં તહારત સાથે હાજર રહો. નમાજ, તિકાવત તથા હુદ્દમાં સમય પસાર કરો. હુનિયાની વાત કોઈ મસ્તિજદમાં ન થવી જોઈએ, ન કે અહીંયા.

(૨૯) હંમેશા દરેક મસ્તિજ્ઞમાં જરી-
વેણા એ'તેકાદની નિયત કરી લો.
(એ'તેકાદનો અર્થ છે મસ્તિજ્ઞમાં ઈરાદા-
પૂર્વક નિયત કરીને થોલવું, એટલાં માટે
કે જિંકે ઈલાહી કરીશ) અહીંચા તમને યાદ
હેવડાવું છું કે દરવાજાથી આગળ વધતાં
જ આ લખેલું મળશે. નવયતુ સુન્નતલું
એ'તેકાદ (મેં સુન્નત એ'તેકાદની નિયત
કરી)

(૩૦) મહીના તરેણથી રોજો નસીબ
થાય તો શું કહેવું, ખાસ કરીને ગર્ભીમાં,
કે તેના પર શાચાકૃતનો વાયદો છે.

(૩૧) અહીંચા દરેક નેકો એકની પચાસ
હુલાર લખવામાં આવે છે. માટે ઈખાદતમાં
અધિક કોશીશ કરો, ખાવા-પીવાની કમી
જરૂર કરો અને જ્યા સુધી કંઈ શકે
તસ્ફહુક (સંકો) કરો. ખાસ કરીને અહીંચા-
વાળાઓએ પર, ખાસ કરીને આ જમાનામાં
અક્ષર જરૂરત મંદ છે.

(૩૨) અહીંચા અને હુતીમે કા'બામાં
ઓછામાં ઓછો એક એક કુર્ચાન ખતમ
કરી લો.

(૩૩) રોજુએ અન્વર પર નજર (દિન-
પાત) પણ ઈખાદત છે. જેલું કા'બા
શોઅજમા અથવા કુર્ચાન મળુછને જેલું.
તો અદિબ સાથે તેની અધિકતા કરો અને
હુદ્દો સલામ અર્જ કરો.

(૩૪) પંજગાના અથવા ઓછામાં
ઓછું સવાર-સાંજ મળાજહ શરીરમાં
સલામ અર્જ કરવા માટે હાજર થાવ.

(૩૫) શહેરમાં અથવા શહેરથી બહાર

જ્યાંથી પણ શુંખ સુખારક પર નજર પડે
તુરત જ હાથ બાંધીને તે બાળુએ સુખ
કરીને સલાતો સલામ અર્જ કરો. તેલું ક્ષ્યો
સિવાય હરગિજ પસાર ન થાવ કે તે
અદિની બિલાકૃ (વિદ્ધ) છે.

(૩૬) જમાઅતનો ત્યાગ ઉજર વગર
દરેક કગ્યાએ શુનોહ છે અને કેટલીએ
વખત થાય તો સણ્ણત હરામ તથા કણીરો
શુનોહ અને અહીંચા તો શુનાહ ઉપરાંત
કેવી સણ્ણત મહેદીમી છે. અદલાહ બચાવે.
સહીહ હંગમાં છે રસુલુદ્દીલાહ સદ્દલદ્દીલાહ
અલયહે વસ્તુલમ ઇરમાવે છે : જારી
મસ્તિજ્ઞમાં જેની ચાલીસ નમાજો ઝીત
ન થાય તેના માટે દોઊખ તથા નિઝાક-
થી આજાદીએ લખવામાં આવે.

(૩૭) શક્ય હોય ત્યાં સુધી કોશીશ
કરો કે મરિજ દે અન્વલ અર્થીત હુસુરે અક્ષદ્દુ
સદ્દલદ્દીલાહ અલયહે વસ્તુલમના જમાનામાં
જેટલી હતી તેમાં નમાજ પણ અને તેની
માત્રા (૧૦૦) હાથ લાંખી અને ૧૦૦ હાથ
પહેલી છે. જેકે પાછળથી જે કાંઈ વધારો
થયો છે તેમાં નમાજ પઠવું પણ મસ્તિજ્ઞ
નખીમાં જ પઠવું છે.

(૩૮) પવિત્ર કંઘ શરીરને હરગિજ
પીઠ ન કરો અને શક્ય હોય ત્યાં સુધી
નમાજમાં પણ એવી જરૂરાએ ન ઉભા રહો
કે પીઠ કરવી પડે.

(૩૯) રોજુએ અન્વરનો ન તવારું કરો
ન સિજારો, ન એટલા ઝુકવું કે ઝુકાની
બરાબર થાય, રસુલુદ્દીલાહ સદ્દલદ્દીલાહ અલયહે
વસ્તુલમની તઅગીમ તેમની ઈતાઅતમાં છે.

બડીએ વાળાઓની જિયારત

(૪૦) અનતુલ બડીએની જિયારત સુનની છે. રોજાએ અકટસની જિયારત કરીને ત્યાં જાય, ખાસ કરીને જુગાના દિવસે. આ ઇન્સ્ટાન્ચમાં લગલગ દસ હન્દર સહોણાએ કિરામ રહીયડલાહો અન્હુમ ઇન ધ્યેલા છે અને તાયેર્ધન, તાયેતાયેર્ધન, ઔલિયા, ઉદ્મા તથા સુંદા વિગેરની તો ગણુંની ન નથી. અહીંથા જ્યારે હાજર ધાવ ઇન ધ્યેલા તમામ સુસલભાનોની જિયારતને પ્રથમ ઇસ્ટ-ઈચાહો કરે અને આ પઢો :

“અસસલામા અલૈકુમ દારા કોમિન્
સુસેનીના અનતુલ લના અલફુલ વ ર્જના
ઈન્શાઅદલાહો તથાલા એકુલ લાહેકુલ
અદલાહુમાઝીર લેન્યાલુલિલબકીદગરકુલ
અદલાહુમાઝીર લનાવલાહુમ.”

તરણુમો : તમારા પર સલામ અય કોમે મોમેનિના ઘરવાળાએ તમે અમારા પેશવા છો અને અમે ઈન્શાઅદલાહો તમારાથી મળવાના છીએ. અય અદલાહુ બડીએ વાળાઓની મગફેરત કર. અય અદલાહુ અમને અને તેમને બદ્દી હો.

અને જે ધીજું કાંઈ વધુ પદવા ઈચ્છે તો આ પઢો :

અદલાહુમાઝીર લના વ લે વાલેનીના
વ લે ઉસ્તાદેના વ લે ઇખવાનેના વ લે
અખવાતેના વ લે ઔલાદેના વ લે અહેર્દેના
વ લે અસહાયેના વ લે અહૃપાયેના
વ લે મન લહુ હુકુન : અહૌના વ લે મન
ઔસાના વ લિટસુમેનીના વદ્ભુમેનાતે

વદ્ભુસ્લેમીના વદ્ભુસ્લેમાતે.”

તરણુમો : અય અદલાહુ અમને અને અમારા માં-ખાપને અને ઉત્તાહો અને લાઈએ-અહુનો અને અમારી ઔલાદ અને પૌત્રાએ અને સાથીએ અને મિત્રને અને તેમને નેમણે અમને અમારા પર હુકુ છે અને નેમણે અમને વસ્તિયત કરી અને તમામ મોમેનીના તથા મોમેનીનાત તથા સુસ્થીમીન તથા સુસ્થમાતને બખ્શી હો.

અને દુર્દીદશારીએ તથા સૂર્યએ ઝાંઠેણા
તથા આયતુલ્કુસી તથા કુલાલેવલ્લાહ
વિગેર ને કાંઈ યાદ હોય પઢીને તેનો
સલામ નજર કરે. તે પછી બડીએ શરીરમાં
ને મજારા મશહૂર છે તેમની જિયારત કરે.
તમામ બડીએવાળાએમાં અદ્ભુત (૧) અમીર્લ
મોમેનીન હૈયેના ઉસ્તાન ગની રહીયડલાહો
અણો છે. તેમના મજાર પર હાજર થઈને
સલામ અર્જ કરે.

“અસસલામા અલૈકા યા સાલેલદ્યોલ-
દ્યાધર્દીશીના વસ્તામે અહૌકા યા
સાહેલદ્યીજર્તેને અસહલામે અહૌકા યા
મુજહુહેજ નૈશદહેર્સરતે બિનતકુલ વદ્યૈને
જાદાકદાહો અન રસુસેહુ વ અન સાયેરલ
સુસ્લેમીન વ રહેયડલાહો અહો વ
અનિરસહાયતે અજમધીન.”

તરણુમો : અય અમીર્લ મોમેનીન
આપ પર સલામ અને અય ખુલ્લાએ
રાશેહીનમાં વીળ ખ્લીઝા આપ પર સલામ.
અય એ હિજરત કરનાર આપ પર સલામ
અય ગજવાયેતખૂફની નકદ તથા જિન્સ
(રાડા તથા સામની)થી તૈયારી કરનાર

આપ પર સલામ. અદલાહુ આપને પોતાના રસૂલ અને તમામ મુસલમાનો તરક્કથી બદલો આપે, આપથી અને તમામ સહાયથી.

(૨) હજરત સૈયેદના ઈથ્રાહીમ ઈઝને સરહારે હો. આલમ રસૂલદલાહુ સદ્દલદલાહો અલયહે વસદ્દલમના કુણબા અને એજ કુણબા શરીરમાં આ હજરતોના પણ મજારાતે તૈયબહુ છે. હજરત ઇક્વીયા (હુસુરના સાહિયાદી) હજરત ઉદ્માન બિન મજબુન (આ હુસુરના દુધલાઈ છે) અધુર્ડહુમાન બિન ઔર્ફ તથા સાફ બિન અણી વજાસ (આ બંને હજરતો અશરથે મુખશશરાહ છે) અધુર્દલાહુ ઈઝને મસજિદ અતિશય જબીલુલ કર સહાયી, ચારે ખદીજાઓ પણી સૌથી મહાન ઈક્વીય (ખુનૈસ બિન હુઅદ્દા સહમી તથા અસફ બિન ઓહરાહુ રહીયદલાહો અન્હુમ અજમિન, આ હજરતોની બિદ્ધમતમાં સલામ અઝ્ કરો. (૩) કુણબા હજરત સૈયેદના ઈમામ હુસન મુજતબા તથા સરે મુખારક સૈયેદના ઈમામ હુસૈન તથા ઈમામ જૈનુલ આણેદીન તથા ઈમામ મોહમ્મદ બાકર તથા ઈમામ બાકર સાદિક રહીયદલાહો અન્હુમના મજારાત તૈયેબાત છે. તેમના પર સલામ અઝ્ કરો (હવે આ કુણબાઓ રહ્યા નથી, બહુભીઓએ તે બધા કુણબાઓ શહીદ કરી નાખ્યા છે.

(-અનુવાદકો)

(૪) કુણબા અજવાને મુતહરાત (પુનિત પત્નીઓ) હજરત ઉમ્મુલ મોમેનીન હજરત ખહીજતુલ કુણા રહીયદલાહો અન્હોનો મજાર મજાર મજાર અજમામાં અને હજરત મયમૂનહુ

રહીયદલાહો અન્હોની સરક્રમાં છે. બાકીના તમામ પુનિત પત્નીઓ આ કુણબામાં છે.

(૫) કુણબા હજરત અકીલ બિન અલી તાલિબ. આમાં સુહિયાન બિન હારિસ બિન અહુલ મુત્તલિબ તથા અધુર્દલાહુ બિન જાફરે તૈયાર પણ છે.

(૬) અને તેની નિકટ એક કુણબા છે જેમાં હુસુર અજદસ સદ્દલદલાહો અલયહે વસદ્દલમની પ્રથુ ઓલાહો છે.

(૭) કુણબા સાફિયહુ રહીયદલાહો અન્હો. હુસુર અનવર સદ્દલદલાહો અલયહે વસદ્દલમની ઝાઈ.

(૮) કુણબા ઈમામ માલિક રહીયદલાહો અન્હો.

(૯) કુણબા નાહેઅ મૌલા ઈઝને ઉમર રહીયદલાહો, અન્હોમા આ હજરતોની જિયારતથી ઝારેગ થઈ માલિક બિન સનાન તથા અખૂ સાઈદ ખુદરી રહીયદલાહો અન્હોમા તથા ઈમામાઈલ બિન જાફર સાદિક તથા મોહમ્મદ બિન અધુર્દલાહુ બિન હુસન બિન અલી રહીયદલાહો અન્હુમ તથા સૌયહુશ શોહદા અમીરહુમજા રહીયદલાહો અન્હોની જિયારતથી લાલાંવિત થાં.

(આ સર્વ મજારાતોને પણ ઈઝને સબુદે શહીદ કરાવી નાખ્યા છે. અનુવાદક) જનનતુલ અકીનાની જિયારત કોનાથી શરૂ થાય તેમાં મતલેદ છે. કેટલાક ઉદ્માચો કેરમાવે છે કે અમીરી મોમેનીન હજરત ઉદ્માનગની રહીયદલાહો અન્હોથી આરંભ કરે કે તેઓ સૌમાં અઝજલ છે અને કેટલાક કહે છે કે, હજરત ઈથ્રાહીમ ઈઝને રસૂલદલાહુ સદ્દલદલાહો અલયહે વસદ્દલમથી શરૂ કરે અને કેટલાક કેરમાવે છે કે કુણબા સૌયહેના અધ્યાત્મ

રહીયલાહો અનહોથી આરંભ થાય અને કુ઱્યાએ સદ્ગ્રિયહુ પર ખતમ કરે કે સૌથી પહેલા એજ મળે છે તો સલામ અર્જ કર્યો વગર ત્યાંથી આગળ ન વધો અને એજ સરળ પણ છે.

(૪૧) કુ઱્યા શરીરીની જિયારત

કુ઱્યા શરીરીની જિયારત કરે અને મહિન્દ શરીરીમાં એ રકમત નમાજ પઢે. તિરમિશીમાં મરવી છે કે રસુલુલલાહ સહલલાહો અલયહે વસ્ત્વમે ફરમાંયું : મહિન્દાનું કુ઱્યામાં નમાજ પઠનું ઉમરા જોતું છે. અને સહીહ હૃદ્દિસોથી સાયિત છે કે નણીએ કરીમ સહલલાહો અલયહે વ સહલમ દરેક અઠવાડીએ કુ઱્યા તશરીફ લઈ જતા. ડ્યારેક સવાર ડ્યારેક પૈદલ. આ સ્થળની ખુજુગીમાં બીજુ પણ હૃદ્દિસો છે.

(૪૨) શોહદાએ ઉહુદ શરીરીની જિયારત કરો. હૃદ્દિસમાં છે કે હુઝુરે અકદસ સહલલાહો અલયહે વસ્ત્વમ દરેક વર્ષની શરૂઆતમાં ઉહુદના શહીદોની કથો પર આવતા અને ફરમાવતા : “અરસદામો અહોકુમ હેમા જાયરતુમ ઉકયદ્વારે.”

અને ઉહુદના પહુંચની પણ જિયારત કરો કે સહીહહૃદ્દિસમાં ફરમાંયું : (અર્થ) ઉહુદ પહુંચ અમને પ્રિય રાખે છે અને અમે તેને પ્રિય રાખીએ છીએ. અને એક રિવાયતમાં છે કે જયારે તમે હાજર થાવ તો તેના વૃક્ષથી કાંઈક આવ લાલે બાવળ હોય, બહેતર એ છે કે જુમેરાતના દિવસે સવારના જમથે જાવ અને સૌથી પહેલા હુઝરત સૈયેહુશ શોહદા અમીર હમગ્રહ રહીયલાહો

અનહોના મજાર પર હાજર થઈને સલામ અર્જ કરો અને હુઝરત અહુલુલાહ બિન જહશ તથા સુસાબબિન ઉમીર રહીયલાહો અનહોમા પર સલામ અર્જ કરો કે એક રિવાયતગાં છે કે આ બંને હુઝરતો અહીંચા જ દેંન છે.

નોટ :- સૈયેહુશ શોહદાથી ડાખી તરફ અને મહિન્દની સહનમાં જે ક્ષયર છે, તે આ બંને, શોહદાએ ઉહુદમાં નથી.)

(૪૩) મરીના તૈયાખહના તે કુવાએને હુઝુર પ્રતિ સંબંધિત છે અથીત કોઈથી કુઝ કશું અને કોઈનું પાણી લીધું અને કોઈમાં લુઅાયેદહન (શુદ્ધ) નાખું. જે કોઈ જાણનાર-ખતાવનાર મળી જાય તો તેમની પણ જિયારત કરો અને તેનાથી કુઝ કરો અને પાણી પીઓ.

(૪૪) અને ઈંછે તો મહિન્દને નખવી-માં હાજર રહો. સૈયેહી ઈંછે અથી જમારેહ કુદસસિર્રહુ જયારે હુઝુરંમાં હાજર થયા તો આછે પહોર બરાબર હુઝુરીમાં ઉલા રહેતા, એક દિવસ બદ્દીઅ વિગેરેની જિયારતનો ઘયાત આંદ્રો પછી ફરમાંયું : આ છે અર્દલાહનો દરવાજો લીખ માંગવાવાળાએ માટે ખુલ્દો છે. તેને છોડીને કયાં જાડો. માથું અહીંચા, સિજદો અહીંચા, બંદગી અહીંચા, કરાર અહીંચા.

(૪૫) ઇખસત (વિદ્યા)ના સમયે મવાજહ અનવરમાં હાજર થાવ અને હુઝુરથી વારંવાર આ નેચમતની અતાનો સવાલ કરો અને તમામ આદાય કે જે મકડા માઅજમાથી ઇખસતના બયાનમાં

વણું થથા છે તેનું ધ્યાન રાખો. અને ત્યાલા અદ્દા સૌથેદેના મોહમ્મદિબ્બ-
સાચા દિલથી હુઅ કરો કે ઈલાહી ઈમાન આદેહિ વ સહાયેહિ વ હનેહિ વ હિઝેહિ
તથા સુનનત પર મદીના તૈયેખહુમાં મરવું અજમધન, આમીન બદ્દુર્દો લિલાહે
અને બકીઅમાં ફરેન થવું નસીબ કર.

આંહુમરાયુકના આમીન, આમીન,
આમીન. યા અરહમરહેમીન વસ્તુદ્વાહે

—: તમભત બિલફૌર :—

બજમે રૂકુનુદીન નકશબંદી મુજદેદીનાં પ્રકાશનો

	કિંમત રૂ.
(૧) અનવાહલ આરિશીન (તસવુફ)	૪૨-૦૦
(૨) દર્દો સલામકે ઇબાઈલ ઉફે જનતી તૌહિફ (સ્ટોકમાં નથી)	૧૬-૦૦
(૩) હૃયાતે રસુલના દસ દિવસ (શુષ્ણ અરિત્ર)	૨૦-૦૦
(૪) હિદાયતુત તાલેખીન	૬-૦૦
(૫) તૌહિફે આખેરત (સ્ટોકમાં નથી)	
(૬) રૂકનેદીન ભા-૧ (નમાજ)	૩૦-૦૦
(૭) તૌશીહુલ અકાઈદ (રૂકનેદીન ભા-૨)	૨૦-૦૦
(૮) હિતાખુજ અકાત (રૂકનેદીન ભાગ-૩) (સ્ટોકમાં નથી)	૬-૦૦
(૯) હિતાખુસિસ્યામ (રૂકનેદીન ભાગ-૪)	૨૫-૦૦
(૧૦) અન્વારે હજજ (રૂકનેદીન ભાગ-૫)	૨૦-૦૦
(૧૧) મારિબુન નથુંવત (શીરતે પાઠ)	૭૫-૦૦
(૧૨) ગૌસે આઝમ કે ૨૦ વાઅજ	૧૫-૦૦
(૧૩) સીસ્તે ભાયાદ ખુસ્તામી	૨૦-૦૦
(૧૪) તજકિસ્તુલ ઓલીયા	૬૦-૦૦
(૧૫) શુલિસ્તાં-એસ્તાં	૪૫-૦૦

પ્રાપ્તિસ્થાન :

બજમે રૂકુનુદીન નકશબંદી મુજદેદી
ત્રણ દરવાજા, અડીયાર ગઢીના નાડે, અહુમદાયા-૧.

અંજુમનો રગાઓ મુદ્રણશા-દયાદરા

GRWB/059/Bharuch/02 C/O. ફયૂજાને રજા
મંજિલ, મુ. પો. દયાદરા-૭૬૨૦૨૦ તા. જિ. ભરુચ.
ફોન : ૦૨૬૪૨-૨૮૦૦૧૧, મો. ૮૪૨૭૪ ૬૪૪૧૧
Email ID : anjuman2006@hotmail.com

વરસોથી સુની સાહિત્ય ક્ષેત્રે મજાહબે હક્ક અહિદે
સુન્નત વ જમાઅતની અજોડ ખિદમત આપતી આપની
આ ઘારી સંસ્થાએ નાની મોટી કુલ ૧૭૫ કિતાબો
ગુજરાતી વાંચકોને વિશ્વભરમાં મોટા ભાગે મફત
પહોંચાડી છે અને સમયની માંગને અનુરૂપ સચોટ
સાહિત્ય કુર્ચાની, હદીષ, અકવાલથી ભરપૂર દલીલ સભર
સાહિત્ય અફીદાની મજબૂતી તથા અમલી ઈસ્લાહ માટે
પ્રકાશિત કરવાનું કામ અવિરત ચાલુ છે. અસંખ્ય સુનીઓને
તેનાથી લાભ મેળવે છે.

- ★ અહિદે સુન્નત વ જમાઅતનું ઠોસ સાહિત્ય
ફેલાવવા, મસ્લકે આ'લા હજરતની રોશનીને
ચમકાવવા આપ કિતાબોના પ્રકાશનમાં આપના તથા
મર્ઝુમોના સવાબ અર્થે સવાબે જરીઆ કમાવા માટે
લિલાહ રકમ આપીને અપાવીને સહાય રૂપ થઈ
શકો છો.
- ★ કોઈ આખી કિતાબ છપાવવાની જિમ્મેદારી લઈને
સહાયરૂપ થઈ શકો છો.
- ★ આપની અકાત, સદકા, ફિઅા, ઐરાત, બુઝુગોણી
ન્યાય, કુલાનીની ખાલોની રકમો, M.O., ચેક,
D.D. થકી કિતાબો છપાવવા માટે મોકલીને
સહાયરૂપ થઈ શકો છો.
- ★ ઇધિયા પ્રણાસો (રૂ. ૩૦૦/-) "વાર્ષિક મેળના"
ફી તરીકે ભરીને, ભરાવીને મેળ્ખરો બની બનાવીને
સહાયરૂપ થઈ શકો છો.
- ★ કિતાબો મંગાવીને મિત્રો, સગામાં, લાયબ્રેરીઓમાં,
માસ્ઝિદોમાં, દારુલ ઉલ્લૂમોમાં વહેંચી તફ્લીગે દીનના
કાર્યને વેગવંત બનાવી સહાયરૂપ થઈ શકો છો.
- ★ ખાસ તો કિતાબો વાંચીને-વાંચાવીને તેના ૫૨
અમલ કરી કરાવીને સહકાર આપી શકો છો.



બરકાતે ખ્વાજા (માસિક) દયાદરા

C/O. ફયૂજાને રજા મંજિલ, મુ. દયાદરા-૭૬૨૦૨૦
તા. જિ. ભરુચ, ગુજરાત (ઈન્ડિયા) મો. ૮૪૨૭૪ ૬૪૪૧૧

અહિદે મુલિલાહ ! અહિદે સુન્નત વ જમાઅત યા'ને
'મસ્લકે આ'લા હજરત'નું આ અજોડ માસિક ઇલા વર્ષમાં
પ્રવેશ પામવાતૈયારી કરી રહ્યું છે. પાંચ વરસની કારકિર્દીમાં
આ માસિકે અજોડ લોકચાહના મેળવી છે. બરકાતે ખ્વાજા
માસિક અટલે.....:-

- ★ અહિદે સુન્નત વ જમાઅતનું અનોધુ માસિક !
- ★ મસ્લકે આ'લા હજરતનું પ્રચારક માસિક !
- ★ ડંકાની ચોટ પર એલાને હક્ક કરતું માસિક !
- ★ ઈસ્લામ તથા સુન્નિયત વિરુદ્ધ ઉઠતા વિરોધ વંટોળનો
જડબાતોડ જવાબ આપતુ માસિક !
- ★ સુનીઓના આ ઘારા માસિકના ગ્રાહક બનો તથા
બનાવો !

લવાજમ

છુટક નકલ	રૂ.	૧૫/-
વાર્ષિક લવાજમ	રૂ.	૧૨૦/-
વિદેશ માટે	રૂ.	૧૫/-
પેટ્રન ફી (૧૧ વર્ષ માટે)	રૂ.	૧૫૦૦/-
આજુવન (૨૫ વર્ષ માટે)	રૂ.	૩૫૦૦/-
વિદેશ માટે પેટ્રન	રૂ.	૧૫૦/-
વિદેશ માટે આજુવન	રૂ.	૨૫૦/-

બરકાતે ખ્વાજા (માસિક) C/O. ફયૂજાને રજા
મંજિલ, મુ. પો. દયાદરા-૭૬૨૦૨૦ તા. જિ. : ભરુચ,
ફોન : (૦૨૬૪૨) ૨૮૦૦૧૧, મો. : ૮૪૨૭૪ ૬૪૪૧૧
Email : anjuman2006@hotmail.com

www.barkatekhwaja.net

જન્મુઅસ્તા-૨૦૦૪થી અત્યાર સુધીના 'બરકાતે
ખ્વાજા' (માસિક)ના અંકોમાં વિવિધ ઇલા વાનગીઓની
લિજજત માણો ! અને તમારા દીન ઈમાનને મજબૂતી બધશો !
નેક અમલોવાળા બનો !

